# જરથોસ્તી ધર્મના પુસ્તકો

**ખોરદેહ અવસ્તા** ( બાળકો સારૂ )
વગર એસની ... ... રૂ. ૦।=
**ખોરદેહ અવસ્તા** ( ૧૦ એસની ) રૂ. ૦॥।
**પોકેટ તમામ અવસતા** ... રૂ. ૧॥)
**તમામ અવસતા** ( ૨૫ એસની)
મોટા અક્ષરથી છાપેલી... રૂ. ૨)
**તમામ અવસતા** ( આફરગાન આફ્રીન ધુપનીરંગ, ખશનુમન વગેરે સાથે ... ... રૂ. ૨॥
**તમામ અવસતા** બા એજમતીનીરંગ ( બાઇ દીનબાઈ સો૦ એનજીનીયરવાલી ) ... ... રૂ. ૩॥



જરથોસ્ત સપેંતમાન

# શેહેનશાહી

## પાક

# ખોરદેહ અવસ્તા.

સઘળી ગેહો, નીઆયશો, પતેતો, પતેત ફરશોસતરો, દુઆ, બાજે, નમશકારો, અખદયાચાની અરદીબેહેસ્ત યશ્ત સાથે ૧૧ યશ્તો.

છાપી પ્રસિદ્ધ કરનાર

**મનચેરજી જમશેદજી પોસ્ટવાલા.**

**નાણાવટ, સુરત.**

"ખોદાબક્ષ" પ્રેસમાં છાપી.

**કીંમત ૧૨ આના.**

# સાંકળીયું

# સાંકળીયુ

# સાંકળીયું

કદમી ખોરદેહ અવસતા ( બાળકો
સારૂં મોટા અક્ષરથી ... રૂ ૦।=

કદમી ખોરદેહ અવસતા ૭ એસની રૂ ૦॥।

કદમી તમામ અવસતા ... રૂ ૧॥

ઈરાની રૂઆની પતેત કદમી ... બે આના

ઈરાની રૂઆની પતેત શહેન૦... બે આના

ફરામરોદના તથા ગાથાના હા... રૂ ૦।

બાજધરનું ફરૂશીનું ( મોટા અક્ષરથી) રૂ ૦।

સતુમ-ધુપનીરંગ-આફરગાન ખશ
નુમન આફરીન વગેરે ... ૬ આના

| | | |
|---|---|---|
| ઈજશને | ... ... ... ... | રૂ ૧॥ |
| વીસપરદ બાજધરનું | ... ... | રૂ ૧) |
| વંદીદાદ | ... ... ... ... | રૂ ૨) |
| બેરામ ઈઅશત | ... ... ... | ≈ |
| મુનાજાત | ... ... ... ... | ૦। |

એમ. જે. પોસ્ટવાલા, સુરત.

રબરસ્ટાંમ બનાવનાર.

અનામે ઈઅજદે બખશાએનદેહ
બખશાએશગરે મેહરબાન દાદગર

# પાક ખોરદેહ અવસતા.

---

## અહુનવર

ઈઅથા અહુ વેરીઓ. અથા રતોશ અશાદ ચીદ હચા વંઘહેઓશ દજદા મંનંઘો. શીઓથનનાંમ. અંઘહેઓશ મજદાઓ. ખશથરેમચાહ. અહુરાઓ. આઈઅમ. દરેગોબીઓ. દદદ વાસતારેમ

---

## અશેમ વોહુ

અશેમ વોહુ. વહેશતેમ અસતી. ઓશતા અસતી. ઓશતા અહમાએ.
૧ હીઅદ અશાએ વહેશતાએ અશેમ.

## કેમના મજદા

કેમનાં મજદાં. મઉએતે પાઇઉમ દદાઓ. હીઅદ માં દરેગુઆઓ. દીદરેશતા. એનંઘહે અનીએમ. થવ અહુમાદ. આથરસચા મનંઘસચા. દઅ ઈઆઓ શીઓથેનાએશ. અશેમ થરેશતા. અહુરા તાંમ. મોએ દાંસતુઆંમ-દેનીઆઓ ફેરાઉચા કે વેરેથરેમ જાથ વા. પોએસંઘા. દઆએ હેનતે. ચેથરા મોએ. દાંમ અહુમએશ. રતુમ ચીજદી. અદ હોએ વોહુ. સરોશો જંતુ મંનધા મજદા અહુમાએ દએ અહુમાએ. વશી કહુમાએચીદ. પાતનો દએશીઅંતદ. પેરે મજદાઓસચા. આરમેતશચ. સપેનતસચ. નસે દેઉઓ દરોખશ. નસ દેઉએ: ચેથર. નસ દેઉઓ ફેરકારસચ નસ દેઉઓ ફેરદાએતે. અપ દરોખશ.

નસ અપ દરોખસે. દુઆરે અપ દરો ખશ. વીનસે અપા ખેદર. અપ નસી અહે. મા મેરેન ચેનીસ ગેથાઑ. આસ તુએતેશ અશહે. નેમસચા ઈઆ આર મેતેશ ઇજાચા. અશેમ વોહુ (૧)

## નીરંગી કુસતી બાંધવાની

હોરમજદ ખોદાએ આહુરેમન અવાદશાં. દુર અવાજ દશતાર. જદ શેકસતે બાદ. આહુરેમન દેવાંન. દરૂ જાન જાદુઆંન દરૂઅંદાંન કીકાંન. કર ફાંન. સાસતારાંન. ગુનાહગારાંન આશ મોગાંન. દરૂઅંદાંન. દુશમનાં ફરીઆંન. જદ શેકસતે બાદ. દુશ પાદશાહાંન અવાદશાં બાદ. દુશમનાં સેતાહ બાદ. દુશમનાં અવાદશાં બાદ. હોરમજદ ખોદાએ એજ હમા ગોનાહ. પતેત

પશેમાનોમ. એજ હુરવસતીન. હુશમત. હુજુખત. હુજુઅરેશત. મેમ પ ગેથી મનીદ. ઍાએમ ગોફ્ત ઍાએમ કરદ. ઍાએમ જસત ઍાએમ બુન બુદ એસતેદ. અજ ગોનેહા. મન શની. ગવશની કુનશની. તની રોઆંની ગેથી મીનોઆંની. ઍાબે અવાખશ. પશેમાંન પશે ગવશની. પ પતેત હોમ. ખશનોથર આહુરહે મજ દાઍા. તરોઅદીતે. અંઘરહે મેનીએ ઍાશ. હુ થીઆ વરશતામ હીઅદ વસના ફરસોતેમેમ સતોગે. અશેમ વોહુ (૧)

ઈસ્નથા અહુ વેરીઆ (૨)

અસેમ વોહુ (૧)

## જસમે અઉઅંવહે મજદ.

જસમે અઉઅંધહે મજદ. જસમે અઉઅંધહે મજદ. જસમે અઉઅંધહે મજદ. માજદીઅસનો અહમે. મજદી અસનો જરથોશતરેશ. ફ્રુઆરાને આસ તુએ તસચા. ફરૂઅરે તસચા. આસતો ઇએ હુમતેમ મનો આસતોઇમે હુખ તેમ વચો. આસતોઇએ હુઅરેશતેમ શીઓથનેમ. આશતોઇમે દેનાંમ વંઘો હીમ માજદીઅસનીમ. ફરસપાઇઓ એદરામ. નેદા સનેથેશેમ. ખેતુઅદથાંમ અશોનીમ. ઇઆ હેતે નાંમચાં. ખુશી અતનાંમચાં. મજેરાતાચા. વહેશતાચા. સરેશતાચા ઈઆ આહુએરીશ. જર થોશતરેશ. અહુરાએ મજદાએ. વીસપા વોહુ ચેન અહમી. એશા અસતે દની આઓ. માજદીઅસનોએશ. આસતુ એતેશ. અશેમ વોહુ (૧)

(તાહારા તનથી નશશ ઘણો દુર થાએ અને તહારૂં તન પવીતર અને નુર ભરેલું થાએ)

## નીરંગ આબેજર લેવાની.

શેકસતે શેકસતે શેતાંન. આહુરેમન ગજસતે કારો કેરદાર. નરસઇ ગજસતે કારો કેરદાર. સીઓશે અમેશાસપંદાંન દાદાર હોરમજદ પીરોજગર પાક. આશાને અશેમ વોહુ (૧) (વાર ૩ પઢે) ( પછે સરોશ બાજ પઢે )

---

(ફરજીઆતની અગાઊ પઢવી જેથી તાહારી ફરેજીઆત ખોદા કબુલ કરે.)

## સરોશ બાજ

૫ નાંમે ઇઅજદાંન. હોરમજદ ખોદાએ. અવજુની ગોરજ ખોરહે અવજોઇઆદ. સરોશ અશો. તગીતંન ફરમાંન. શેકફત જીન જીના અવજાર.

સાલારે દામાંને હોરમજદ બેરેસાદ. એજ હુમા ગોનાહ પતેત પશેમાનોમ એજ હુરવસતીન. દુશમત દુજુખત. દુજુઅરેશત. મેમપ ગેથી મનીદ. ઑઍમ ગોફ્ત, ઑઍમ કેરદ. ઑઍમ જસંત. ઑઍમ બુન. બુદ એસતેદ. અજાં ગોનેહા મનશાની. ગવશાની. કુનશાની. તની રેઆંની ગેથી મીનો આંની. ઓખે અવાખશ. પશેમાંન પસે ગવશાની. પ પતેત હોમ.

અથા અહુ વેરીઓ (પ)

અશેમ વોહુ (૩)

ફ્રૂઅરાને મજદીઅસનો જરથોશત રેશ. વીદ્દેઊઓ અહુરહે દકેશો.

(જે ગેહ હોએ તે પઢે)

ફ્રસેસતીઅચ, સરોશહે અશીઅહે તખમહે તનુ માંથરહે, દરેશી દરોશ

આહુઅરીઅહે. ખશનોથ્ર. ઇઅસના એચ. વહમાએચ ખશનાથ્રાએચ ફ્રસસતીએચ. ઇઅથા અહુ વેરીઓ જોતા. ફ્રામે મરૂતે. અથા રતુશ. અશાદ ચીદ. હચ ફ્રા અશુઅ. વીહુઆઓ મરોતુ. સરોશેમ અશ્રીમ હુરોદેમ વેરેથ્રાજનેમ. ફ્રાદદ ગેથેમ. અશુઅનેમ અસહે રંતુમ ઇઆજમેદે. અહુનેમ વેરીમ તનુમ પાએતે. અહુનેમ વેરીમ તનુમ પાએતે. અહુનેમ વેરીમ તનુમ પાએતે. ઇઅથા અહુ વેરીઓ. (૧)

(કેમના મજદા. આખી પઢે)
ઇઅથા અહુ વેરીઓ ૨)

ઇઅસનેમચ. વહમેમચ ઓજસચ જફ્રિઅરેસચ. આફ્રીનામે સ્રોશહે અશીઅહે. તખમહેતનુમાંથ્રહે. દરેશી દ્રોશ આહુઅરીઅહે અશેમ વોહુ(૧)

(એ પઢતાં જીંદગીનુ સઘલુ સુખ ખોદાતાલાથી
ચાહવાનો અંદેશો કરવો.)

અહુમાએરેસચ. ખરેનસચ. અહુમા
એ તનુઓ દરૂઅતા તેમ. અહુમાએ
તનુઓ વજહુઅરે. અહુમાએ તનુઓ
વેરેથરેશ. અહુમાએ ઇશતીમ પોઅોરોશ
ખાથરાંમ. અહુમાએ આસનામચેહ
ફ્રજંતીમ અહુમાએ હરેગાંમ હરોગોજી
તીમ. અહુમાએ વહેશતેમ અહુમ
અશોનાંમ. રોચેંઘેમ વીસપો ખાથરેમ.
અથ જમીઆદ ઈઅથા આફ્રીનાંમે
અશેમ વોહુ (૧)

હંજધરેમ પઢતાં ખોદાતાલાથી પોતાનાં રવાને
આકેબતનું સુખ માગવું.

હજંધરેમ બેશોજનાંમ. બેઉઅરે
બેશોજનાંમ હજંધરેમ બેશોજનાંમ.
બેઉઅરે બેશોજનાંમ. હજંધરેમ

બેશેજનાંમ. બેઉિઅરે બેશેજનાંમ.
અશેમ વોહુ (૧)

(એ પઢતાં નમવું અને ખોદાથી મદદ
ચાહવાનો અંદેશો કરવો.)

જસમે અઊિઅંઘહે મજદ. જસમે.
અઉિઅઘહે મજદ. જસમે અઊિઅંઘહે
મજદ. અમહે હુનાશતહે. હુરેદહે
વેરેથરગનહે અહુરદાતહે. વનેતીઆ
ऑासच ऑापरतातो. शंमनो ખાસતરે.
વઈઓઅેશ ऑापरो કેરીઅહે. तरदातो.
અનીઆએશ દામાંન. એનદતે
વઇઓ ઈઅદ તે અસતે. સપેંતોમેની
ओाम. थवाशहे ખદાતહે જરૂઆનહે
અકરનહે. જરૂઆનહે દરેગો ખદાતહે.
અશેમ વોહુ (૧)

૨૦૨૫

પાંચે ગેહે જુદીજુદી પઢવાની ૧૧

કેરેબા મુજદ. ગુનાહ ગુજારેશનેરા કુનમ અશાહી રવાંને, દાશારમરા. હમ કેરબી હમા ગુહાંને. હફત કેશાવર. જમીન જમીન પેહેના. રોદ દરાનાં. ખેર શેદ બાલા. બુનદીહાદ બેરેસાદ અશોબેદ દરજી. અથ જમીઆદ. ઇઅથ આફરીનાંમે. અશેમ વોહુ (૧)

---

પાંચે ગેહે જુદી જુદી પઢવાની

ફ્રૂઅરાને મજદીઅસનો જરથોશતરેશ વીદઉઓ અહુરહે દકેશો.

## હાવંન

(દરરોજ બામદાદથી તે બપોરના ૧૨ કલાકસુધી)

હાઉઅને અસોને અશાહે રથવે. ઇઅસનાએચ. વહમાએચ ખશનોથરા એચ. ફ્રસસતીએચ. સાઉઅંઘહે વી શીઆએચ અશોને અશાહે રથવે. ઇઅ

૧૨ પાંચે ગેહ જુદીજુદી પઢવાની

સુનાએચ. વહુમાએચ. ખશનોથરાએચ

ફ્રેસસતીએચ.

(તથા આરાંમ મહીનાથી અશપંદાદ મહીનાની પંજવાકેના પાંચમા ગાથા સુધી બીજી હાવંન ગેહમાં બપોરના ૧૨થી તે કલાક ૩ સુધી પઢે)

## રપીથવન.

(ફ્રરવરદીન મહીનોને હોરમજદ રોજથી તે મેહેર મહીનો અને અનેરાંન રોજ શુધી બપોર નાં ૧૨ કલાકથી તે ૩ કલાક શુધી.

રપીથવનાએ અશોને અશાહે રથવે. ઇઅસનાએચ વહુમાએચ ખસનોથરા એચ. ફ્રેસસતીએચ. ફ્રરાઃદ ફ્રશુઅ જંતોમાંએચ અસોને અશાહે રથવે ઇઅ સનાએચ વહુમાએચ ખશનોથરાએચ. ફ્રેસસતીએચ.

પાંચે ગેહ જુદીજુદી પઢવાની ૧૩

## ઓજીરંન.

(પાછલાપોરના ૩ કલાકથી તે સાંજ શુધી)

ઑજીરનાએ અસોને અશાહે રથવે. ઇઅસનાએચ. વહુમાએચ ખશનોથરા એચ. ફ્રસસતીએચ. ફ્રરાદદ વીરાએ હખીઑમાએચ. અશોને અશાહે રથવે. ઇઅસનાએચ. વહુમાએચ, ખશનો થરા એચ ફ્રસસતીએચ

## એવેસરૂથરેમ

(શાંજ પછીથી તે રાતના ૧૨ કલાક શુધી)

એવેસરૂથરેમાએ એએગઇઆએ અશોને અશાહે. રથવે. ઇઅસનાએચ વહુમાએચ, ખશનોથરાએચ. ફ્રસસતીએચ. ફ્રરાદદ વીસપાંમ હુજીઆએતે જરથોશતરો તેમાએચ અશોને અશાહે રથવે. ઇઅસનાએચ. વહુમાએચ. ખશનોથરાએચ. ફ્રસસતીએચ.

## ઓશહેન.

(પાછલી રાતના ૧૨ કલાકથી તે બામદાદ સુધી)

ઑસહેનાએ અસોને અસહે રથવે ઇઅસનાએચ. વહુમાએચ ખશનોથરા એથ. ફ્રસસતીએચ. બેરેજીઆએ નમાની આએચ. અશોને અશહે રથવે. ઇઅસનાએચ. વહુમાએચ. ખશનોથરાએચ. ફ્રસસતીએચ.

---

બામદાદને વખતે સુરજ ઉગવા આગમજ પઢ઼ે

## હોશબાંમ

અથ એમાંમ વચો. દરેજીઆયેશ. ઇઓએ અંગેન વારેથરગનીઆતેમેમચ. બેરાજીઓ તેમેમચ. પંચ અહુનહે વેરીઅહે ફ્રસરાઉ અઇઓએશ. ઇઅથા અહુ વેરીઓ (પ)

અહુનેમ વેરીમ તનુમ પાએતે

અહુનેમ વેરીમ તનુમ પાએતે. અહુ નેમ વેરીમ તનુમ પાએતે. ઈઅથા અહુ વેરીઓ (૧)

કેમનાં મજદાં (તમાંમ પઢે) અશેમ વોહુ (૧)

ઈઅથા અહુ વેરીઓ (૨૧) અશેમ વોહુ (૧૨) નેમસેતે હોશબાંમી નેમ સેતે હોશબાંમી. નેમસેતે હોશબાંમી, એતદ દેમ વીશપનાંમ, મજેશતેમ દજ દીઆએ. અહુમચ. રતુમચ ઈમ અહુરેમ મજદાંમ. સનથાએ અંઘરહે મેનીએઑશ દરૂઅતો. સનથાએ એસ ગહે ખરૂઈ દરોખશ સનથાએ માંજની અનાંમ દેઉઅનાંમ. સનથાએ વીસપ નાંમ દેઉઅનામ વરેનીઅનાંમચ. દરૂ અતાંમ

(બાજમાં પઢે) શેકશત ગનામેનીઓ બરઆહુરેમંન લેઆંનત સહ હુજારબાર

(પરગટ પઢે) ફ્રરહથાએ અહુરહે મજદાઓ રેઉઅતો ખરેનંઘહુતો. ફ્રરહ થાએ અમેશનાંમ સ્પેંતનાંમ. ફ્રરહ થાએ તેશતરીઅહે સતારો રેઉઅતો ખરેનઘહુતો. ફ્રરહથાએ નરશ અશોનો ફ્રરહથાએ વીશ્પનાંમ. સ્પેંતહે મેનીએ ઓશ દાંમનાંમ. અશોનાંમ ઇઅથા અહુ વેરીઓ (૨)

વહુચ. વંઘુહઆઓશચ. આફ્રીનાંમે વીસપીઆઓ અશોનો સતોએશ. હેથી આએચ. બુઆંએથીઆએચ બુશીઆ એથીઆએચ. અસીમ રાશેનતીમ. દરે ગો વાંરેથમનેમ. મેશાચેમ. હુવો એવે શાચેમ મેશાચેમ સ્પફ્રસાઓઘહુતેમ. બરેનતેમ. વીસપાઓ બેશજાઓ અપાં

મચ ગઉઆંમચ. ઑારૂઅરનાંમચ. તારૂ
અઇઅંતીમ વીસપાઑા દએશા ઑા
દઉઅનાંમ મશીઆનાંમચ. આરેશી
અતાંમ અહુમાએચ નમાનાએ
અહુમાએચ નમાનહે. નમાનો
પેતે વંઘહુસચા આદાઑા. વંઘ
હુસચા. અશીઆ હુપોઑારૂઆઑા વહે
હીશ. અપરાઑા આસેનતીશ. દરેગા
વારેથરમનો. ઈઅથનો મજેશતાઑ
સચ. વહેશતાઑાસચ. સરેશતાઑાસચ
અશીઆ એરેનુઅંતે. અમેશનાંમ સપે
તનાંમ ઈઅસનાએચ, વહુમાએચ. ખશ
નોથરાએચ. ફ્રસસતીએચ. ફરદથાએ.
અહે નમાનહે. ફરદથાએ વીસપીઆઑા
અશોનો સતોએસ. હમસતે વીસપી
આઑા દરૂઅતો સતોએશ. સવુઅશ
અશાઈએ. હુદાઑા. ઇઓએ હેનતી

વસસચતુ અહુરમજદ ઑારાતાચખશેશ હુઅનાંમ દાગનાંમ. વસો આપો વસો. ઑારૂઅરાઍા. વસો વીસપવોહુ અરા ચેથર. ખરશીઅમનેમ. અશુઅનેશ દાઇ અત. અખરશીઅમનેમ. દરૂઅંતેમ. વસો ખશાથરો હીઆદ અશુઅ. અઉઅશો ખશાથરો હીઆદ દરૂઆઍા. ગતો હમે સતો નેજબરેતો. હચ સપેંતહે. મેની અઍાશ દામેબીઆ. વરેતા અઉઅશો ખશાથરો. હુખશીઅ અજેમચેદ. ઈઆ જરથોશતરો. ફરતેમાંમ. નમાનનાંમચ. વીસાંમચ. જંતોનાંમચ. દખીઓનાંમચ અંઘાઍા દેનીઆઍા. અનુમતીએચ અનુખતીએચ. અનુવરશતીએચ. ઈઅા આહુએરીશ. જરથોશતરેશ. ઇઅથનો આઍાંઘાંમ. શાતો મનાઍા વહેશતો ઑારૂઆનો. ખાથરૂએતીશ. તનુઓ

હેનતો. વહેશતહે અંઘહુઑશ આકાશ
તોએદ. આહુએરીઅમજદ જસેંતાંમ.
અશાહે વહેશતહે. અશાહે સરેશાતહે.
દરેસામ થવા. પેરેથવા જમીઆમ..
હુમેમ થવા હુખમ. અશેમ વોહુ (૧)
અશાહે વહેશતહે. અશાહે શરેશાતહે.
દરેશામ થવા. પેરેથવા જમીઆમ.
હુમેમ થવા હુખમ. અશેમ વોહુ (૧)
અશાહે વહેશતહે. અશાહે સરેશતહે.
દરેશામ થવા. પેરેથવા જમીઆમ.
હુમેમ થવા હુખમ. અશેમ વોહુ (૧)
☞ અહુમાએરેસચ.-હુજંઘરેમ.-જસમે
-કેરબા મુજદ.-અશેમ વોહુ (૧)

---

## હાવંન ગેહે

ખશનોથર અહુરહે મજદાઓ.
અશેમ વોહુ (૩)

ફ્રૂઅરાને મજદીઅસનો જરથોશત રેશ. વીદ્દઉઓ અહુરહે દકેશો. હાઉ અને અશોને અશહે રથવે. ઇઅસના એચ. વહમાએચ. ખશનોથરાએચ. ફ્રર સસતીએચ. સાઉઅંઘહે વીસીઆ એચ. અશોને અશહે રથવે. ઇઅસ નાએચ. વહમાએચ. ખશનોથરાએચ. ફ્રરસસતીએચ. મેથરહે વોઆરો ગોઇ ઓઓતોએશ હજંઘર ગોશહે. બેઉ અરે ચશમનો. ઓખતો નામનો ઇઅ જતહે. રાંમનો ખાસતરહે. ખશનોથર ઇઅસનાએચ. વહમાએચ. ખશનોથરા અચ. ફ્રરસસતીએચ. ઇઅથા અહુ

વેરીઓ જોતા. ફરામે મરૂતે. અથ્રા
રતુરા. અશાદ ચીદ. હચ ફ્રરા અશુઅ.
વીદુઆઑ મરોતુ.

અહુરેમ મજદાંમ અશુઅનેમ અશાહે
રતુમ ઇઅજમેદે. જરથોશતરેમ અશુ
અનેમ અશાહે રતુમ ઇઅજમેદે. જર
થોશતરહે અશોનો ફ્રરૂઅશીમ ઇઅજ
મેદે. અમેશ સપેંત અશોનાંમ ઇઅજ
મેદે. અશાઑનાંમ વંઘોહીશ સુરાઑ
સપેંતાઑ ફ્રરૂઅશીઓ ઇઅજમેદે.
અસતુઅતો મનખીઆચ. અપનો તેમેમ
રથવાંમ ઇઅજમેદે. ઇઍતુશતેમેમ. ઇઅ
જતનાંમ. હંધનુશતેમેમ. અશાહે રથ
વાંમ. એવે નસાંસતેમેમ. જગસુશતે
મેમ. અશોનો અશાહે રથવો રતુ ફ્રરે
તીમ ઇઅજમેદે.

હાઉઅનીમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. હુરૂઅતાતેમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. અમેરેતાતેમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. આહુઍરીમ ફ્રરશનેમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. આહુઍરીમ દકેશેમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. ઇઅસનેમ સુરેમ હુપતંઘહાએતીમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. સાઉઅંઘેમ વીસેમચ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. એરીઅમનેમ અશીમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. અસુઅંતેમ વેરેથરાજનેમ. વેદએશંઘેમ. વીસપે દએશાઓતાૈરઇઅંતેમ. વીસપે દએશાઓ તેતારેતે ઇઓ આપેમો. ઇઓ મદેમો ઇઓ ફ્રરતેમો. જોજી જોઇએ. તનુ માંથરેમ.

પંચ ગાથાઓ. મેથરેમચ વોઓરો ગોઈ
ઓઓતીમ. ઇઅજમેદે. રાંમસચ ખાસ
તરેમ ઇઅજમેદે. વીસીઅ રથવો. ઇઅ
સનાએચ. વહુમાએચ. વીસીમચ અશુ
અનેમ અશહે રતુમ ઇઅજમેદે. મેથ
રેમ વોઓરો ગોઈઓએતીમ. હજંઘરે
મ ગોશેમ. બેઉઅરે ચશમનેમ. ઓખ
તો. નાંમનેમ ઇઅજતેમ ઇઅજમેદે.
રાંમ ખાશતરેમ ઇઅજમેદે.

થવાંમ આતરેમ અહુરહે મજ
દાઓ પોથરેમ અશુઅનેમ અશહે
રતુમ ઇઅજમેદે. હુદ જોથરેમ. હુદ
એવીઆઓંઘનેમ. એમદ બરેસમ
અશીઅ ફરસતરેતેમ અશુઅનેમ અશ
હે રતુમ ઇઅજમેદે. અપાંમ નપતા
રેમ ઇઅજમેદે. નેરેમ સંઘેમ ઇઅજ
મેદે. તખમેમ દામોએશ ઓપમનેમ

યઝતેમ યઝમેદે. એરેસતનાંમ ઓરૂઆનો યઝમેદે.

યાઓ અશોનાંમ ફ્રવશીઓ રતુમ બેરેજંતેમ યઝમેદે. યેમ અ હુરેમ મજદાંમ યો અશહે અપનોતેમો. યો અશહે જગમુસતેમો. વીસપ સરૂઆઓ જરથોશતર યઝમેદે. વીસપેચ હુઅરેશત શીઓથન યઝમેદે. વરશતચ. વરેસીઅમનચ. યેંઘહે હાતાંમ. આદ યસને. પેતે વંઘો. મજદાઓ અહુરો. વેથા અશાદ હચા. યાઓંઘાંમચા. તાંસચા. તાઓસચા યઝમેદે. યથા અહુ વેરીઓ (૨)

યસનેમચ. વહમેમચ. ઓજસચ. જઊઅરેચ. આફ્રીનાંમે. મેથ્રહે વોઓરો ગોયઓએતોએશ. હજંઘરે ગોશહે બેઊઅરે ચશમનો. ઓખતો

નામનો ઈઅજતહે. રાંમનો ખાશાનરહે અશેમ વોહુ. (૧) અહુમાએરેસચ, હુજ વરેમ.-જસમે.-ડેરેખા મુજદ.-અ સેમ વોહુ (૧)

## રપીથવન ગેહે

ખશનોથર અહુરહે મજદાઓ. અશે મ વોહુ (૩)

ફરૂઅરાને મજદીઅસનો જરથોશત રેશ. વીદઉએ અહુરહે દકેશો. રપી થવનાએ અસોને અશાહે રથવે. ઈઅ સનાએચ. વહુમાએચ. ખશનોથરાએ ચ. ફરસસતીએચ. ફરાદદ ફશુઓ જંતોમાએચ. અશોને અશાહે રથવે દઅશનાએચ. વહુમાએચ. ખશનોથરા એચ. ફરસસતીએચ. અશાહે વહેશતહે

[illegible]રઘચ [illegible] [illegible]દાઓ. [illegible]
[illegible]ર ઘ્યશનાએ[illegible]. [illegible]ચ. [illegible]
નોથરાએચ. ફ્રર[illegible] [illegible] ઘ્ય[illegible]
અહુ વેરીઓ જોતા [illegible] [illegible]. [illegible]
રતુશ અશાદ ચીદ. [illegible] [illegible] [illegible].
વીદુઆઓ મરેતુ.

અહુરેમ મજદાંમ [illegible] [illegible]
હે રતુમ યઝમઇદે. [illegible]શાત્રેમ
અશુઅનેમ અહુ[illegible] [illegible] [illegible].
જરથોશાતરહે [illegible] [illegible]
યઝમઇદે. અ[illegible]શે [illegible]પંત [illegible]
યઝમઇદે. [illegible] [illegible]
શુરાઓ સપેંતાઓ [illegible] [illegible]
જમેદે. અસતુઅ[illegible] [illegible]. [illegible]
નાતેમેમ રથવાં[illegible] [illegible]. [illegible]
તેમેમ ઇઅ[illegible]. [illegible].
અશાહે રથવાંસ. [illegible] [illegible]

શુશતેમેમ. અસો[illegible] [illegible] [illegible]
ફરેતીમ ઇઅજમેદ.

રપીથવનેમ અશુઅ[illegible] [illegible] [illegible]
[illegible]મજમેદ. અહુનુ એ[illegible] [illegible]
[illegible]શુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદ.
ઑારાતુએતીમ ગાથાંમ અશુઅનેમ
અશાહે રતુમ ઇઅજમેદ. સપેંતા મેની
ઑામ ગાથાંમ અશુઅનેમ અશાહે
રતુમ ઇઅજમેદ. વોહુ ખશાથરાંમ ગાથાં
[illegible] અશુઅનેમ અશાહેરતુમ ઇઅજમેદ.
વહેશાતોએશતીમ ગાથાંમ અશુઅને
મ અશાહે રતુમ ઇઅજમેદ. ફ્રા
[illegible] ફ્રશુ[illegible] જંતોમેમચ અશુઅનેમ
અશાહે રતુમ ઇઅજમેદ. ફ્રશુશેમચ
આથરેમ ઇઅજમેદ. અરશોખદેમચ
વાચેમ ઇઅજમેદ. [illegible] અરશોખદ
ઇઅજમેદ. વા[illegible]ર [illegible] દઉઓ ગાને

ચે ઇઅજમેદે. અપસચ જેમસચ ઇઅ
જમેદે. ઑરૂઅરાઑસચ. મેનીઉસચ
ઇઅજત ઇઅજમેદે. ઇઆ વંઘોજદાઑ
અશોનો અમેશેસચ સપેંત અશોનાંમ
ઇઅજમેદે. અશાઑનામ વંઘોહીશ
શુરાઑ સપેંતાઑ ફ્રૂઅશીઓ ઇઅજ
મેદે. બરેશનેચ. અશાહે ઇઅદ વહેશતહે.
મજેશત માંથર મજેશત વેરેજીઅ. મજે
શત ઑરૂએતીઅ મજેશત હુથીઆ
વેરેજીઅ મજેશત વીનદેથીઅ દેનીઆ
ઑ માજદીઅસનોએશ ઇઅજમેદે. અ
ઉઅદ વીઆખનેમચ હુંજમનેમચ
ઇઅજમેદે. ઇઅદ અશ અમેશનાંમ
સપેંતનાંમ. નઅરેશનુઓ. અઉઅંઘહે
અશોનો ગેમતેમ. જંતોમહે રથવો.
ઇઅસનાએચ. વહમાએચ. જંતોસેમચ
અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે.

અશેમ વહેશતેમ આતરેમચ અહુરહે મજદાંઓ પોથરેમ ઇઅજમેદે.

થવાંમ આતરેમ અહુરહે મજદાઓ પોથરેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. હુદ જોથરેમ હુદ એવીઆ ઓાધનેમ એમદ બરેસ્મ. અશીઅ ફ્રસતરેતેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. અપાંમ નપતારેમ ઇઅજ મેદે. નેરેમ સંઘેમ ઇઅજમેદે. તખમે મ દામોએશ ઓાપમનેમ ઇઅજતેમ ઇઅજમેદે. એરેસતનાંમ ઓાફ્રઆનો ઇઅજમેદે. ઇઆઓ અશોનાંમ ફ્રરૂઅ શીઓ. રતુમ બેરેજતેમ ઇઅજમેદે. ઇએમ અહુરેમ મજદાંમ. ઇઓ અશાહે અપનોતેમો. ઇઓ અશાહે જગમુશતેમો વીસપ સરૂઆઓ જરથોશતર ઇઅજ મેદે. વીસપચ હુઅરેશ્તત શીઓથન

ઇઅજમેદે. વરશતચ. વરેશીઅમનચ
હએ ધહે હાતાંમ. આદ ઇઅસને. પેત
વંધો. મજદાઓ અહુરે. વેથા અશાદ
હુચા. ઇઆઓધાંમચા. તાંસચા. તાઓ
સચા ઇઅજમેદે. ઇઅથા અહુ
વેરીઓ (૨)

ઇઅસનેમચ. વહમેમચ. ઓજસચ
જફ્રિઅરેચ. આફરી નાંમે. અશહે વહે
રાતાહે. આથરસચ અહુરહે મજદાઓ.
અશેમ વોહુ (૧) અહમાએરેસચ.-
હજંવરેમ.-જસમે*-કેરબા મુજદ.-અ
શેમ વોહુ (૧)

## ઑાજીરંન ગેહે

ખશનોથર અહુરહે મજદાઑા અશે મ વોહુ (3)

ફ્રફ્રઅરાને મજદીઅસનો જરથોશત રેશ. વીદઉઓ અહેરહે દકેશો. ઑાજી રનાએ અશોને અશાહે રથવે. ઇઅસના એચ. વહુમાએચ. ખશનોથરાએચ ફ્રસસતીએચ. ફ્રાદદ વીરાએ દખીઑા માએચ. અસોને અશાહે રથવે. ઇઅ સનાએચ. વહુમાએચ. ખશનોથરાએ ચ. ફ્રસસતીએચ. બેરેજતો અહુરહે નફેદરો. અપાંમ અપસચ મજદદાતી આઑા. ખશનોથર ઇઅસનાએચ. વહુ માએચ. ખશનોથરાએચ. ફ્રસસતીએચ ઇઅથા અહુ વેરીઓ જોતા ફ્રામે મરૂતે. અથા રતુશ. અશાદ ચીદ. હચ ફ્રા અશુઅ વીદુઆઑા મરોતુ.

અાહુરેમ મજદાંમ અશુઅનેમ અશાહે રતુમ ઈઅજમેદે. જરથોશતરેમ અશુઅનેમ અશાહે રતુમ ઈઅજમેદે. જરથોશતરહે અશોનો ફ્રૂઅશીમ ઈઅજમેદે. અમેશે સપેંત અશોનાંમ ઈઅજમેદે. અશાઑાનાંમ વંઘાહુીશ સુરાઑા સપેંતાઑા ફ્રૂઅશીઓ ઈઅજમેદે. અસતુઅતો મનખીઆચ. અપનો તમેમ રથવાંમ ઈઅજમેદે. ઈઅતુશતેમેમ. ઈઅજતનાંમ. હુધનુશતેમેમ. અશાહે રથવાંમ એવેનસાંસતમેમ. જગમુશતેમાંમ. અશોનો અશાહે રથવો રતુમ ફ્રેતી ઈઅજમેદે.

ઑાજીરેનેમ અશુઅનેમ અશાહે રતુમ ઈઅજમેદે. જોતારેમ અશુઅનેમ અશહે રતુમ ઈઅજમેદે. હાઉિઅનાનેમ અશુઅનેમ અશાહે રતુમ ઈઅજમેદે

આતરવખસેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે.

ફરઐરેતારેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. આઐરેતેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. આસનતારેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. રથવેશકરેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. સરોશા ઉઅરેજેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. ફરાદદ વીરેમ દખીઑામેમચ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. સતરેઑાસચ. માઑાંઘેમચ હુઅરેચ રોચાગ્ઑા ઇઅજમેદે. અનગર રોચાઑા ઇઅજમેદે. આફ્રસંઘાંમચ ખાથ્રેમ ઇઅજમેદે. ઇઆ નરસ સાદરા દરેગુઅતો. હુથીઆઉઅરેજેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. અપરેમચ દકેશેમચ

યઅજમેદે. હુશ્રીઆઊઅરેજેમ અશુઅ
નેમ અશોનો સતીમ યઅજમેદે. પેત
અસતે. પેતે ખસફ્ને. યઅસો બેરેતા
બીઓ. જોથરાબીઓ. દખીઑામહે
રથવો. યઅસનાએચ. વહ્મુાએચ.
દખીઑામેમચ. અશુઅનેમ અશાહે
રતુમ યઅજમેદે. બેરેજ તેમ અહુરેમ
ખશથ્રીમ ખશેતેમ અપાંમ નપાતેમ
ઑારૂઅદ અસપેમ યઅજમેદે. અપેમચ
મજદદાતાંમ અશોનીમ યઅજમેદે.

થવાંમ આતરેમ અહુરહે મજદાઑ
પોથરેમ અશુઅનેમ અશાહે રતુમ યઅ
જમેદે. હુદ જોથરેમ હુદ એવીઑાંઘનેમ
એમદ બરેસમ. અશીઅ ફ્રસતરેતેમ
અશુઅનેમ અશાહે રતુમ યઅજમેદે.
અપાંમ નપતારેમ યઅજમેદે. નેરેમ
શંઘેમ યઅજમેદે. તખમેમ દાંમોએશ.

ઑાપુમનેમ ઇઅજતેમ ઇઅજમેદે. ઑરે
સ્તનાંમ ઑાકૂઆનો ઇઅજમેદે. ઇઆઑા
અશોનાંમ ફ્રૂઅશીઓા રતુમ બેરેજ
તેમ ઇઅજમેદે. ઇઑમ અહુરેમ મજ
દાંમ. ઇઑા અશહે અપનોતેમો. ઇઑા
અશહે જગમુસતેમો. વીસપ સ્રૂઆઑા
જરથોશ્તર ઇઅજમેદે. વીસપચ હુઅ
રેશત શીઓથન ઇઅજમેદે. વરશતચ
વરેશીઅમનચ. ઇઑંધહે હુાતાંમ. આ
અદ ઇઅસને. પેતે વંઘો. મજદાઑા
અહુરો. વેથા અશાદ હચા. ઇઅ
ઑાવ્રાંમચા. તાંસચા. તાઑાસચા ઇઅ
જમેદે. ઇઅથા અહુ વેરીઓા. (૨)
ઇઅસનેમચ. વહુમેમચ. ઓાજ
સચ. જઊીઅરેચ. આફ્રીનાંમે. બેરે
જતો. અહુરહે નફ્રેદરો. અપાંમ અપ
સચ મજદદાતીઆઑા. અશેમ વોહુ

(૧)અહુમાંઅેરેસચ.—હુજ઼ઘરેમ.—જસમે. કેરબાસુજદ.—અશેમ વોહુ. (૧)

## અવેશાઙ્થરેમ ગેહ.

ખશનોથર અહુરહે મજદાઓ અશેમ વોહુ (૩)

ફ્રઙ્અરાને મજદીઅસનો જરથો શતરેશ વીદઓિઓ અહુરહે દકેશો. અવશાઙ્થરેમાએ અશ્ગઓઆએ અશો ને અશહે રથવે. દઅશનાએચ. વહુમા એચ. ખશનોથરાએચ. ફ્રસસતીએચ. ફ્રાદદ વીસપાંમ હુજીઆએતે. જરથો શતરો તેમાએચ અશોને અશહે રથવે દઅસનાએચ. વહુમાએચ ખશનોથરા એચ. ફ્રસસતીએચ. અશાઓનાંમ ફ્રઙ્અશનાંમ ગેનાનાંમ્ચ વીરો વાંથવ નામ. દઓએરીઆઓસ હુશેતાએશ.

અમહેચ હુતાશતહે. હુરોદહે. વેરેથર
ગનહે. અહુરદાતહે. વનંતીઆઓસચ
ઓાપરતાતો. ખશનોથર ઇઅસનાએચ
વાદમાએચ. ખશનોથરાએચ. ફ્રસસ
તીએચ. ઇઅથા અહુ વેરીઆ જોતા
ફ્રશમે મરૂતે અથા રતુશ. અશાદ ચીદ
હચ ફ્રરા અશુઅ વીદુઆઓ મરોતુ.

અહુરેમ મજદાંમ અશુઅનેમ અ
શાહે રતુમ ઇઅજમેદે. જરથોશતરેમ
અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે.
જરથોશતરહે અશોનો ફ્રરૂઅશીમ ઇઅ
જમેદે. અમેશે સપેંત અશોનાંમ ઇઅ
જમેદે. અશાઓાનાંમ વંઘોહીશ સુરાઓા
સપેંતાઓ ફ્રરૂઅશીઓ ઇઅજમેદે.
અસતુઅતો મનખીઆચ અપનો તેમે
મ રથવાંમ ઇઅજમેદે. ઇએતુશાતેમેમ
ઇઅજતનામ હુંધનુશાતેમેમ અશાહે

રથવામ એવેનસાંસતેમેમ. જગમુસ
તેમાંમ. અશાનો અશાહે રથવો રતુ
ફ્રેતીમ ઇઅજમેદે.

એવેસરૂથરેમેમ અશુઅનેમ અશાહે
રતુમ ઇઅજમેદે. એએગાએમ અશુઅ
નેમ અશાહે રતુમ ઇઅજમેદે. થવાંમ
આતરેમ અહુરહે મજદાઓ પોથરેમ
અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે.
અસમન હાઉિઅન અશાહે રતુઓ ઇઅ
જમેદે. અઇઅંઘેન હાઉિઅન અશાહે
રતુઓ ઇઅજમેદે. હુદ જોથરેમ હુદ
એવીઆ ઓાંધનેમ. એમદ બરેસમ અ
શીઅ ફ્રસતરેતેમ અશુઅનેમ અશાહે
રતુમ ઇઅજમેદે. આપે ઓારૂઅરે ઇઅ
જમેદે. ઓારૂઅતાંમ. ઓારોનેમ અશુઅ
નેમ અશાહે રતુમ ઇઅજમેદે ફ્રાદદ
વીસપાંમ હુજીઆએતીમ અશુઅનેમ

અશાહે રતુમ ઇઅજમેદે
જરથોશાતરેમ અશુઅનેમ અશાહે
રતુમ ઇઅજમેદે. માંથરેમ સપેંતમ
અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે.
ગેઑશ ઑરૂઆનેમ અશુઅનેમ અશ
હે રતુમ ઇઅજમેદે. જરથોશાતરો તેમ
મચ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજ
મેદે. જરથોશાતરેમ અશુઅનેમ અશાહે
રતુમ ઇઅજમેદે. આથરૂઅનેમ અશુઅ
નેમ અશાહે રતુમ ઇઅજમેદે. રથેશતા
રેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજ
મેદે. વાસતરીમ ફશોઇઅતેમ અશુઅ
નેમ અશાહે રતુમ ઇઅજમેદે. નમાનહે
નમાનો પેતીમ અશુઅનેમ અશાહે
રતુમ ઇઅજમેદે. વીસો વીસપેતીમ
અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે.
જંતઑશ જંતો પેતીમ અશુઅનેમ

અશહે રતુમ ઇઅજમેદે. દઘ્યોશ દંઘાપેતીમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે.

ઇઉઅનેમ હુમનંઘેમ. હુ વચંઘેમ હુશીઓથનેમ હુ દેનેમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. ઇઉઅનેમ ઓખદો વચંઘેમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. ખેતુઅદથેમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. દંઘાઓરૂએસેમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. હુમાઇમ પેરેજથનેમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. નમાનહે નમાંનો પથનીમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. નાએરેકાંમચ અશોનીમ ઇઅજમેદે ફ્રાઇઓ હુમતાંમ. ફ્રાઇઓ હુખતાંમ. ફ્રાઇઓ હુઅરશતામ હુશહાંમ સાસતાંમ. રતુ ખશ

થરાંમ અશોનીમ ઇઆંમ આરમતીમ
સપેંતાંમ. ઇઆઑસચતે ગેનાઑ આહુ
રમજદ. નરેસચ અશુઅનેમ ઇઅજમેદ.

ફરાઇઑ હુમતેમ ફરાઇઑ હુખતેમ.
ફરાઇઑ હુઅરશતેમ. વીસતોએ ફ્રેરેરે
તીમ. એહિઅસતો કઇઅદેમ ઇઑંઘાડ
શીઑાથનાએશ. ગેથાઑ અશ ફરાદતે
જરથોશતરો તેમહે રથવો. ઇઅસના
એચ. વહુમાએચ. જરથોશતરો તેમેમ
ચ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજ
મેદ. અશાઑાનાંમ વંઘાહીશ સુરાઑ
સપેંતાઑ ફરૂઅશીઑ ઇઅજમેદ. ગે
નાઑાસચ વીરો વાંથવાઑ ઇઅજમેદ
ઇઆએરીઆંમચ હુશેતીમ ઇઅજમેદ.
અસેમચ હુતાશતેમ હુરોદેમ ઇઅજ
મેદ. વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજ
મેદ. વનંતીમચ ઑાપરતાતેમ ઇઅ

જમેદે.

થવાંમ આતરેમ અહુરહે મજદા ઓ પોથરેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. ૯૬ જોથરેમ ૯૬ અવીઆ ઓંધનેમ. અમદ બરેસમ. અશીઅ ફર સતરેતેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. અપાંમ નપતારેમ ઇઅજ મેદે. નેરેમ શંઘેમ ઇઅજમેદે. તખમેમ દામોઅેશ ઓપમનેમ ઇઅજતેમ ઇઅ જમેદે. અરેસતનાંમ ઓરૂઆંનો ઇઅ જમેદે. ઇઓઓ અશોનાંમ ફરૂઅશી ઓ. રતુમ બેરેજંતેમ ઇઅજમેદે. ઇઓમ અહુરેમ મજદાંમ. ઇઓ અશાહે અપનો તેમો. ઇઓ અશાહે જગમુસતેમો. વીસપ સરૂઆ ઓ જરથોશતર ઇઅજમેદે. વીસપચ હુઅરેશત શીઓથન ઇઅજમેદે વરશ

તચ. વરેશીઅમનચ હ્મેંધહે હાતાંમ. આદ ઈઅસન. પેતે વધો. મજદાઓ અહુરો. વેથા અશાદ હચા. ઈઆઓ઼ાં ધામચા. તાંસચા. તાઓસચા ઈઅજ મેદે. ઈઅથા અહુ વેરીઓ (૨)

ઈઅસનેમચ. વહમેમચ. ઓજ સચ. જફિઅરેચ આફરીનાંમે. અશા ઓનાંમ ફરૂઅશનાંમ ગેના નાંમચ વીરો વાંથવનાંમ. ઈઆઓરીઆઓસ ચ હુશેતોએશ. અમહેચ હુતાશતાહે હુરોદહે. વેરેથરગનહે. અહુરદાતહે. વનંતીઆઓસચ. ઓપરતાતો. અશેમ વોહુ. (૧) અહમાએરેશચ.-હજંધરેમ. -જસમે.-કેરેઆ મુજદ.-અશેમ વોહુ (૧)

## ઑશહેન ગેહ.

ખશનોથ્ર અહુરહે મજદાઓ અશેમ વોહુ (૩)

ફ્રસ્તવાને મજદીઅસ્નો જરથોશ્ત્રેશ. વીદેવઓ આહુરહે દકેશો. ઑશેહેનાએ અશોને અશહે રથ્વે. ઇઅસનાએચ. વહમાએચ. ખશનોથ્રાએચ. ફ્રસસ્તીએચ. બેરેજીઆએ નમાનીઆએચ. અશોને અશહે રથ્વે. ઇઅસનાએચ. વહમાએચ. ખશનોથ્રાએચ. ફ્રસસ્તીએચ. સરોશહે અશીઅહે. અશ્રુઅતો વેરેથ્રાજનો. ફ્રાદદ ગેથહે. રસ્નોએશ રજેશતહે અરસતાતસચ. ફ્રાદદ ગેથીઆઓ. વરેદદ ગેથીઆઓ. ખશનોથ્ર ઇઅસનાએચ. વહમાયચ ખશનાથ્રાએચ. ફ્રસસ્તીએચ.

ઇઅથા અહુ વેરીઓઆઓના ફરાએ મરૂતે. અથા રતુશ અશાદ ચીદ હચ ફરા અશુઅ વીદુઆઑ મરોઇ.

આહુરેએ મજદાંમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. જરથોશતરેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. જરથોશતરહે અશોનો ફરૂઅશીમ ઇઅજમેદે. અમેશે સપેંત અશોનાંમ ઇઅજમેદે. અશાઑનાંમ વંઘાહીશ સુરાઑ સપેંતાઑ ફરૂઅશીઓ ઇઅજમેદે. અસતુઅતો મનખીઆચ. અપનો તેમેમ રથવાંમ ઇઅજમેદે ઇએતુશતેમેમ. ઇઅજતનાંમ. હંઘનુશતેમેમ અશાહે રથવાંમ. એવેનસાંસતેમેમ. જગમુશતેમાંમ. અશોનો અશાહે રથવો રતુફરેતીમ ઇઅજમેદે.

ઑારાહેનમ અશુઅનેમ અશાહે

રતુમ ઇઅજમેદે. ઑશાંમ સરીરાંમ
ઇઅજમેદે. ઑશાઑંધેમ ઇઅજમેદે.
ખશોએથનીમ. રેઉઅદ અસપાંમ.
ફ્રરમેન નરાંમ. ફ્રરમેન નરો વીરાંમ.
દઆ ખાથ્રૂએતે. નમાનીઆએતે ઑ
શાઑંઘેમ ઇઅજમેદે. રેઉઇમ રેનજદ
અસપાંમ દઆસનદ ઑએ હુપતો
કરશુએરીમ જાંમ. અઉઆંમ ઑશાં
મ ઇઅજમેદે. અહુરેમ મજદાંમ અશુ
અનેમ અશાહે રતુમ ઇઅજમેદે. વોહુ
મનો ઇઅજમેદે. અશેમ વહેશતેમ
ઇઅજમેદે. ખશથ્રેમ વેરીમ ઇઅજમેદે
સપેંતાંમ વંઘોહીમ આરમેતીમ ઇઅ
જમેદે. બેરેજીમ અશુઅનેમ અશાહે
રતુમ ઇઅજમેદે. બેરેજા વંઘહેઑશ
અશાહે બેરેજ. દેનીઆઑ વંઘોહીઆ

ઑા માજદીઅસનોએશ નમાનીઅહે રથવો ઈઅસનાએચ. વહુમાએચ. નમા નીમચ અશુઅનેમ અશાહે રતુમ ઈઅ જમેદ. સરોશેમ અશીમ. હુરોદેમ વેરેથરાજનેમ. ફરાદદ ગેથેમ અશુઅ નેમ અશાહે રતુમ ઈઅજમેદ. રશાનુમ રજેશતેમ ઈઅજમેદ. અરશાતાતેમચ. ફેરાદદ ગેથાંમ. વરેદદ ગેથાંમ ઈઅજમેદ.

થવાંમ આતરેમ અહુરહે મજ દાઑા પોથરેમ અશુઅનેમ અશાહે રતુમ ઈઅજમેદ. ઙદ જોથરેમ ઙદ એવીઆઑાંધનેમ. એમદ બરેસમ. અશીઅ ફરસતરેતેમ અશુઅનેમ અશા હે રતુમ ઇઅજમેદ. અપાંમ નપતારેમ ઈઅજમેદ. નેરેમ સઘેમ ઈઅજમેદ.

તખમેમ દામોએશ ઑાપમનેમ ઇઅજ
તેમ ઇઅજમેદ. એરેસતનામ ઑારૂઆ
ઇઅજમેદ. ઇઆાઑા અશોનાંમ
ફ્રૂઅશીઓ. રતુમ બેરેજતેમ ઇઅજ
મેદ ઇએમ અહુરેમ મજદાંમ. ઇઓ
અશાહે અપનોતેમો. ઇઓ અશાહે જગ
મુશતેમો. વીસપ સરૂઆાઑા જરથોશ
તર ઇઅજમેદ. વીસપચ હુઅરેશત
શીઓથન ઇઅજમેદ. વરશતચ. વરે
શીઅમનચ. ઇએંઘહે હાતાંમ. આાદ
ઇઅશ્નને પેતે વંઘો. મજદાઑા અહુ
રો. વેથા અશાદ હચા. ઇઆાઑાંઘાંમ
ચા. તાંસચા. તાઑાસચા ઇઅજમેદ.
ઇઅથા અહુ વેરીઓ (૨)

ઈશ્તસ્નેમચ. વહુમેમચ. ઓજસચ
જફ્રીઅરેચ. આફ્રીનામી. ખરેશેદ
અશ્રીઅહે. અમુઅતો વેરેથરાજતો.
હુરાદદ ગેઆહે. રસાનોએશ રજેશતહે.
અરશતાતસચ. ફ્રરાદદ ગેથીઆઓ.
વરેદદ ગેથીઆઓ. અશેમ વોહુ (૧)
અહુમાઈરેશ્ચ.— હુજ્યરેમ.—જસમે.—
કેરપા મુજદ. અશેમ વોહુ(૧)

## ખોરશેદ નીઆએશ.

પ નામે ઇઝદહાંન સતાએ
મ. જઆએસ. દાદાર હોરમજદ
રઇઓમંદ. ખોરેહમંદ. ડરવે
સપ આગાહ. કેરદેગાર. ખોદા
વંદાંન ખોદાવંદ. પાદશાહ બર
હમે પાદશાહાં. નગેહદાર. ખા

લેક મખલુક. અલરેજક રોજી.
દેહ દેહે કાદેર. ઑ કવી. ઑ
કદીમ. બખશાએશ દેહે. બખશા
એશગર. મેહેરબાંન. તવાંના.
ઑ દાંના. એ પાક પરવરદેગા
ર. આદેલ પાદશાહી. બેજવાલ
બાશદ. હોરમજદ ખોદાએ.
અવજુની. ગોરજ ખોરહે અવ
જાઇઆદ. ખોરશેદ અમરગ.
રઇઓમંદ. ઑરૂઅદ અસપ બે
રેસાદ. એજ હમા ગોનાહ. પતે
ત પશેમાનોમ. એજ હરવસતીન
દુશમત. દુજુખત. દુજુઅરેશત.
મેમ પ ગેતી મનીદ. ઑએમ
ગોફ્ત. ઑએમ કરદ. ઑએમ

જસત. ઓઆએમ બુન બુદ એસ તેદ. અજો ગોનેહ્ડા. મનશની. ગવશની. કુનશની. તની રોઆં ની. ગથીમાનો આંની. એઆખ અવાખશ. પશેમાંન પસે ગવશની પ પતેત હોમ.

નેમસેતે અહુરમજદ. નેમ સેતે અહુરમજદ નેમસેતે અહુ રમજદ. થરીસચેદ. પરો અની આએશ દામાંન. નેમોવે અમેસા સપેંતા. વીસપે હુખરે હ્ડોશ. એતદ જઆદ અહુરેમ મજદાંમ એતદ અમેશે સપેંતે. એતદ અશોનાંમ ફરૂઆશી. એતદ વઇ આંમ દરેગો ખદાતેમ. ખશનોથ

દ અહુરહે મજદાઓ. તરેએ
હીત આંઘરહે મેનીઓરા. હુથી
આ વરશતાંમ. હીઆદ વશના
હુવશોતેમમ. સતોમે આરોમ આરો
મ વાહુ (૧)

ફરેસતોઇએ હુમતોએ બીઆ
સચા. હુખતોએ બીઆસચા.
હુવરશતોએ બીઆસચા. માથવો
એ બીઆસચા. વખેદાએ બીઆ
સચા વરશતોએ બીઆસચા. અએ
ગીઆ. દેથે વીસપા. હુમતાચા
હુખતાચા હુઆરશતાચા. પેત રે
ાચા. દેથે વીસપા. હુરામતાચા.
હુ...ગતાચા. હુજુઆરશતાચા.

ફરાવીશાહી. અમેશાસપેંતા. ઇઆ
સનેઅરઘા વાડમેમઘા. ફરા મનંઘા
ફરા વચંઘા. ફરા શીઓથના. ફરા
અંઘોઇઆ. ફરા તનુઅશચીદ
ખરપીઆઓ. ઓશતનેમ. સોવ
મે અનેમ. અશેમ વોહુ (૧)

નેમો અહુરાએ મજદાએ.
નેમો અહુરાએ મજદાએ. નેમો
અહુરાએ મજદાએ. નેમો અમે
શેબીઓ સપેંતબીઓ. નેમો
મેથરાએ વોઓરૂ ગાઇઓએત
નેમો હુઅરેખશેતાએ ઓરૂઅદ
અસપાએ. નેમો આબીઓ બો
ઓથરબીઓ. ઇઆ અહુરહે
મજદાઓ. નેમો ગેઓશ. નેમો

ગઇઅહે. નેમો જરથોશતરહે સપેંતામહે. અશોનો ૬૩ અશે. નેમેમ વીસપીઆઓ અશોનો સતાએશ. હુથીઆએચ. ખુઆંએથીઆએચ. ખુશી આંથીઆએચ.

(જો હાવંન ગેહે હોએ તો એમ પઢીએ.)

વોહુ ઓખશીઆ મનંઘા ખશથરા અશાચા ઓશતા તનુમ વોહુ ઓખશીઆ મનંઘા ખશ થરા અશાચા ઓશતા તનુમ. વોહુ ઓખશીઆ મનંઘા ખશ થરા અસાચા ઓશતા તનુમ. અશેમ વોહુ (૩)

(જો રાપીથવન અથવા બીજી હાવંન
ગેહ હોએ તો એમ પઢીએ.)

**અમાઓ રોચાઓ બેરેજ શતેમ બેરેજમનાંમ. અમાઓ રોચાઓ બેરેજશતેમ બેરેજમનાંમ અમાઓ રોચાઓ બેરેજશતેમ બેરેજમનાંમ. અશેમ વોહુ (૩)**

(જો ઉજીરંન ગેહ હોએ તો એમ પઢીએ.)

**ઇઆહમી સપેંતા થવા મેની ઊ ઑરૂઆસે જસો. ઇઆહમી સપેંતા થવા મેનીઊ ઑરૂઆસે જસો. ઇઆહમી સપેંતા થવા મેનીઊ ઑરૂઆસે જસો. અશેમ વોહુ (૩)**

(હરએક અશેમ વોહુ પઢતાં સર નીચુ
કરી નમવું જોઈએ)

હુઆરેખશએતેમ અમેશેમ રએમ ઑરૂઅદ અશ્પેમ યઝમઇદે મિથ્રેમ વોઉરૂ ગઓયઓઈતીમ યઝમઇદે. અરશ વચંઘેમ. વીઆખનેમ. હઝંઘ્રેમ ગઓશેમ હુતાશતેમ. બએવરે ચશમનેમ. બેરેઝંતેમ. પેરેથો વએદીઅનેમ. સુરેમ અખ્વફનેમ. જગાઓરૂઆઓંઘેમ. મિથ્રેમ વીસ્પનાંમ. દખીઓનાંમ દંઘો પૈતીમ યઝમઇદે. યિમ ફ્રદથદ અહુરો મઝદાઓ ખરેનંઘસ્તેમેમ. મેનીઅઉનાંમ. યઝતનાંમ. તદનો જમીઆદ. અઉઆંઘહે મિથ્ર અહુર બેરેઝંત. હુઆરેખશએતેમ

અમેશેમ રેમ ઑક્રૂઅદ અસપે
મ ઇઆજમેદે.

તેશતરીમ દરૂઓ ચશમને
મ ઇઅજમેદ. તેશતરીમ દરૂઓ
ચશમનમ ઇઆજમેદે. તેશતરીમ
દરૂઓ ચશમનેમ ઇઆજમેદે. તેશ
તરીમ ઇઅજમેદે. તેશતરીઅ એ
નીઓ ઇઆજમેદ. તેશતરીઓ રે
ઊઆઓ પરેનંઘાડાઓ ઇઆજ
મેદે. વનંનતેમ સતારેમ મજદદાતે
મ ઇઆજમેદે. તેશતરીમ સતારેમ
રેઊઆંતેમ પરેનંઘાડતેમ ઇઆજ
મેદે. થવાશેમ પદાતેમ ઇઆજમે
દે. જરૂઆનેમ અકરનેમ ઇઆજ
મેદે. જરૂઆનેમ દરેગો પદાતેમ
ઇઆજમેદ. વાતેમ સપેંતેમ હુદા

ઍ:થહ્રુંમ ઇઆજમેદ. રજશતાંમ ચેશતાંમ મજદદાતાંમ અગાની મ ઇઆજમેહે. હેનામ વંઘોહ્રીમ માજદીઅસનીમ ઇઆજમેહે. .૫ થાંમ ખાશતાતેમ ઇઆજમેહે જ ગેનાંમંતેમ સુરેમ ઇઆજમેહે. શો કંતેમ ગેરીમ મજદદાતેમ ઇઆજ મેહે. વીસપેમચ અશુઆનેમ મ નીઉમ ઇઆજતેમ ઇઆજમેહે. વી સપેમચ અશુઆનેમ ગેથીમ ઇઆ જતેમ ઇઆજમેહેહ્રામ ઑરૂઆ નેમ ઇઆજમેહે. હુઆંમ ફરૂઅ શીમ ઇઆજમેહે. જસમે અઉઆ ઘહ્રે મજદ. અશાઑનાંમ વંઘો હ્રીશ સુરાઑ સપેંતાઑ ફરૂઅ

શીઆ ઇઅજમેદે. હુઅરેખશેતે

મ અમેશેમ રેમ ઑઉરુઅઇ અસ

પેમ ઇઅજમેદે. અશેમ વોહુ (૩)

ફરુઆરાને મજદીઅસનો

જરથોશતરેશ. વીદઊઆ અહુ

રહે દકેશો.

(જે ગેહ હોય તે પઢે.)

હુઅરેખશેતહે. અમેશહે

રેઊઅહે. ઑઉરુઅઇ અસપહે.

ખશનોથર ઇઅસનાએચ. વહમા

એચ. ખશનોથેરાએચ. ફરસસ

તીએચ. ઇઅથા અહુ વેરીઓ

જોતા ફરામે મરુતે. અથા રતુશ.

અશાદ ચીદ. હચ ફરા અશુઅ

વીદુઆઓ મરોતુ.

હુઅરેખશેતેમ અમેશેમ રએમ
અઁઉરુઅદ અસપેમ યઝમઇદે.
આદ યઅદ હુઅરે રેઓખશને
તાપીઅેતિ. આદ યઅદ હુઅરે
રેઓચો તાપીઅેતિ. હિશતંતે. મેની
ઊઆઓંઘો. યઝતાઓંઘો.
સતેમચ. હઝંગ્રેમચ. તદ ખરેનો
હંમબારીઅંતે. તદ ખરેનો નેપા
રીઅંતે. તદ ખરેનો બખશંતે
જાંમ પૈતે અહુરદાતાંમ. ફ્રાદ
તેચ અશહે ગેથાઓ. ફ્રાદતેચ
અશહે તનોઇઍ. ફ્રાદતેચ હુઅ
રે. યઅદ અમેશેમ રએમ અઁઉરુઅ
દ અસપેમ.

આદ યઆદ હુઅરે અઓજો
ખશીએત. બઊઆદ જાંમ અહુ
રેદાતાંમ યઓજદાથરેમ. આપેમ
તચેંતાંમ યઓજદાથરેમ. આ
પેમ ખઇઆનાંમ યઓજદાથરેમ
આપેમ જરીઆનામ. યઓજદા
થરેમ. આપેમ આરેમશતામ ય
ઓજદાથરેમ. બઉઆદ દાંમ
અશુઆ યઓજદાથરેમ. યઆઓ
હેંતે. સપેંતે. મેનીઓઅઓશ યઓ
૬૭. હુઅરે નોએદ અઓજોખશી
એત. આદ દઉઓ વીસપાઓ
મરેનચેંતે. યઆઓ હેંતે.ડ
પતો કેરેશો હુઆ નઊઆ એશ
મેનીઅઊઆ. યઆજત. આંઘ
હુઆ અસતુએત પેત દરાંમ.

નોએદ પૈતસતાંમ વીદેંતે. ઇએ,
ઇઅજત હુઅરે. ઇઅદ અમેશેમ
રેમ ઑરૂઅદ અસપેમ.

પૈતેશતાતે તેમઘાંમ. પૈતેશતાતે
તેમસચેથરનાંમ દશીઅનાંમ. પૈ
તેશતાતે તાઇઓનાંમચ હજ
શનાંમચ. પૈતેશતાતે ઇઆતો
નામચ પૈરેકનામચ. પૈતેશતાતે એ
થી અજંઘો મરેશોનહે ઇઅજત
અહુરેમ મજદાંમ. ઇઅજત અમેશે
સપેંતે. ઇઅજત હોમ ઑરૂઆ
નેમ. ખશનાઉઅથ્રએતે. વીશપ
મેનુઆએચ. ઇઅજત ગેથીઆ
એચ. ઇએ ઇઅજત હુઅરે ઇ
અદ. અમેશેમ રેમઑરૂઅદ અ

સપેમ. ઇઆજાએ. મેથરેમ વોઆૅ
રો ગાઇઓઆએતીમ. હજંઘરેમ
ગોશેમ એઊઆરે ચશમનેમ..ઇઆ
જાએ વનંરેમ. હુનેઊખતેમ.
કમેરેદે પેતે દેઊઆનાંમ. મેથરે
ઇઓ વોઆૅરોગોઇઓઆ એતાએશ
ઇઆજાએ હખેદરેમચ. ઇઆદ
આસતે હખેદરનાંમ. વહુશતેમ
અંતરે માઓંઘહેમચ. હુઆરેચ.
આહુરીઆ ખરનઘહુચ. તેમ
ઇઆજાએ સોરોનુઆત ઇઆસન
હુઆરેખશેતેમ અમેશેમ રેમ ઓઆરૂ
અંદ અસપેમ. જોથરાબીઓ.
હુઆરેખશેતેમ અમેશેમ રેમ ઓઆ
રૂઆદ અસપેમ ઇઆજમેદે. હો
મીઝ્દો ગઉઆ બારસમન. હુજુ

ઓ હંધંધ્રુ સાંથરેચ. વચ્ચ.
શી ઓથનસચ. જોથ્રવાઈઆસચ
અશ્શોખરેવીઆસચ. વાગવી
ઓ. ઇએંઘહે ડાલાંમ. આફ
ઇઆસને. પેંત વંઘો. મજદાઓં
અહુરો વેથા અશાઇ હુચા ઇઆ
ઓંઘામચા. તાંસચા. તાઓસચા
ઇઆજમેદ.

[ બાજમાં પઢે ] હોરમજ
દ ખોદાએ. અવજુની મરદુમ.
મરદુમ સરદગાં. હમા સરદગાં.
હુમ બાએસતે બેહા. ઓએમ
બેહદીન માજદીઆસનાં. આગ
હી આસતુઆની. નેકી રસાંનાદ.
એદુનબાદ.

[ પરગટ પઢે ] ઇઆથા અહુ વે
રીઓ (૨) ઇઆસનેમચ. વહમે
મચ. ઓઆજસચ. જઉઆરેચ. આ
ફરીનાંમે. હુઆરેખશેતહે. અમે
શાહે રેઉઆહે. ઑાકુઆદ આસપહે.
અશેમ વોહુ (૩) અહુરાનીશ અ
હુરહે. વહેશતાબીઓ જોથરાબી
આ. સરેશતાબીઓ. જોથરાબી
આ. દહમો પરંઘરેશતાબીઆ.
જોથરાબીઓ. અશેમ વોહુ (૧) એ
હમાઓરેસચ.-હજંઘરેમ-જસમે.
કેરેબા મુજદ. અશેમ વોહુ [૧]
રોજ [ફલાન] માહ [ફલાન]
ગેહે ( ફલાંન ) નમાજ દાદાર.

ગોડાંન હામાંન. ખશનોથર અહુ
રહે મજદાઓ. તરોએદીતે. અ
ઘરહે મેનીએઓાશ. હુથીઆ
વરશતાંમે હીઆદ વસોના. ફરશો
તમેમ. સતોમે અશેમ વોહુ [૧]

ગોરજખોરહે અવજાઇઆદ.
ખોરશેદ અમરઅ. રઇઓમંદ.
ઑરૂઅદ અસપ બેરેસાદ. અ
માવંદ પીરોજગર. અમાવંદી
પીરોજગરી. દાહદીનખેહ્રે માજદા
અસનાં. આગાહીરવાઇ ગોઆશ
રઆંની બાદ. હુપંત કેશવર જમી
ન એદુન બાદ. મંન આંનો

આવાઈઅદ શુદંન. મંજ આંનો આવાઇઅદ શુદંન. મજઆનો આવાઇઅદ શુદન અશોને અશેમ વોહુ [૧]

(દખણ દશા તરફ મોહોડું કરી પઢે.)

દાદાર ગેહાંન દીન માજદીઆસની. દાદ જરથોશતરી નેમસેતે અશોઅસાંમ સોઊઇઅસેશતે અરદુ ઇઝુર અનાહેતે. અશોને અશેમ વોહુ (૧) નેમો ઓરૂઅદ વંઘો હીશ મજદદાતહે. અશોને અશેમ વોહુ (૧) હુઅરેખશેતેમ. અસેશેમ રેમ ઓરૂઅદ આસપે

મ ઇઆજમેદે. આશેમ વોહુ (૧) ખારશેદ અમરગ રએઓમંદ. ઑરૂઅદ. અસપ બેરેસાદ આશેમ વોહુ [૧]

## મેહેર નીઆએશ.

૫ નાંમે ઇઆજદાંન. હોરમજદ ખોદાએ. અવજુની ગોરજ ખોરહેઆવજાઇઆદ. મેહેર ફરાગઈ ઑદ દાવરે રાસત બેરેસાદ. એજ હમાં ગોનાહ. પતેત પશેમા નોમ એજ હરવસતીન. દુશમત. દુજુખત. દુજુઅરેશત મેમ પે ગેથી મનીદ ઑએમ ગોશત.

આએમ ૬૨૬. આએમ જસત આએમ ખુન ખુદ અસતે દ માજાં ગોનોડા. મનશની. ગ વશની. કુનશની. તની રોઆંની ગેથી સીજાઆંની. આખે આવા ખશ. પશોમાંન પસે ગવશની. પ પતેત હોમ

નેમસેતે આહુરમજદ. નેમસેતે આહુરમજદ. નેમસેતે આહુ રમજદ. થરીસએદ. પરોઆનીઆ એશ. દામાંન નેમોવે આમે શા સપેંતા. વીસપ હુઆરે હ જોશ. એતદ નહાદ. આહુરેમ મજદાંમ. એતદ અમેશો સપેંત એતદ અસોનાંમ ફરૂઆશોશ.

એતહ વઇઆંમ હરેસા ખહાતે
મ. ખશનોથર આહુરહે મજદા
આ તશેઆદીતે. અંઘરહે મેની
આએઃશ. હુથીઆ વરશતોંમ.
હીઆદ વસનાં. ફરશોતમેમ. સતો
મે. અશેમ આશેમ વોહુ (૧)
ફરેસતોઇએ હુમતોએ બીઆ
સચા. હુખતોએ બીઆસચા. હુ
અરશતોએ બીઆસચા. માંથવો
એ બીઆસચા વખદોએ બી
આસચા. વરશતોએ બીઆસચા.
એબે ગેરીઆ દેથે વીસપા. હુ
મતાચા. હુખતાચા. હુઅરશતા
ચા. પેતે રેચીઆ દેથે વીસપા.
દુશમતાચા. દુજુખતાચા. દુજુ

અરસતાચા. ફ્રશ વીશહી અમે
શા સપેંતા. ઇઅસનેમચા. વહુ
મેમચા. ફ્રશ મનંઘા. ફ્રશ વચં
ઘા. ફ્રશ શીઓથનાં. ફ્રશ અંઘો
ઇઆ. ફ્રશ અનુઆસચીદ ખણી
આઓ ઓરુનેમ. સતામે અ
શેમ અશેમ વાહુ (૧)

નેમો અહુરાએ મજદાએ. ને
મો અહુરાએ મજદાએ. નેમો અ
હુરાએ મજદાએ. નેમો અમેશેબી
આ. સપેંતબીઆ. નેમો મેથરા
અ વાઆરો ગાઇઆએતે. ને
મો હુઅરેખશેતાએ આરૂઅદ
અસપાએ. નેમો આબી આ. દો
અથરાબીઆ. ઇઆ અહુરહે.

મજદાયઁા. નેમો ગેઍાશ. નેમો અઇઆહે. નેમો જરથોશત્રહે સ પેંતામહે. અશોનો ફ્રવશી. ને મેમ વીસપીઆઅઁા અશોનોસ્તો એશ. હેથીઆએચ. ખુઆં એ થીઆએચ. ખુશીઆં એથીઆ એચ.

( જો હાવંન ગેહે હોએ તો એમ પઢીએ.

વોહુ ઓખશીઆ મનંઘા. ખશ થરા અશાચા ઓશતા તનુમ. વોહુ ઓખશીઆ મનંઘા. ખશ થરા અશોચા ઓશતા તનુમ. વોહુ ઓખશીઆ મનંઘા ખશ થરા અશાચા ઓશતા તનુમ. શ્ર શેમ વોહુ (૩)

(જો રપીથવન અથવા બીજી હાવન ગેહે હોએ તો એમ પઢીએ.

**અમાઓ રેઆઓ બેરેજશતેમ. બેરેજેમનાંમ. અમાઓ રેઆઓ બેરેજશતેમ. બેરેજેમનાંમ. અમાઓ રેઆઓ બેરેજશતેમ. બેરેજેમનાંમ. અશેમ વોહુ (૩)**

(જો ઓજીરંન ગેહે હોએ તે એમ પઢીએ.)

**ઇઆહમી સપેંતા થવા મેનીઉ ઓરૂઅસે જસો. ઇઆહમી સપેંતા થવા મેનીઉ ઓરૂઅસે જસો. ઇઆહમી સપેંતા થવા મેનીઉ ઓરૂઅસે જસો. અશેમ વોહુ (૩)**

(હરએક અશેમ વોહુ પઢતાં સર નીચું કરી નમવું જોઇએ)

મેથ્રેમ વોઅૅારે ગોઇઓતીમ ઇઅજમેદે. અરશ વચંઘેમ. વીઆખનેમ. હજંઘ્રેમ ગોશેમ. હુતાશતેમ. બેવરે ચશમનેમ. બેરેજંતેમ. પેરેથો વેદીઅનેમ. સુરેમ અખફનેમ. જગાઅૅરૂઆઓંઘેમ. મેથરેમ વીસપનાંમ દખીઓનાંમ દંઘો પેતીમ. ઇઅજમેદે. ઇએમ ફરદથદ અહુરો મજદાઓ ખરેનંઘસતેમેમ. મેનીઅઊઅનાંમ. ઇઅજતનામ તદનો જમીઆત અઊઅંઘહે મેથ્ર-અહુર બેરેજંત. હુઅરેખશેતેમ. અમેશેમ રેમ. ઓરૂઅદ અસપેમ ઇઅજમેદે. તેશતરીમ દરૂઓ

અશમનેમ ઇઆજમેદે. તેશતરીમ હકુઓ અશમનેમ ઇઆજમેદે. તેશતરીમ હકુઓ અશમનેમ ઇઆજમેદે. તેશતરીમ ઇઆજમેદે. તેશતરીમ એનીઓ ઇઆજ મેદે. તેશતરીઓ રેઊઆઓ ખરેનંઘેહાઓ ઇઆજમેદે. વનંતે મ સતારેમ મજદાતેમ ઇઆજમેદે તેશતરીમ સતારેમ રેઊઅંતેમ ખરેનઘડંતેમ ઇઆજમેદે થવાશેમ ખદાતેમ ઇઆજમેદે. જરૂઆનેમ અકરનેમ ઇઆજમેદે. જરૂ આને મ દરેગા ખદાતેમ ઇઆજમેદે. વાતે મ સપેંતેમ હુદાઓંઘહેમ ઇઆજ મેદે. રજરાતાંમ ચેશતાંમ મજદદા

તાંમ અશોનીમ ઇઅજમેહે. હે
નાંમ વંઘાહીમ માજદીઅસનીમ
ઇઅજમેહે. ખુશાંમ આસતાતેમ
ઇઅજમેહે. જરેનોમંનેમ સુરેમ
ઇઅજમેહે. શોકંતેમ ગેરીમ મજ
દદ્ધાતેમ ઇઅજમેહે. વીસપેમચ
અશુઅનેમ મેનીઉીમ ઇઅજતેમ
ઇઅજમેહે. વીસપેમચ અશુઅનેમ
ગેથીમ ઇઅજતેમ ઇઅજમેહે.
હોમ ઑહૂઆનેમ ઇઅજમેહે.
હુઆંમ ફ્રૂઅશીમ ઇઅજમેહે
જસમે અઉીઅંઘહે મજદ અશા
ઑનાંમ વંઘોહીશ શુરાઑ સપેં
તાઓ ફ્રૂઅશીઓ ઇઅજમેહે.
મેથરેમ વોઓઃરો ગોઇઓઓતીમ
ઇઅજમેહે. અશેમ વોહુ (૩)

ફ્રુઅરાને મજદીઅસનો જર
થોશતરેશ વીદેઓઓ અહુરટ
કેશો.

( જે ગેહ હોએ તે પઢીએ. )

મેથરહે વોઅૅારો ગોઇઓઇ
તોશ. હજંઘર ગોશહે. બેઓઅરે
ચશમનો. ઓખતો નામનો યઅ
જતહે. રામનો ખાસતરહે. ખશ
નાથર. યઅસનાઇઅ. વહમા
ઇચ. ખશનોથराઇચ. ફ્રસાસ
તીઇચ. યઅથા અહુ વેરીઓ
જોતા ફ્રામે મરૂતે. અથા રતુશ
અશાત ચીત. હચ ફ્રા અશૌ
ઝા. વીદુઆઓ મરૌતુ
મેથરેમ વાઆરો ગોઇઓઇ
તીમ યઅજમેદ. અરશ વચંઘેમ

વીઆખનેમ. હુજંઘરેમ ગોશેમ હુતાશતેમ. બેઉઆરે ચશમનેમ. બેરેજંતેમ. પેરેથે વેદીઅનેમ. સુરેમ આખશ્નેમ. નગા ઓરૂઆ ઓંધેમ.

મેથરેમ એવે દખીઓમ ઇઆજમેદે. મેથરેમ અંતરે દખીઓમ ઇઆજમેદે. મેથરેમ આ દખીઓમ ઇઆજમેદે. મેથરેમ ઓપેરે દખીઓમ ઇઆજમેદે. મેથરેમ અદેરે દખીઓમ ઇઆજમેદે. મેથરેમ પેરે દખીઓમ ઇઆજમેદે. મેથરેમ એપે દખીઓમ ઇઆજમેદે. મેથરેમઆહુર બેરેજંત. એથી એજંઘહ અશુઅન ઇઆજમેદે. સતરેઓસરા. માઓં

ઘેમચ હુઅરેઅ એઆહુઅરાઍા.
પેતઅરેસમનીઆઍા. મેથરેમ
વીસપનાંમ દખીઍાનાંમ દંઘે પે
તીમ ઇઅઅજમેદ

આહુરીઅ ખરેનઘેડચ. તેમ
ઇઆજાઍ સોરોનુઅત ઇઅસન
મેથરેમ વાઍારે ગાઇઍાઍાતીમ
જોહરાબીઆ. મેથરેમ વાઍારે
ગાઇઍાઍાતીમ ઇઆજમેદ. રાંમ
શીઅનેમ હુશીઅનેમ. ઍારીઆ
બીઍા. દંઘેબીઍા. આચનો
જમોઆદ અઉઅંઘહે. આચનો
જમીઆદ રઉઅંઘહે. આચનો
જમીઆદ રશ્નંઘહે. આચનો
જમીઆદ મરેજદકાએ. આચનો

જમીઆદ બેશજીઆએ. આચ
ના જમીઆદ વેરેથરગ્નીઆએ.
આચનો જમીઓદ હુશીઅંઘા
એ. આચનો જમીઆદ અશુ
અશતાએ. ઓગરે અવથુરે
ઇએસનીઓ. વહુમીઓ. અન
એવ હરેખતો. વીસપેમ માઓં
ઘહે અસતુએત. મેથરો ઇઓ
વાઓરો ગોઇએઓતોએશ. તેમ
અમુઅં તેમ ઇઅજતેમ સુરેમ.
હાંમો એસેઉએસ તેમ. મેથરેમ
ઇઅજોઇપે જોથ્રઓીપો. તેમ પેરે
જસાએ. વનતેચ નેમંઘહુચ.
તેમ ઇઅજએ સોરેનુંઅત ઇઅ
સન. મેથરેમ વાઓરો ગોઇઓ

ઐતીમ જોથરાબીઓ. મેથરેમ વો ઔરો ગોઇઓપેતીમ ઇઅજમેદે.

હુમીઓ ગઊઅ બરેસમન. હુજીઓ હઘંધહ. માંથરેચ. વચ ચ. શીઓથનસચ. જોથરાબીઅ સચ. અરશોખદબીઅસચ વાગ નગીઓ. ઇમેંઘહે હાતાંમ. આદ ઇઅસને. પતે વંધો. મજદા ઔ અહુરો વેથા અશાદ હચા ઇઆઔઘાંમચા. તાંસચા. તાઔ સચા ઇઅજમેદે.

[ બાજમાં પઢે ] હોરમજદ ખોદાએ અવજુની મરદુમ. મરદુમ સરદગાં. હમા સરદગાં હમ બખ્શેસત બેહાં. ઔએમ બેહે દીને માજદીઅસનાં. આગાહી

ખાસતુઆંની. બેરી સ્ત્રાનાંદ. એદુન બાદ. (ધરગાદ પઢે) ઇઆ થા અહુ વેરીઓ [૨]

ઇઆસનેમચ. વહુમેમચ. ઓ જસચ. જઊઆરેચ. આફ્રીનાં મે. મેથ્રહે વાઓઓરૂ ગોઇઓ એતાએશ. હુજંઘર ગોશહે. અ ઊઆરે ચશમનો. ઓઆખ્તો નાંમ નો ઇઆઝતહે. રામનો ખાસત રહે. અશેમ વોહુ [૧] અહમા રેરેસચ.—હુંજ ઘેર જ —જ્દુમે. — કેરબા મુજદ.—અશેમ વોહુ[૧]

શેજ (કુશાંજ) બાદ [કુશાંજ] ગાહે [કુશાંજ] બગાજ દાદાર. ગેહાંન દાનાંન. પશેનાથર અહુ

રહે મજદાઓં. તરોએદીતે. અં
ઘરહે મેનીઓઓશે. હુથીઆવર
શતાંમ. દીઅદ વસના. ફ્રશોતે
મેમ. શતામે અશોમ અશોમ વાહુ
(૨) ગાસ્જ બારહે આવજાઇઆદ
મેહેર ફ્રરાગાઇથોદ. હાવરે રાસન
બેરેસાદ. અમાવંદ પીરોજગર.
અમાવંદી પીરોજગરી. દાદ દીન
બેહે મોજદીઅસનાં. આગાદી
રવાઇ ગોઆફ્રરંગાની બાદ. ઇપન
કેશવર જમીન બેહુન બાદ. મન
આનો આવાઇઅદ શુદંન. મંન
આનો આવાઇઅદ શુદંન. મંન
આનો આવાઇઅદ શુદંન. અશો
ને અશોમ વાહુ [૨]

(દખાણ દશાની તરફ મોહડું કરીને પઢે)

દાદાર ગેહાંન દીન માજદીઅ સની દાદ જરથોશતરી નેમસેત અશાઓંમ સેઉઇએશતે અરદુઇ સુર આનાહેતે. અશોને અશેમ વોહુ (૧) નેમો ઓંરૂઅર વંઘો દીશ મજદદાતહે. અશોને અશેમ વોહુ (૧) મેથરેમ વોઓંરો ગોઇ ઓએતીમ ઇઆજમેદે. અશેમ વોહુ (૧) મેહેર ફરા ગઇઓદ દાવરે રાસત ઍરેસાદ. અશેમ વોહુ (૧)

## હુવા વીસપ હુમત.

(હાવન ગેહમાં ખોરશેદ મેહેરની નીઆ એશ કીધા પછી પઢીએ.)

વીસપં હુમત. વીસપ હુખત. વીસપ હુઅરેશત. ખોદા વરેશત વીસપ હુશમત. વીસપ હુજીખત. વીસપ હુજીઅરેસત. નાએદ ખોદા વરેશત. વીસપ હુમત. વીસપ હુખત. વીસપ હુઅરેશત. વહેશ તેમ અંધોહીમ એસેતે. વીસપ હુશમત. વીસપ હુજીખત. વીસપ હુજીઅરેશત. અચેશતેમ અંધો હીમ એસેતે. વીસપનાંમચ હુમત નાંમ. હુખતનામ. હુઅરશતનાંમ.

વહેશતેમ આં ઘોહીમ અેાદ હુચ્યે
થરેમ અશેમ વોહુ (૧) વાર ૩ પઢે)

## હુઆ નાંમ સેતાએશને.

(હર વખત નીઆએશ તથા ઇઅર
પઢેઆ પછી પઢીએ.)

ખશનોથર અહુરહે મજદાએ
અશેમ વોહુ (૧) બનામે ઇઅજદ
બખસાએંદહે બખશાએશગર.
મેહેરબાંન. નાંમ સેતાએશને ઑ
હોરમજદ. ઑ હમા બુદ. ઑ
હમા હસત. ઑ હમા બેદ.
નાંમ એજદ સપેનામીનો. અંદર
ચ મેનુઆંન. મીનો. અજશ
બોદશ. ઇઆકનાંમ હોરમજદ એ
બાદાએ મેહેસત. એ તવાંનાં.

ઑ દાંનાં. ઑ દાદાર. ઑ પર
વરદેગાર. ઑ પાંના. ઑ ખાવર.
ઑ કેરફેગર. ઑ અવખશીદાર.
ઑ વેજ વેહ દાદસતાંની. હમા
જોર સેપાસ. ઓએ બજોરગ
હસતીઆંન. કે આફરીદ. અવ
નીદ. ઑ પખેશ. અંગાંમ બતી.
જોર દાંનાઇ. અવર તરશશ અમે
શાસપંદાંન. અવદ વોસ ઇઆજ
દાંન. રોશંન બેહેશત ગરોથમાંન.
ઑ ગેરદ આસમાંન. ઑ ખુર
તાવા. ઑ માહબાંમી. ઑ સત
રવસ તોખમ આદ અંદર ઓઆપે.
આવ ઑ આતશ. ઑ જમીન
ઑ ઑરૂઅર. ઑ ગોસપંદ.
ઑ અઇઓખશસત. ઑ મરદુમ.

ઇઆનજશને. ઓ નીઆએશને.
અજ એઆએ એહાએ કેરફેગર.
કે મેહે કરદ. અજ હર ગેતીહા
દેહેશનાં મરદુમ પ ગવાએશ.
મા હાંમ દાદ એઆહે શેહેરીઆરેશ.
અંઆંગ ઓઆઇએની દાઇશ દામાં
ન. પ રખમ. અંગેજશન. પર
હેજ દેવાંન. નમાજ એઆએ વી
સપ આગાહ અશ ખાવર. કેશ
ફરેસતીહ. પ જરથોશતર સપેંત
માંન અશો ફરોહર. અશતશઓ
એ દામાંન. દીન દાંનેશને. રેશન.
આશન ખેરદી. ગોશો સરૂત ખેરદી.
ઓ દાનાએશ. ઓ રાએનીદારેશ
વીસપ હસતાંન. ઓ ખુદાંન.
ઓ બેહેદાંન. ફરહંગાંન ફરહંગ

માંથરહે સપેંતે. હુમેદ રોઆંન.
હુપુલ બોખતાહેશ. અજ હોજખ
વહારદાર. બોઓ આને પેહેલુમ
અખાંન. અશોઆંન રોશંન હુંદ.
હુ બોઓ હુમા નેકશ ય ફરમાંન
તો ખાવર. ય ફરમાંનેતો ખાવર.
ય ફરમાને તો ખાવર.

પદીરમ. ઑ મીનમ. ઑ ગોએ
મ. ઑ વરજમ. દીન અવીનડ
આસતુઆં હોમ. ય ડર કેશે
અવાખશ. અજ વીનપે એહુજ
આવેજ દારોમ. બોદશ આશ
નીદે હુનશને. પરહેજશને. ઑ
યાક શશ. જોશંન જાંન. મનશને.
ગવશને. હુનશને. ઑ વીર. ઑ
હોશ. ઑ બેરદ. ય હાંમ તો

કેરેશ્ગાર તવાંનમ ફ્રરૂદ. આંતેતા
પરશતશેન્. પ બેહ્રે મનશેનેશ.
બેહ્રે ગાવશનેશ. બેહ્રે વુરજશનેશ.
વશાએમ રાહ્રે રોશંન. એઆમ
નરસાદ ગોરાંન. પરદે હોજખ.
વહીરૂમ પ એશ પંદરગ. રસ્મ
આંન બેહ્રુશત પુર બોએ. ઙરવે
સપ પેસીદ. હુમાખારેઙ સેતાએ
શને. એઆએ અવખશીદાર. બો
દાએ કુફાંમ કેરેશ્ગાર. પાદાએશને
કુનદ. ફરમાંન રાએનીદારાંન.
અવહેમ બુઝ્દ ફ્રુઅંદાન. અજ
હોજખ. એ ચાવેનઙા વીનારેદ.
☞ વીસપ સેતાએશને. દાદાર
હોરમજદ. ઙરવેસપ આગાઙ.
તવાંના. એ તવંગર. હુસ્ત આમે

શાશપંદ. બેહેરાંમ ઇઅજદ પીરોઝ જગર. દુશમંન જદાર. અમહે હુતાશતહેં બેરેસાદ. અશેમ વોહુ (૧) (વાર ૩ પઢે)

## નમસકાર ચેહારે દશાનો

(ખોરશેદ મેહેરની નીઆએશ તથા દુઆ પઢેયા પછે ચેહારે દશાની તરફ ફરી ફરીને પઢો)

અએજ ડમા ગોનાડ. પતેત પશેમાનોમ. અશેમ વોહુ (૧)

☞ નેમો આઓંઘાંમ અસંગાંમચ. શોએથર નાંમચ. ગોઇઆએતનાંમચ. મેથનનાંમચ.

અઉઈઓ ખરેનબાંમચ. અપાંમચ. નેમાંમચ. ઑરૂઅરનાંમચ. અંઘા ઑસચ નેમો અઉઅંઘહેચ અસનો. વાતહેચ અશોનો. સતા રાંમ. માઑંધો હુરો. અનગર નાંમ. રોચંઘાંમ ખહાતનાંમ. વીસ્પનાંમચ સપેનતહે મેનીઓ ઑશ હામનાંમ. અશોનામ અશોનેનાંમચ અશહે રથવાંમ. અશેમ વોહુ (૧) અહુમાઓરેસચ. હુજંઘરેમ.——જસમે.—— કેરેબા મુજદ.—અશેમ વોહુ (૧)

એ માહા નીઆએશને દર મહીનામાં તરણ મરતબે જરૂર પઢવી.

ચાંદરાત—પુનમ—અને અમાસ

## માહા બોખતાર નીઆએશ.

૫ નાંમે ઇઅજદાંન. હોરમજદ ખોદાએ. અવજુની ગોરજ ખોરહે અવજાઈઆદ. માહાબોખતાર માહ ઇઅજદ બેરેસાદ. એજ હમાં ગોનાહ. પતેત પશેમાનોમ એજ હરવસતીન. દુશમત. દુજુખત. દુજુઅરેશત. મેંમ ગેથી મનીદ ઓઆએમ ગોફ્ત. ઓઆએમ કરદ. ઓઆએમે જસત. ઓઆએમ બુન બુદ એસ તેદ. આજા ગોનેહા. મેનશની. ગવશની.

કુનશની. તની હોઆંની ગથી મા
નાઆંની. આણે અવાખશ. પશે
માંત પશે ગવશની. ૫૫તત હોમ.

નેમો અહુરાએ મજદાએ.
નેમો અમેશેઓઆ સપેનતેઓ
આ. નેમો [માઓંઘાએ ગો
એથરાએ.] નેમો પેત દીતાઓ.
નેમો પેતે દીત. નેમો અહુરાએ
મજદાએ. નેમો અમેશેઓઆ સ
પેનતેઓઆ. નેમો માઓંઘાએ
ગોએથરાએ. નેમો પેતે દીતઃઓ
નેમો પેત દીત. નેમો અહુરાએ
મજદાએ. નેમો અમેશેઓઆ
સપેનતેઓઆ. નેમો માઓંઘાએ
ગોએથરાએ. નેમો પેત દીતાઓ

નેમો પેતીતે. પશેનાથર અહુરે
હે મઝદાઓ. તશ્યેહીતે. અ
ઘરહે મેનીઆઅઆશ. હેથીઆ વ
રેશાનાંમ. હીઆહ વસના. ફ્રશોતે
મેમ. સતોમે અશેમ. અશેમ૦ (૩)

ફ્રૂઆરાને મઝદીઆસનો
જરથોશત્રેશ. વીદેઓઆ: અહુર
હે ત્કેશો.

[અવેસરૂથ્રેમ ગેહમાં પઢવું]

અએવેસરૂથ્રેમાએ અએબેગાઇઆએ
અશોને અશહે રથવે. ઇઆસના
એચ વહમાએચ. ખશનાઓથરા
એચ ફરસસ્તીએચ. ફ્રાદદ વી
સપાંમ હુજીઆએત. જરથોશત
રો તેમાએચ. અશોને અશહે

રથ્વે ઇઅસ્નાએચ. વહ્માએચ. ખશ્નોથ્રાએચ. ફ્રસસ્તીએચ.

[ ઉશહેન ગેહમાં પઢવું. ]

ઓશહિનાએ અશોને અશહે રથ્વે. ઇઅસનાએચ. વહ્માએ ચ. ખશ્નોથ્રાએચ. ફ્રસસ્તી એચ. બેરેજ્યાએ નમાનીઆ એચ અશોને અશહે રથ્વે. ઇ અશનાએચ. વહ્માએચ. ખશ નોથ્રાએચ ફ્રસસ્તીએચ,

*　*　*　*　*　*

માઓંઘહે ગઓથ્રહે. ગેઓ શચ એઉઈએ. દાએતીઆઓ. ગેઓશચ પોઓરુ સરેદીઆઓ ખશનોથ્ર ઇઅસનાએચ. વહ્મા

એચ. અશનોથરાએચ. ફરસસ
તીએચ. ઇઆથા અહુ વેરીઆ
જોતા. ફરામે મરૂતે. અથારતુશ
અશાહ ચીહ્ર. હચ ફરા અશુઅ
વીદુઆઓ મરોતુ.

નેમા અહુરાએ મજદાએ નેમા
અમેશેગ્નીઆ. સપેન્તેગ્નીઆ
નેમો માઓંઘાએ. ગોચેથરાએ.
નેમો પેતે દીતાઓ. નેમા પેતે
દીતે. કદ માઓ ઓખરીએતે.
કદ માઓ નેરેફસેતે. પંચ દસ
માઓ ઓખરીએતે. પંચ દસ
માઓ નેરફસેતે. ઇઆઓ હે
ઓખરીઆંસતાતો. તાઓ નેરે
ફરીઆંસતાતો. તાઓ નેરેફરી

આંસતાતો. ઇઆઓ કે ઓખ
શીઆંસ તાવસાચીદ. કે ઇઆઓ
માઓ ઓખશીએત. નેરેફ્સેત
થવદ માઓંઘહેમ ગોએથરેમ
અશુઅનેમ અશાહે રતુમ ઇઅજ
મેદે. તદ માઓંઘહેમ પેત વેનેમ.
તદ માઓંઘહેમ પેતવીસેમ. રોખ
શનેમ માઓંઘહેમ અવે વેનેમ.
રોખશનેમ માઓંઘહેમ અવે
વીસેમ. હુશતેંત અમેશા સ્પેંતા
ખરેનો દારીઅંત. હુશતેંત અ
મેશાસ્પેંતા ખરેનો અપરોંત.
જાંમ પેતે અહુરદાતાંમ. આક
ઇઅદ માઓંઘહે રોખશને તાપી
એત. મેશાતે અરૂઅરનાંમ. જ

રેગોનનાંમ. જરમેય પેત જમાદ.
આજુખશીએઅંતે. અંતરે મા
ઓંઘડાઓસચ. પેરેનો માઃઓં
ઘડાઓસચ. વીસપ તથાઓસચ.
અંતરે માઓંઘહેમ અશુઅનેમ
અશાહે રતુમ ઇઅજમેદે. પેરેનો
માઓંઘહેમ અશુઅનેમ અશાહે
રતુમ ઇઅજમેદે. વીસપતથેમ
અશુઅનેમ અશાહે રતુમ ઇઅજ
મેદે. ઇઅજાએ માઓંઘહેમ
ગોએથરેમ. ખગેમ રેઉઅતેમ.
ખરેનઘંહતેમ. અશ્ન ઘહંતેમ.
તષ્ન ઘહંતેમ. વરેચ ઘહંતેમ.
ખશાતાઉઅંતેમ. ઇશતુઅંતેમ
ઇઓખશતુઅંતેમ. સોકુઅંતેમ.

જરેમીઆઉઅંતેમ. વોહુઆઉઅં તેમ· બગેમ બેશજેમ.

અહુરીઅ ખરેનઘહુચ. તેમ ઇઅજાએ સોરેનુઅત ઇઅસન. માઓંઘહુમ ગોચેથરેમ જોથરાબીઓ. માઓંઘહુમ ગોચેથરેમ અશુ અનેમ અશહુ રતુમ ઇઅજમેહે.

હુમીઓ ગઊઅ બરેસમન. હુજુઓ દંઘંઘહુ માંથરેચ. વચચ શીઓથનસચ. જોથરાબીઅસચ. અરશોખદબીઅસચ. વાગજબીઓ. ઇએંઘહુ હાતાંમ. આદ ઇઅસને. પૈતે વંઘો. મજદાઓ અહુરો વેથા અશાદ હચા ઇઅ, ઓંઘાંમચા. તાંસચા. તાઓસચા ઇઅજમેહે.

( બાજમાં પઢે ) હોરમજદ
ખોદાએ. અવજુની મરદુમ.
મરદુમ સરદગાં. હમા સરદગાં.
હમ બાએસત બેહડાં. ઑએમ
બેહેદીને માજદીઅસનાં. આગાહી
આસતુઆંની. નેકી રસાંનાદ.
એદુન બાદ. (પરગટ પઢે) ઇઅથા
આહુ વેરીઓ (૨)

ઇઅસનેમચ. વહમેમચ. આ
જસચ. જઊિઅરેસચ. આફરી
નામે. માઑંધહે ગોએથરહે.
ગેઑસચ એઉઓ દાએતીઆ
ઑ. ગેઑસચ પોઑરો સરેદી
આઑ. અશેમ વોહુ. (૩)

દસત અમેમ. વેરેથરગનેમ. દસત ગેર્ઓશ ખાથરોનહી. દસત નરાંમ પોઓરૂઅતાતેમ. સનાહી અનામ. વીઆખનાંમ. વનંનતી મ. અઊિઅને મનનાંમ. હથરૂઅં તાંમ. હમેરેથે હથરૂઅંતાંમ. દુશ મેનીઓશ. સતેરપેંતાંમ. એથરા અઊિઅંધેમ. ઇઅજત પોઓરો ખરેનંધાડ ઇઅજત પોઓરો બેશ જીઅ એથર વોઓરો બોઇઆરેશ એથર વોઓરો જઊિઅનો શુઓ મશાનાર્ઓ એથરેમ બોએદીએ નમ. તઈ ખરેનો ઇઅજમનાએ આપો દાઇઅત અશોમ વાહુ

(૧) અહુમાએરેસચ—હુજંઘરેમ
જસમે-ફ્રેરેથાસુજદ અશેમવો૦૧)

રોજ [ફલાન] માહા [ફલાંન]
ગેહ [ફલાંન] નમાજ દાદાર ગે
હાંન દામાંન. ખશનોથર અહુર
હે મજદાઓ. નેમો અહુરાએ મ
જદાએ. નેમો અમેશેઆએ. સ
પેનતેઆએ. નેમો માઓંઘાએ
ગાએથરાએ. નેમો પેત દીતાઓ
નેમો પેત દીત. અશેમ વોહુ (૧)

ગોરજ ખોરહે અવજાઇઆદ.
માહ બોખતાર માહ ઇઅજદ
બેરેસાદ. અમાવંદ પીરોજગર
અમાવંદ્દી પીરોજગરી. દાદ દીન
બેહે માજદીઅસનાં. આગહી

રવાઇ ગોઆઝરગાંની બાદ. હપત
કેશવર જમીન એદુન બાદ. મ'ન
આંના આવાઈઆદ શુદ'ન મ'ન
આંના આવાઇઆદ શુદ'ન. મ'ન
આંના આવાઇઆદ શુદન. અશો
ને અશેમ વોહુ (૧)
(દખાણ દશાની તરફ મોહડું કરીને પઢે)

દાદાર ગેહાન દીન માજદીઆ
સ્નની. દાદ જરથોશતરી નેમસેત
અશાઓંમ સેઉદઅશતે અરદુઇ
સુર અનાહિતે. અશોને અશેમ
વોહુ (૧) નેમો ઓંરૂઅર વ'ધોહી
શ મજદદાતહે. અશોને અશેમ
વોહુ (૧) માઓંઘહેમ ગોચેથરેમ
અશુઅનેમ અશહે રતુમ ઇઆજ

એદે. અશેમ વોહુ. (૧) માહા બોખતાર માહ ઇઆજદ બેરેસાદ અશેમ વોહુ (૧)

---

## આવાં અરદુઇસુર નીઆએશ.

૫ નાંમે ઇઆજદાંન. હોરમજદ ખોદાએ. અવજુની. ગોરજ ખોરહે અવજાઇઆદ. આવાં અરદુઇસુર બાંનો બેરેસાદ. ઐજ હમા ગોનાહ. પતેત પશેમાનોમ એજ હરવસતીન. દુશમત દુજુખત. દુજુઅરેશત મેમ. ૫ ગેતી મનીદ. ઓંએમ ગોશ્ન. ઓંએમ કરદ. ઓંએમ જસત ઓંએમ બુન બુદ એસતેદ.

અજાંગોનેહા મનાશની. ગાવશની. ફુનાશની. તની રોઆંની. ગેથી મીનોઆંની. એ:ખ અવા ખશ. પરોમાંન પસે ગાવશની. પ પતેત હોમ. ખશનોથર અહુરહે મજદાઓ. તરોએ દીત અંઘરહે મેનીએઓશ. હુથીઆ: વરશતાં મ. હીઅદ વશના. ફ્રશોતેમમ સતોમે અશેમ અશેમ વોહુ (૩) ફ્રરૂઅરાને મજદીઅસનો જરથો શતરેશ વીદેઉપો અહુરહે દકેશો.

(હાવંન ગેહ હોય તો એમ પઢે.)

હાઉઅને અશોને અશાહે રથવે. ઇઅસનાએચ. વહમાએ ચ. ખશનોથરાએચ. ફ્રસસતી

એચ. સાઉઅંઘહે વીસીઆએ
ચ અશોને અશહે રથવે ઇઅસ
નાએચ. વહમાએચ. ખશનોથ
રાએચ. ફરસસતીએચ.

(જો રપીથવંન ગેહ હોએ. તો એમ પઢીએ.)

રપીથ્વનાએ અશોને અશહે
રથવે. ઇઅસનાએચ. વહમાએ
ચ. ખશનોથરાએચ. ફરસસતી
એચ. ફરાદક ફશુઅ જંતોમા
એચ અશોને અશહે રથવે.
ઇઅસનાએચ. વહમાએચ. ખશ
નોથરાએચ. ફરસસતીએચ.

(જો ઓજીરંન ગેહ હોએ તો એમ પઢીએ)

ઓજીરનાએ અશોને અશહે
રથવે. ઇઅસનાએચ. વહમાએ
ચ. ખશનોથરાએચ ફરસસતી

એચ. ફરાદદ વીરાએ દખીઓા
માએચ. અશોને અશહુ રથતે.
ઇઆસનાએચ વહમાએચ ખશ
નોથરાએચ ફરસસતીએચ.

* * * * *

અપાંમ વંધોહુનાંમ. મજદદા
તનાંમ. અરેદુઇઆઓા આપો
અનાહુતીઆઓા. અશોનીઆ
ઓા. વીસપનાંમચ અપાંમ મજ
દદાતનાંમ વીસપનાંમચ ઓાકૃઅ
રનાંમ. મજદદાતનાંમ. ખશનોથ
ર. ઇઆસનાએચ. વહમાએચ.
ખશનોથરાએચ. ફરસસતીએચ.
ઇઅથા અહુ વેરીઓા જોતા
ફરામે મરૂતે. અથા રતુશ. અશાદ
ચીદ. હચ ફરા અશુચા.

વીદ્દુઆર્ચો મરેતુ. ઈઆથા
અહુવેરીઅ (૧૦)

મરોદ અહુરો મજદાર્ચો.
સપેતમાર્ચે. જરથેશાતરાએ.
ઈઅેજેશમે હીમ. સપેતમ જરથો
શતર ઈઆામ અરેદુઈમ શુરામ
અનાહેતાંમ. પેરેથા ફ્રાકામ
બેશજ્આાંમ. વીદેઊીઆાંમ અહુ
રે દકેશાંમ. ઈઅસનીઆાંમ. અ
ઘહે અસતુઅતે. વહમીઆાંમ
અંઘહે અસતુએતે. આદુ ફ્રા
દનાંમ અશોનીમ. વાંથવો ફ્રાદ
નાંમ અશોનીમ. ગેથો ફ્રાદનાંમ
અશોનીમ. ખશેતો ફ્રાદનાંમ
અશોનીમ. દંઘો ફ્રાદનાંમ અ
શોનીમ. ઈઆ વીસપંનાંમ અર

૧૧૭ આવાં અરદુઈસુર નીઆઍશ
શનાંમ ખશોહરાઍાૅ ઇઍાજદહા
ઍત. ઇઆ વીસપનાંમ ડાઍરે
શનાંમ જાંથાઍ ગેરેવાંન ઇઍા
જદહાઍત. ઇઆ વીસપાઍા
ડાઍરેશીશ. હુજામેતા દહાઍત
ઇઆ વીસપનાંમ ડાઍરેશનાંમ
દાઍાતીમ રથવીમ પેમે. અઊઆ
બરેતે મસેતાંમ દુરાદ ફરસરૂતાં
મ. ઇઆ અસતે. અઊઆ અઊ
અતે મસો ઇઅથ. વીસપાઍાૅ.
ઍમાઍાૅ. આપો ઇઆગ્રાૅ ન
માઍાૅ. પેતે ફરતઍાેગતે ઇઆ અ
મુઍત. ફરતઍેત. હુ કેરીઆદ
હુચ બેરેજંઘાદ. અઊઍ નરી
ઍા. વાઍારો કશોમ. ઇઍાનંતે

વીસપો કરનો જરીઆએ. વો
અૉશો કશીઆએ. આ વીસપો
મેદીએ. ઈઓનતે. ઈઅદ હીશ
અઉઅ ફ્રતચેતે. ઈઅદ હીશ
અઊઅ ફ્રરજ ગેરેતે. અરદઈસુર
આનાહેતે. ઈઅંવહે હંજંઘરેમ
વેરીઆનાંમ હંજંઘરેમ આપ ગા
જારનાંમ કસચહચ એશાંમ વેરીઆ
નાંમ કસચહચ એશાંમ અપઝાજાર
નાંમ. એથવરેસતેમ. અઈઆરે અરે
નાંમ. હુઅસપાએ નરે અરેમના
એ. અંઘાઅૉસચ મે અઊઅં
ઘાઅૉ આપો અપ ગજારો.
વીજસેતે વીસપાએશ. અઊઅ
કેરેશુઆંન. ઈઆએશ હપત.
અ ઘાઅૉસચ મે અઊ અંઘાઅૉ.

આપો હમથ. અઊઅ બરેતે. હા મનેમચ જીઅનેમચ. હા મે આપો ઇઅોજદદાએતે. હા અરશનાંમ ખશો દરાઅેા. હા ખશથરનાંમ ગેરેવાંન હા ખશથરનામ પેમે.

(જેને નીચલો હા નહી પઢવો હોય તે પુરો થાય ત્યાં સુધી નહી પઢે.)

[ આહુતાંમચનાં હા, પઢે. ]

આહુતાંમચ. અંઘોશાંમચ જાતનાંમચ અજાતનામચ અશો નાંમ યદ જસેંતો રફુઅશીઓ ઇઓ હીશ બેવરેરે. પેતે આપેમ નજદેશતીઆદ. અપદ હચ માનો આપો દોશ મનંઘહ. માનો આપો દોશ વંચઘહ.

માનો આપો દાશ શીખ્યોથનાય. માદુજદેનાય. મા હુશ દ્દખેરો. મા સોગો દ્દખેરા. મા વેરેજાનો દ્દખેરો. મા નાફ્રીઅ। દ્દખેરો માદ્દનો અડમે ફ્રદાયતે. આપો વંધોહીશ વ હુશતાઓ મજદ્દહાતાઓ અશો નીશ. ઇઓનો યરીરેયેનાંમ. રીર ખશાયતે ગેથેનાંમ. માદનો આડમે. ફ્રદાયતે. આપો વંધોહીશ વહુશતાઓ મજદ્દહાતાઓ અશોનીશ. ઇઅનો યરીરેયેનાંમ. રીરખશાયતે તનોનાંમ. ઇઓ નાઇ આશ ઇઓ ડજ ઘહો. ઇઓ ગદો. ઇઓ અશુઅજ. ઇઓ ઇઅાતોમા ઓ. ઇઓ નસોસપાઓ. ઇઅ।

સપેરેજુઆઆઁ. ઇવ્યો અરાય તુઆઆઁ. ઇવ્યો અરેમાગો. અન અશુઅ. ઇવ્યો મશીવ્યો દરૂ આઆઁ સાસત. તેમ અઊય દએ શાઆઁ પેતીઅંતો. યથીયજાઆઁ દશ ઇવ્યો દદદ યથીયજાવ્યો દ યંતો. દ્વ્યોય દદદદ.

આપો ગાતુવ્યો. ગામોય દવેમ દઊત જોત દઅજાયતે. કથજોત ખરાયતે. વઅ આપો વંઘોહીશ દઅજાયતે. કોથર ઘુઆદ હેતો હેંજુઆઃઆઁ. દયજ અમરેથ દઅજાયતે. કોથર વાહો અઊય બુયતે. દઆંમ હેચખશે. યથરપે તશ. કોથર તાઆઁ ફરીવ્યો બુઆંન. કોથર તાઆઁ યશદા બુઆન.

કોથર તાર્યો રાયતીઓ ભુઆંન
ઇઆંમ અહુરહે મજદાર્યો જર
થોશતરાય. ફરાીઆચ. ફરા
જરથોશતરો. ગેથાબીઓ અસતુ
યતબીશે.અઉયજોસતીમપોર્યારૂ
આંમ. આપો નહીઓયશ. જર
થોશતર. પેસચેત. ચમાર્યો જો
ફરાર્યો. ફરથરોયશ. ઇઓજદા
તાર્યો. દડમો પરેશતાર્યો યમાં
મ વરેઓ. ફરમઝુઆ. આપો ઈઆ
નેમ. વો ઇઆસામે મજદાર્યો
અતેમ. તેમ. મે દાઇઅત. ઇયં
ઘહે દાઇઅતે. પેતવંધો નેસરીત.
અનયવે દરોખત. આપો ઇશતીમ
વો નહીઆમે. પોર્યારો સરેદાંમ
અમુયતીમ ફરજંતીમચ ખાપરાં

મ. ઇયંઘાઓ પોરોસચ્ય એરેજી આંન. નેચેશ અંઘાઓ ઇઆ સાયતે. જીઆનાય. નાયદસનેથાય નાયદ મહ્ડરકાય. નાંયદ યનઘહે. નાયદ અપીયતે.

યમદ વો આપો નહીયમે. યમદ નમો. યમદ ઓહુઅરાઓ યમદ અમેશાસપેંતા. હુખરાથરા હુદાઓંઘહો. વંઘહુસચ્ય વંઘહીસચ્ય. વોહુનાંમ હાતાંરો યમદ અશોનાંમ વંઘોહીશ સુરાઓ સપેંતાઓ ફ્રૂઅશીઓ. ઓગરાઓ યવેશુરાઓ. યમદ મેથરહે વાઓરો ગોઇઓયતેશ. યમદ સરોસહે યસીહે હરોદ. યમદ

રશનુઓ રજેશત. યમહ આથરો
અહુરહે મજહાઓ ોથર યમહ
બેરજ અહુરે ખશથરીઅ.

અપાંમનપોઓારૂઅહ અસપ.
યમહ વીસપ ઇઅજતાઓંધહો.
ઇઓ વંધહોજહાઓ અશોનો.
યમહ મે આપો હાઇઅત. યમહ
નમો. યમહ ઓારૂઅરાઓ. યમહ
અમેશા સપેંતા હુખશથરા હુદા
ઓંધહો. વંધહુસચ વંઘહીસચ
વેહુનામ શાતારો. યમહ અશો
નામ વંધોહીશ સુરાઓ સપેંતા
ઓ શરૂઅશીઓ. ઓાગરાઓ
યવેથુરાઓ. યમહ મેશરહે વો
ઓારો ગોઇઓયતાયશ. યમહ સ

રેશહે અશીઅહે હુરેહહે યમઙ
રશાનુશ્પો રજીશાત. યમહ આથરો
અહુરહે મઝદાઓ પોથ્ર. યમહ
બેરેજ અહુર બશાથરીઅ.

અપાંમ નપો ઓરૂઅહ અસપ. યમહ વીસપ ઇઅંજતાઓંઘહો ઇશ્મોય વંધોંજદાઓ અશોનો. ઇઅહ્યચ અહુંમાહ અસતે મઝ્યો. ઇઅહ્યચ અહુંમાહ અસતે વંધો. ઇઅહ્યચ અહુંમાહ અસતે સરીશ્પો. ઇઅહ્યચ અહુંમાહ અસતે ફ્રેરો અરે જસતરેમ. તહનો દાઇઅત ઇઉજેમ ઇઅજત. અશુઅનો ખશીઅમનો. યશાને મોશોચ. આસો ઇઆચ. હથર આન. ગાથ

વીઅ વચ. હુથીઆ વરશતાંમ. હીઅદ વસના. ફ્રસોતેમેમ.

( આહુતામચનો હા પુરો )

ઇઆંમ અનેમ ઇએ્આ અહુરો મજદાઓ. હુજુઆરેન ઓજ મેરે. ફ્રદથાએ અહુ નમાનહુ ચ. વીસહુચ. જંતઓસચ. દંગે ઓસચ. ઇઆ અહુમાદ. સતાત ઇઅસનેમ સરાઊઇએને. અહુને મચ વેરીમ સરાઊઇએને. અશે મચ વહુશતેમ હુસરૂઆને. અપ સચ વંઘેઓશ ઇએ્આજદથાને. હુથર અંન ગાથાવીઅ વચ. ગરો નમાનેમ. અહુરહે મજદા ઓ. જસદ પોએ્રીએ્આ દથદ

આડમાહ તદ અશીઅદ આઇ
અપતેમ અહુરીઅ ખરેનઘચ.
તાંમ ઇઅજાએ સોરેનુઅત
ઇઅસન. તાંમ ઇઅજાએ હુઇઅ
શત ઇઅસન. અન જોઇઆઓ
જુઅનો સાસત. અન જોઇઆ
ઓ હુઇઆશત. અરેદુઇમ સુરાંમ
અનાહિતાંમ અશોનીમ જોથરા
બીઓ. અરેદુઇમ સુરાંમ અના
હિતાંમ અશોનીમ આશહિ રતુમ
ઇઅજમેદે.

હોમીઓ ગઉઅ બરેસમન.
હિજુઓ દંઘંઘાડ. માંથરેચ.
વચચ. શીઓથનસચ. જોથરા
બીઅસચ. અરશોખદેબીઅસચ.

વાગઝબીઓ. ઇઓંઘહે હુતાંમ. આદ ઇઆસને. પેત વંઘો. મજ દાઓં અહુરે. વેથા આશાદ હચા ઇઆઓંઘાંમચા. તાંસચા. તાઓંસચા ઇઆઝમેદે.

(બાજમાં પઢે) હોરમજદ ખોદાએ. અવજુની મરદુમ. મરદુમ સરદગાં. હમા સરદગાં હમ બાએસત ખેહાં. ઓંઆએસ ખોદે દીને માજદીઆસનાં. આગાહી આસતુ આંની. નેકી રસાંનાદ એદુનબાદ. (પરગટ પઢે) ઇઆથા અહુ વેરીઓ. (૨)

ઇઆસનેમચ. વહમેમચ. ઓજસચ. જઉઆરેચ. આફરીનાંમે

અપાંમ વંધોહેનાંમ મજદદાતનાં
મ. અરેદુઇઆએ. આપેઃ અના
હેતીઆએ અશોનીઆએ.
વીસપનાંમચ અપાંમ મજદદાત
નાંમ. વીસપનાંમચ ઓરૂઅરનાં
મ મજદદાતનાંમ, અશોમ વાહુ
(૧) આહમાએરેસચ. હજંઘરેમ
જસમે.—કેરબા મુજદ.— અશે
મ વાહુ. (૧) રોજ [ફલાંન]
માહા [ફલાંન] ગેહ [ફલાંન]
નમાજ દાદાર ગેહાંન હામાંન.
ખશનોથ્રર આહુરહે મજદાએ.
તરોઇહીતે. આંઘરહે મેનીએ
ઓશ. હેથીઆ વરશતાંમ. હીઅદ
વસના ફરશોતમેમસતામે અશોમ.

અશેમ વોહુ (૧) ગોરજ ખોરહે
અવજાઇઆદ. આવાં અરદુઇસુ
ર બાંનો બેરેસાદ. અમાવંદ
પીરોજગ રઅમાવંદીપીરોજગરી
દાદ હીમ બેહે માજદીઅસનાં.
આગાહી ર્‌વાઈ ગોઆફ્રેં
ગાંની બાદ. હપત કેશવર જમી
ન ઓઝુન બાદ. મંન આંનો
આવાઇઅદ શુદંન. મંન આંનો
આવાઇઅદ શુદંન. મન આંનો
આવા ઇઅદ શુદંન. અશોને
અશેમ વોહુ (૧)

(દખ્ખણ દશાની તરફ મોહોડું કરીને પઢે)

દાદાર ગેહાંન દીને માજદી અસની. દાદ જરથોશતરી. નેમ સેતે અશાચ્યોમ સેઊઇચ્યશતે. અરદુઇસુર અનાહિતે. અશોને અશેમ વોહુ (૧) નેમો ચ્યાંઉઆ ર વંઘોહીશ મજદદાતહે. અશો ને અશેમ વોહુ (૧) અરેદુઇમ સુરાંમ અનાહિતાંમ અશોનીમ અશાહે રતુમ ઇચ્યજમેદે. અશે મ વોહુ (૧) આવાં અરદુઇસુર આંનો બેરેસાદ. અશેમ વોહુ (૧)

## આતશ નીઆએશ.

પનાંમે ઇઆજદાંન હોરમજદ
ખોદાએ. અવજુની. ગે.રજ
ઓહરે અવજાઇઆદ

(આતશબેરાંમની નજદીક નીચે મુજબ પઢે)

**આતશ બેહેરાંમ આદર ફરા**

(આદરાંનની નજદીક નીચે મુજબ પઢે.)

**આતશ આદરાંન આદર ફરા**

(ઘેરમાંના આતશની નજદીક નીચે મુજબ પઢે.)

**આતશ દાદગાહ આદર ફરા**

એજ હમાં ગોનાહ પેતત
પશેમાનોમ. એજ હરવસતીન.
દુશમત દુજુખત દુજુઆરેશત.
મેમપ ગેથી મનીદ ઓ.એમ ગો.ફત
ઓ.એમ કરદ ઓ.એમે જસત

ઑાએમ ભુન ભુદ એસતેદ. અજાં ગોમેડા. મનાશની. ગવશની. ફુનશની તની રોઆંની. ગેથી મીનોઆંની. ઓએ. અવાખશ પશોમાન પસે ગવશની પ ઘતેત હોમ.

ઑાશ મોએ ઑાજારેશુઆ. અહુરો આરમેતીમ તઓઇશીમ દશુઆ સપેનસતા. મેનીઓ મજદા. વંઘોહીઆ.જઓનેસ્ા આદા. અશાહુતે એમુઅદ. વાહુમનંઘાશો રતુમ વેહદરાએ. વેઑારો ચશાને હોઆશી મેએ. દઆા વે એપેઝરા. તા પાશાથ રહીઆ અહુરા. દઆા વંઘેઑા

સ અશોસ મનંઘો. ફ્રેરો સંપેતા આરમેતે. અશા દેનાઓઁ. ફ્રરદ ખશીઆ. અદ રાતાંમ જ્ઝર થોશતરો. તનુઅસચીદ ખખ્ખી આઓઁ. ઓઁશતનેમ દદાપેતીમ પાઓઁઙ્ઘૂઅતાતેમ મંનઘસચા. વંઘેઓઁાશ મજ્દા શીઍાથનાદ્રી આ. અશા ક્ષઆાચા. ઓઁખદ ખ્બીઆચા. સરોશેમ ખશથ્રેસ ચા. ખશનોથર અહુરહે મજ્દા ઓઁ. નેમસેતે આતરશ મજ્દા ઓઁ. અહુરહે હુદાઓઁ. મજ્દશાન ઇઆજત. અ:શેમ વોહુ (૩)

ફ્રૂઅદાને મજ્દીઆસનો જ્ઝર થોશતરેશ. વીદેઊઍા અહુરહે

દકેશો. [જે ગેહે હાએ તે પઢે]

આથરે અહુરહે મજદાઓં પોથર. તઊઆ આતરશ પોથર અહુરહે મજદાઓં. આથરે અહુરહે મજદાઓં પોથર. ખરેનંઘો સઊઅંઘો મજદદાતહે. ઐરીઅનાંમ ખરેનો મજદદાતનાંમ. કાઉઆઇઅહેચ ખરેનંઘો મજદદાતહે. આથરે અહુરહે મજદાઓં પોથર. કઊઆઇપેશ હુસરૂઅંઘહે. વરેઓશ હુસરૂઅંઘહે. અસનુઅંતહેગરેએશ મજદદાતહે. ચેચસતહે વરેએશ મજદદાતહે. કાઉઆઇઅહેચ ખરેનંઘો મજદદાતહે. આ

થરો અહુરહે મજદાઓ પોથર. રેઉઅંતહે ગરોએશ મજદદાતહે. કાઉઆઇઆહેચ ખરેનંઘો મજદદાતહે. આથરો અહુરહે મજદાઓ પોથર. આતરશ સંનતહે. અરથેશતારે. ઇઆમજત પાઓરો ખરેનંઘ. ઇઆજત પાઓરો બેશજીઅ. આથરો અહુરહે મજદાઓ પોથર. મઝવીસપેબાએ આતરેબાએ. ખશથરો નફરો. નેરીઓ સંઘહેયજતહે. ખશનાથર ઇઆસનાએચ વાડમાએચ. ખશનોથરાએચ. ફરસસતીએચ. ઇઆથા અહુવેરીઓ જોતા. ફરાંમે મરૂતે અથા

રતુશ. અશાદ ચીદ. ડચ ફરા
અશુઅ વીદુઆર્ઓ મરોતુ.

ઇઅસાનેમચ. વહમમચ. હુબે
રેતીમચ અૉશાતા બેહ્તીમચ.
વંતા બેરેતીમચ. આફ્રીનાંમ.
તઊઅ આતરશ પોથર અહુરહે
મજદાર્ઓ. ઇઅસનીઓ અહે
વહુમીઓ ઈઅસનીઓ બોઈ
આર્ઓ. વહુમીઓ નમાનાહુ
મશ્ચીઆકનાંમ. ઓૅશત બોઈ
આદ. અહુઆએ નરે ઇઅસે
થવાબાદ. ફ્રાઇઅજાએત. એસ
મો જસતો. બરેસમો જસતો. ગો
જસતો. હાઊઅનો જસતો.
દાએતીઓએસમે બોઇઆઓ.

દાએતીઓ બોએદ બોઇઆઓ. દાએતીઓ પેથવે બોઇઆઓ. દાએતીઓ ઓપંસીએને બોઇઆઓ. પેરેનાઇઓશ ડેરેથરે બોઇઆઓ. દહમાઇઓશ હરેથરે બોઇઆઓ. આતરશ પોથર અહુરહે મજદાઓ. સોચે બોઇએ અહમીઅ નમાને. નદ સોચે બોઇએ અહમીઅ નમાને. રોચે બોઇએ અહમીઅ નમાને. વખશથર બોઇએ અહમીઅ નમાને. દરેગેમચેદ. એપે જરૂ આનેમ. ઓઆપ સુરાંમ. ફરશો કેરેતીમ. હદ શુરીઆઓ. વંઘો હીઆઓ. ફરશો કેરેતાએદ.

દાઇઆઍ મે આતરશ પોથંર અહુરહે મજદાઍ.

આસો ખાથરેમ. આસો થરા એતીમ. આસો જીતીમ. પોઍા રો ખાથરેમ. પોઍારો થરાએ તીમ. પોઍારો જીતીમ. મસતીમ સપાનો. ખશુએવેરીમ. હુંજુ આંમ ઑારોને ઑારો ખરતુમ. પસયેતે મસેતેમ. મજાનઑાંતેમ. ઑાપિરે આતરેમ. નેરેહામ પસ ચેતે. હાંમ વેરેતીમ. એરેદવો જવાંમ. અખરૂનીઆંમ. થરેશુમ આશોનાંમચ. ખસરૂનામચ. આ સેતો ગાતુમ. જઆઍરોમ. તોથ રોશાંન. આસનાંમ. ફરજંતીમ.

કરશો રાજાંમ વીઆખનાંમ. હાંમ રોદાંમ. હુઆપામ. આજો ખુજીમ હુઇરાંમ. ઇઆ મે ફરા દીઆદ. નમાનેમચ. વીસેમચ. જંતુમચ દખીઓઁમચ. દંઘો સસતીમચ. દાઇઆઓઁ મે આતરશ પોથર અહુરહે મજ દાઓઁ. ઇઆ મે આંઘદ. અફ્રર સાઓઁઘાઓઁ. નુરેમચ. ઇઆઊ ઐચ તાએતે. વહેશતેમ અહુમ અશોનાંમ. રોચંઘેમ. વીસપો ખાથરેમ. જન બોઇએ વંઘાઓસચ. મેજદે વંઘાઓઁસચ સરૂઆહે ઓઁરોનેચ દરેગ હુઆં ઘહે. વીસપેબીઓ. સસતીમ

બેરેતે આતરશ મજદાઓ.
અહુરહે. ઇએઘીએ એમ
હાંમ પએતે. ખશનાફનીમચ.
ઉશ્તીમચ. વીસપેઘીએ હચ
હજઅંતે. હુ બેરેતીમ. ઓસતા
બેરેતીમ. વંતા બેરેતીમચ સપે
તમ. વીસપનાંમ પરચરંતામ.
આતરશ જસત. આહેદીઅ.
એમ હખ હશી બરેતે. ફ્રચરેથ
વાઓ. અરમેશાદે. આતરેમ
સપેનતેમ ઇઅજમેદે. તખમેમ
હેનતેમ અરથેશતારેમ. આદ
ઇએનશે. એમ બરેતે. એસમેમ
વા અશીઅ બેરેતે. બરેસમેમવા
અશીઅ ફ્રસતરેતેમ. ઓરૂ
અરાંમ વા હદાને પતાંમ. આહે

પસચેતે. ફ્રીનેતે. આતરશ
મજદાઓ અહુરહે. ખશનુતા
અહમૈસતા. ઉગાહંથેમ. ઓઆપ
થવા હુખશોઈદ ગેઓશ વાથવ
ઓઆપ વીરનાંમ પોરુઓરોતાશ.
ઓઆપ થવા વરેજુઅહ્ચ. મનો
વરેજુઅતેચ. હુખસોઈદ
અંઘહે. ઓઆકુઆખશ્થેહે.
ગહમ જગેશ. તાઓ ખશફ્નો
ઇઆઓ જુઆહી. ઓમદ
આથ્રો આફ્રીઉઅનેમ ઇઓ
અહુમઓ. ઓસસેમ ઓરેત.
હેકુશ. રોચશ પેરેશતીશ અશાહે
ખરજ ઇઓઆજદાતાંમ.

[ખાજમાં પઢે] હોરમજદ
ખોદાએ અવજુની મરદુમ

મરહુમ સરકગાં. હુમા સરહગાં હુમબાખ્ત્રોસત બેહુાં. અઁાઓમ બેહ્રેદીન માજદીઅસનાં. આગ હ્રી આસતુઆંની. નેકી રસાનાદ અહ્રુજ બાદ. [પરગાટ પઢે] ઇઆથા આહુ વઇરીઓ(૨)

ઇઅસનેમચ. વહ્મેમચ. હોઓજ સચ. જઊઆરેચ. આફ્રીનાંમે. આથરે અહુરહે મજદાઓ પોથેર તઊઆ આતરશ પોથર અહુરહે મજદાઓ. આથરે અહુરહે મજદાઓ પોથર. ખરે નંઘો સઊઅંઘો મજદદાતહે એરીઅનાંમ ખરેનો મજદદાત નાંમ. કાઊઆઇઆહેચ ખરેનંઘો

મજદદાતહે. આથરો અહુરહે
મજદાઓ પોથર. કઉઓએશ
હુસરૂઅંઘહે વરેઓએશ હુસરૂઅં
ઘહે. અસનુઅંત ગરેઓએશ મજ
દદાતહે. રેવઅંતહે વરેઓએશ
મજદદાતહે. કાઉઅઇઅહેચ
ખરેનંઘો મજદદાતહે. આથરો
અહુરહે મજદાઓ પોથર. રેઓ
અંતહે ગરેઓએશ મજદદાતહે.
કાઉઅઇઅહેચ ખરેનંઘો મજદ
દાતહે. આથરો અહુરહે મજ
દાઓ પોથર આતરશ સપેનતહે
અરથેશતારહે. ઇઅજત પાઓઇરો
ખરેનંઘ. ઇઅજત પાઓઇરો
બેશજીઅ. આથરો અહુરહે

મજદાઓ પોથર. સદ વીસપેઓ
એ આતરેઓએ. ખશથ્રે
નેરદરે. નરીઆ સંઘહે હઆજ
નાહે. અશેમ વોહુ (૩)

અહ તાએ આતરેમ. અહુરા
એજો અંઘહુઅંતેમ. અશા
ઓંસે મહી. અસેશતેમ. એઝુ
અંતેમ. સતાએ રપંતેમ. ચથરા
અઊઅંઘેમ. અહ મજદાએ
ફ્રેમરીઅંતે. જસતા શનાએશ.
હરેશતા એનઘેમ. અશેમ વોહુ
(૧) અહમાએરેમચ.— હુજં
ઘરેમ. જસમે.—કેરેથા મુજદ
અશેમ વોહુ (૧)

રોજ [ફલાંન] માહા[ફલાંન] ગેહે (ફલાંન) નમાજ હોહાદ. ગેહાંન હામાંન. પશેનાથર અહુરહે મજદાઓં. બેમસ્તે આતરશ મજદાઓં. અહુરહે હુદાઓં. મજેશન ઇઅમજત. અશેમ વોહુ (૧) ગોરજ બોહે અવજાઇઆદ.

(આતશબેહેરામની નજદીક નીચે મુજબ પઢે)

આતશ બેહેરામ આદર ફરા

(આદરાંનની નજદીક નીચે મુજબ પઢે.)

આતશ આદરાંન આદર ફરા

(ઘરમાંના આતશની નજદીક નીચે મુજબ પઢે.

આતશ દાદગાહ આદર ફરા

આંદરાંન શાહા ફીરોજગર.

આદર ગોશસપ. આદર ખોરદાદ. આદર બુરજીન મેહેર. અવરે આ દરાંન. ઑા આતશાંન. કે પ દાદ ગાહુ. નશાંસત એશતેદ. ગોરજ ખોરહે અવજાઇઆદ. મીનો કરકો. અમાવંદ પીરોજગર. અમાવંદી પીરોજગરી. દાદદીનં બેહે માજદીઆસનાં. આગાહી રવાઇ ગોઆશરંગાંની બાદ હપત કેશવર જમીન એદુન બાદ. મંન આંનો આવાઇઆદ શુદંન. મંન આંનો આવાઇઆદ શુદંન. મંન આંનો આવાઇઆદ શુદંન. અશોને અશોમ વોહુ (૧)

[દખાણ દશાની તરફ મોહાડું કરીને પઢે)

દાદાર ગેહાંન હીને માજદ્દી અસની. દાદ જરથોશતરી નેમ સેતે અશાઓમ સોઈઇએશતે આરદુઇસુર અનાહેતે. અશોને અશેમ વોહુ (૧) નેમો ઑરૂ અર વંઘોદીશ મજદદાતહે. અશોને અશેમ વોહુ (૧) ખશ નોથર અહુરહે મજદાઓ. નેમ સેતે આતરશ મજદાઓ. અહુ રહે હુદાઓ. મનોશત ઇખ્અજત અશેમ વોહુ (૧)

એ પતેત તમાંમ તાહારા ગુનાહને ઘટાડે છે. એ પતેત પઢવામા હમેશાં કોશેશ અને મેહનત કર કે તાહારૂં દુખ હોએ તે સઘલું દુર થાએ.

## પતેત પશેમાની

ક્ષ્‍અથા અહુ વઈરીઓ (૧)

ક્ષ્‍અથા અહુ વઈરીઓ પ ંજ ઓંજ હમા ગોનાહ. પતેત પશે માનોમ. ઓંજ હરવસતીન. હુશ મત. હુજુખત હુજુઅરેશત. મેમ ૫ ગેથી મનીદ. પેશે શોમાં વેંડાંન. મનશની. ગવશની. કુનશની. તની રોઆંની. ગેથી મીનોઆંની. ઓખે અવાખશ પશેમાન પશે ગવશની. પ

પતેત હોમ. ઇથા આહુ
વેરીઓ (૫) અશેમ વોહુ (૩)
ફ્રઅરાને મજદીઅસ્નો
જરથોશતરેશ. વીદેઓ આહુ
રહે કેશો. [જે ગેહ હોએ
તે પઢે] ફ્રસસ્તીએચ. સરો
શહે અશીઆહે નમહે. તનુ
માથ્રહે. દરશી દરોશ આહુએ
રીઅહે. ખશનોથ્ર ઇઆસના
એચ. વહમાએચ. ખશનોથરા
એચ. ફ્રસસ્તીએચ. ઇથા
આહુ વેરીઓ જોતા ફ્રામે મરૂતે.
અથા રતુશ અશાદ ચીદ. હચ
ફ્રા અશુઅ. વીદુઆઓ મરોતુ.
ઈથા આહુ વેરીઓ (૧)

(કરદે ૧ લો) ફ્રશાર્જ સેતાએ મ ડરવેસપ હુમત. હુખત. હુઅરેશત. ૫ મનશને. ગવશને. કુનશને. અવાર્જ સેતાએમ ડરવેસપ હુશમત. હુજુખત. હુજુઅરેશત. એજ મનશને. ગવશને કુનશને. અવર ગીરસની હેહુામ ડરવેસપ હુમત. હુખત. હુઅરેશત. ૫ મનશને. ગવશને. કુનશને. કુ કેરફે કુનમ. બહેલશનાી. હેહુામ ડરવે સપે. હુશમત. હુજુખત. હુજુઅરેશત. એજ મનશને. ગવશને. કુનશને. કુ ગોનાહ ને કુનમ.

ફ્રશાર્જ આએ શોમારાદ હોમ. કે અમસાસપંદ. હેદ ઇઓનશને.

ચ્યૉ નીચ્યાચ્યેશને. ફરાજ પ મનશને. ફરાજ પ ગવશને. ફરાજ પ કુનશને. ફરાજ પ ચ્યોાહ. ફરાજ પ તંન. ફરાજ પ ચ્યાંનેચ. ઇન પેશ જાંન. તંન ચ્યૉ જાંને. નામ રોચ્યાંન. ખુન બર ખાસત. ઇન હુસત. પ પેશીચ્યે ઇચ્યજદાંન દારોમ. પ પેશીચ્યે ઇચ્યજદાંન દાશતંન ચ્યે બહોદ. કુ ચ્યગર તશ. ચ્યજાં રસદ. કે ઇન તંન રોચ્યાંરા. બ ચ્યાવાઇચ્યદ દાદંન બ દાડમ સતાચ્યેમ ચ્યશાહી પહેલુમ. નગુનેમ દેવાન. પ નેકી કાદાર હોરમજદ. સેપાસ દાર હોમ. પ પેતીચ્યાર ચ્યનાઇ.

એમંજ ગનાહેનીઆ. અવર મદ ઊમેદ. રસતા એજ રા. પદશ ખારસંદ હુમ દાસતાં હોમ. દીન હોરમજદ. દાદ જરથોશ તર. રસતએ ફરાફન. કરદ પાએરીઆ દકેશાંન. પ દસતુર દાર હોમ. આં જાદહુરા એજ ગોનાહ. પ પતેન હોમ. પ પતેત હોમ. એજ ગોનાહ.

(કરદા રજો ) કુ મરદુમાં આ બુન શાઇઆદ બુદન. ઇઆઆ મંન ઓ બુન બુદ અસતેદ. પેશ ઓઆએ ચેહેર અંદા. પસ ઓઆએ ચેહેરપેશ. ઇચ્ચદશાંન અંદર. જસત અસતેદ. આજ

સે સરોશો. ચરનાંમ ગોનાહ. આજાંની તુમ ગોનાહ. અંદા હજારાં હજાર મરગાર જાંન.અંદ ચંદ ગેઓાશ હશાત શાઇઆદ બુદન. પ નામે ચેસત હરવેશપ. દુશમત. દુજુખત. દુજુઆરેશત. મેમ પં રાએ કસાં રાં. આઇઆઓા કસાન. પ રાએ મંન રા આઇઆઓા ગોનાહ. કારી પ મન રા. કરો ગોનાહ આ બુન બુદ એસતેહ. આજાં ગોનેહા. મનશની. ગવશની. કુનશની. તની રોઆંની. ગેથી મીનોઆંની. ઓએ અવાખશ પરોમાંન પસે ગવશની. પ પતેત હોમપ પતેત હોમ એજ ગોનાહ

(ફરદો ૨ જો) ઇન અંદ આપો પાએ ગોનાહ નામ. ચુંન હંદ રખત. મેહીઆ: સાસત અંદરજ ફરમાન. બેઆએદીઆજદ. કાએ દીએઆજદ. આ ગેરફત ગોનાહ અઉઆઉઅરશત ગોનાહ. અરદુશ ગોનાહ. પારહે ગોનાહ બાજાએ ગોનાહ. ઇઆતો ગોનાહ તલવલગાંન ગોનાહ. મરગારંજાન ગોનાહ. અવસોસ ગરાંન ગોનાહ. નોહ મરજ ગોનાહ. દશતાંન મરજ ગોનાહ ફુન મરજ ગોનાહ. આવારૂન મરજશની. શોએથર ગોનાહ સેશની. ગોનાહે રોઆંની. ગોનાહ

હમીમાલા. ગોનાહીઆ પુલ શહોદ. વખશે વખશાંન. વખશી ગોનાહ ગોનાહ એર્જ ગોનાહ. અવરે આપો ગોનાહ. કુ મર દુમ. ઓ યુન શાઇઅદ યુદંન. ગર્જસતે ગનામીનો. દરૂઅંદ પ પેતીઆર દામાન. હોરમર્જદ ફરાર્જ કરનીદ. હોરમર્જદ પોદા એ ગોનાહ અંદર દીન. પેદા એકરદ. ગોહાંને પાઅેરીઆ હકેશાંન. ગોનાહ દાસતેઅેસતેદ. મનશની પેશે દાદાર હોરમર્જદ. મેનુઆન ગેતીઆન ખોદેસત. પેશે અમેશાસપંદાંન. પેશે મેહેર સરોશ રશને. પેશે આતશ બહર

સમ હોમ. પેશો દીન શેઆંન એશ. પેશો રદ હસતુરે દીની. પેશો ઓએકે વહે મહ એસતેદ. આજાં ગોનેહા. મનશની ગવશની. કુનશની તની શેઆંની. ગેથી મીનોઆંની. ઓપે આવાખશ. પશેમાંન પસે ગવશની. વ પતેત હોમ. વ પતેત હોમ. એજ ગોનાહ.

(કરદો ૪થો) અંદર પેદ માદ. ઓહ બેરાદર્જંન ફરજંદ. શોહે સાલાર. ખેશ નજદીક. હમ ગેહાંની આંહમ ખાસતગાં. હમ સાએગાં. હમ શેહેરીઆં વ ઇરમાનીઆં જસત. વ હર આદાદીઆ. ચુંન

મ'ન અ'હર ગોનાહગાર ખુદ
અસતેદ હોમ. અજાં ગોનેહા
મનશની. ગવશની. કુનશની.
તની રોઆંની. ગેથી એનીઆંની
આખે અવાખશ. પશેમાન પશે
ગવશની. પ પતેત હોમ. પ
પતેત હોમ અજ ગોનાહ.

(કરદાપ મો: હુહુર નશા
ખારશની. હુહુર નશા જોઅ
શની. હુહુર નશા અેાએ આવ
ઓ આતશ ખોરદ'ન. ઇઆ
આવ ઓ આતશ. હુહુર નસા
ખારદ'ને. અવસતા પચે મનશને
ને ગાશ્તન. મોએ નાખુન.
હ'દા ફરેશ. દસત શવીન. ઓ

અવરે હરવ્યે પહર. હેહેર નમા ચુંન મંન અંદર. ગોનાહગાર બુદ એસતેદ હોમ. અજાં ગોનેહા. મનશની ગવશની. કુનશની. તની રોઆંની. ગેથી મીનોઆંની. એોખે અવાખશ પશેમાંન પસે ગવશની. પ પતેત હોમ. પ પતેત હોમ અજ ગોનાહ.

(કરદા ૬ઠો) કુ કામે દાદાર હોર મજદ બુદ. એોએમ આવાઇઅસત મનીદંન એોએમ ને મનીદ. એોએમ આવાઇઅસત ગોફતંન એોએમ ને ગોફત. એોએમ આવાઇઅસત કરદંન

ચોચ્યેમ ને કરદ. અજાં ગોનેહ્રા મનશની. ગવશની કુનશની તની રોઆંની. ગેથી મીનોઆંની. ચોપે અવાખશ પશેમાંન પસે ગવશની. પ પતેત હોમ. પ પતેત હોમ. ચોજ ગોનાહ.

(કરદો ૭મો) કુ કાંમે આહાહે સંન બુદ. ચોચ્યેમ ને આવાઇ અસત મનીદંન ચોચ્યેમ મનીદ. ચોચ્યેમ ને આવાઇઅસત ગોફ્તંન ચોચ્યેમ ગોફ્ત. ચોચ્યેમ ને આવાઇઅસત કરદંન ચોચ્યેમ કરદ. અજાં ગોનેહ્રા. મનશની. ગવશની. કુનશની. તની રોઆંની ગેથી મીનો આંની

એ।એ અવાખશ. પશેમાન પસે ગવશની પ પતેત હોમ. પ પતેત હોમ. એજ ગોનાહ.

[કરદો ૮મો] એજ હમોઇન હડર આઇન ગોનાહ. હડર આઇન મરગરજાંન. હડર આઇન ફરોદ માંદ. હડર આઇન માંનીદ. હડર આઇન ગોનાહ એજ ગોનાહ.

એ।એમ અંદર હોરમજદ મરદુમ મરદુમ સરદગાં. જસત. પ પતેત હોમ એજ હમોઇન. હડર આઇન ગોનાહ. હડર આઇન મરગરજાંન. હડર આઇન ફરોદ માંદ. હડર આઇન માનીદ. હડર આઇન ગોનાહ. એજ ગોનાહ.

ઓ।એમ અંદર બહુમંનગાઓ।
ગોસપંદ ગોસપંદ શરદગાં જસત
૫ પતેત હોમ એજ હુમોઇન
હર આઇન ગોનાહ. હુર આઇન
મરગરજાન હરઆઇન ફરેહમાંદ.
હર આઇન માંનીદ. હર આઇન
ગોનાહુ એજ ગોનાહ.

ઓ।એમ અંદર અરદીબહેશત
આતશ. આતશ સરદગાં જસત.
૫ પતેત હોમ એજ હુમોઇન
હુરઆઇન ગોનાહ હર આઇન
મરગર જોંન હર આઇન
ફરેહમાંદ હર આઇન માંનીદ હર
આઇન ગોનાહુ. એજ ગોનાહ

ઓ।એમ અંદર શેહરેવર
આઇઓખશસત. આઇઓખશસત

સરહદગાં જસત. ૫ પતેત હોમ એજ હુમોઇન હર આઇન ગોનાહ. હરઆઇન મરગરજાંન હર આઇન ફરોદમાંદ. હર આઇન માંનીદ. હર આઇન ગોનાહ. એજ ગોનાહ.

એઓએમ અંદર સપંદારમદ જમીન જમીન સરહદગાં જસત. ૫ પતેત હોમ એજ હુમોઇન હર આઇન ગોનાહ. હર આઇન મરગરજાંન. હર આઇન ફરોદ માંદ. હર આઇન માંનીદ. હર આઇન ગોનાહ એજ ગોનાહ.

એઓએમ અંદર ખોરદાદ આવ આવ તોખમગાં જસત. ૫ પતેત હોમ એજ હુમોઇન

હુર આઇન ગોનાહ. હર આઇન મરગરજાંન. હર આઇન ફરોહ માંદ. હર આઇન માંનીદ. હર આઇન ગોનાહ ઓજ ગોનાહ.

ઓએમ અંહર અમરદાદ ઓારૂઆર. ઓારૂઆર સરદગાં જસત. ૫ પતેત હોમ એજ હગેઇત. હર આઇન ગોનાહ હર આઇન મરગરજાંન. હર આઇન ફરોદમાંદ. હર આઇન માનીદ. હર આઇન ગોનાહ ઓજ ગોનાહ.

ઓએમ અંહર દાંમે હોરમજદ જસત ચુંન. સતર માહા ઓા ખોરશેદ. આતશ સોહર સોજા.

સગ વચ્એ ગોસપંદ. પંજ આઇન
ઑ અવર ગવહે દેહેશના.
ઇન હોરમજદ પેશ. ચુંન અંદ
રગ જમીન ઑ આસમાંન.
ચુન મંન અંદર. ગોનાહગાર
બુદ એસતેદ હોમ. અજાં
ગોનેહા. મનશની. ગવશની કુન
શની તની રોઆંની. ગેથી માનો
આંની. ઓએ અવાખશ પશે
માંન પસે ગવશની. પ પતેત હોમ.
પ પતેત હોમ એજ ગોનાહ.

(કરદો ૯ મો) સતર શેકશની
એતાદથ વસોવશની. દુદએ
વેહાંન વસો વશની. ગહંબાર
રફૂઅરદીઆંન. હોમ દફૂન.

હોશ ફરીફ. ઇઅજદાં નોડાક.
ઑ। પદીરફત. રપીથવનેમ ફર
દુમ. રોજે વહરગાંન. ચુન મંન
આવાઇઅસત ઇઅશતંન યોઅ
મ ને ઇઅશત. અજાં ગોનાહો.
મનશની. ગવશની. કુનશની
તની રોઆંની. ગેથી મીનોઆંની
ઓખ અવાખશ. પશેમાંન પસો
ગવશની પ પતેત હોમ. પ
પતેત હોમ. એજ ગોનાહ

[કરદો ૧૦ મો] અવર મનશની
તર મનશની. આજુરી પંદી.
ખશમગની. અરશગની. વદ
ચશમી. શુર ચશમી. વદ નેગર
શની ખુરદક નેગરશની. નગી

શાઇ પંહી. ખુદ શાહી. અસ
ગહુની. સપોજગારી. વઝુની
ગોમાંની. આહુમોઇ. જોર
ગુઆહી. હરોગહાવરી. ઍાજદ
સત પરસતી કેરશદ હવાવરશની
અરહુન હવારશની. એમોક હવા
રશની. દરાએ આં જોયશની દરાય
આં પોરશની. દુજદી ગદહી. જ
હીજાદુઇ જાદુ પરસતી. રોસપી
રોસપે અાગ્ગી, ગવહે પતી.
ગવહે વનીદી. શીન મોઇ ઍાં
અવર હર આઇન ગોનાહ. ઍા
પ ઇન પતેતી હોશમારદ. આંન
ને હોશમોરદ. આંન દાનેસત.
આંનને દાનેસત. આંન અંગરદ.

આમાન ને અંગરહ. સરોશાહા વેરજીઆ. પેરી રહ હમતુર દીની. આવાઇઆસત અહૃજી હંગ. ઓરાએમ ને ગરજીહ. અજાં ગોનેડા. મનશની ગવ શની. કુનશની. તની રોઆંની ગેથી મીનોઆંની. આએ અવા ખશ. પરોગાંન પકે ગવશની. પં પતેત હોમ પ પતેત હોમ. અએજ ગોબાહુ.

(કરદો ૧૧મો) કુ અગર કસાં પતેતી. પદીરફત હોમ. ઓઓએમ ને કરદ હોમ. એશાં રોઆંરા હુશાખારી મદ. ઇઆદશાંન જાદ હરા. હર ઇઆક જુદ જુદરા.

મનશની. ગવશની. કુનશની.
તની રેઃઆંની. ગેથી મીનોઆંની
ઓખે અવાખશ. પશેમાન પસે
ગવશની. પ પતેત હોમ પ પતેત
હોમ. એંજ ગોનાહ.

(કરદેહ ૧૯મો) પ આંદીન દશ
તુર એસત હોમ. ઈનહોરમજદ
જરથોશતર ચાશત. જરથોશતર
ઓય ગોશતાસપ. પપેવંદ આદ
રબાદ. મારાસપંદાંન મદ. પદશ
પસાખત. કરદ ઓખન. આશાહી
વેહ રેઆંને દોશારમરા. આવા
અશોની. તર વેહુરી હોમ. પ
જીવંદીએ જાંન. આસતુઆં
હોમ. હુમત પ મનશને. આસ

તુઆં હોઇમ. હુખત પ ગવશને. આસતુઆં હોઇમ. હુઅરેશત પ કુનશને. આસતુઆં હોઇમ. પ ગવહે દીને આજદીઅસનાં. હમાં કેરઆડા. હમ દાસતાં હોઇમ. એજ હમા ગોનાહીઆ જુદ. દાસતાં હોઇમ. પ નેકી સેપાસ દાર હોઇમ. આજ અનાઇ ખોર સંદ હોઇમ. પુલ પાદ ફરાહુ. ખંદ હરોશં. તોજશને તાવાં દીન. પાદ ફરાહે સેસખ. પંજાહુ હફત સાલ પહશ. ખોરશંદ હમ દાસતાં હોઇમ.

એઆએમ કરદ હોઇમ. ઇન પતેતી ગુજરગા ઊમેદ કેરબારા.

ગેરૂં બીમે દોઝખરા. આશાદી
વેહ રોઆંન દોશારમરા. પ ઈન
મનશની કરદ હોમ. કુ કોર કેર
બાડ. મંન અંદાજુ કરદ.
આચ જું કુનમ. ઉગર અમેશાસ
શાને કેરબ રા ગેબાદશાને ગોનાહ
રા. બોખતઓ રોઆંરા. આગર
માંદહે બહોદ. કુ ગોનાહે મંન
તોખત ને બહોદ. પાદ ફરાહે
સેશબ. આનાહીઆ. પદશ બાર
સંદ ઉમ દાસતાં હોમ. ઉમેદ ફરમા
એમ આરોમ વાહુ. બેગુદીરશાની
પતેતી. પેશ આજ બેગુદીરશાની
પંસ ગુદરદે મંન. મન બોદહરા
આજ ગોનાહ. પે પતેત બહોદ

એદાશ ગેતી ફરીદ. ફરમાઇઆદ ફરઝુદાર. પાદુશાની હુમ દાસતાં હોમ. હોરમજદ ખશ હોમ હોરમજદ દહમાંની કુનમ. આશાહી સતાએમ.

એઆએમ ગેરફત હોમ હરવે સપ. હુમત હુખત હુઆરેશત. ચ મનશને ગવશને કુનશને. બાડલશની દેહોમ હરવેસપ. હુશમત હુજુખત હુજુઆરેશત. એજ મનશને ગવશને. કુનશને

એઆએમ ગેરફત હોમ હરવે સપ હુમત હુખત હુઆરેશત. ચ મનશને ગવશને કુનશને. બહુલશની દેહોમ હરવેસપ

દુશમત દુઝુખત દુઝુઆરેશત. એજ મનશને ગવશને કુનશને. આ૦એમ ગેરફ્ત હોમ હરવેસપ હુમત હુખત હુઆરેશત. ૫ મન શને ગવસને કુનશને. બેહેલસની દેહોમ હરવેસપ. દુશમત દુઝુ ખત દુઝુઆરેશત એજ મનસને ગવશને કુનશને

આ૦એમ ગેરફ્ત હોમ હરવે સપ. શાહે શાસતી ફ્રશરૂંન બહે લશની દેહોમ હરવેસપ શાહે અરસતી અશારૂન. ગના શેક શત. હોરમજદ બેહે અવજુન સતામે અશોમ. અશેમ વોહુ (૧)

ફ્રરેસતાઇએ હુમતાએ બીઅ

સચા. હુખતોએ બીઅસચા
હુઅરશતોએ બીઅસચા. મંથ
વોએ બીઅસચા. વખદોએ
બીઅસચા. વરશતોએ બીઅ
સચા. એવ ગરીઆ દથે વીસપા
હુમતાચા હુખતાચા. હુઅરસ
તાચા. પેતે રેચીઆ. દથે વી
સપા. દુશમતાચા. દુજુખતાચા
દુજુઅરસ્તાચા. ફરા વેરાહી
અસેશા સપેનતા. ઇઅસનેમચા
વાડમેમચા. ફરા મનંઘા. ફરા
વચંઘા. ફરા શીઓથના. ફરા
અંઘોઇઆ. ફરા તનુઅસચીદ
ખખીઆઓ. ઓશતનેમ.
સતોમે અશેમ. અશેમ વોહુ (૧)

ઇઆથા અહુવેરીઆ (૨૧) આશેમ વોહુ (૧૨) ઇઆથા આહુ વેરીઓ૨)

ઇઆસનેમચ. વહુમેમચા. આજ સચ જશઆરેચ. આફરીનાંમે. સરોશહે અશીઆહે. તખમહે તનુ માંથ્રહે. દરસી હોરાશ આહુ અરીઆહે. અશેમ વોહુ (૧) અહુમાઅરેસચ. હજ ઘરેમ.— જસમે.— કેરબા મુજદ.— વોહુ [૧]

---

બાજ વારે પીસાબની

(વારેપીશાબની જગોથી તરણ કદંમ દુર ઉભો રહીને પઢે)

ગુનેહે શેકશત સદ હજાર બાર ઇઆથા અહુ વેરીઆ (૧)

(બારે ચીસાબ કરી ખડાઉથી શાફેઅીની નાફ બાંધી તરણ કદમ પાછે ચાલી પડે)

અસ્શેમ વાહુ [૩] ☞ હુમત નાંમ હુખતનાંમ હુઅરશતનાંમ હઅહદ્યા અની અહદ્યા વેરે હુઅમજનાંમચા. વાઉ આરેજન નાંમચા. સહી યખીજરેતારે. ને નસતારે. ઇઆથના વાહુનાંમ મહી. (ચાર ૨ પડે)

☞ હુખશયરે તેમાય ખાદ ખશાથરેમ. આઉમદહીઅદ યખી દદેમહુચા ચીશ મહુચા. હુઆંન મહુચા. ઇઆદ મજદા અહુગ. અશાયચા વહુશતા. [ચાર૩ પડે]

ઇઆથા અહુ વેરીઆ (૪) અ

હુનેમ વેહીમ હાઅજમેદે. અશે
મ વહુશતેમ સરેશતેમ અમેશેમ
સપેંતેમ ઇઅજમેદે. ઇથં વહુ
ઝાતાંમ. આઉ ઇઅસેને. પેતે વં
ઘે. મજદાઓ અહુરે. વેથા
અશાદ્દઝચા. ઇઆઓંઘાંમચા.
તાંસચા તાઓસચા ઇઅજમેદે
અશેમ વોહુ [૧]

## નમસકાર ચેરાગને

૫ નાંમે ઇઅજદાંને હોરમજ
દ ખોદાય. આવજુની ગોરજખો
રહે અચબાઇઆદ. આતશ દાદ
ગાહ આદર ફ્રરા ચજ ઝમા ગો
નાડ પતેત પશેમાનોમ. ચજ હર

વસતીન. દુશમત. દુજુખત. દુ
જુઅરેશાત. મેમ ૫ ગેથી મનોહ.
ઑાયમ ગોશ્ત. ઑાયમ કરદ
ઑાયમ જસત ઑાયમ વ્યુન.
વ્યુહયસતેહ. અનાં ગોનોડા
મનેશની. ગવશની કુનશની
તની રોઅાંની. ગેથી મીનો અાં
ના. ઓખે અવાખશ. પસેમાંન
પસે ગવશની. ૫ પતેત હોમ
☞ ખશનોથર અહુરહે મજદા
ઑાં. નેમસેતે આતરશમજદાઑા
અહુરહે હુદાઑા. મનેશત ઇઅજ
ત. અશેમ વોહુ (૧) (ખશનો
થરથી વાર ૩ પઢે) અહુ

માયરેસચ.—હંજથરેમ.— જસમે.— કેરેનાઓ મુજદ અશોન વોહુ (૧)

## નમસકાર મુકતાદનો.

યજ હમા ગેનાહ. પતેત પશેમાનોમ. અશાઓનાંમ વંઘોહીશ સુરાઓ સ્પેંતાઓ ફ્રવશીઓ ઇઅજમેદે. અશાને અશેમ વોહુ (૧) [વાર ૩ પઢે] અહમા યરેસચ.—હંજથરેમ.—જસમે.— કેરેનાઓ મુજદ. અશેમ વોહુ (૧)

## નમસકાર પાણીનો

યજ્દ હુમા ગોનાહ પતેત પશેમાનોમ. નેમસેતે અશાઓંને સેવીશ્ટે અરદ્વીશુર અનાહીતે. અશાઓંને અશેમ વોહુ (૧) (વાર ૩ પછે) અહમાયરેસચ. હજંઘરેમ.—જસમે. અવંઘે મજ્દ. અશેમ વોહુ (૧)

~ ❦ * ❦ ~

## નમસકાર દાખમાંનો

યજ્દ હુમા ગોનાહ. પતેત પશેમાનોમ. નેમસેતે યદ યઝેસતનાંમ. ઑહુરઆનો ઇજ્યજમેદ. ઇઆઑ અશોનામ ફ્રવશીઓં અશોને અશેમ વોહુ (૧) [વાર ૩

પઢે ] અહ્માયરેસચ. હજંઘરે મ.—જસમે.—કેરબો મુજદ અ શેમ વોહુ (૧)

## બાજ અશેમ વોહુ (૧૨૦૦)

### પઢવાનીં

(તે રોજ ૨૬ મો માહ્ના ૧૨ મેથી દીન (૫) સુધી પઢે.)

૫ નામે ઇઝદ દાંન.હોરમેજદ ખોદાય અવજુની ગોરજ ખોરહે અવજાઇઆદ. અરદાફરૂ અશ બેરેસાદ. પર્જ હમા ગોનાહ પતેત પસેમાનોમ. પર્જ હરવસ્ત તીન. દુશમત. દુજુખત દુજુઆ રેશત. મેમ ૫ ગેથી મનીદ ગો

યમ ગોક્રત. ઑાયમ કરેદ. ઑા
યમ જસત ઑાયમ હુન હુદ યસ
તેદ. અગ્ગ ગોબેડા. મનશની.
ગવશની. કુશનની. તનીશેઆંની.
ગથી ગોનાઆંની. ઑાએ અવા
ખશ. પરીમાંન પસે ગવશની. ૫

પતેત હોમ ખશનોથ્રેઇ અહુ
રહે મજદાઓ. તરોયદીત. અંઘ
રહે મેનીયઓશ. હુથીઆવરસ
તામ. હીઅદ વસના ફ્રશોતમેમ.
સતોમે અશીમ અશેમવોહુ (૩)

ફ્રૂઅશને મજદીઅસનો જર
થોસતરેશ. વીદેઊઓ અહુરહે
દકેશો. (ન ગેહ હોય તે પઢે)
ફરસસ્તીયચ. અહુરહે મજદા

૧૭૬ આજ અસેમ વોહુ (૧૨૦૦)

અઁા રેઊિચાતે: ખરેંનઘહુતો અમે
શનાંમ સપેં અમં તનાંમ અમશાસ્પેં નાં
મ ફ્રૂઅશનાંમ અોઝરનાંમ યંથ્રુ
રનામ પોયરીઓ દકેશનાંમ ફ્રૂ
અશનાંમ નંમા નજદીશતનાંમ
ફ્રૂઅશનાંમ. પારોથર ઇઅસ
નાયચ. વહુમાયચ. પરોથરા
યચ. ફ્રસસતીયચ. ઇઅથા અહુ
વઈર્યો જોતા ફ્રાગે મરૂતે. અ
થા રતુશ. અશાત ચીત હચા ફ્રા
અશુઆ. વીદુઆઓ મરોતુ. અ
હુરેમ મજદાંમ રેઊઅંતેમ ખરે
નઘહુંતેમ ઇઆજમેદે. અમેશા સ
પેંતા હુખશથરા હુદાઓંઘો ઇ
આજમેદે. અશાઓનાંમ વંઘો
હીશ સુરાઓ સપેંતાઓ ફ્રૂ

અશીઓ ઇઅનજમેદ. અશેમ વો
હુ [૧૨૦૦] પઢે પછે

( બાજમાં પઢે )

હોરમજદ ખોદાય અવજુની.
મરદુમ મરદુમ સરદગાં હમા
સરદગાં. હમબાયસત બોહાં.
ઑયમ બેહદીને માજદી,, અસ
નાં આગહી આસતુઆંની. નેકી
રસાંનાદ યદુન બાદ

[ પરગટ પઢે ]

ઇઅથા આહ વેરીઆ (૨)
ઇઅસનેમચ. વહમેમચ ઑાજસ
ચ. જઊિઅરેચ. આફરીનાંમે આ
હુરહે મજદાઓ। રેઊિઅતા ખરેન
૨ ઘહતા. અમેશનાંમ સપેંતનામ.

અશાઓનાંમ ફ્રૂઅશનાંમ ઓ
ગરનાંમ યવેથુરનાંમ પોયરીઓ
દકેશનાંમ ફ્રૂઅશનાંમ બંબા
નજદેશતનાંમ ફ્રૂઅશનાંમ. અ
શેમ વોહુ (૧) અહમાયરેસચ.—
હજંઘરેમ.—જસમે.—કેરબા મુ
જદ.—અશેમ વોહુ (૧)

— ❧ —

બાજ ઈઅથા અહુ વેરીઓ

(૧૨૦૦) પઢવાની

(તે ગાથાનાં દીન ૫ લગી પઢે)

૫ નાંમે ઈઅજદાંન. હોરમજ
દ ખોદાય. અવજુની ગોરજખો
રહે અવજાઈઆદ ગેહે ગાથા
બોઓ. અહૂનુઆદ ગેહે. ઓ

રાતુઅહ ગેહે. સપેંતોમહ ગેહે.
વોહુખશથ્રર ગેહે. વહેશતોઇઅ
સત ગેહે. ગેહે ગાથાબીઓ અ
ર્હાઝ્રૂઅશ બેરેસાદ. યજ હુમા
ગોનાહે. પતેત પસેમાનોમ યજ
હુરવસતીન. હુમત. હુંજુખત
હુંજુઅરેશત મેમ પ ગેથી મનીક્ષ
ઐયમ ગોઝત. ઐયમ કરદ. ઐ
યમ જસત. ઐયમ ખુન ખુદ
યસતેદ. અજાં ગોનેહા મનશની
ગવશની. કુનશની. તની રોઆં
ની ગેથી મીનોઆંની. ઐાબે
અવાખશ. પશેમાન પસેગવસની
પ પતેત હોમ. ખશનોથ્રર અહુ
રહે મજદાઓ. તરોયદીતે. અં

ઘરહે મેનીયઓંઆશ. હેથીઆ વ રશતાંમ. હીઆઙ વસના. ફરશો તેમેમ. સતોમે અશેમ અશેમ વોહુ (૩)

૫૩ અરાને મજદીઅસનો જર થોશતરેશ. વીદઊઓ અહુરેહે ઠ કેશો (જે ગેહે હોય તે પઢે) ફર સસતીયચ. અહુરહે મજદાઓ રેઉઅતઃ ખરેનંઘહતો. અમેશનાં મ સપેંતનામ. ગાથાંબીઓ સપેન તાબીઓ. રતો ખશથરાબીઓ અશોનેબીઓ. અહોનુયતીઆ ઓ ગાથીઆઓ. ઓશતુયતી આઓ ગાથીઆઓ. સપેંતા મે નીયઓંશ ગાથીઆઓ. વોહુ ખ

શથરીઆઓ ગાથીઆઓ. વહુ
શતાયશતાયશ ગાથીઆઓ અ
શાઓનાંમ ફ્રુઅશનાંમ ઓગર
નાંમ પવેથુરનાંમ. પાયરીઓ દકે
શોનાંમ ફ્રુઅશનાંમ નંબા નજ
દેશાતનાંમ ફ્રુઅશનાંમ ખશનાથ
ર ઇઅસનાયચ. વહમાયચ. ખશ
નાથરાયચ. ફ્રસસતીયચ.ઇઅથા
અહુવેરીઓ જોતા ફ્રશમે મરૂતે.
અથા રતુશ. અશાદ. ચીદ હચ
ફ્રરા અશુઅ વીદુઆઓ મરાતુ.
  અહુરેમ મજદાંમ રેઉઅં
તેમ ખરેનઘહંતેમ ઇઅજમેદ.
અમેશ સપેંતા હુખશથરા હુદા
ઓંઘહુ ઇઅજ મેદ. ગાથાઓ

સપેંતાર્ઑ. રતો ખશથરાર્ઑ. અ
શોનીશ ઇઅજમેદ. અહોનુયતી
મ ગાથાંમ અશુઅનેમ અશહુ
રતુમ ઇઅજમેદે. ઑશતુયતીમ
ગાથાંમ અશુઅનેમ અશહુ રતુમ
ઇઅજમેદ. સપેંતા મેનીયઑશ
ગાથાંમ અશુઅનેમ અશહુ રતુમ
ઇઅજમેદે. વોહુ ખશથરાંમ ગા
થાંમ અશુઅનેમ અશહુ રતુમ
ઇઅજમેદે. વહેશતોયશતીમ ગા
થાંમ અશુઅનેમ અશહુ રતુમ
ઇઅજમેદ. અશાર્ઑનાંમ વંઘો
હીશ સુરાર્ઑ. સપેંતાર્ઑ. ફ્રૂઅ
શીઓ ઇઅજમેદ. અહુનેમ
વેરીમ તનુમ પાયતે. અહુનેમ

વેરીમ તનુમપાયતે. અહુનેમ વે
રીમ તનુમ પાયતે ઇઆથા અહુ
વેર્‌ઈઓ। (૧૨૦૦) પઢે પછે

[બાજમાં પઢે] હોરમજદ ખો
દાય. અવજુની મરદુમ મરદુમ
સરદગાં. હમા સરદગાં. હમબા
યસત બેહાં ઓયમ બેહ્‌દીને
માજદીઅસનાં આગાહી આસનુ
આની નેકી રશાંનાદ યહુન બાદ

[પરગટ પઢે] ઇઆથા અહુ
વેર્‌ઓ। (૨) ઇઅશનેમચ વહુમે
મચ. ઓજસચ. જઊિઅરેચ.
આફરીનામે અહુરહે મજદાઓ
રેઊિઆતો ખરેનંઘહતો. અમેશ
નાંમ સપેંતનાંમ. ગાથા બીઓ।

સપેંતાબીઓ. રતો ખશથરાબી
ઓ અશોનેબીઓ અહુનુયતી
આઓ ગાથીઆઓ. ઓશતુય
તીઆઓ ગાથીઆઓ સપેંતામે
નીઅઓસ ગાથીઆઓ વોહુ ખ
શથરીઆઓ ગાથીઆઓ વહેશ
તોયશતોયશ ગાથીઆઓ અશા
ઓનામે ફરૂઅશનાંમ. ઓગરનાંમ
યવેથુરનાંમ. પોયરીઓ ફકેશનાંમ
ફરૂઅશનાંમ. નંબાનજદેશતનાંમ
ફરૂઅસનાંમ અશેમ વોહુ(૧) અ
હમાયરેસચ.-હજંઘરેમ--જસમે.
કેરબા મુજદ. અષેમ વોહુ (૧)

# દુઆ તંનદરોસતી.

બ નાંમે ઇઆજદ બખશાય નદેહ. બખશાયશેગર. મેહેરબાન ઇઅથા આહુ વેરીઓ (૨) તંનદ રોસતી ફરાખરોજી. તંનદરોસતી બીસીઆર રોજી. તંનદરોસતી ફરજંદાંન. ફરજંદ રોજી. તંન દરોસતી જીનદેગાંની ઑામરદરાજ તંનદરોસતી જાંન. દેર જીવશાની આાવાંઇઆદ. બોરહે આંગદ. અશહીદાર. ઇઆજદાંને મેનુઆ ન. ઇઆજ દાંને ગેતીઆંન. હફત અમશાસપંદાંન મીઆજદ રોશંન. હમે બેરેસાદ. ઇન દુઆ યઆં બાદ. ઇન ખુઆહબાદ.

હમે અંદર કશાંરા જરથોશત

દીન શાદબાદ. યદુન બાદ.

ઇઆ બારી બોદા બોદાવંદે

આલંમ રા. હમે અંનજુમન રા

(ફલાંન રા) ( જેહેની નઇઅત તન

દરોસતી પઢીએ તેહનું નામ એ

જગા ઉપર લીજીએ )

બાફ્રરજંદાન હજારસાલ. દેર બે

દાર શાદ બેદારે. તંનદરોસત બે

દાર યદુન બેદાર બરસરે આરજોં

નીઆં. સાલાહડાય બીસીઆર

વકરંનાહડાય બેસુમાર. બાકી એ

યાયન દેહ દારે. હજારાં હજાર

આફ્રરીન બાદ. સાલ બોજસતેહ

બાદ. રોજ ફ્રરોખ બાદ. માહ મા

બારેક બાદ. ચંદી સાલ. ચંદી

રોજ ચંદી માહા.બાસીઆર સાલ
અરજાંની હાર.ઇઅજશને.ઑની
આયસને. ઑ શાદી ઑ જોર
બરશને અશાયદાર. અવરે હમા
કારો. કેરફેહા. તંનદરોસતી બાદ
નેકી બાદ. ખુબ બાદ. યદુન બાદ
યદુન તરજ બાદ. ૫ ઇઅજદાંન
વ અમશાસપંદાંન. કાંમે બાદ
અશેમ વોહુ (૧)

## દીનનો કલમો.

દેનીઆર્મા વંઘોહીઆર્મા માજદીઅશનોયશ. દીન ઓહુ રાસત. વ દરૂસત. કે ખોદાય. બ ખલક. ફરેસતાદેહ. ઇન હુસત કે જરથોશત આવોરદેહ અસત. દીન દીને જરથોશત. દીને હોર મજદ. દાદ જરથોશત. અશોને અશોમ વોહુ (૧) (વાર ૩ પઢે)

## તીશે રોજના નાંમ.

૧ હાદાર અહુરમજદ.
૨ બેહ્મન અમેશાશપંદ.
૩ અરદીબેહેશત અમેશા૦
૪ શેહેરેવર અમેસાશપંદ.
૫ અસપનદારમદ અમેસાસપંદ
૬ ખોરદાદ અમેશાસપંદ.
૭ અમરદાદ અમેશાસપંદ.
૮ દએપઆદર દાદાર.
૯ આદર ઇઅજદ.
૧૦ આવાં ઇઅજદ.
૧૧ ખોરશેદ ઇઅજદ.
૧૨ મોહોર ઇઅજદ.
૧૩ તેશતર તીર ઇઅજદ.
૧૪ ગોશ ઇઅજદ.
૧૫ દએપમેહેર દાદાર.

૧૬ મેહેર ઇઝદ.
૧૭ સરોશ ઇઝદ.
૧૮ રશને રાશત ઇઝદ.
૧૯ ફરરોખ ફરવરદીન.
૨૦ બેહેરામ ઇઝદ.
૨૧ મીનો રામ.
૨૨ ગોવાદ ઇઝદ.
૨૩ દએપદીન દાદાર.
૨૪ દીન ઇઝદ.
૨૫ મીનો અરશીસંગ.
૨૬ આસતાદ ઇઝદ.
૨૭ મીનો આસમાન.
૨૮ જમીઆદ ઇઝદ.
૨૯ મીનોમારેસપંદ.
૩૦ મીનો અનેરાંન.

## બારે મહીનાના નાંમ.

૧ ફરરોખ ફરવરદીન.
૨ અરદીબેહેસત અમેશાસપંદ.
૩ ખોરદાદ અમેશાસપંદ.
૪ તીર ઇઝદ.
૫ અમરદાદ અમેશાપંદ.
૬ શેહેરેવર અમેશાસપંદ.
૭ મેહેર ઇઝદ.
૮ આવાં ઇઝદ.
૯ આદર ઇઝદ.
૧૦ દએ દાદાર.
૧૧ બેહમન અમેશાસપંદ.
૧૨ અસપનદારમદ અમેશા૦

# પાંચ ગાથાના નાંમ.

૧ અહુનવદ.

૨ ઓશતવદ.

૩ સપેનતોમદ.

૪ વોહુખશથર.

૫ વહેશતાઇશત.

આ એ પતેતને ગુજરેલાંઓને વાશતે પઢે.

ગુજરનાર પોતે પઢે છે એમ એકીનથી જાણવું.

---

## પતેત રવાનની.

**ઈઅથા અહુ વઈર્યો (૧)**

**ઇઅથા અહુ વઈર્યો પંજ યજ હુમા ગોનાહ. પતેત પશેમાનોમ. યજ હરવસતીન. હુશમત. હુજ્ઞુખત હુવર્શત. મન પઈથી મનીહ પેશ શોમાં વેહાંન મનશની. ગવશની. કુનશની તનીરેઆંની ગેથી મીનો આંની. ઓખ અવાખશ. પસેમાન પસે ગવશની**

૫ પતેત હોમ. ઇઅથા આહુ વઈરીઓ ( ૫ ) અશેમ વોહુ (૩)

ફ્રઅરાને મજદીઅસ્નો જરથોશ્ત્રેશ. વીદઈવો અહુરટકેશ. [ જે ગેહ હોય તે પઢે ] ફ્રસસ્તીયચ. સરોશહે અશીઅહે તખમહે તનુ માંથ્રહે દરશી દરોશ આહુઈરીઆહે. ખશનાઓથ્રે ઇઅસનાઇચ. વહમાઇચ. ખશ નોથ્રાઇચ. ફ્રસસ્તીયચ. ઇઅથા અહુ વઈરીઓ જોતા ફ્રા મે મરૂતે. અથા રતુશ અશાત્ ચીત્ હચ ફ્રા અશવ વીદ્વા ઓ મરોતુ. ઇઅથા અહુવઈરીઓ ( ૧ )

ફરાજ સેતાયમ હડરૂપેસપ. હુ
મત. હુખત. હુઅરેશત. પ
મનશને. ગવશને. કુનશને. અ
વાજ સેતાયમ હુરવેસપ. હુસમત.
હુજુપત હુજુઅરેશત. યજ મન
શને. ગવશને. કુનશને. આવર
ગીરશની દહેમ હુરવેશપ. હુમત.
હુખત. હુઅરેશત. પ મનશને.
ગવશને કુનશને. કુ કેરદે કુનમ.
બહેલશની. દહેમ હુરવેસપ.
હુશામત. હુજુપત હુજુઅરેશત.
યજ મનશને. ગવશને. કુનશને.
કુ ગોબાદ ને કુનય. ફરાજ
ચોાય શોમારાદ હોમ. કે આમશા
સપંદ યઝ દઆલેશને. ઓાં ની

આ યશને ફ્રરાજ પ મજશને.
ફ્રરાજ પ ગવશને. ફ્રરાજ પ
કુનશને ફ્રરાજ પ આહુ. ફ્રરાજ
પ તંન. ફ્રરાજ પ આંનચ. ઇન
એશ જાંન. તંન ઑજાંન. નાંમ
રોઆંન. ઙુન બર બાસત. ઇન
હસ્તત. પ એશીય ઇઆજશાંન
દારોમ. પ એશીય ઇઆજદાંન
દાશતંન. પ બાહોઇ કુ આગરતશ.
અજાં રશઇ. કે ઇન તંન રોઆં
રાં બ આવાંયદ દાશ્તંન. બ દ
હુમ સતાયમ. અશાહી પહેલુમ
નગુનેમ દેવાંન પ નકી દાદાર
હોરમજદ. સેપાસ દાર હોમ.
પ પેતીઆર અનાઇ યજ ગના

મેનીઓ. ખાવર મદ. ઊમેદે રસતા ખેજરા. પદશ ખાર શંદ ઉમદાસતાં હોમ. દીગ હોર મજદ. હાદ જરથોશતર રસતચ ફરાકૂન કરદ પાયરીઆ. દકેશાંન પ દશાતુર કાર હોમ [ફ્લાંન] જાદેઉ રા. ચજ ગોનાહ. પ પતેત હોમ. પ પતેત હોમ. ચજ ગોનાહ.

ફુ મરદુમાં ઓ બુન શાહીઅ દ બુદન. ઇઆઓ [ફ્લાન] ઓ બુન બુદ ચસતેદ. પેસ ઓય ચેહેર અંદા. પસ ઓય ચેહેરપે શ ઇબ્અદશાંન અંદર. જસંત ચ સતેદ. અજ સે સરોશો ચરનામ ગોનાહ અજાંની તુમ ગોનાહ.

અંદા હજારાં હજાર મરગારજાંન.
અંદ અંદ ગોસ્પોરાં હસત. શાઇ
આદ બુદન. પ નાંમે ચેસત હર
વેસપ. દુશમત. દુજુખત. દુજુ
અરેશત. [ફલાંન] પ રાય કસાં રા.
આઇઆઓ કસાંન. પં રાય [ફલાંન]
રાં. આઇઆઓ ગોનાહ કારી
પ [ફલાંન] રા. કસો ગોનાહ. ઓ
બુન બુદ યસતેહ. મન યજ આં
હરજ ફરમાં પેદાંમબરી જાદંગો
ઇ હમ દાંસતાંની. [ફલાંન પુસ્ર ફલાંન]
જાદહરા. મનશની. ગવશની. કુન
શની. તની રોઆંની ગેથી મીનો
આંની ઓઆખે અવાખશ. પશેમાંન
પંસે ગવશની. પ પતેત હોમ.

[ ખુદ કસાંન ] જાદુઆડરા. ય પતેત હોમ યજ્દ ગોનાહ.

ઇન અંદ આપો પાય ગોનાહ નાંમ. ચુંન હંદરખત. મેહીઆ સાંસત. અંદરજ ફરમાન. બાયહીઆજદ. કાયહીઆજદ આ ગેરફત ગોનાહ. અઉઆ ઊઆરેશાન ગોનાહ. આરદુશ ગોનાહ બારસે ગોનાહ. બાજાય ગોનાહ. ઇઆતો ગોનાહ. તન વલગાં ગોનાહ. મરગરજાન ગોનાહ અવસોસ ગરાંન ગોનાહ. જેહ મરજ ગોનાહ. દશતાંન મરજ ગોનાહ. કુન મરજ ગોનાહ. આવારૂન મરજશની. શો

ચથર ગોનાહ હોશની. ગોના
હ. રોશાની ગોનાહ કમીસા
લાં. ગોનાહે [illegible] પુલ[illegible]હાદ વ
ખશે વખશાંન. [illegible] ગોનાહ
ગોનાહ [illegible] ગોનાહ. અવરે
આપો ગોનાહ. [illegible]માં ઓ
ખુન શાઇઅહ ખુદ[illegible]. [illegible]સાતે ગા
નામીના દરૂઅંદ ય પેટીઆરેહ દા
માંન હોરમજદ. ફરાજ કરની
દ હોરમજદ ખોદાય ગોનાહ
અંદર દીન પેદા ઓકરદ. ગોહાંને
પાયરીઆ દકેશાંન. ગોનાહ દાસ
તે યસતેદ. મનશની પેશે દાદાર
હોરમજદ મેનુઆંને ગેતીઆંન
મેહેસત. પેશે અમેશાસપંદાંન
પેશે મેહેર સરોશ રશને. પેસે

આતશ બરસમ હોમ. પેશ દી
ન રોઆન બેશ. પેશ રદ દસતુ
રે દીની. પેશ ઓઆય ફે વહ મદથ
સતેહ. મ'ન યજ અ'હરવજ જરમા
ન પેદામશરી જાદ'ગોઈ હમદાસ
તાંની [ફલાંન ખુદ ફલાંન] જાદ
હરા. અનશાની ગવસની. ફુનશાની.
તની રોઆંની ગેથી મીનોઆંની
ઓબે આવાખશ. પશેમાંન પ
સે ગવસની. પ પતેત હોમ. [ખુ
દ ફલાંન] જાદહરા પ પતેત હો
મ યજ ગોનાહ

અ'હર પેદ માદ. ખાહ બેરાદ.
જ'ન ફરજ'દ શોય સાલાર. બેશ
નજદીક. હમ ગેહાંનીઆં. હમ

આશતગાં. હુમ સાયગાં. હુમ
શેહરીઆં. પ અરમાનીઆં જસત.
પ હુર આફાહીઅ. ચુંન [ફલાંન]
અંદર ગોનાહગાર ખુદ પશતેહ.
સંન ચજ અંદરજ ફરમાન
પેહાંમબરી જાહ ગોઇ હુમ હાસ
તાંની. [ફલાંન ખુદ ફલાંન]
જાહહરી. મનશાની ગવશાની. કુન
શાની. તનીરોઆંની. ગેથી મીનો
આંની ઓએ અવાખશ. પશે
માન પસે ગવશાની. પ પતેત હોમ
[ખુદ ફલાંન] જાહહરા. પ પતેત
હોમ ચજ ગોનાહ.

હુહુર નશા આગ્રશાની. હુહુર
નસા જોયાની. હુહુર નસા

ઓય આવ ઓ આતશ બોર્ દ‍ંન. ઇઆ આવ ઓ આતશ હુહેર નસા બોફદ‍ંન. અવસતા પએ મનશને. ને ગોશ્ત‍ંન. મોય નાખુન. દ‍ંદા ફ્રેશ. દસત શવીન. ઓ અવરે ઙરએ પંદર. હુહેર નસા ચુન (ફલાંન) અ‍ંદર ગોના હગાર ખુન યસતેહ. મ‍ંન યર્જ અ‍ંદરર્જ ફરમાંન પેદામબરી જા દ‍ંગોઇ ઙમદાસતાંની. [ ફલાંન ખુદ ફલાંન ] જાદહુરા. મનશની. ગવશની. કુનશની. તની રેઆંની ગેથી મીનોઆંની. ઓબ અ વાખશ. પશેમાન પસે ગવશની પપતેત હોમ. (ખુદ ફલાંન) જાદ

હુરા. ૫ પતેત હોમ. ચજ ગોનાહ.

કે કામે દાદાર હોરમજદ ખુદ (ફલાંન) આવાઇઅસાન મનીદંન વશા તો મનીદ. (ફલાંન) આવાઇઅશાન ગોફ્‌તંન. વશાને ગોફ્‌ત [ફલાંન] આવાઇઅસેત કરદંન. વશ તો કરદ. મંન ચજ અંદરજ ફરમાંન પેદાંમબરી જાદંગોઇ હમદાસતાંની [ફલાંન ખુદ ફલાંન] જાદહુરા. મનશાની. ગવશાની. કુનશાની. તની રોઆંની ગેથી માનોઆંની આબે અવાખશ. પશેમાન પસે ગવશાની. ૫ પતેત હોમ. [ખુદ ફલાંન] જાદહુરા. ૫ પતેત હોમ. ચજ ગોનાહ

કુ કાંમે આહારે મંન ખુશ [ફલાંન ]ને આવાદઆસત મની દંન. વશ મનોહ. ( ફલાંન ) ને આવાદઆસતે ગોફતંન વશ ગોફત ( ફલાંન) ને આવાદઆ સત કરદન વશ કરદ મંન યજ અંદરજ ફરમાંને પેદાંમબરી જા દંગોઇ હમદાસતાંની. ( ફલાંન ખુદ ફલાંન ) જાદહરા. મનશની. ગવશની. કુનશની તની રોઆંની ગેથી મીનોઆંની. ઓએ આવા ખશ. પસેમાન પસો મવશની. પ પતેત હોમ (ખુદ ફલાંન)જાદહરા.

પ પતેત હોમ. યજ ગોનાહ.

યજ હુમોઇજ હુર ચાઇન ગોના
હ. હુર આઇન મરૂગરજાંન હુર
આઇન ફ્રોહમાંહ. હુર આઇન
માનાહ. હુર આઇન ગોનાહ યજ ગો
નાહ. ( ખુદ ફ્રસાંન ) જાદહુરા.

અંહર હોરમજદ મરદુમ
મરદુમ સરદગા જશાત. પ
પતેત * * * યજ ગોનાહ. [ ખુ
દ ફ્સાંન ] જાદહુરા.

અંહર બહમંન ગાવ્યાં ગોસ
પંદ ગોસપંદ શરદગાં જસત. પ
પતેત * * * યજ ગોનાહ. [ ખુ
દ ફ્રસાંન ] જાદહુરા.

અંહર અરદીબેહેશત આતશ.
આતશ સરદગાં જસત. પ

પતેત * * * પજ ગોનાહ. ( ખુ
દ ફલાંન ) જાદહુરા.

અંદર શેહેરેવર અઇઓખશ
સત. આઇઓખશસત. સરહગાં
જસત પ પતેત * * * પજ ગો
નાહ. [ ખુદ ફલાંન ] જાદહુરા.

અંદર સ્પંદારમદ જમીન.
જમીન સરહગાં જસત. પ પતેત
* * * પજ ગોનાહ. [ ખુદ ફ
લાંન ] જાદહુરા.

અંદર ખોરદાદ આવ આવ તે
ખમગાં જસત. પ પતેત * * * પજ
ગોનાહ. [ ખુદ ફલાંન ] જાદહુરા.

અંદર અમરદાદ ઓરૂઆર.
ઓરૂઆર સરહગાં જસત. પ

પતેત * * * વર્જ ગોનાહ.
[ ખુદ રવાંન ] જાદાહરા.

અંદર દાંસે હોરમજદ. જસત
ચુન. સતર માહ્ડા ઑ. ખોરશેદ.
આતશ સોહ્ર સોજા. સગ વય
ગોસપંદ. પંજ આઈન. ઑ
આવર ગવહે દેહુશનો. ઈન હોર
મજદ ખેશ. ચુન અંદરગ જ
મીન ઑ આસમાન. ચુન (રવાં
ન ) અંદર ગોનાહગાર ખુદ
પસતેદ. મંનપજ અંદરજ રર
માંન પેદાંમથરી જાદ ગોદ હમદાસ
તાંની. [ રવાંન ખુદ રવાંન ] જા
દાહરા. મનશની. ગવશની. કુન
શની. તની હોઆંની. ગથી મી

નોઆંની. ઓએ અવાખશ. પશે
માન પસ ગવશની. ૫ પતેત હો
મ. ( ખુદ ફલાંન ) જાદહડશ. ૫
પતેત હોમ. યજ ગોનાહ.

સતર શેકશની. ફેલાદથ વ
સોવશની. દુદય વેહાંન વસોવ
શની. ગહંઆર ફરૂઆરદીઆંન.
હોમ દરૂન. હોસ ફરીદ. ઇઅ
જદાં નેહાદ. ઓ પદીરફત
રપીથવનેમ ફરદુમ. રોજ વદર
દગાંન. ચુન [ ફલાંન ] આવાઇ
અસત ઇઅશતંન. વશાન ઈઅશત
મંન યજ અંદરજ ફરમાન પેદા
મઅરી જાદંગાઇ હુમદાસતાની.

 (ફલાંન ખુદ ફલાંન) જાદહુરા. મ

નશાની. ગવશની. કુનશની. તની શેઆંની. ગેથી માનોઆંની એ એ અવાખશ. પશેમાંન પસે ગવશની. પ પતેત હોમ. ( ખુદ શ્રાંન ) જાદાડરા. પ પતેત હોમ પર્જ ગોનાહ

અનર મનશેની. તર મનશની. આજુરી પંદી. ખશમગની. અરશગની. વહ ચશમી. શુર ચ શમી. વદ નેગરશની. ખુરહક નેઘરશની. નગીરાય પંદી ખુદ શહી. અસ ગહેની સપોજગારી. વરૂનો ગોમાંનો. આરમોઇ. જોર ગુઆહી. દરોગદાવરી. ઑાજ દેશત પરસતી. કોશાદ દવારશ ની. બરહેન દવારશની. યમોક દ

વારશની. હરાયઆં જોયશનો. હરોયઆં ખોરશની. હુજદી ગદ હી. જદી જોદ્રુઇ જાદુ પરસતી. રોસપી. રોસપે બોરગી. ગવહે પતી. ગવહે વનીદી શીન મોઇ. અઁ: આવર હર. આઇન ગોનાહ. આંપ ઇન પતેતી હોશમોરદ. આં ન ને હોશમોરદ. આંન દાંનેસત. આંન ને દાંનેસત. આંનઅંગરદ. આંન ને અંગરદ. સરોસાદા વેરે જુઆ પેશ રદ઼ દસતુર દીની (ફ્રુલાંન) આબાઇઅસત ગરજુદં ન. વશ ને ગરજીદ. મંન યજ અંદરજ ફ્રરમાન પેદામ બેરીજાદં ગોઇ હમ દાસતાંની. (ફ્રલાન ખુદ

ફલાન) જાદહ્રા. મનશની ગાવ શની. કુનશની. તની રોઆંની ગેથી મીનોઆંની. ઓાપે અવા ખશ. પશેમાંન પસે ગાવશની. પ પતેત હોમ. (ખુદ ફલાંન) જાદહ રા પ પતેત હોમ. યજ ગોનાહ.

કુ અગર કસાં પતેતી. પદીરફત વશ ને કરદ. યશાં રોઆંરા દુશ ખારી મદ. ઇઆહશોંન જાદહ્રા. હ્રર ઇઆક જુદ જુદરા. મનશની ગાવશની. કુનશની. તની રોઆં ની. ગેથી મીનોઆંની. ઓાપે અવાખશ. પશેમાંન પસે ગાવશની પ પતેત હોમ. (ખુદ ફલાંન) જાદ હ્રર પં પતેત હોમ યજ ગોનાહ.

પ આંદીન ફશતર યશાન હો

મ. ઈન હોરમજદ. જરથોશતર ચાશત. જરથોસતર ઓય ગોસ તાસપ પ પેવંદ આદરબાદ માર સપંદાંન મદ. પદશ પસાખતે કરદ બોખત. અશહો વેહે રો આંને દોશારમરા. આવાયશેની તર વહેશી હોમ. પ જીવંદીય જાંન આસતુઆં હોમ. હુમત પ મનશને. આસતુઆં હોમ. હુખત પ ગવશને આસતુઆં હોમ. હુઅ રેશત પ કુનશને આસતુઆં હોમ પગવહે દીને માજદીઅસનાં ઉમા કેરબ ડા ઉમદાસતાં હોમ. યજ ઉમા ગોનહીઆ જુદ દાસતાં હો મ. પ નેકી સેપાસદાર હોમ અજ અનાઇ બારસંદ હોમ. પુલ પાદ

ફરા. બંદદરોશ. તોજશને તાવાં દીન. પાદ ફરોહે સેસબ. પં જોહ હફત સાલ પદશ ખારસં દ હમદાસતાંહોમ (ફલાંન) કરદ હોમ. ઇન પતેતી ગુજરગ ઊમેદે કેરબરા. ગેરાં બીમે દોજખરા. આ શાહી વેહે રોઆંન દાશારમરા. પ ઇન મનશને કરદ હોમ. કુ કાર કેરબેહ. ( ફલાંન ) અંદાનુ કરદ. આચ નું કુનમ. હમા ય શતશને કેરબ રા. ગોજારશને ગો નાહ રા. બાખતય રોઆંરા આ ગર માંદહે બેહોદ. કુ ગોનાહ (ફલાંન ) તાખત ને બહોદ. પાદ ફરાહે સેશબાંઆન હીઆ. પદ

શ ખોરશંદ હમ દાસતાં હોમ હમે ફરમાયમ અશેમ વોહુ. બેગુ દીરશની પતેતી. પેશ અજ બેગુ દીરશાની. પસગુદરહે ( ખુદ ફલાં ન ખુદ ફલાંજ ) જાદહશ. યજ ગોન્નાહ. પ પતેતબહોદ. સેદોશ ગેતા ફરીદ. ફરમાઇઅદ ફરમુદાર. ખાહેસનો હમે દાસતાં હોમ. હો મજદ બેશ હોમ. હોરમજદ દહ માની કુનમ. અશાહી સતાયમ.

અાયમ ગેરફત હોમ હરવેસપ. હુમત. હુખત. હુઅરેશન. ( ખુદ ફલાંન) જાદહશ. પ મનશને. ગ વશને. કુનશને. બેહલશનો દહો મ હરવેસપ. દુશમત. દુજુખત.

હુજીુઅરેશત. (ખુદ ફ્લાન ) જાદ ‌હ્ડરા. યજ મન‌શાન. ગાવશાનેે. કુન શાને. એેાયમ ગેરફત હોમ હ્ડર વેસપે. હુમત હુખત. હુઅરેશત. (ખુદ ફ્લાંન) જાદહ્ડરા પ મન શાન ગાવશાને. કુનશાને. બેહેલ શાની દેહોમ હ્ડરવેસપ. હુશામત હુજીુખત. હુજીુઅરેશત. (ખુદ ફ લાંન) જાદહ્ડરા. યજમનશાને. ગાવશાને. કુનશાને. એેાયમ ગેરફત હોમ હ્ડરવેસપ. હુમત હુખત. હુઅરેશત. (ખુદ ફલાંન ) જાદહ્ડ રા. પ મનશાને. ગાવશાને. કુનશાને. બેહેલશાની દેહોમ હ્ડરવેસપ. હુશા મત. હુજીુખત. હુજીુઅરેશત. (ખુ દ ફલાન) જાદહ્ડરા. યજ મનસ

ને. ગચશને. કુનશને એયમ ગેર ફત હુમ હરવસપ. રાહે રાસતી ફરાકૂન અહેલશની. દેહુમ હરવે સપ રાહે અરસતી અવાકૂન ગના શેકશત. હોરમજદ બેહે અવ જુ ન સતૈમે અશેમ અશેમ વોહુ(૧)

ફરેસતોઇય હુમતાય બીઅસચા અશેમ વોહુ (૧) ઇઅથા અહુ વેરીઓ (૨૧) અશેમ વોહુ (૧૨) ઇઅથા અહુ વેરીઓ (૨)

ઇઅસનેમચ—હર્જંઘરેમ—જ સમે—અશેમ વોહુ (૧)

## પતેત ફ્રશોસતરે.

( બીજી પતેતોની માફક એ પતેતની હંમેશા ભનવાથી ગુનાહાની માફી મંગાએ છે, ઉપરાંત માનશને હાંફો ચાલતી વેલાએ. અખીયાંના ભણતી વખતે તો એજ પતેત ભણવાની ખાસ ફરજ છે. તે નીચલા તરજુમા ઉપરથી ખુલ્લું જણાએ છે.

હોરમજદે જરથોસ્તને કહયું કે આ પાક શખુનો જીવ ફરવાને આખેર વખતેની તું અને જે કોઈથી ખુબ પઢે તેના રવાનને બદ મકાનથી દુર રાખું.)

**ઇથા અહુ વેરીઓ [૧] ઇથા અહુ વેરીઓ પ જ યજ હમા ગોનાહ પતેત પસે માનોમ. યજ હરવસતીન. દુશમત. દુજુખત. દુજુઅરેશત. મેમ પ ગેથી મનીદ. પેશ શોમાં વેહાન. મન**

શની. ગવશની. ફુનશની. તની રો આંની. ગેથી માનોઆંની. ાખે અવાખસ પશેમાન પસે ગવશની. ૫ પતેત હોમ. ઇઅથા અહુ વેરીઓ (૫) અશેમ વોહુ (૩)

ફરૂઆરાને મજદીઅસનો જર થોશતરેશ. વીદઉઓ અહુરહે દકેરૈાા (જે ગેઠ હાએ તે પઠે) ફરસ સતીયચ. સરોશહે અશીઆહે. તખમહે તનુ માંથરહે. દરશી દરોશ આહુયરીઅહે. ખશનોથર ઇઅસનાયચ. વહમાયચ. ખશનો થશાયચ. ફરસસતીયચ. ઇઅથા અહુ વેરીઓ જોતા ફરાસે મરૂતે. અથા રતુશ અશાદ ચીદ. હચ

ફ્રરા અશુઅ. વીદુઆર્ઓ મરો

તુ. ઇઅથા અહુ વૈરીઓ. (૧)

પૈરેસદ ફ્રરશોનતરો અશુઅ

અશુઅનેમ જરથોશતરેમ પેત

મરુઅઠ્ઠ પાઓરૂઅતરે. જરથોશ

તરે કદ અસતે રથવાંમ ફ્રરમરેત

રા કદ ગાથનાંમ હુ કેરેતશ. આ

અદ ઓખત જરથોશતરો

અહુરેમ મજદાંમ અશુઅનેમ

અશહે રતુમ ઇઅજમેદે. જરથો

શતરેમ અશુઅનેમ અશહે રતુ

મ ઇઅજમેદે. જરથોશતરહે અ

શોનો ફ્રરૂઅશીમ ઇઅજમેદે.

અમેશે સપેંતે અશોનાંમ ઇઅ

જમેદે. અશોનાંમ વંઘોહીશ શુ

શાઓ સપેંતાઓ ફ્રરૂઅશીઓ,
ઇઆજમેદે. અસતુઅતો મનખી
આચ અપનાતેમેમ રથવાંમ ઇઆ
જમેદે. ઇએતુશતેમેમ ઇઆજત
નાંમ હંઘનુસતેમેમ અશાહે રથ
વાંમ એવેનસાંસતેમેમ જગમુશતે
મેમ અશોનો અશાહે રથવો
રતુ ફરેતીમ ઇઆજમેદે.

અહુરેમ મજદાંમ અશુઅનેમ
અશાહે રતુમ ઇઆજમેદે. વીસપે
મચ કેરેફશ અહુરહે મજદાઓ
ઇઆજમેદે. વીસપેસચ અમેશાસ
પેંત ઇઆજમેદે. વીસપેચ અશાહે
રતુઓ ઇઆજમેદે. વીસપાંમચ
દેનાંમ માજદીઅસનીમ ઇઆજમે
દે. વીસપેમચ અફશમનેમ ઇઆ

જસેહે. વીસપેમચ આંથરેમ સપેં
તેમ ઇઆજમેહે. વીસપેમચ દાતેમ
વીદાઇઊીમ ઇઆજમેહે. વીસપાંમ
ચ હરેગાંમ ઑાપીઆનાંમ ઇઆજ
મેહે. વીસપેચ અશુઅનો મેની
અઊીઅચ ઇઆજત ગેથીઆઐ
ચ ઇઆજમેહે. વીસપાઑાસચ
અશાઑાનાંમ વંઘોહીશ સુરાઑા
સપેંતાઑા ફરૂઅશીઐા ઇઆજ
મેહે. વીસપાચ દામ મજદદાત
અશોનીશ ઇઆજમેહે. ઇઆ અ
શુઅ દાત અશુઅ ફરથવરેશાત
અશુઅ દકેશ અશુઅ ફરાઇઅ
શાત. અશુઅને અશુઅબીઐા
ઇઆડ્મીઅચ અશુઐબીઐા વી
સપેચ પંચ ગાથાઑા અશોનીશ

ઇચ્અનજમેદે. વીસપેમચ્ ઇચ્અસનેમ ફશાચ્એતીમચ્ પેતતીમચ્ ચ્એગેજ રેતીમચ્ ઇચ્અનજમેદે. વીસપાક્પેચ્ સતોત ઇસનીચ્અ ઇચ્અનજમેદે. વીસપેચ્ વાચ્ેા મજ્હો ફરોખત ઇચ્અનજમેદે. ઇચ્ઓચ્એ હુંતે દુશામ તેમ જગનેશત. ઇચ્ઓચ્એ હુંતે દુજુખતેમ જગનેશતે. ઇચ્ઓચ્એ હુંતે દુજુઅરશતેમ જગનેશત. ઇચ્ઓચ્એ હુંતે ચ્એપકેરેત દુશામતેમ ઇચ્ઓચ્એ હુંતે ચ્એપકેરેતે દુજુખતેમ ઇચ્ઓચ્એ હુંતે ચ્એપકેરેતે દુજુઅરેશતેમ. ઇચ્આ ચ્એપીકેરેતંતે વીસપેમ દુશામતેમ. ઇચ્આ ચ્એપીકેરેતંતે વીસપેમ દુજુખતેમ. ઇચ્આ ચ્એપીકેરેતંતે વીસપેમ

હુજુઅરશતંમ માનીએન અહે
ઇઅથ આતરશ હુશકેમ અએસ
મેમ ઇઓજદાથરેમ હુપેરેશતમ.
એપીકેરે઼તંત હાઊઇએત હજત.
વીસપનાંમચ એતશાંમ વચાંમ
ઓજસચ વેરેથરેમચ ખરેનસચ
નાઊઅરેચ ઇઅજમેદે. વીસપા
ઔા આપો ખાઓ પેતથરાતા
સતાતસચ ઇઅજમેદે. વીસપાઓ
ઔારૂઅરાઓ ઔારૂઅથમાસચ
પેત વરેશ જીસચ ઇઅજમેદે.
વીસપાંમચ જાંમ ઇઅજમેદે.
વીસપેમચ અસમનંમ ઇઅજમેદે.
વીસપેસચ સતરેઔાસચ માઔાં
ઘેમચ હુઅરેચ ઇઅજમેદે. વીસ
પ અનગાર રોચાઓ ઇઅજમેદે.

વીસપાંમચ ગાંમ ઑપાપાંમચ
ઑપસમનાંમચ ફ્રપતરેજાતાંમચ
ફ્રેઊીઅસચ રાતાંમચ ચંઘરઘાચ
સચ ઇઅજમેદે. વીસપેત આહુરો
મજદાઑ હુઅપો વંઘોહીશ દા
માંન અશોનીશ ઇઅજમેદે. ઈ
આએશ દદાએત પોઑરોચ
વોહુચ ઇઓએતે હુંત ઇઅસની
આચ વહમીઆચ અશાદ હચ
ઇઅદ વહેશતાદ વીસપાઑસચ
ગેરીઆ અશ ખાથરાઑ ઇઅજ
મેદે. વીસપાઑસચ વેરીઆ
મજદદાતાઑ ઇઅજમેદે. વીસ
પેચ આતરો ઇઅજમેદે. વીસપે
૧૫ ચ વાચો અરશ ઑખદો ઇઅ

જમેદે. વીસપેચ એતે અરોશ
હુડાગેહ આરમેતેશ હુડાગેહ ઇઆઓજ
મેદેચ. નેપાતીએચ. નેશંઘરેતી
એચ હુરેથરાચ એવીઆ ખશ
થરાચ હુઆંથેમ મે ખુઇએત.
ગાથાબીઓ સપેંતાબીઓ રતો
ખશથરાબીઓ અશોનેબીઓ
જબીએમે ઇઆનજમેદેચ નેપાતી
એચ નેશંઘરેતીએચ હુરેથરાચ
એવીઆખશથરાચ હુઆંઘહુમ
મે ખુઇએત. માઊઓઆઇઆ હુઆ
ઍાહ્રાને જબીએમે ઇઆનજમેદેચ
નેપાએતીએચ નેશંઘરેતીએચ
હુરેથરાચ એવીઆખશથરાચ.
અરૂહુતામ અશુઅનેમ એત

શાહ્રે રતુમ ઇઆજમેદે. અમેરેતાતેમ અશુઆનેમ આશાહ્રે રતુમ ઇઆજમેદે. આહુઐરીમ ફ્રરશોનેમ અશુઅનેમ આશાહ્રે રતુમ ઇઆજમેદે. આહુઐરીમ દકેશેમ અશુઅનેમ આશાહ્રે રતુમ ઇઆજમેદે. ઇઆસનેમ સુરેમ હ્રપતંગાહ્રાઐતીમ અશુઅનેમ આશાહ્રે રતુમ ઇઆજમેદે.

હુઆ અશુઆ જરથોશતરો ઓરૂઅથેમ થેરાતારેમ ઐસોઐદ અશુઅનેમ તે અશોનદ આફ્રીઐદ્રીઆઐ મરેમી ઓરૂઅથેમ ઓરૂઅથાદ તદ જી વંધો હુઐ જી દરેગુઆઓ ઇશ્પે દરેગુઆઐ

ક્ષેતવહુશતો. હુઆ અશુઆઓ
ઇઅડમાક્ષે અશુઆ ફશાઓ ક્ષેત
જી વાચો વહુશતો અહુરો મજ
દાઓ ફરામરોદ જરથોશતરાએ
એત જી જરથોશતર ઓશતમે
ઓરૂએસે ગઇએહે ફરમરૂ એદ
ઇએદ જી જરથોશતર એત વા
ચો ઓશતમે ઓરૂઅસે ગઇએ
હે ફરમરૂઆએ પેરેતે તનુઅ
અનામ ઇઓ અહુરો મજદાઓ
ઓરૂઆનેમ હચ અચેશતાદ
અંઘોદ અઊઅઊઅએતીઅ બાં
જસચ ફરથેંસચ પેરેતનુઇએ ઇઅ
ચ ઇમ જાઓ અસતેચ ઇમજા
ઓ અઊએત બાંજો અઙઅથ

ફરથસચીદ. ફરચ અએતદ ઇઅ
થ વશે અશાએઁમ અદ અંઘો
અશુઅ: ફરપારીઆઓંઘો ઑરૂ
આનેમ તરો ચેનુઅતો પેરેતુમ
વહેશત અંઘેઓઁશ અશુઅ જ
શો ઑશતુએતીમ ગાથાંમ સરા
ઊઇએ ઑશતતાનેમ નેમરોમનો

ઑશતા અહમાએ ઇઅહમા
એ ઑશતા કહમાએચીદ. વશે
ખશીઆંશ મજદાઓ દાઇઆદ
અહુરો ઑતીઉએતી તઉઇશી
ગદ તાપે વસેમી. અસેમ દરેદી
આએ તદ મોએ દાઓ આરેમે
તશ. રાઇએ અશીશ વંઘેઓઁશ
ગેમ મંનઘો. ઑશતા અહમાએ

ઇઆડમાએ ઑાશતા કાડમાએ ચીદ. વશો ખશીઆંશ મજદાઓ દાઇઆદ અહુરો ઑાતીઊએતી તઊઇશી ગદ તાએવસેમી. અશો મ દરેદીઆઘે તદ મોએ દાઓ આરમેતેશ. રાઇઆ અશીશ વંધે ઑાશ ગેમ મનંધો. વેરેજીમચ હુમનંધેમચ ઇઆજમેદે. હુમનંધે મચ વેરેજીમચ ઇઆજમેદે. પેત શતાતે તેમંઘાંમ પેતશતાતે ખશી આસચ અમુઇઆઓાસચ વેરેજી મચ હુમનંધેમચ ઇઆજમેદે. હુ મનંધેમચ વેરેજીમચ ઇઆજમેદે પેતશતાતે તેમઘાંમ પેતેસતાતે ખ શીઆસચ અમુઇઆઓાસચ. વેરે

ઝમચ હુમનંઘેમચ ઇઆજમેદે
હુમનંઘેમચ વેરેઝમચ ઇઆજમે
દે. પેતેશતાતે તેમંઘાંમ પેતેશતાતે
ખશીઆસચ અમુઇઆઓંસચ.

હશુઆરેચ ખેશેનેમચ ઇઆજ
ગેદે. ફરદથેમચ વરેદથેમચ ઇઆ
જમેદે. પેતેશતાતે અખતનાંમ અ
સતરેમનનાંમચ. વાચ હુંકેરેથ
ઇઆજમેદે. ગાથનાંમચ અઉઆ
ઉઆરશતેમ ઇઆજમેદે. ગાથાઊ
સપેંતાઓ રતો ખશથરાઓ અ
શોનીશ ઇઆજમેદે. સતોત ઇઆ
સનીઅ ઇઆજમેદે. ઇઆ દાતા
અંઘેઓશ પોઓરૂએ હીઆ
હુરૂઆંમ હુંદાએતીમં સતોતનાં

મ ઇઆસનીઆનાંમ ઇઆજમેદે.
હુમ ઑરૂઆનેમ ઇઆજમેદે. હુ
આંમ ફ્રૂઆશીમ ઇઆજમેદે.
દહમાંમ વંઘોહીમ આફ્રેતીમ
ઇઆજમેદે. દાહમેમચ નરેમ
અશુઆનેમ ઇઆજમેદે. ઑ
ગરેમ તખમેમ દામોઇશ
ઑપંમનેમ ઇઆજતેમ ઇઆજમેદે.
ઇમાઑ અપસચ જેમસચ ઑ
રૂઅરાઑસચ ઇઆજમેદે. ઇમા
ઑ અસાઑસચ શોઇથરાઑ
સચ ગોઇઓઇતીસચ મેથની
આઑસચ અઉઆખરેનાઑસ
ચ ઇઆજમેદે. અમેમચ શોઇથ
રપેતીમ ઇઆજમેદે. ઇઇમ આહુ
રેમ મજદાંમ રતુઓ વીસપે મનો

શત ઇઆજમેદે. અઇઆર આસ
નીઆ માહ્રીઆ ઇઆએરીઆ સ
રેદ. અશાઓંલાંમ વંઘોહ્રીશ સુ
રાઓ સપેંતાઓ ફરૂઅશીએ:
સતોમે જળીએમે ઑફ્રીએમે
ઇઆજમેદે. નમાનીઆઓ વીશી
આઓ જંતોમાઓ દખીઆ
માઓ જરથોશતરો તેમાઓ થ
વાંમ આતરેમ અહુરહે મજદા
ઓ પોથરેમ અશુઆનેમ અશાહે
રતુમ ઇઆજમેદે. હુદ જોથરેમ
હુદ એવીઆઓંઘનેમ એમહ
અરેસમ અશીઆ ફરશનરેતેમ
અશુઆનેમ અશાહે રતુમ ઇઆ
જમેદે. અપાંમ નપતારેમ ઇઆજ

મેદે. નરેમ સાંઘેમ ઇઆજમેદે. તખમેમ હાઓઇશ ઑપંમનેમ ઇઆજતેમ ઇઆજમેદે. એરેશત નાંમ ઑરૂઆનો ઇઆજમેદે. ઇઆઓ અશાઓનાંમ ફરૂઅ શીએ.

રતુમ બેરેજનતેમ યજમઇદે ચીમ અહુરેમ મજદાંમ યો અશ હુ અપનોતેમો યો અશાહુ જધ મુશતેમો વીસપ સરવાએો જર થુશતર યજમઇદે વીસપચ હુવ રશત શીઓથન યજમઇદે. વર શતચ વરેષયમનચ.

ઇએંઘહેં હાતાંમ આ અહ ઇઆસને પેતી વંઘો મજદા ઑ અહુરો વેથા અશાહ હચા

ઇઆઅઁઘાંમચા તાંસચા તાઅઁ
સચા ઇઆજમેદે.

### કરદો ૨ જો

ઇઆથા અહુ વેરીઓ (૨)

ગાઊઓ અદાઓશ તાઓશ શીઓથનાઓશ ઇઆઓશ વહુ શતાઓશ. ફરશીઆ મહી અદ અખીઆઓ. અશા મજદા ઓરૂઆરાઓ વખશદ. વસસચ તુ અહુરમજદ.

ઓશતાચ ખશેશ હુઆનાંમ દાંમનાંમ વસો આપો વસો ઓરૂઆરાઓ વસો વીસપ વોહુ અશ ચેથર. ખશીઆ મનેમ અશુઆનેમ દાહ્યેત અખશીઆ મ

નેમ દરૂઅંતેમ વસો ખશથરો
હીઆદ અશુઅ અઉઅસો ખ
શથરો હીઆદ દરૂઆઓ ગતો
હમસતો નેજબેરેતો હચ સપેં
તહુ મેનીએઓશ દામેબીઆ
વરેતો અઉઅસો ખશથરે. હ
ખશીઅ અનમચેદ ઇઓ જર
થોશતરો ફરતેમાં નમાનનામચ
વીસાંમચ જંતોનાંમચ દખીઓ
નાંમચ અંધાઓ દેનીઆઓ
અનુમતીએચ અનુખતીએચ
અનુવરેશતીએચ ઇઆ આહુએ
રીશ જરથોશતરેશ ઇઆથનો આ
ઓંઘાંમ શાદ્રામનાઓ વહુશતો
ઓરૂઆનો ખાથરૂએતીશ તનુ

આ હુંતા વહેશતહે અંઘેઆ
રા આકાસએઆએક આહુઅરીઆ
મજદ જસેંતાંમ.

અશહે વહેશતહે અશહે
સરેશતહે દરેશામ થેવા પેરે થવા
જમીઆમ હમેમ થવા હખમ
અશેમ વોહુ ૧ અશહે વહેશતહે
અશહે સરેશતહે દરેશામ થવા
પેરે થવા જમીઆમ હમેમ થવા
હખમ. અશેમ વોહુ (૧) અશહે
વહેશતહે અશહે સરેશતહે દરે
શામ થેવા પેરે થવા જમીઆમ
હમેમ થવા હખમ. અશેમ૦ ૧)

ઇઅથા અહુ વેરીઓ (૪)
અશેમ વોહુ (૩) અહુનેમ વેરી

મ ઇઅજમેહે. અશેમ વહિશતેમ સ્રેશતેમ અમેશેમ સપેંતેમ ઇઅજમેહે. ઇએંઘહે હાતાંમ આઆદ ઇઅસને પૈતે વંઘો મજદાઓ અહુરો વેથા અશાદ હચા ઇઆઓંઘાંમચા તાંસચા તાઓસચા ઇઅજમેહે.

કરદો ૩ જો

અહુનેમચ વૈરીમ ફ્રેશીઆ મહી અંતરેચ જાંમ અંતરેચ અસમનંમ અશેમચ વહિશતેમ ફ્રેશીઆ મહી અંતરેચ જાંમ અંતરેચ અસમનંમ. ઇએંઘહે હાતાંમચ હુ ફ્રા ઇઅશતાંમ ફ્રેશીઆ મહી અંતરેચ જાંમ

અંતરેચ અસમનેમ. દહુમહેચ
નરશ અશોનો દહંમાંમચા વં
ઘોહીમ આફરેતીમ ફરેશીઆ
મહી અંતરેચ જાંમ અંતરેચ
અસમનેમ

હમેસતીએચ નેજબેરેતીએચ.

અંઘરોમનીઓશ અદ દામનો
દુજદામનો પોઓરો માડરકહે
હમેસતીએચ નેજબેરેતીએચ.

કખરેદનાંમચ કખરેદનાંમચ.
હમેસતીએચ નેજબેરેતીએચ.

કખરેદહેચ કખરેદીઆઓસ
ચ. હમેસતીએચ નેજબેરેતીએચ

કઇઆદનાંમચ કાઇદીઆનામચ.
હમેસતીએચ નેજબેરેતીએચ.

કઇઅહહુચ કાએદીઆઓસ
ચ હુમેસતીએચ નેજબેરેતીએચ

લાઇઓનાંમચ હજશનાંમચ.
હુમેસતીએચ નેજબેરેતીએચ.

જંહાંમચ ઇઆતો મતાંમચ.
હુમેસતીએચ નેજબેરેતીએચ.

મેથરો જીઆંમચ મેથરો દરી
નમચ. હુમેસતીએચ નેજબેરે
તીએચ.

અશુઅગનાંમચ અશુઅ હબે
શાંમચ. હુમેશતીએચ નેજબેરે
તીએચ.

અરોમાઘહુચ અન અરીનો
સાસતરહુચ પાઓરોમહરકહે
હુમેસતીએચ નેજબેરેતીએચ.

કેહે કહીઆચીદ દરૂઅંતાંમ અરથવીઅ મનંઘાંમ અરથવી અ વચંચાંમ અરથવીઅ શીઓ થનનાંમ. સપેતમ જરથોસતર કથ દરૂજેમ નીશ અહમદ આ નીશ નાએશામ નીશ નાએશા મ સોશીઅંતા દરેજેમ કથ નીશ નાએશામ ઇઅથ હીમ જનાંમ ખશીઅમનો અખશીઅમનનાંમ વીસપાએશ હુચ કેરેશુઆંન ઇઆએશ હુરૂત હમેસાતે બજએ રેતે વીસપીઆઓ દરૂઅતા સ તાએશ સતુઅશ અશા ઇએ હ દાઓ ઇઓએ હેંતી.

ઇઅથા અહુ વેરીઓ (૨)

ઇઅસનેમચ. વહુમેમચ ઓ

**જસચ જઉઅહેચ. આફરીનાંમે. સરોશહે આશીઅહે. નખમહે તનુ માથરહે દરસી દરોશ આ હુયરીયહે. અશેમ વોહુ (૧) અ ડમાથરેસચ.—ઉંજ ધરેમ. જસ મે.— કુરબા મુજદ.— અશેમ વોહુ (૧)**

(આ ઉપલી "પતેતે ફરશોશતરો" આજ સુધી છપાઇ નથી, પણ હાથે લખેલી કેતાબોપરથી ય૦ ઝ૦ સને ૧૨૭૯ માં સુરતવાળા મોબેદ ધનજીશા નશરવાનજી નાયલા દારૂએ "ખુણે પડી રહેલા અવસ્તા બાબાના ભણતરો" એવા નામનું ચોપાનીયું છપાવીયું તેમાં એ પતેત જાહેર થવાથી આ ચોપડી મધે દાખલ કરવાનું દરૂસત ધારી છાપી છે. એ યાજશનનો હા. ૭૦-૭૧ અને ૭૨નો છે)

એ ઇઅશત પઢવાથી તાહારી મોરાદ યાને હાજત ખુશીથી બર લાવે અને તાહારાં દેલને ખુશીઓ બખશે.

## હોરમજદ ઇઅસત

પ નાંમે ઇઅજદાંન. હોરમજદ ખોદાય. અવજુની. ગોરજ ખોર રહે અવજાઇઆદ. દાદાર હોરમ જદ. રઇઆમંદ. ખોરહેમંદ મેનુઆંન મનીઓ. બરતુમ ખેરે સાદ. યજ હમા ગોનાહ. પતેત પશેમાંનોમ યજ હરવશાતીન. દુશ મત. દુજુખત. દુજુઅરેશત મેમ પ ગેથીમનીદ. ઓયમ ગોફ્ત. ઓયમ કરદ. ઓયમ જસત. ઓયમ બુન. બુદ યસતેદ. અજા

ગાનેડા. મનશની. ગવશની કુન
શની. તની ગેઆંની. ગથી માના
આંની. ઞોખે આવાખશ પશેમાંન
પસે ગવશની. ૫ પતેત હોમ
ખશનાથર અહુરહે મજદાઅ્
તરોયદીતે. અંઘરહે. મેનીયઅ્
શા. હેથીઆ વરશતાંમ. હીઆદ
વસના. ફરશોતમેમ. સતામે આ
શેમ આશેમ વાહુ (૧)

ફરેસતાઇય હુમતાય બીઆસ
ચા. હુખતાય બીઆસચા. હુઆરસ
તાય બીઆસચા. માંથવાય બીઆ
સચા. વખદાયબીઆસચા વરશતા
યબીઆસચા. યવે ગેરીઆ દેથે
વીસપો. હુમતાચા. હુખતાચા

હુઅરશતાચા. પેતે રેચીઆ દેથે વીસપા. હુશમતાચા. હુજુખતા ચા હુજુઅરશતાચ. ફરા વેરા હી આમેશા સપેંતા. ઇઆરાનેમ ચા. વહુમેમચા. ફરા મનંહી. ફરા વચંઘા. ફરા શીઓથના. ફરા અંઘાહીઆ. ફરા તનુઆસ ચીદ ખપઈઆઓ ઓશતનેમ. સતોમે અશેમ. અશેમ વોહુ (૩)

ફરુઆરાને મજદીઆસનો જર થોશતરેશ. વીદઉઓ અહુરહે દકેશો. (જ ગેહ હોઅે ત પઢે) ફરસસતીચય અહુરહે મજદાઓ રેઉઆતો. ખરનઘંહતો ખશનોથ ર ઇઆસનાયચ વહમાયચ. ખશ

નોથરાયચ. ફ્રસસતીયચ. ઇઅથા
અહુ વેરીઓ જોતા ફ્રામે મરૂતે.
અથા રતુશ. અશાદ ચીદ. હચ
ફ્રા અશુઅ વીદુઆઓ મરોતુ

પેરેસદ જરથોશ્તરો અહુરેમ
મજદાંમ અહુરમજદ મેનીઓ
સપેનેશત. દાતરે ગેથનાંમ અસ
તુયતનાંમ અસાઓમ. મેશુઆન
હે ગાતુઓ ખદાતહે. કદ અસતે
માંથરહે સપેંતહે. અમુઅસતે
મેમ. કદ વેરેથરૂઅસતેમેમ. કદ
ખરેનંઘહુસતેમેમે. કદ ઇઆસકેરે
સતેમેમ કદ વારેથરગનીઓતેમેમ.
કદ બેસજીઓતેમેમ. કદ દબેશો
તારૂઇઆંસતેમેમ દેહુઅનાંમ મસી

આંગામરા. કદ વીસપ અંઘહુર્યાં
શ અસતુઅતો. મંન અસતે વીજ
ગમુશનસ. કદ વીસપ અંઘહુર્યાં
શ અસતુઅતો. અઘહુઆંમ અ
સતે. વીમરે જશતેમ.

આઆદ મરોદ અહુરે
મજદાર્યાં. આહમાકેમ નાંમ.
સપેતમ જરૂથોશતર. ઇઆદ
અમેશનાંમ સપેંતનાંમ તદ
અસતે માંથરહે સપેનતહે.
અમુઅસતમેમ તદ વેરેથરૂઅસ
તેમેમ. તદ ખરેનંઘહશતેગેમ. તદ
ઇઆસ કેરેસતેમેમ. તદ વારેથર
ગનીઆ તેમેમ. તદ બેશજ્યોત
મેમ. તદ હબેશો તોરૂઇઆંસતેમે
મ. દઊઅનાંમ. મશીઆનાંમચ.

તદ વીસપે અંઘહે [illegible]શ અમનુ અતો. મન અસેત વીજગામુ[illegible] તેમ. તદ વીસપ અંઘહે[illegible] અમનુઆતો. અંઘહુઆંન અસેત વીમ્રેંજશતેમ.

૨. અ[illegible] ઓ[illegible]મન જરશો શતહે. ફ્રોયદ [illegible] નદમાંસ. ફ્રસ્રૂયદ. અશાઓંમ અફ્રુ[illegible] મજદ. ઇચાદ તે અસતે. મજેશ તેમચ. વહેશતેમચ. સપેશતેમચ. ઇઆસકેરેસતેમચ વારેથરગની ઓતેમચ. બેશજીઓતેમચ. ફ્રેશો તારૂઇઆંસતેમચ. દેઊ અનાંમ મશીઆનાંમચ. ઇચાથ અનોમ તારૂઆઇયને વીસપે દેઊ ઓ મશીઆંસચ ઇચાથ અનોમ

તાહુમાઇયને વીસપે યાતુઓ પેરેકાઓસાચ. યાદ. માંમ નેચેશ તાહુયાદ. નોયદ દેઊઓ. નોયદ મશીઓ. નોયદ યાતુ ઓ નોયદ પેરેકાઓ.

આઆદ મરોદ અહુરો મજદાઓ. ફ્રખ શતાઇય નાંમ અહુમે. અશાઓમ જરથોશ તર. ઓતીઓ વાંગવીઓ ચેરેતીઓ અઊય તનોઇઓ. તુ ચરીઅ અશાહે વહેશતહે. પોખદ વીસપ વોહુ મજદદાત અશચેથર. ખશાતુઓ યઆ૰ અહમે ખરતુશ. હુપતથા ખરતુમાઓ. અસ્તેસા યઆદ આહમે ચેસતેશ. નાઓમો

એસતુમાર્ઓ. હમેમાં ઈઆદ અ
હમે સાપાંનો. પઉઆં હમો સાપ
નંઘાર્ઓ. હુઆદહમો આહુરો પરે
હમો સેઉયસતો. ચપર હમો:
યઆદ વીદુયસતુઓ પંચ હસ
અઉઆનેમન. પશુઅશ હસ હો
તમરેનેશ હુપત હસ વીસપ હુશાસ
અશત હસ પેશઊઅ. નઉઆ હસ
ઇઆદ આહમે હાતો. વીસાંસ
તેમો આહમે ઇઆદ આહુમે મજ
દાઓઁ નાંમ ઇયનશમામ જર
થોશતર. પેતે અસને. પેતે ખશ
ફને. ઇયસો પેરેતાબીઓ જોથ
રાબીઓ. જસાયનેતે. અઉઆંઘ
હુચ. રફંઘહુચ. આનેમ ઇઓ
અહુરો મજદાઓ. જસાયતે ત

અઉઅંઘહેચ. રફનંઘહેચ. ઇઍા
વંઘહેઍાશ સરોશો અશીઆ
જસાઍાઅંતે તે અઉઅંઘહેચ.
રફનંઘહેચ. ઇઆઍા આપો. ઇ
આઍાસચ ઍારૂઅરાઍા. ઇઆ
ઍાસચ અશાઍાનાંમ ફરૂઆશી
ઍા.

ઇચજી વશી જરથોશતર.
અઉિઆઍા હબેશાઍા તારૂઅ
ઇઍા દઉિઅનાંમ મશીઆનાંમચ
ઇઆથવાંમ પેરેકનાંમચ. સાથરામે
કોઇઆંમ કરપનાંમચ. મેરીઅનાં
મચ બેજંઘરનાંમ. અશેમાગનાં
મચ. બેજંઘરનાંમ. વેહરક નાંમ
ચ ચેથવરે જંઘરનાંમ. હેનીઆ
ઍાસચ પેરેથો યનેકીઆઍા.

પેરેથે. હરફશીઆઆર્ઓ. યરેહવો
હરફશીઆઆર્ઓ. ઑાજ ગેરેફતા
હરફશીઆઆર્ઓ. ખરૂરેમ હરફરોમ
ભરેનતીઆઆર્ઓ. ઝથ યમાઆર્ઓ
નાંમેનીશ. હેરેનજીઆર્ઓ ફરમરૂઅ.
વીસપાયદ આઇઆાંગસચ. ખશ
ફનસચ. પાઇરીસચ આહમે. દાતા
ચ. થરાતાચ આહમે. જનાંતાચ
મેનીઓસચ આહુમે. સપેનતો
તેમા. બેશાજનાંમ આહમે બેશ.
જીઓ તેમ નાંમ આહમે. આથ
રૂઅ નાંમ આહમે. આથરૂઅસ
તેમ નાંમ આહમે. આહુરેહે નાંમ
આહમે. મજદાઓ નાંમ આહમે
અશુઅ નાંમ આહમે. અશુઅસ

તેમ નાંમ આહમે. ખરેનંઘહ નાંમ
આહમે. ખરેનંઘહસતેમ નાંમ આ
હમે. પોઆરો દરસત નાંમ
આહમે. પોઆરો દરશતો તેમ
નાંમ આહમે. દુરે દરેસત નાંમ
આહમે. દુરે દરેશતો તેમ નાંમ
આહમે. સપેશોત નાંમ આહમે.
વીત નાંમ આહમે. દાત નાંમ આ
હમે. પાત નાંમ આહમે. થરાત
નાંમ આહમે. જનાત નાંમ આહ
મે. જનીઆસતેમ નાંમ આહમે.
ફશુમાઓ નાંમ આહમે. ફશુશો
માંથર નાંમ આહમે. યસે ખસ
થર નાંમ આહમે. યસે ખશથરી
આ તેમ નાંમ આહમે. નાંમા

ખશથરનામ અહમે. નાંમો ખશ
થરીઓ તેમ નાંમ અહમે.
અદ વીશ નાંમ અહમે. વી હવી
શ નાંમ અહમે. પેતે પાઇઉસ નાંમ
અહમે. હમેશા તારૂઆચો નાંમ
અહમે. હુથરઊઆન નાંમ અહમે.
વીસપ ઉઅન નાંમ અહમે. વીસપ
તશ નાંમ અહમે. વીસપ ખાથર
નાંમ અહમે. પાન્ઓશે ખાથર
નાંમ અહમે. ખાથરૂઆચો નાં
મ અહમે. વેરેજસોક નાંમ અહ
મે. વેરેજ શુરાચો નાંમ અહમે.
સેઇઉ નાંમ અહમે. શુરાચો નાંગ
અહમે. સેઉયશતેમ નાંમ અહમે.
અશહે નાંમ અહમે. બેરેજ નાંમ
અહમે. ખશથરીઓ નાંમ અહ

મે. ખશથ્રીઆ તેમ નાંમ અહમે હુદાનુશ નામ અહમે. હુદાનુશ તેમ નાંમ અહમે. હુરે સોક નાંમ અહમે. તાસ્તાસચ યઆચો નાં મનીશ. ઇઆસચ મે યન અહમે અંઘહુયો ઇઆદ આસનુઆને. સ્પેતમ જરથોશતર. યઆચો નાંમેનીશ. દરેનજ્યો ફ્રમરૂઆ. પેતેવા આસને પેતે વા ખશફ્ને. ફ્રમરૂઆ. ઓશ વા હેશતો. નીવા પેદીઆમનો. નીવા પેતીઆમનો. ઓશ વા હેશતો. યવીઆ ઓંઘનેમ વા યવીઅંઘઇઆમનો યવીઆઓંઘનેમ. વા ખુજીઆમ નો. ફ્રા વા શુસ હચ ગાતોદ.

ફ્રશા વા શુસ હુચ જંતાદ. ફ્રશાવા
શુસ હુચ દંઘોદ. અઊઅ જસ
દખ્શીઓામ આ નોયદ કૈમ. નર
ચંઘહે. અઇઆંને. નોયદ અંઘા
ઓ ખશપો. ચશમો કરૂતહે દરો
ખશ. મનંઘો. અઊઅશી આદ.
નોયદ અકઉઓ. નોયદ અકઊ
ઓ. નોયદ. ચશુઓ. નોયદ
કેરેત. નોયદ વજર નોયદ વી
સંતે અસાનો. અઊઅશીઆદ.

વીસાંસતસચ ચમાઓ નાંમેની
શ. પરસતસચ. પેરેઊઆરસચ વી
સંતે પેરે મેનીઓઇઆદ કરૂજદ.
વરેનીઆદચ. દરૂઓ આંચથી
આદ. જનેઇઊશદચ. કઇઆદાદ.
વીસપો મહુરકાદચ. પેરે દરૂઅ

નહ. ઈઆદ અંઘરાદ મેન્યોઇઆયદ
માંનીધજ્ઞઅંહે. ઇઅથ યજંઘ રેમ
જરાંમ. ઓયમ નરેમ યવી આ
ખશોયદ. કે વેરેથ્રેમ જાથવા.
પાયરાંઘા. ઇઓય હેનતે. ચેથરા
ઓય. દાંમ આહુમ બેશ. રતુમ
ચીજદી. અદ હોય વોહુ સરોશો
જંતુ મનંઘા. મજદા આહમાય.
ઇય આહુમાય વશી કહમાયચીદ.
નેમેમ કુઉયમ ખરેનો. નેમો
યરીયને વેજહે. નેમો. સોકહે
મજદદાતહે. નેમો આપો દાય
તીઆઓં. નેમો અરેદુઇઆઓં
આપો અનાહેતીઆઓં નેમેમ
૧૭ વીસપીઆઓં અશોનો સતાયશ.

ઇઅથા અહુ વેરીઓ (૧૦) અશે
મ વોહુ (૧૦)

અહુનેમ વેરીમ ઇઅજમેદે. અ
શેમ વહેશતેમ સરેશતેમ અસેશ
મ સપેંતેમ ઇઆજમેદ. અમેમ
ચ. થરેમમચ ઓજસચ. વેરેથ
રેમચ. ખરેનસચ. જઉઆરે ચ ઇ
અજમેદે. અહુરેમ મજદાંમ
રેઉઅંતેમ ખરનંઘહંતેમ ઇઆજ
મેદ. ઇયંઘહે હાતાંમ. આદ ઇઅ
સને. પેતે વંઘો મજદાઓ અહુ
રો. વેથા અશાદ ડચા ઇઆઓં
ઘાંમચા. તાંસચા તાઓસચા
ઇઅજમેદે.

(બાજમાં પઢે) હોરમજદ ખોદાય અવજુની મરદુમ. મરદુમ સરદગાંહ માંસરદગાં. હમબાયસત બેહાં. ઓયમ બેહદીને માજદી અસનાં. આગાહી આસતુઆંની. નકી કસાંનાહ. યદુન બાદ [ પર ગટ પઢે ] ઇઆથા આહુ વેરીઓ

(૨) ઈઅસનેમચ. વહમેમચ. ઓજસચ. જઉઓરેચ. આફરીનામિ આહુરેહે મજદાઓ રેવઆંતો ખરેનંઘહતો. અશેમ વોહુ (૧)

નેપાઇઉોશ મશીમ ઓરૂઅંતેમ ઇઅઉઅતાયતે જરથોશતર હુરૂ અથાહ પરો દુશ મેનુઆંન. માતેમ ઓરૂઅંતેમ. ફ્રરાદર્યો:યદ સનથા

ય. મા દુર્જ ઓરૂતે. ૭ આનાંમ
ઑાપીયતે. માઇ આસ્રોયશ. આ
ઑાગ્ર નરેમ હાયતીમ. ઇર્યોના
મનશ્તેમ. ઇઆસનેમ ઇઅજાયતે.
ફ્રેસ્તેમ ઇઅસ્નીઆઇ. ફ્રાઇપ્રો-
ડયતીઆઇ. આઉમીઆંન અ
મેશે સ્પેનતે મન અસતે વોહુ
મનો. મનહાંમ જરથોશતર. ઇઅ
દ અશેમ વહીશ્તેમ મનહાંમ
જરથોશતર. ઇઆદ ખશથરેમ વેરી
મ. મન હાંમ જરથોશતર. ઇઅ
દ સપેનતીઆર્મે આરમેતાયશ.
મન હાંમ જરથોશતર. ઇઆદ
હુરૂઅત અમેરતાત. ઇર્ઑા સતે
મીજદેમ. અશોનાંમ ફ્રેરા અસતે
જસેનતાંમ. મન હાંમ જરથોશતર

અહિઆ હથાચા હદચા કથદચ. આાચ
આશાઓંમ જરથોશતર. મનખરે
તુરાચ. હેશતેશ ઇજમાયશ આાઅ
ઘહેઓંશ. પેયરીદેઝ્આ ઘુવદ ઇ
આંઘાચ આંઘદ. અપેમ અંઘ
હેઓંશ

હજંઘરેમ બેશેજનાંમ બેઉ
આરે બેશેજનાંમ. હજંઘરેમ
બેશેજનાંમ બેઉઆરે બેશેજનાંમ
હજંઘરેમ બેશેજનાંમ. બેઉઆરે
બેશેજનાંમ.—જસમે અઉઆંઘ
હે મજદ. જસમે અઉઆંઘહે
મજદ. જસમે અઉઆંઘહે
મજદ. અમહે હુતાશતહે હુરો
દહે. વેરેથરગનહે આહુરદાતહે.
વનંતીઆાઓંસચ ઓંપરતા

તા. સ્પેનતહેચ. આરમેતાયશ આરમેતીઅ. સપેનતીઅ વશાંમ હમેરેશા. સ્પેનદીઅદવેમ. પેરે ઑશી દારીઅદ વેમ. હુમ ગેન હરેનજીઅદવેમ. હુમ નેને અઊઆ જંદીઅદવેમ. યબે હરેનેને હરેનજી અદવેમ. કદ અશુઅ મજદ. વનદ દરૂઅંતેમ. અશુઅવનંદ દરૂ નેમ. અશુઅ વનદ દરૂઅંતેમ.

ઑશી અહુરહે મજદાઑ ઇઅ જમેદ. હરેથરાય માંથરહે સપેનત હે. ખરેતુમ અહુરહે મજદાઑ ઇ અજમેદ. મેરેથરાય માંથરહે સપેન તહે. હેંજુઆંમ અહુરહે મજદા ઑ ઇઅજમેદ. ફરૂઆકાય માંથ

રહ્રુ સાંગનહ્રુ. અઙિયમ ગેરીમ ઇઅજમેદ. ઇઆાંમ ઍાશેદાંમ ઍાગેહરેગમ. પેતે આસંગ. પેતે ખશરૂને. ઇયસો બેરેતાબીઍા બેથરાગીઍા. આાઅદ ઍાખ ત જરદ્યોશતગો. ઍાપેરીવા જમેરેને દુઇય સપેનંતીઆઍા આર મેતાયશ. દોયથરાબીઍા અવા સતર વતરૂમબીઍા. ઙ્જંધરેમ બેશેજનાંમ બેઊઅરે બેશેજનાંમ ઙ્જંધરેમ બેશેજનાંમ બેઊઅરે બેશેજનાંમ. ઙ્જંધરેમ બેશેજ નાંમ બેઊઅરે બેશેજનાંમ.

☞ અહ્રુ નરશ અશોનો ફરૂઅશીમ ઇઅજમેદ. ઇઍા અસમા ખનુઆઍા નાંમે

અહાદ. અનીયશાંમ. અશોનાં
મ. ફ્રરખશત ઇઆજોય ફ્રૂઆરેત
ગોઇરેનહે સુરહે મજદદાતહે.
ગોઇરેનમ સ્રેમ મજદદાતેમ
ઇઆજમેદે. આશી અહુરહે મજ
દાઓ ઇઆજમેદે. ગેઉશરાય માંથ
રહે સપેનતહે. ખ્રતુમ અહુરહે
મજદાઓ ઇઆજમેદે. ગેઉશરાય
માંથરહે સપેનતહે. હિજુઆંમ
અહુરહે મજદાઓ ઇઆજમેદે.
ફ્રૂઆકાય માંથરહે સપેનતહે
અશિયમ ગેરીમ ઇઆજમેદે. ઇઆ
મ ખ્આશેદાંમ ખ્આશે હરેનેમ પેત
અસને. પેતે ખશફ્ને. ઇયઓ
બેરેતાબીઓ બોથરાબીઓ. અ

શેમ વાહુ (૧) ( અહુ નવર થી
ત્રણવાર પઢે.)

હાંમીમ ઇઅજમેદે. ઇઆંમ
આરમેતીમ સપેનતાંમ ઇઅજ
મેદે. અહુ દાથરહુ. અશહુચ
અશોનાંમચ. અશહુ પોયરીઅ
નાંમ. હામનાંમ. યતહ દેમ વીસ
પનાંમ. મજદાતેમ દજહીઆય
અહુમચ. રતુમચ. ઇઅમ અહુ
રેમ મજદાંમ. સનથાય અંઘર
હુ મેનીયઓંશ દહુઆતો. સન
થાય યસમહુ ખરૂદ દરોખશ
સનથાય માઝનીઅનાંમ દેઉઅ
નાંમ. સનથાય વીસપનામ દેઉઅ
નામ વરેનીઅનાંમચ દરૂઅતાંમ.
[બાજમાં પઢે] શેકસત ગના

મેનીઓ. બર આહુરેમન લેઆં
ભત. શદ હજાર બાર

[પરગટ પેઠે] ફરદથાય આહુ
રહે મજદાઓ રેઉઆતો ખરેનંઘ
હતો ફરદથાય અમેશાનાંમ સપેંત
નાંમ. ફરદથાય તેશતરીઆહે સતા
રો રેઉઆતો ખરેનંઘહતો. ફરદ
થાય નરશ અશોનો. ફરદથાય
વીસપનાંમ સપેંતહે મેનીયઓશ
દામનામ અશોનાંમ અશેમ
વોહુ (૧) અહમાયરેસચ.—હ
જંથ્રેમ.—જસમે.—કેરબા મુજદ.
અશેમ વોહુ [૧]

રોજ [ફલાંન] માહ (ફલાં
ન) ગેહ (ફલાંન) નમાજ
દાદાર ગેહાંન દામાંન. ખશનોથ

२ અહુરહે મજદાઓ તરોયદીતે. અંઘરહે મેનીયઓસ. હૈથીઆ વરશતાંમ. હીઅઽ વસના. ફર શોતેમેમ-સતોમે અશેમ. અશેમ વોહુ (१) ગોરજ ખોરહે અવજા ઇઆઽ. દાદાર હોરમજદ. રઇઓ મંદ. ખોરેહેમંદ. મેનુઆંન મેની ઓ બરેતુમ બેરેસાદ અમાવંદ પીરોજગર. અમાવંદી પીરોજગ રી દાદ દીને બેહે માજદીઅસ નાં. આગાહી રવાઇ ગોઆફરં ગાંનીબાદ. હપત કેશવર જમીન ચહુન બાદ. મંન આનોઆવા ઇઅદ શુદંન. મંન આંનો આવા ઇઅદ શુદંન. મંન આંનો આવા ઇઅદ શુદંન. અશોને અશેમ વોહુ (१)

(દખણ દશાની તરફ મોહોડું કરીને પઢે)

દાદાર ગેહાંન દીન માજદીઅસની. દાદ જરથોશતી. નેમસે તે અશાઓંઘ સેઓઈશતે. અરદુઈસર અનાહુતે. અશોનેઅશેમ વોહુ (૧) નેમો અહુમર વરેઘ્રીશ મજદદાતહે. અશોને અશેમ વોહુ (૧) અહુરેમ મજદાંમ રેઉઆંતેમ ખરેનઘાડંતેમે ઇઆજમેદે. અશેમ વોહુ (૩) દાદારે હોરમજદ. રઇઓમંદ ખોરહેમંદ મેનુઆંન મેનીઓ ખરેતુમ એરેસાદ અશેમ વોહુ [૧]

# નારંગ ઇઆ દાહારી.

[એ નીરંગ હોરમજદ ઇઅશાત પઢેયા પછે વાર ૩ પઢે]

ઇઆ દાહારી હોરમજદ. યહે રેમંન મરોચીનીદાહારી. નગુનમ હેવાન. અર બુહને. રસતાખેજ તંન પસીન બે ગુમાંનમ અશોમ વાહુ (૧)

એ ઈઅશત પઢનાર જે મોરાદ ચાહે તે બર આવે અને તેહનાં દેલનું દુખ અને શખ્તો ગમ દુર થાએ, રાત દાહાડો પઢે તો તેનું રવાંન ખુશી અને ફતેહમંદમી થાએ. દોજખથી તેહન છોડવે છે.

## મોહોટો હપત અમેશાસપંદ ઈઅસત.

પં નાંમે ઇઆજદાંન. હોરમજદ ખોદાય. અવજુની. ગોરજ. ખોરહે અવજાઇઆદ. હપત આ મેશાસપંદ બેરેસાદ યજ હમા ગોનાહ. પતેત પશેમાનોમ. યજ હરવસતીન. દુશમત. દુજુખત દુજુઅરેશત. મન વ ગેથી મ નીંદ. ઑયમ ગોશ્ત. ઑયમ કરદ. ઑયમ જસત. ઑયમ બુ

ન થ્રુદ યસતેદ. અજાં ગોનેહા
મનશની. ગવશની. કુનશની તની
હૈઆની. ગેથી મીનોઆંની
ઐઆપે અવાખશ. પરોમાંન પસે
ગવશની. ૫ પતેત હોમ. ખશનો
થર અહુરહે મજદાઓ તરોયદી
ત. અંઘરહે મેનીયઓશ હેથીઆ
વરશતાંમ. હીઅદ વસના ફરશો
તેમેમ. સતામે અશેમ અશેમ
વોહુ (૩)

ફ્રૂઆરાને મજદીઅસનો જર
થોસતરેશ. વીદેઓ અહુરહે
દકેશો (જો ગેહ હોય તે પઢે) ફ્ર
સસતીયચ. અહુરહે મજદાઓ
રેઉઆતો ખરેનંગહતો. અમેશાનાં

મ સપેંતનાંમ. વંઘહુંય મનંઘહે. આખશતાય હાંમવેઆંતીઆઓ તરેહાનો અનીઆયશ હામાંન. આ સનહે ખરેથવો મજદહાતહે. ગા શો સઋતહે ખરથવો મજદ હાત હે. અશહે વહેશતહે સરેશતહે યરીઅમનો યશીયહે શુરહે મજ દહાતહે. સોકીઆઓ વંઘોહી આઓ. વોઓરો દાયથરીઆઓ મજદહાતીઆઓ અશોનીઆ ઓ:. ખશાથરહે. વેરીઅહે અઇ ઓ ખશોસતહે મરેજદકોય. થરા ઇઆ હરેગુઅહે. સપેંતીઆઓ. વંઘોહીઆઓ. આરમેતાયશ. રા તીઆઓ વંઘોહીઆઓ. વોઓ રો દાયથરીઆઓ. મજદહાતીઆ

ઑ. અશોનીઆઓ. હુરૂઅતા
તા રથવો. ઇઆયથ્રીઆઓસચ
હુશેતાયશ. સરેદથ્રીઓ અશહે
રતોથ્રીઓ અસેરેનાતો. રથવો
ફ્રશોનેથ્રીઅ. વાંથ્વનેથ્રીઅ. આસ
પનેથ્રીઅ. ઇઅઓઅનેથ્રીઅ. ગો
કેરેનહે શુરહે મજદદાતહે.

[હાવન ગેહ હોએ તો એમ પઢીએ]

મેથરહે વોઉરૂ ગઓઇઓય
તાયશ રામસચ ખાશતરહે.

(રપીથવંન ગેહ હોએ તો એમ પઢીએ)

અશહે વહીશતહે આથ્રસચ
અહુરહે મજદાઓ પોથ્ર.

(ઓજીરંન ગેહ હોએ તો એમ પઢીએ)

બેરેજતો અહુરહે નફદરો.

**આપાંમ અપસચ મજદદાતીઆ આઁ.**

[અવેસદ્રથરેમ ગેહે હોએ તો આમ પઢોએ]

**અશાઅઁાનાંમ ફ્રહ્રાશનાંમ. ગેનાનાંમચ વીરો વાથ્વનાંમ. ઇઆથરીઆઅઁાસચ હુશેતાયશ. અમહેચ હુતાસતહે હુશેદહે વેરેથરગનહે આહુરદાતહે. વનં નતીઆઅઁાસચ આઁપરતાતો.**

(આશાહેન ગેહે હોય તો એમ પઢોએ.)

**સરોશહે અશીઅહે અસુ અતો વેરેથરાજનો ફ્રરાદદ ગેથહે. રશનોયશ રજીશતહે. અરશતા તસચ ફ્રરાદદ ગેથીઆઅઁ. વરે દદ ગેથીઆઅઁ.**

* * * * *

ખશનોથર ઇઅસનાએચ. વહ
માએચ. ખશનોથરાએચ. ફરસસ
તીએચ. ઇઆથા અહુ વેરીઓ
જોતા ફરામે મરૂતે આથા રતુશ
અશાત ચીદ. હચ ફરા અશુઅ
વીદ્વાઓ મરોતુ-આહુરેમ મજ
દાંમ રેઊઅંતેમ ખરેનંઘહંતેમ
ઇઅજમેદે. અમેશાસપેનતા હુખ
શથરા હુદાઓંઘહો ઇઅજમેદે.
વોહુમનો અમેશેમ સપેઅંતેમ
ઇઅજમેદે. આખશતીમ હાંમવ
અંતીમ ઇઅજમેદે. તરદાતેમ
અનીઆયશ દામાન. આસનેમ
ખરતુમ મજદદાતેમ ઇઅજમેદે.
ગોશો. સરૂતેમ ખરતુમ મજદદા
તેમ ઇઅજમેદે. અશેમ વહુસતેમ

સરેશતેમ અમેરોમ સપેઅંતેમ
ઇઅજમેહે. યરીઅમનોમ યશીમ
ઇઅજમેહે. શુરેમ મજહદાતેમ
ઇઅજમેહે. સોકાંમ વંઘોહ્રીમ
વોઓંગ્રે. હોયથરાંમ મજદકાતામ
આરોનીમ ઇઅજમેહે. ખશાથરેમ
વેરીમ અમેરોમ સપેઅંતેમ ઇઅજ
મેહે. આઇઓપાશુસતેમ ઇઅજમે
હે. મરેજદકેમ થરાઇઓ દરેગુમ
ઇઅજમેહે. સપેંતામ વંઘોહ્રીમ
આરમેતીમ ઇઅજમેહે. રાતાંમ
વંઘોહ્રીમ વોઓંગ્રે હોયથરાંમ
મજદકાતાંમ આરોનીમ ઇઅજ
મેહે. હુરૂઆતાતેમ અમેરોમ જપેંતે
મઇઅજમેહે. ઇઆયતીઆંમ હશે

તીમ ઇઆજમેદ. સરેહ અશુઆન
આશાહુ રતુઓ ઇઆજમેદ. અમે
રેતાતેમ અમેશેમ સપેનતેમ ઇઆ
જમેદ. ફ્રશોનીમ વાંથવાંમ ઇઆજ
મેદ. આસાપનાંચ ઇઆઉઆનો ઇઆ
જમેદ. ગોઇરેનેમ સુરેમ મજદદા
તેમ ઇઆજમેદે.

(હાવંન ગેહ હોએ તો એમ પઢીએ)

મેથરેમ વોઓરો ગાઇઓ
યતીમ ઇઆજમેદે. રાંમ ખાશત
રેમ ઇઆજમેદે.

(રપીથવન ગેહ હોએ તો એમ પઢીએ)

અશેમ વહુશતેમ આતરેમચ
અહુરહે મજદાઓ પોથરેમ
ઇઆજમેદે.

[આજીરંન ગેહ હોએ તો એમ પઢીએ]

બેરેજંતેમ અહુરેમ ખશથ્રીમ ખશેતેમ. અપામ નપાતેમ ઑરૂઅદ અસપેમ ઇઅજમેદે. અમેમચ મજદદાતાંમ અશોનીમ ઇઅજમેદે.

(એવેસરૂથરેમ ગેહ હોએ તા એમ ૫ ઢીએ) અશાઑનાંમ વંઘોહીશ સુરાઑ સપેંતાઑ ફરૂઅશીઓ ઇઅજમેદે. ગેનાઑસચ વીરોવાં થવાઑ ઇઅજમેદે. ઇઆયરી આમચ હુશેતીમ ઇઅજમેદે. અમેમચ હુતાશતેમ હુરોદેમ ઇઅજમેદે. વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજમેદે. વનેંનતીમચ ઑપરતાતેમ ઇઅજમેદે.

(આશાહીન ગેહે હોએ તો એમ પઢી એ.) સેરોશેમ અશીમ હુરોદેમ વેરેથરાજનેમ ફરાદદ ગેથેમ અસુ અનેમ અશાહે રતુમ ઇઅજમેદે. રૂશનુમં રનશતેમ ઇઅજમેદે. અરશતાતેમચ. ફરાદદ ગેથાંમ વરે દદ ગેથાંમ ઇઅજમેદે.

અશાઓનાંમ વંઘોહીસ સુરા ઓ સપેઅંતાઓ ફરૂઅશીઓ ઇઅજમેદે.

☞ ઇઆ તુજી જરથોશતર. વનંદ દેઉઓ મશીઓ. કો ન માનહુબાક. સપેતમ જરથોશતર. વીસપ દરોખશ જાનાયતે. વીસપ દરોખશ નાસાયતે. ઇઅથ હોનોં યતશાંમ વચાંમ. આયતેઆય

નનુઅ્યો દહાયતે. અ્યાયતે અથોર
નેમ જાનાયતે. અશોરેનેમ. ઇઅથ
રશ્રૂશતારિમ વીસ્પનો આસરોશતે.
નાસાતનાંમ અ્યોજંઘહુ ઇઅ્યો
હુાહીમ દસત દારેનેમ. ઇઅ્યો
હુાહીમ દસત કેરેનેમ. ઇઅ્યોય
ઉપત અમેશા સ્પેંતા. હુખશથ્રા
હુદાઓંઘો. ઉમેરેથે નાંમચેદ.
દેનાંમ માજદીઅસનીમ. અસ્પો
કેહરપેમ. આપેમ મજદદાતાંમ
અશોનીમ ઇઅજમેદે. આતરેમ
વતરેમેબીઆઓ. વતરેમેબીઆ
ઓ. વીમેરોદ જરથોશતર ઇઅદ
વંઘહુઓશ મનંઘો. ઇઅદ હુથી
અજંઘ વચાંમ. ફ્રસપાઉઅરેશ.

ફ્રરાશ. ફ્રમેરેથ્વચ્ય. ફ્રજાંથ્વચ્ય. સ્રુઆત. સતેવત. ઓંતરિઆત ઓંતવેત. ઓંતે આપ ભરેંતઇઆધ ભરાંતેમ ફ્રશાનાંમ. દેનામ માજદીઆસનીમ. નાશાયતનાંમ ઓજંઘ્રુ. અશેમ વોહુ (૧)

(કરદો ૧ લો) અહુરેમ મજદામ અશુઆનેમ અશહે રતુમ ઇઆજમેદે. અમેશા સપેંતા હુખશેથ્રા હુદાઓંઘહો ઇઆજમેદે. વીસપાંસ અશોનો સતીમ ઇઅજમેદે. મેનીઊમચા. ગેથીમચા. બેરેજ વંઘહુઓંશ અશહે બેરેજ. દેનીઆઓ વંઘોહીઆઓ માજદીઅસનાયશ.

હુમતનાંમ. હુખતનાંમ. હુઆ

રશાતનાંમ. ઇઅહદ્યા અનીઅહ
દ્યાં. વેરેજીઅમનનાંમચ્યા વાહુઅ
રેજનનાંમચ્યા. મહીયબીજરેતારો
નેનેસતારો. ઇઅથ ના વાહુ નાંમ
મહી. હુમતનાંમ. હુખતનાંમ.
હુઅરશાતનાંમ. ઇઅહદ્યા. અની
અહદ્યા. વેરેજીઅમનનાંમચ્યા. વાહુ
અરેજનનાંમચ્યા. મહી યબીજરે
તારો. નેનેસતારો. ઇઅથ ના વાહુ
નાંમ મહી. તહ અહ વેરેમહી.
અહુર મજદા. અશા સરીરા
હીઅહ ઇમેને મહેચ્યા. વાચો
માચ્યા. વેરેજ માચ્યા. ઇઆ હાતાં
મ શીઓથેનનાંમ. વહેશતા ખી
આહ ઓબોયબીઆ અહુબીઆ

ગિય આદાયશ. તાયશ શીઓ
થનાયશે. ઇઆયશ વહેશતાયશ.
ફરેશીઆ મહી. રામાચા વાસ
તરેચા. હજદીઆય સોરોનુ અન
સચા. અસોરોનુઅતસચા. ખશી
અતસચા.અખશીઅંતસચા.

હુખશથરોતેમાય. બાદ. ખશથ
રેમ. અહમદ હીઅદ. અયબી.
હદેમહેચઃ ચીશ મહેચા હુઆંન
મહેચા. ઇઅદ મજદા અહુરા.
અશાયચા વહેશતા. હુ ખશથરો
તેમાય. બાદ ખશથરેમ. અહમદ
હીઅદ. અયબી હદેમહેચા ચીશ
મહેચા. હુઆંન મહેચા. ઇઅદ

મઝદા અહુરા. અશાયચા વહિશતા.

હુ બરેથરો તેમાય. બોદ પશ થ્રેષ. અહુરહ હીઅહ. અય ની દદમહિઆ ચીશ મહિઆ. હુ આંગ મહિઆ. ઇઅહ મજદા અહુરા. અશાયચા વહિશતા.

ઇઅથા આઅહ ઓતા. નાવા નાયરે વા. વીદાયતીમ. અથા ઙહ વોહુ તહ. ઇયઆહુ વેરેજીઓ તુચા. ઇહ અઙમાય ફરોઆ વાતો. ઇઓ તુ ઇહ અયબીઓ. ઇઓ ઇહ અથા વેરેજીઆંના. ઇઅથા ઇઅહ અશતી. અહુરહી આ. જીઅહ વે મજદા. ઇઅસ

નેમચા. વહ્ડેમેમચા. વહ્રેશેતેમ અહ્ડુમે હ્ડેરી. ગેઓશચા વાસત રેમ. તક અક વે વેરેજ્ઞ્યા મહ્રી. ફ્રરચા વાતાઇચા મહ્રી ઇચા તુ અશાગેદ.

અશાહ્રીઆ આદ સેરી અશહ્રીઆ વેરેજ્ઞને કહ્ડમાયચીદ. હ્ડાતાંમ જ્ઞેનશાંમ વહ્રેશતાંમ. આદા ઓબાયબીઆઅહુવીઆ. અશાહ્રીઆ આદ સેરી અશાહ્રીઆ વેરેજ્ઞને કહ્ડમાયચીદ. હ્રાતાંમ જ્ઞેનશાંમ વહ્રેશતાંમ. આદા ઓબાયબીઆ. અહુવીઆ.

યમાઆદ ઓખદા વચા અહુર મજદા. અશેમ મેનીઆ.

વહુહીઆ. ફરાહુઓચામાં થવા
મ અદ યશાંમ પેતીઆશતારેમ
ચા. ફરદખશતાહ્રેમચા. દંદમેદે.
અરાાદ હચા. હચા વંધેચોંાશ
ચા. મનંધા. વંધેચોંાશચા ખશ
થરાદ સતાતાયશ. થવા આાદ
અહુરા સતાતાયબાએ. યબાહ્યા
ચોંાખદા થવાદ ચોંાખદાયબી
એ. ઇઅસના થવાદ ઇઅસનો
યબીએ. દયંઘહે હાતાંમ. આ
અદ ઇઅસને. પેતે વંધા મન્જ
દાચોં અહુરે. વેથા અશાદ
હચા. ઇઆચોંાઘાંમચા. તાંસચા
તાચોંાસચા ઇઅજમેદે.

(કરદા ૨ જો) અહીઆ થવા

આથેરો વેરેજના પોરૂઇય પેરે જ
સામેદ. મજદા. અહુરા થરા થવા
મેનીઉ સપેનેશતા. ઇયઆ અખ
શતેશ. અહમાય ઇયમ અખતોઇ
ઑ. દાઑઅંઘહે ઑરૂઆજ
સતો હુઑના ઇઆ તાઇઆ. પેતે
જમીઆઑ. આતરેમ મજદા
અહુરહીઆ. ઑરૂઆ. જેશતહી
આ. ઑરૂઆ જીઆ નાંમેશત
હીઆ. જેમઅંઘાનાઑ. મજેશ
તા ઇઆઑંઘાંમ. પેતે જમીઆ
ઑ. આતરેશ વોય મજદા
અહુરહીઆ. અહી મેનીયઑશ
વોય અહીઆ સપેનેશતો. અહી
હીઅદ વાતોય નાંમ નાંમ. વા

નશતેમ આતરેમ મજદા અહુર
હીઆ. ના થવા પેરે જસામેહે.
વોહુ થવા મનંઘા વોહુ થવા
અશા વંઘેહીઆ. થવા ચશતે
ચશ શીઓથનાચસચા. વચોથી
અસચા પેરે જસામેહે. નેમખી
આ મહી. યશુયહીઆ મહી.
થવા મજદા અહુરા વીસપાયશ
થવા હુમતાયશ. વીસપાયશ હુ
ખતાયશ વીસપાયશ હુઅર શતા
યશ. પેરે જસામેહે સરેશતાંમ. અ
હતાય કેહુરપેમ કેહરપાંમ. આઓી
યહીઅ મહી. મજદા અહુરા.
યમાઓ રેઆઓ બેરેનશતે મ
બેરેજમનાંમ. અઓીઆદ ઇઆદ.

અહુરે અઊઆચી. ઇયંઘહે હા
તાંમ આઅદ ઇઅસને. પેત વંઘે.
મજદાઓ અહુરે. વેથા અશાઃદ
હચા. ઇઆઓઘાંમચા. તાંસચા
તાઓસચા ઇઅજમેદે.

(કરદે ૩ જો) યથા આદ ઇઅ
જમેદે. અહુરેમ મજદાંમ. ઇય
ગાંમચા અશેમચા દાદ. અપસ
ચા દાદ ઓઃરૂઅરાઓસચા વંઘે
હીશ. રેચાઓસચા દાદ ભુમી
મચા વીસપાચા વોહુ. અહીઆ
ખશથેરાચા. મજેનાચા હુઅપંઘા
ઓસચા. તેમં અદ ઇઅસની
અનાંમ. પોઓરૂઅતાતાઓ ઇચા
૯ જમેદે. ઇઓય ગેઓશ હચા

શીઅંતે. તેમ અહે આહુઇરીઆ
નાંઇરીકીશ. મજદા આહુરે સાંપે
અંતા તેસાગ્જા ઇઅજમેદે. તેમ
અહુમાય કાયશ. અર્જદે બીઆ
સચા. અંઆરાતા નારીઆ ઇઅજ
મેદે. તેમ અશાનાંમ ફ્રૂઅશીશ.
નરાંમચા નાયરૈનાંમચા ઇઅજમે
દે. અરોમ ઇઅહ વહુશતમ ઇઅજ
મેદે. ઇઅહ સ્રેશતેમ. ઇઅહ સ્પે
અંતેમ અમેશેમ. ઇઅહ રેઓ
અંઘહુહ. ઇઅહ વીસ્પા વોહુ વો
હુચા મના ઇઅજમેદે. વોહુચા
ખશથ્રેમ. વંઘેઉહીમચા દેનાંમ.
વંઘેઉહીમચા ફ્રૂ રતુમ વંઘેઉહીમ
ચા આરમેતીમ. ઇયં ઘહે ઝાતામ.

આહ ઇઅસને પેતે વંઘો મંજદા
ઑ. આહુરે. વેથા અશાદ હુ
આ. ઇઆાઓંઘાંમચા. તાંસચા
તાઓસચા ઇઅજમેદે.

[કરદે ૪થો] યમાંમ આહજાં
મ. ગેનાબીશ હરથરા ઇઅજમે
દે ઇઆનાઓ ખેરેતી. ઇઆાઓ
સચા તોય ગેનાઓ આહુર મ
જદા. આશાદ હુઆવેરીઆ તા
ઓ ઇઅજમેદે. ઇઅજાઓ ઇઓ
શતીઓ. ફ્રેરતીઓ. આરમેતી
ઓ. વંઘોહુીમ આબીશ. અશીમ
વંઘોહુીમ. ઇશીમ વંઘોહુી આ
જુયતીમ વંઘોહુીમ. ફ્રસસતીમ
વંઘોહુીમ. પારેઅંદીમ ઇઅજમેદે
અપો આદ ઇઅજમેદે. મેકી

અંતીસચા. હેઉુઅંતીસચા ૬૩ અજંઘો. અહુરાનીશ અહુરહી આ. હુઅપંઘાઓ હુપેરેશવાઉઅ ચા. વાઓ હુઓ ગજેથરાઓ સચા. હોશના થરાઓસચા. ઓ બાયબીઆ અહુબીઆ. અગેશ ઉયતી. ઇઆવે વંઘોહીશ અહુર મજદાઓ નામાંમ દદાદ. વંઘો દાઓ હીઅદ વાઓ દદાદ. તા યશ. વાઓ ઇઅજમેદ. તાયશ ૬ રીઆન મહી. તાયશ નેમખી આમહી. તાયશ યશુદીચા મહી અપસચા વાઓ. અજુસચા વાઓ. માંથરસચા વાઓ અ ગ્નાઆઓ દરેગો દાઇઅંઘો

વીસ્રપો પેતીશ અઉઓ ચામા વહેશતાઓં સરેશતાઓં. અઉ આઓં વે વંઘોહ્ડીશ રતોયશ દરેગો ખાજાઓંશ. નાશુપેતી વીઆદાઓં. પેતીશે અંદાઓં. માતરે જીતીઓ ઇયંઘહેડાતાંમ. આદ ઇઅસને. પેતવંઘો. મજદા ઓં અહુરે. વેથા અશાદ ઙચા ઇઆઓંઘાંમચા. તાંસચા તાઓં સચા ઇઅજમેદે.

(કરદો ૫મો) યથો આઅદ ઇઅજમેદે. ગેઓંશ ઓંરૂઆ નેમચા. તશાનેમચા. અઙમાય કેઅંગ આદ ઓંરૂનો પંશુકનાંમ ચા. ઇઓનાઓં જીનેસેઅંતી. ઇયબીઅસચા તોયઆ ઇયચા.

ઇયબીઓ અંઘહેન દેહેકનાંમચા. આહ ઇઉનાંમ હીઅહ ઓરેનો ઈઅજમેદ. અશાઓનાંમ આહ ઓરેનો ઈઅજમેદ. કુદ્દો જાન નાંમ ચીદ. નરામચા નાયરેનાં મચા. ઇયશાંમ વહેહોશ દેનાઓ વનેઅંતીમ વા વેઅંઘેજ વા. વો નરેવા. આહ યથા ઈઅજમેદે વંઘહુસચા ઇઅહ વંઘોહોસચા. ઇઅહ સપેઅંતીયઅંઘ અમેશે અંઘ ઈઅઉીય જીઓ. ઇયઉીય શુઓ. ઇઓ વંઘહેઓસચ આ મનંઘો. શીયઅંતે ઇઆઓસચ ઓયતે.

ઈઆથા તુઇ અહુર મજદા મે અંઘાચા. વોચસચા. દાઓ

સચ્ચા. વરેસચ્ચાઇચ્આ વોહુ.
અથા તુઇ દદેમહી. અથા ચીશ
માડો. અથા થવા આયશ ઇઅ
જમેદ. અથા નેમખીઆ મહી
અથા યશુયદીઆ મહો થવા
મજદા અહુરા. ઇઅથાતુઇ અહુ
ર મજદા. મેઅં ઘાચા. વોચ
સચા. હાર્મોમચા વરેસચા ઇઆ
વોહુ અથા તુયદદે માડોં અ
થા ચીશ માડો. અથા થવા
આયશ ઇઅજમેદ. અથાનેમખી
આ માડો. અથા યશુયદીઆ
માડો. થવા મજદા અહુરા.

વંઘહુઓાશ ખેતઓાશ ખેતા
તા. વંઘહુઓાશ અશાહીઆ.

થ્વાપેરેજસામેદે. વંઘોહીઆઓ
ફ્શે રતુઓ. વંઘોહીઆઓ
આરમેતાયશ. ઇયંઘહે હાતાંમ
આદ ઇઅસને. પેતે વંઘો. મજદા
ઓ અહુરો. વેથા અશાદ હચા
ઇઆ ઓંઘાંમચા તાંસચા તા
ઓસચા ઇઅજમેદે.

(કરદો ૬ઠો) આહુઅદ પેતી
આહુ મજદા અહુરા. મજ
દાંમચા બુયરેચા. કરેશુઆ રા
યતી. તુખર પેતી અહમદ હીઆદ
અયબી હીઆદ મીઅજદેમ મઉય
થેમ ફ્રદદાથા દેનાબીઓ મજદા
અહુરા. અહીઆ હુઓને દાય
દી અહમાયચા. અહુઇય મનખી

આચા. તદ અહીઆ ઇઆ તદ
ઑપા જમીઆમા તુઅચા હ
ખેમા. અશેખીઆચા. વીસપાઇ
ઊઅય. દાયદીઅદ નરાંશ મજ
દા અહુરા. અશોનો અસચેનં
ધો યદીઊશ વાંશતરીયઅંધ.
દરેગાય યજીઆય ઍજુયતે. હ
ખમેન અહમે બીઆચા. અહ
માય રફેનંધો. અથા ખેતઑશ.
અથા વેરેજીના અથા ઽખમાંમ
ખીઆદ. ઇઆથંશ હુશતમેદી.
અથા વેઑતા ખીઆમા મજ
દા અહુરા. અશાઑનો યરેશ
આ અશતીમ. શયતીમ ઇયંઘહે
હાતાંમ. આઅક્ર ઇઅસન પેતવં
ધો. મજદાઑ અહુરો. વેથાઅ

શાહ ઙચા. દઅઆઓંધાંમચા તા

સચા. તાઓંઃસચા ઇઆજમેહે.

(કરહો ઙંમા) સતુતો ગરો

વઙ્હેમેઅંધ. અહુરાય મજદાય.

અણાયચા વહુશતા. દદમહુચા.

ચીણ મહુચા આચા આઉયદીઆ

મઙ્હી. વોહુ ખશથરેમ તાય મજ

દા અહુરા. અપેમા વીસપાઇઅઉ

ય. હુખશથરો સતુને. નાવાના

યઙ્હે વા ખશેતા ઓંબોઇઓ અં

ઘહુ બો હાનાંમ. હુદાઓંશતેમા.

હુમાઇમયચા. ઇઝેમ ઇઅજતેમ.

અશે અંધાંએમ દદ મેહે. અથા

તુમે ગઇઆમચા અશતેતાઓંસ

ચા. ખીઆઓં ઓંબોઇઓ. અ

ઘહુઆ ડાતાંઅ. હુહાઓશતેમા.
હુમાઇમ થવા ઈજીમ ઇઆજતેમ
અશે અં ઘાચેમ દદેમેદ. અથા તુને
ગઇઅસચા. અશતંતાઓસચા
ખીઆઓઓબાઇપા અંઘહુઆ
આ ડાતાંમ હુહાઓશતેમા. હુ
નીમાચા જીમાચા. મજહાઓઅ
હુરા થવહુમી રેખની. દરેગાઇઓ
યશાચા. થવા યમુઆંતસચા. ઓ
ઇઆમા રપોયસચા. તુમને હેગો
મચા. ઓશનાચા ડાતાંગ હુહા
ઓશતેમા. થવોય સતાંનતરનચા
માથરનસચા. અહુર મજદા. ઓ
ગમદેચા ઓશમહેચા. વીસાઝદ
ચા હીઅદસીઆજદેમ. મઉઆથે

મ ફ્રરદદાથા. હેનાબીઓ મજદા
આહુરા. થવોય સતોય નરસચા
માથરજસચા. આહુર મજદ: ઓ
ગેમેદચા ઓશમહેચા વીસામેદ
આ હીઆદ મીઅજદેમ મઉય
થેમ. ફ્રરદદાથા દેનાબીઓ મજ
દા આહુરા. અહીઆ હુઓને
દાયદી અહમાયચા. આહુઇય મન
ખીઆચા. તદ અહીઆ ઇઆ
તદ ઓપાજમીઆમાં. તઉઅચા
ક્ષરેમ અશ ખીઆચા. વીસપા
ઇઅઉય ઇયંઘહે હાતાંમ આઆદ
ઇઅસને. પેતે વંધો. મજદાઓ
આહુરે. વેથા અશાદ હચા. ઇ
આઓાંઘાંમચા તાંસેચા તાઓસ
ચા ઇઅજમેદે.

હુમતનાંમ. હુખતનાંમ હુ
અરશતનાંમ ઇઅદચા. અની
અદચા. વરેજીઅમનનાંમચા.
વાઉઅરેજનનાંમચા મહીયબી
જરેતારો. નેનેસતારો. ઇઅથ
ના વોહુનાંમ મહી. હુમતનાંમ.
હુખતનાંમ હુઅરશતનામ. ઇઅ
દચા. અનીઅદચા. વરેજીઅમ
નનાંમચા. વાઉઅરેજનનાંમચા
મહી સબીજરેતારો. નેનેસતા
રો ઇઅથના વોહુનાંમ મહી
ઇઅથા અહુ વેરીઓ (૪) અ
શેમ વોહુ (૩) ઇયસનેમ સુરેમ
હુપતંઘહાયતીમ અશુઅનેમ અ
શાહે રતુમ ઇઆજમેદ. ઇયંઘહે

હુાતાંમ. આઆમદ ઇઆસને પેતે
નથો મર્જદાઑ આહુરા. વેથા
આશાહ હુઆ. ઇઆ ઑાંઘામચા.
તાંસચા નાઑાસચા ઇઆર્જમેદે.
(કુરેદા ૮મો) ઇઆર્જમેદ વે
આએશા સપેંતા. ઇઆસને હુપતંથ
હુાતાયશ. હુંદાતા અપાંમચા
ખાઑા ઇઆર્જમેદે. અપાંમચા પેરે
તુશ ઇઆર્જમેદે. પથાંમચા વીચરે
નાઑા ઇઆર્જમેદે. પથાંમચા હું
જમનાઑા ઇઆર્જમેદે. ગેરીઆસ
ચા આ[illegible]શાતચનોઇઆર્જમેદ વેરીઆ
સચા અવજદાનાઑાઅંઘો ઇઆ
ર્જમેદે. અસપેનાચા ઇઆઉનો ઇ
આર્જમેદે. પોઇઉસચા થવેરેશતા
રા ઇઆર્જમેદે. મર્જદાંમચાજરથો

શતરેમચા. ઇઅજમેહે જાંમચા
અસગનેમચા ઇઅજમેદ વાતેમ
ચા હૂરેશેમ મજહદાતેમ ઇઅજ
મેદ. તરેમચા ડરેશીઅચાઓ બેરે
લો ઇઅજમેદ. જુમીમચા વીસપા
ચા વાહુ ઇઅજમેદ. મના વાહુ
ઓારેગનસચા અશાઓનાંમ ઇ
અજમેદ. વાસીમચા ઇઅાંમપં
ચા સહૂઅરાંમ ઇઅજમેદ. ખરે
મચા ઇયમ અશુઅનેમ ઇઅ
જમેહે ઇબ્ઓાય હુશતેત મેદમ
જરીઅંધા વાઓારે કશહુ જ
રાબ્ઓા. વાઓારો કરોમ ઇઅજમે
દ. હુામેમચા જાયરીમ બેઅજં
તમ ઇઅજમેદ. હાંમમ ફરાશે
મેમ ફરાહદ મેથેમ ઇઅજમેદ

હોમેમ દુરેશેમ ઇઆજમેદે. અ
પાંમચા ફ્રેરખશોશતરીમ ઇઆજ
મેદે. વઇઆંમચા ફ્રર ફ્રેરોથરીમ
ઇઆજમેદે અથુઓઆરૂનાંસચા પેત
અજાંથરેમ ઇઆજમેદે. ઇગ્મોય
ઇઆન દુરાદે. અશો ઇશ દખી
ઓઆનાંમ. વીસપાંસચા અમેશના
મ સપેઅંતનાંમ ઇઆજમેદે. ઇયં
ધહે હોતાંમ. આદ ઇઆસને. પેત
વંઘો. મજદાઓ આહુરો વેથા
અશાદ હચા. ઇઆઓંઘાંમચા.
તાંસચા તાઓસચા ઇઆજમેદે.
(આજમાં પહે) હોરમજદ
ખોદાય અવજુની મરદુમ મરદુ
મ સરદગાં. હમા સરદગાં. હમ

આયસાત બેહાં ઑયમ બેહેદીન માજદીઅસનાં. આગાહી આશ તુઆંની. નેકી રસાંબાદ. યદુબઆદ.
(પરગટ પઠે) ઇઅથા આહુ વરીગ્મા (૨) ઇઅસનેમચ. વાક્ષેમ મચ. ઔાજસચ. જઉઅરેચ. આફ્રીનાંમે. અહુરહે મજદાઔા રેઉઅતા ખરેનંઘહતો. અમેશા નાંમ સપેંતનાંમ. વંઘહુય મંન ઘહે. આખશતોય હાંમ વેઅતા આઔા તરેદાતા અનીઆયશ દામાંન. આસનહે ખરેથવો મજ દદાતહે. ગોશો સરૂતહે ખરથવો મજદદાતહે. અશહે વહેશતહે ૨૦સરેશતહે યરીઅમના યશાયહે

શુરહે મજદદાતહે સોઇરીઆઆઓ,
વંઘોહીઆઆઓ. વાઓઇ્ર. હોયથ
રીઆઆઓ મજદદાતીઆઆઓ અ
શોનીઆઆઓ. ખશથ્રહે વઈરીઅ
હે. અઈઓખશોસતહે. મેરેજ
દકાય. થરાઈઓ દરેગુઅહે. સ
પેંઅતીઆઆઓ. વંઘોહીઆઆઓ.
આરમેતોયશ. રાતીઆઓ વંઘો
હીઆઆઓ. વાઓઇરે હોયથરીઆ
ઓ. મજદદાતીઆઆઓ. અશો
નીઆઆઓ. હુક્રેઅતાતો રથવો.
ઇઆયરીઆઆઓસચ હુશેતોયશ.
સરદબીઓ અશહે રતાબીઓ
અમેરેતાતો. રથવો ફ્રશોનેબીઅ.
વાંથવનેબીઅ. અસપેનેબીઅ.

ઇઆઉઅનેઘીઆ. ગાઉકેરેનહે.
શુરહે મજદદાતહે.

[હાવન ગેહ હોએ તો એમ પઢીએ]

મેથરહે વાઓરો ગોઇઓયતોયશ
રામસચ ખાશતરહે. અશેમ
વોહુ (૧)

(રપીથવંન ગેહ હોએ તો એમ પઢીએ)

અશહે વહીશતહે આથ્રેસચ
અહુરહે મજદાઓ પોથ્ર
અશેમ વોહુ (૧)

[ઓજીરંન ગેહ હોએ તો એમ પઢીએ]

બેરેજતો અહુરહે નફેદરો.
અપાંમ અપસચ મજદદાતીઆ
ઓ. અશેમ વોહુ (૧)

(એવેસરૂથરેમ ગેહમાં એમ પઢીએ)

અશાર્ચોનાંમ ફરૂઅસનાંમ. ગેનાનાંમચ વીરો વાંથવનાંમ. ઇઆયરીઆર્ચોસચ હુશેતો યશ. અમહેચ હુતાસતહે હુરોદહે. વેરેથરગનહે અહુરદા તહે. વનંતીઆર્ચોસચ ચોપ રતાતો અશેમ વોહુ (૧)

[ઓશોહેન ગેહેહાએ તા એમ પઢીએ.]

સરોશહે અશીઅહે અશુઅતો વેરેથેશાજનો ફરાદદ ગેથહે. રશનોયશ રજેશતહે. અરશતા તસચ ફરાદદ ગેથીઆર્ચો. વરેદદ ગેથીઆર્ચો. અશેમ વોહુ (૧)

અહમાયરેસચ.—હુંજધરેમ. જસમે. કેરબા મુજદ.—અશેમ વોહુ (૧)

દોજ [ફલાંન] માહા (ફલાંન) રોજે (ફલાંન) નમાજ દાહાર ગેહાંન દામાંન. ખશનોથર આહુરહે મજદાઓ તરોયદીતે અંઘરહે મેનીયઓસ. હેથીઆ વરશતાંમ. હીઆદ વસના. ફ્ર શોતેમેમ. સતામે અશેમ અશેમ વાહુ (૧) ગોરજ ખોરહે અવ જાઇઆદ. હપત અમેશાસપંદ બેરેસાદ. અમાવંદ પીરોજગર અમાવંદી પીરોજગરી દાદ દીને બેહ માજદીઅશના. આગાહી રવાઇ ગોઆફરંગાંનીબાદ. હપત કેશવર જમીન યદુન બાદ. મંન આંનો આવા ઇઆદ શુદન મંન આંનો આવા ઇઆદ શુદંન. મન

આંનો આવા ઈઅહ શુદંન અશોને અશોમં વોહુ (૧)

(દખાણ દશાની તરફ મોહોડું કરીને પઢે)

હાહાર ગેહાંન દીને માંજદી અસની. દાહ જરથોશતરી નેમ સતે અશાઓંમ સેઊઈયશતે. અરદુઈસર અનાહુતે. અશોને અશોમ વોહુ (૧) નેમો ઓંહુઅર વંઘોહીસ મજદહાતહે અશોને અશોમ વોહુ (૧) અહુરેમ મજ દાંમ રેઉઅંતેમ ખરેનઘહુંતેમ ઈઅજમેદે. અમેશા સપેઅંતા હુખશથરા હુદાઓંઘહો ઈઅજમે દે. અશોમ વોહુ (૧) હપત અમેશા સપંદ ખેરેસાદ અશોમ વોહુ (૧)

## નાહની હુપતન પ્રઅશાત

મોટી હુપતન યશત પઢવી વાજેબ છે, **પણ** જે કોઈ **પઢનારને** કમ ફુરસદ હોય અને તેને નાહની પઢવી હોય તો મોટી હુપતન યશતના સફે **૨૭૦** થી શરૂઆતથી તે સફે **૨૮૧ મે " નાશાયતનાંમ ઓજંઘઙ અશેમ વોહુ (૧)** " સુધી પઢવુ, ફરી સફે ૨૭૯ની ૧૧મી લીટી **"ઇઆતુ૭ જરથોશતર"** થી તે સફે ૨૮૧ મધે " **નાપાયત નામ ઓજંઘાઙ**" સુધીનો આખો કરદો ૭ **વાર પઢવો;** ત્યાર બાદ મોટી હુપતનયશ ત ના **કરદા ૧લાથી** કરદા **૮મા સુધી** યાને સફે **૨૮૧** થી તે સફે **૩૦૪** સુધી **નહી** પઢે પણ સફે **૩૦૪ (બાજ**

આં પછે )કરી છાપ્યું છે ત્યાંથી ફ્ર૧૮ સુધી પઢીને નાની હપતન યશત તમામ કરે

## અરદીબેહેશત યસત.

૫ નાંમે ઇઅજદાંન. હોરમજદ ખોદાય. અવજુની. ગોરજ ખોર હે અવજાઇઆદ. અરદીબેહેશત અમેશાસપંદ બેરેસાદ. યજહમા ગોનાહ. પતેત પશેમાંનોમ. ૫ જ હરશતીન દુશમત. દુજુ ખત દુજુઅરેશત. મેમ ૫ ગેથી મનીદ. ઑયમ ગોશ્ત. ઑયમ કરદ. ઑયમ જસત. ઑયમ ખુન ખુદયસતેદ. આંજા ગોનેહા. મન શની. ગવશની કુનશની. તની રો

આંની. જેથીઆનોઆંની આંખે અવાખશ પશેમાંન પસે ગવશની પપેતત હોમ. ખશનોથર અહુરહે મજદાઓ તરોયદીત. અંધરહે મેનીયઓશ હેથીઆ વરશ તાંમ. હીઅદ વસના. ફરશોતેમ મ. સતોમે અશેમ. અશેમવોહુ (૩)

ફ્રુઅરાને મજદીઅસનો જરથોશતરેશ. વીદેવોઆ અહુરહે દકેશો. [ના ગેહે હાએ ત પઠે] ફ્રસસતીયચ. અશહે વંહેશતહે સરેશતહે. યઝીઅસનો યશીયહે. સુરહે મજદદાતહે. સોકીઆઓ વંધોહીઆઓ વા ઓરો દાયથરીઆઓ. મજદ

દાતીઆઓ. અશોનીઆઓ ખ
શનોથર. યઅેસનાયચ વહમાય
ચ ખસનોથરાયચ. ફ્રસસતીયચ
યથા અહુ વરીઓ જોતા
ફ્રામે મરૂતે. અથ: રતુશ. અશાદ
ચીદ. હચ ફ્રા અશુઅ વીદુઆ
ઓ મરોતુ.

અશેમ વહેસ્તેમ સરેશતેમ અ
મેશેમ સપેનતેમ યઅજમેદે. યરી
અમનેમ યશીમ યઅજમેદે. સુરે
મ મજદદાતેમ યઅજમેદે. સોકાં
મ વંઘોહીમ વોઓરોા દોયથરાંમ
મજદદાતાંમ અશોનીમયઅજમેદે

મરોદ અહુરો મજદાઓ સપે
તમાય જરથોશતરાય આદ યઆદ

અશાહે વહેશતહે. ફ્રરહથીશ સપે
તમ જરથોશતર. સતાતરેચ. જોત
રેચ. જબા તરેચ. માંથરનસચ
ઇઅશતરેચ. આફરી તરેચ. યબે
જરતરેચ. વંધાંન ખશેતેરોઆર્ઓ
ખનુપતીશ. વેરેજો. અહમાયકેમ
ઇઅસનાયચ. વાડમાયચ. ઇઅહ
અમેશનાંમ સપેનતનાંમ. આહ
ઓાખત જરથોશતરો. મરોહ બા
વચો અરસ વચો અહુરમજદ.
ઇઅહ તે અંધેન ઇઅહ અશાહે વહે
શતહે ફ્રરહથીશ સપેતમ જરથોશ
તર સતાતરેચ. જોતરેચ. જબાત
રેચ. માંથરનસચ ઇઅશતરેચ.
આફરીતરેચ. યબેજર તરેચ.

વંઘાન ખરેતેગેચાઓ. ખનુયતી
શાચ વેરેજો ઇઉશમાકેમ ઇઅસના
યઅ વાડમાયચ. ઇઅદ અમેશનાંમ
સપેનતનાંમ. આદેમ ફ્રમરેમે
અશેમ વહુશતેમ. ઇયંજી ફ્રમ
રેમે અશેમ વહુશતેમ આઇ
અનીયરાંમ ઇઅદ અમેશનાંમ
સપેનતનાંમ. હુઆઇઓનેમ. ઇ
યમ પાયતે મજદાઓ હુમતાયશ
ઇયમ પાયતે મજદાઓ હુખતા
યશ. ઇયમ પાયતે મજદાઓ
હુઅરેશતાયશ. ગરેનમાનેમ. અ
હુરહે. હુઆઇઓનેમ. ગરેનમા
નેમ નરીઓ અશતે ખશાઉઇ

આ નચેશ દરૂઅતાંમ. અઇયને
પેતેશ ગરોનમાનેમ. રેઉઅ
ખશાઈઆજદાંમ. ચેથરેમ આહુ
રેમ મજદાંમ. જનેતે વીસગેશાંમ.
અંઘનો મેનીઓશ. અહમાય
ઈઅાથવાંમ પેરેકનાંમચ. પરીઅમ
નેમ માંથરનાંમ. મનેશનહે માથર
નાંમ. વહેશતહે માંથરનાંમ. સરેશ
તહે માંથરનાંમ. સરેશતો તેમ
માંથરનાંમ. ઓગર માંથરનાંમ
ઓગરીઆતેમેમ માંથરનાંમ. ફરે
જરે માંથરનાંમ. ફરેજરીઆતેમેમ
માંથરનાંમ. વેરેથરગનહે માથ
રનામ વેરેથરગનીઆ તેમ માંથ
રનામ. બેશજ માંથરનાંમ.
બેશજીઆતેમ માથરનાંમ. અશો

બેશજો. દાતો બેશજો. કરેતો
બેશજો. ઓઃરૂઅરો બેશજો મા
થરો બેશજો. બેશેજનાંમ બેશજી
આ.ઇઅદ માંથરેમ સપેનતેમ બેશ
જીઆ.ઇઆ નરશા અશોનો. ઙઅ
ઓરોથવાંમ બેશજીઆદ યશો
જી અસતે બેશજનાંમ બેશજીઆ
તેમા ઇઅસક અપ દુઅરત. મઙ
રક અપ દુઅરત. દેઉઅ અપ
દુઅરત. પેતીઆર અપ દુઅરત.
અશેમેગો અજ અસુઅ અપ
દુઅરત. મશીશ્યા સાસત અપ
દુઅરત. અર્જ ચેથર. અપે દુઅ
રત. વેઙરકો ચેથર અપ દુઅરત.
બેર્જંધરો ચેથર અપ દુઅરત
તરોમેતે અપ દુઅરત. પેરૂં

મેતે અપ હુઅરત. તશ્નુ અપ હુઅરત. સપર્જગ અપ હુઅરત. આનાખ્શત અપ હુઅરત. દાય જ દાથરે અપ હુઅરત. દરેગો વાખશ દરોજસત અપ હુઅરત. નોહે ઇગ્માતુ મેતે અપે હુઅરત. નોહે કખરેહન અપ હુઅરત. વાતો પોર્ઓરૂઓ અપાખતર અપ હુઅરત. વાતો પોર્ઓરૂઓ અપાખતર અપ નસીયતે. ઇઅ સચ મે યતેશાંમ. ઇઅદ અજ ચેથરનાંમ ઇઓ જનદ યશાંમ દેઉઅનાંમ. હર્જંધરાય હર્જંધરો. પેરે બેઊઅરાય બેઉઅનો. પેતે ઇઆસક જંત. મહરક જંત

હેઉીઅ જંત. પેતીઆરૅ જંત. અશેમોગો અન અશુઅ જંત મશીઍા સાસત જંત અજ ચેથર જંત. વેહરકો ચેથરૅ જંત બેજંઘરો ચેથર જંત. તરોમેતે જંત પેરે મેતે જંત. તરૂન જંત. સપજગ્ર જંત અ નાખશત જંત. દોયજ દોયથર જંત. દરેગો વાખશ દરાજસત જંત. નેહે ઇઆતુમેતે જંત ગેહે ફખરેદંન જંત. વાતો પાઅૉરૂઍા અપાખતર જંત. વાતો પાઅૉરૂઍા અપાખતર અપ નશી યત. ઇઅસચ મે યતેશાંમ. ઇઆદ બેજંઘરે ચેથરનાંમ. ઇઍા જન ર યશાંમ દેઉઅનાંમ. ઉજંઘરાય

ડજ'ઘરો પેરે બેઉઅરાય બેઉઅ
નાપેત પોઅઁરૂઅનેમાદ. પેત દી
ઉશ દેઉઅનાંમ દરૂજસતો. અ
ઘરો મેનીયઅઁાશ પોઅઁારો મહ
રકો. અહુઅત. અંઘરો મેનીય
અઁાશ પોઅઁારો મહરકો. આઊિ
ઇઅ મે થગે. અશાહુ વહુશતહુ.
ઇઅસકનાંમ ઇઅસકો તેમેમ
જનાદ. ઇઅસકનાંમ ઇઅસકો
તેમેમ દબેશીઆદ. મહરકનાંમ
મહરકોતેમેમ જનાદ મહરકનાંમ
મહરકો તેમેમ દબેશીઆદ. દેઉ
અનાંમ દેઊઆ તેમેમ જનાદ.
દેઉઅનાંમ દેઊઆ તેમેમ દબેશી
આદ. પેતીઆરનાંમ પેતીઆરો
૨૧ તેમેમ જનાદ. પેતીઆરનાંમ

પેતીઆરો તમેમ હમેશીઆદ. અશેમોગો અન અશુઅ જનાદ. અશેમોગો અન અશુઅ હમેશી આદ. મશીઆ સાસંત મશીઆ સાસંતો તમેમ જનાદ. મશીઆ સાસંત મશીઆ સાસંતો તમેમ હમેશીઆદ. અનો ચેથર અનો ચેથરો તમેમ જનાદ અનો ચેથર અનો ચેથરો તમેમ હમે શીઆદ. વેહરકો ચેથર વેહરકો ચેથરો તમેમ જનાદ. વેહરકો ચેથર વેહરકો ચેથરો તમેમ હમે શીઆદ. બેજંઘરો ચેથર બે જંઘરો ચેથરો તમેમ જનાદ. બેજંઘરો ચેથર બેજંઘરો ચેથ રો તમેમ હમેશીઆદ. તરોમેત

જનાદ. તરોમેતે હબેશીઆદ. પેરે મેતે જનાદ. પેરે મેતે હબેશી આદ. તફન તફનો તેમેમ જના દ. તફન તફનો તેમેમ હબેશી આદ. સપજગ સપજગો તેમેમ જનાદ, સપજગ સપજગો તેમેમ હબેશીઆદ. અનાખશત અના ખશતો તેમેમ જનાદ અનાખશત અનાખસતો તેમેમ હબેશીઆદ. દોયજ દોયથર દોયજ દોયથરો તેમેમ જનાદ. દોયજ દોયથર દો યજ દોયથરો તેમેમ હબેશીઆદ હરેગો વાખશ હરોજસતો તેમેમ જનાદ. હરેગો વાખશ હરોજ સતો તેમેમ હબેશીઆદ. નેહે ઇઆતુમેતે જનાદ. નેહે ઇઆ

તુમેતે હમેસીઆઇદ. નોહે કખરેહેન
જનાઇદ. નોહે કખરેહેન હમેશી
આઇદ. વાતો પોઐરૂઆ અપા
ખતરે જનાઇદ. વાતો પોઐરૂઆ
આપાખતર હમેશીઆઇદ. અપ ન
સીઆઇદ દરોખશ નસીઆઇદ દરો
ખશ દુરાઇદ. દરોખશ વી નસીઆ
ઇ. અપાખેદર અપ નસીયહે.
મામેરન ચેનીશ ગઇયહે. ઇરીપા
થવ ગેથાઐ. અશહે મેરેગતે

અહુરીઅ ખરેનઘહચ તેમ ઇ
આજાય સોરોનુઆત ઇઅસન. અ
શેમ વહુશતેમ સરેશતેમ અમેશેમ
સપેનતેમ જોથરાબીઆ. અશેમ
વહુશતેમ સરેશતેમ અમેશેમ
સપેનતેમ ઇઆજમેદે.

હોસીઓ ગઉઅ બેરેસમન. હેજુઓ ફંઘંઘહ. માંથરેચ વચ ચ. શીઓથનસચ. જોથરાબીઅ સચ. આરશોખદ બીઅસચ. વાગજબીઓ ઇયંઘહે હાતાંમ. આઆફ ઈઅસને. પેત વંધો. મજફાઓ અહુરે વેથા અશાફ હચા ઇઆઓંઘાંમચા. તાંસચા. તાઓસચા ઇમજમેદે.

(બાજમાં પઢે) હોરમજદ બા દાય. અવજુની મરદુમ. મરદુમ સરદગાં. હમા સરદગાં. હમ બા યસત બેહાં ઓયમ બેહેદીન માજદીઅસનાં. આગાહી આસતુ આની. નેકીરસાંનાફ. યદુન બાદ.

( પરગટ પઢે ) ઈઅથા અહુ

વરીઓ (૨) યઅસનેમચ. વહુમે મચ. ઓજસ્ચ. જઊઅરેચ. આફરીનાંમે. અશાદે વહેશતહે. સરેશતહે યરીઅમને. યશીયહે સુરહે મજદદાતહે. સોકીઆ ઓ વંઘોહીઆઓ. વાઓરા દાયથરીઆઓ. મજદદાતીઆ ઓ અશોનીઆઓ. અશેમ વાહુ (૧) અહમાયરેસચ-હજઘરે મ—જસમે—કેરેબા મુજદ.—અ શેમ વાહુ. (૧)

રોજ (ફલાંન) માહા (ફલાંન) ગાહ (ફલાંન) નમાજ દાદાર. ગેહાંન દામાંન. ખશનોથર અહુ રહે મજદાઓ તરોયદીતે. અંઘ

રહે મેનીયચ્યોશ. હુથીઆ વરશ
તાંમ. હીઆદ વસના ફરશોતેમમ
સતામે અશેમ અશેમ વોહુ (૧)
ગોરજ બારહે અવજો ઈઆદ.
અરદીબેહેશત અમેશાસપંદ બે
રેસાદ. અમાવંદ પીરોજગર.
અમાવંદી પીરોજગરી. દાદદીને
બેહે માજદીઅસનાં આગહી
રવાઈ ગોઆફરંગાંની બાદ. હપ
ત કેશવર જમીન ચદુન બાદ.
મંન આંનો આવાઇઅદ શુંદન.
મંને આંનો આવાઇઅદ શુંદન.
મંન આંનો આવાઈઅદ શુંદન.
અશેમ વોહુ (૧)

(દખણ દશાની તરફ મોહોડું કરીને પઢે)

દાદાર ગેહાંબ દીને માઝદીઅ સની દાદ જરથોશતરી. નેમસતે અશાઓઆસ ગ્રેઉઈયરાતે અરફુઈસુર અનાહીતે. અશોને અશેમ વોહુ (૧) નેમો ઓઆ અર વંઘોહીશ મજદદાતહે અશોને અશેમ વોહુ (૧) અશેમ વહેશતેમ સરેસતેમ અમેશેમ સપેનતેમ ઈઅજેમૈદે. અશેમ વોહુ (૧) અરદીબેહેશત અમેશાસપંદ બેરેસાદ અશેમ વોહુ. (૧)

નીરંગ અરદીબેહેશત યશતનો

દાદાર જેહાંદાર. તવાંનાં ઓદાં ના. ઓપરવરતાર ઓઆફરીદગાર કેરફેગર. અવખશીદાર. આ

હારેમન હેચ નાકાંન. ઑનતવાંન દ. બ હેચ ચીજ નશાહેદ

હોરમજદ દાદારી. આહા રેમન મરોચેનીદારી. દાદાર પાક. આહારેમન નાપાક આહારેમન ખાકશવદ. આહા રેમન દુરશવદ આહારેમન દપેશ વદ આહારેમનશેકસતેશવદ. આ હારેમનહલાકશવદ.અઉઅલ દીન જરથોશતી. પાક હોરમજદ બુલં દ કવી બેહઅવજુની. અશાને અશોમ વોહુ (૧) (વાર ૩ પઢે)

ખોરદાદ અમશાસપંદ બંધે જેહાંનમાં જે કાંઇ ગાબારા હેલથી મેરાદ ચાહુ તે બર લાવે. ખોદાતાલા મારા હેલને ખુશી કરનારી રોજી પોહોંચાડે

## ખોરદાદ ઇઅશત.

૫ નાંમે ઇઅજદાંન. હોરમજદ ખોદાય અવજુની. ગોરજ ખોર હે અવજાઇઆદ. ખોરદાદ અમેશાસપંદ બેરેસાદ યજ હમા ગોનાહ પતેત પશેમાનોમ. યજ હરવશતીન. દુશમત. દુજુખત. દુજુઅરેશત. મેમ પં ગેથી મનીદ. ઑાયમ ગોશ્ત. ઑાયમ કરદ. ઑાયમ જસત. ઑાયમ બુન બુદ યસતેદ. અજાં ગોનેહા. મનશની. ગવશની. કુનશની તની રોઆંની

ગથી મીનોઆંની. ઍઓખે અવાખ
શ. પરીમાંન પસે ગવશની પ
પતેત. હુામ. ખશનોથર અહુર
હે મજદાઍ તરોયદીતે. અંઘ
રહે મેનીયઍાશ. હુથીઆ વરશ
તાંમ. હીઅદ વસના. ફરશોતેમે
મ. સતામે અશેમ અશેમ વો.(૩)
ફરૂઅરાને મજદીઅસના જર
થોશતરેશ. વીદેઉઍા અહુરહે
દકેશો.( ન ગેહે હોઍ તે પઢે )
ફરસસતીયચ. હુરૂઅતાતો રથવો
ઇઆયરીઆઍ હુશેતાયશ. સર
દબીઍા અશહે રતાબીઍા.
ખશનોથર. ઇઅસનાયચ. વહમા
યચ. ખશનોથરાયચ ફરસસતી

ચચ. ઇઅથા અહુ વઈરીઓ જો
તા ફરામે મરૂતે. અથા રતુશ.
અશાદ ચીદ. હચા ફરા અશુઅ.
વીદુઆઓ મરેઓતુ. હુકૂઅતાનંમ
અમેશેમ સ્પેનતેમ ઇઅજમેદે.
ઇઆયરીઆંમ હુશીતીમ ઇઅજ
મેદે. સરદે અશુઅન અશહે રતુ
ઓ ઇઅજમેદે.

મરેદ અહુરે મજદાઓ. મ
પેતમાય જરથોશતરાય. અનેમ
દદાંમ. હુરૂઅતાતો રથવો. નરાંમ
અશોનાંમ. અઉઓઆઓસચ.
રફનાઓસચ. ખુશનાઓસચ.
ખઇઅતાઓસચ. અઉઓ આય
અઉઅરનીઆઓસચ ઇઅજમે

૯. યો તજસાયતે અમેશનાંમ
સ્પેઅંતનાંમ ઇઅથ જસાયતે
અમેશનાંમ સ્પેઅંતનામ. વોહુ
મનો અશેમ વહેશતેમ. ખશથ્રી
મ વેરીમ. સ્પેઅંતામ આરમેતી
મ. હુરૂઅતાતઓસચ. અમેરેતતા
ઓસચ. યો જનદ. યશાંમ દે
ઉઅનામ. હજંઘરાય હજંઘરો
પેતેશ બેઉઅરાય બેઉઅનો. પેત
શ અહાંખશત ગનાય ચાહાંખશ
તીઓ. પેતેશ નમાને. અમેશનાં
મ સ્પેઅંતનાંમ હુરૂઅતાતો જ
બીઓયદ. નસુમ જનદ હશી જ
નદ બેશી જનદ. સોને જનદ. ખુ
ન જનદ.

આદ પોઓઁયરીમ ફ્રમરોમે. નરાંમ અશોનામ. ઇયન પોઓ યરીમ ફ્રમરોમે નરાંમ અશોનાં મ. યમદ રશનુઓ રનશતહે. ય મહ અમેશ્રીબીઓ સપંઅ‌તેબી ઓ. ઇપો અસતે મેનીઅઉઅનાંમ દાંમનાંમ. ઇઅજતનાંમ. નેરીઓ નામનાઓં. તાઓ ખુજ નરેમ અશુઅનેમ હચ નજુમ. હચ ઙ શો. હચ ગશો. હચ સેને. હચ ખુન. હચ હેનીઆઓં. પેરેથો યનકીઆઓં. હચ કરફશીઆ ઓં. પેરેથો ઓંજ ગેરેપતીઆઓં. હચ મશીઆય દફ્રુઅતીઆય સાસતીઆય. હચ સતારાય વેરી આય. હચ નરો સાસતીઆય.

હચ ઈઆતાય હચ પેરેકાય. હચ ઑગ્રેઅસત. કુથપેર અશોનાંમ. પથ્રં ઑરૂઅશેતે. કુથ દરૂઅંતાંમ. આદ મરેદ અહુરો મજદાઑ. ઇયતેમ માંથરેમ ફ્રમરૂઆ મરાઑ વા દરેનજીઆઑ વા. ફ્રરૂઆઑ ફ્રશાય કારીયતે. હો મ તનુમ ગોનતે. કાંમચેદ થવામચ દરૂજનમચ. હુથીઆ અઇઆનાંમ. હતરેમ હુનેમ. કાંમચેદ. થવામચ. દરૂજમચ નોયદ વનાને. હુમતેમ કાંમચેદ. થવાંમચ દરૂ જમચ. અરે થેબીઆ પેરેયેબીઆ જનાને. થવાંમચ દરૂજમચ. એનદાએ. થવાંમચ. દરૂજમચ

નેગને. થવાંમચ. હઉનેમચ. નજ
ખેરેમ. અહરે નેમેમચ થેરે કરશોમ
ફ્રકારીયતે. ફ્રમરોમે. નરેમ અ
શુ અનેમ. અરશ વરશોમ ફ્રશોમ
ફ્રકારીયતે. અરશ વરશોમ ફ્ર
મરોમે. નરેમ અશુઅનેમ. નઇઅ
કરશોમ ફ્રકારીયતે. નઊઅ ફ્રમ
રોમે. નરેમ અશુઅનેમ.

નામને યશાંમ હરોત્નનાંમ. ન
ઇવ્આમ કેરેતે. પેતે જનેતે. જત
કરેપનો. ચેથરાઇમ જામાચ-
મરેતા સોચ ઇવ્આ શેતે જરથો
શતરો ચેરેગેતચેહ દુજુઆહ
હુઆંમ અનુશતીમ જોશોમચ.
ઇઆથ કથચ. હે જોશો. યસચ

હુ ફ્રશાસમો દાયતીમ. વીખરૂ
મંતેમ. જનેતે પસચ હુઓ નાય
દ ઍાજ ખશીઅમનો. નમુમ સત
રૂથેવત. સનથેશ વીખરૂમંતેમ.
મરેમનાશેતે. મેનીઅઊઅનાંમ ઇ
અજતનાંમ. ખશનોથરાયચ. ફ્ર
સસતીયચ. જરથોશતર યતેમ
માંથ્રેમ. મા ફ્રરેદશીઓાયદ. અ
નીઅ:દ પોથરવા. પોંથ્રગાય બરા
થરેવા. હુદાજાતાય. આયરૂઅના
ય વા. થરાઇઓાને. ઇઓ હુશે
દેનો. હુદેનો ઇઓ હુદેનો. અ
શો અઊઅ ઍારૂઓ. વીસપે
ફ્રેરશો શંમીઅહુ.

૨૨ અહુરીઅ ખરેનઘહુચ. તેમ

ઇઅજાય સોરોનુઅત ઇઅસન. હુરૂઅતાતેમ અમેશેમ સપેઅંતેમ જોથરાબીઓ. હુરૂઅતાતેમ અમેશેમ સપેઅંતેમ ઇઅજમેદે. હામીઓ ગઓિઅ અરેસમન હે જુઓ દંઘંઘહે. માંથરેચ. વચચ. શીઓથનસચ. જોથરાબીઅસચ અરશોખહેબીઅસચ. વાગ ર્નબાઓ. ઇયંઘહે ડાતાંમ. આદ ઇઅસને. પેતે વંઘો. મજદાઓ અહુરો વેથા અશાઇ હચા. ઇઆ ઓંઘાંમચા. તાસચા તાઓસચા ઇઅજમેદે.

( બાજમાં પઢે ) હોરમજદ ખોદાય. અવજુની મરદુમ મર

હુમ સરહગાં. હમા સરહગાં. હમબાયસત બેહાં. ઓચમ બેહે દીને માજદીઅસનાં. આગહી આસતુઆંની. નેકી રસાંનાદ. યદુ નબાદ. ( પરગાર પદે ) ઇઅથા આહુ વેરીઓ (૨) ઇઅસનેમચ વહમેમચ. ઓજસચ. જઉઅરેચ આફરીનાંમે હુરૂઅતાતો રથ વો ઈઆયરીઆઓ હુશેતા યશ. સરદેબીઓ. અશાહે રતો બીઓ અશેમ વોહુ (૧) આહમાયરેસચ. — હજંઘરેમ — જસમે. — કેરબા મુજદ. — અશેમ વોહુ (૧)

રોજ (ફલાંન) માહા (ફલાંન)

ગેહે (ફલાંન) નમાજ દાદાર ગેહાં
ન દામાંન. ખશનાથ્રર અહુરહે
મજદાઓ તરોયદીતે. અઘંરહે
મેનીયઓશ. હેથીઆ વરશતાં
મ. હીઅદ વસના. ફ્રરશોતેમમ.
સતામે અશેમ. અશેમ વાહુ (૧)
ગોરજ ખોરહે અવજાઇઆદ.
ખોરદાદ અમેશાસપંદ બરેસાદ.
અમાવંદ પીરોજગર. અમાવંદી
પીરોજગરી. દાદ દીને બેહે મા
જદીઅસનાં. આગહીરવાઇ ગે
આફ્રંગાની બાદ હપત કેશવર
જમીન ચદુન બાદ. મંન આંનો
અવાઇઆદ શુદંન. મંન
આંનો આવાઇઆદ શુદંન.

મંન આંનો આવાઇઆદ શુદંન.
અશોનં અશેમ વોહુ [૧]
(દખ્ખણ દશાની તરફ મોહોડું કરીને પઢો)
દાદાર ગેહાંન દીનેં માજદી
આસની. દાદ જરથોશતરી નેમ
સતે અશાઑંમ સેઉઇયશતે અર
દુઇસુર અનાહિતે અશોનં અશેમ
વોહુ (૧) નેમો ઑરૂઆર વંઘો
હીશ મજદદાતહે. અશોનં અ
શેમ વોહુ [૧]હુરૂઆતાતેમ અમે
શેમ સપેઅંતેમ ઇઆજમેદ અ
શેમ વોહુ [૧] ખોરદાદ અમે
શાસપંદ બેરેસાદ અશેમ
વોહુ [૧]

માહારા જાનની ઉપર ખુશીનો દરવાજો ખુલ્લો થાએ ને માહરાં તનને નેકીની મદદ થાએ.

## ખોરશેદ ઇઅશત.

પ નાંમે ઇઅજદાંન. હોરમજદ ખોદાએ. અવજુની. ગોરજ ખોરહે અવજાઇઆદ. ખોરશેદ અમરગ રઈઓમંદ. ઓરૂઅદ અસપ બેરેસાદ. યજ હમા ગોનાહ. પતેત પશેમાનોમ. યજ હર વશતીન. દુશમત. દુજુખત. દુજુ અરેશત. મેમ પ ગેથી મનીદ ઓયમ ગોફત. ઓયમ કરદ. ઓયમ જસત. ઓયમ બુન બુદ યસતેદ. અજાં ગોનેહા. મ નશની. ગવશની. કુનશની તની

ગાઆની. ગઈથી મીનોઆંની. [illegible] અવાખશ. પશેમાંન પસે ગવશની. ૫ પતેન હોમ ખશનોથર અહુરહે મજદાઓ તરોય દીત. અંઘરહે મેનીયઓશ. હે થીઆ વરસતાંમ. હીઅદ વસના. ફરશોતેમમ. સતોમે અશેમ અ શેમ વોહુ. [૩]

ફરૂઆરાને મજદીઅસનો જર થોશતરેશ. વીદએવો અહુરહે દક શો [જ ગેહ હાએ ત પંઠે ) ફરસ સતીયચ. હુઅરે ખશેતહે. અમેશ હેરેઉઅહે ઔરૂઅદ અસપહે. ખ શનોથરઇઅશનાયચ. વહુમાયચ. ખશનોથરાયચ. ફરસસતીયચ. ઇ

અથા અહુ વઈરીઓ જોતા ફ્રા
મેમરૂતે. અથા રતુશ. અશાહ્
ચીદ હચા ફ્રા અશઉશ વીદ્ધુ
ઓઆઓ મરેતુ.

હુઆરેખશએતેમ અમેશેમ રએમ
અઁરૂઅદ અઅસપેમ યઆજમઈદે.
આદ યઅદ હુઆરે રઓખશ્ને
તાપીયતે. આદ યઅદ હુઆરે
રઓચો તાપીયતે. હિશતંતે મેની
આઓંઘો. યઅજતાઓંઘો
સતેમચ. હજંઘરેમચ. તદ ખરે
નો હમબારીઅંતે. તદ ખરેનો
નેપારીઅંતે. તદ ખરેનો બખશેંતે
જાંમ પેતે અહુરદાતાંમ. ફ્રાદતેચ
અશહે ગેથાઓ. ફ્રાદતેચ

અશહે તનોઇય. ફ્રાદતય. હ્વઆરે
ઇખ્શએત. અમેશેમ રેમ અઁઉરુઅત
અસપેમ. આદ ઇખ્શએત હ્વઆરે
અઁઉરુઅત ખશીચેત. અપિઆદ જાંમ
અહુરદાતાંમ ઇઓજદાથરેમ.
આપેમ તચીંતાંમ ઇઓજદાથરેમ.
આપેમ ખઇઅનાંમ ઇઓજ
દાથરેમ. આપેમ જરીઅનાંમ
ઇઓજદાથરેમ. આપેમ અરમેશ
તાંમ ઇઓજદાથરેમ. અઉઆદ દા
મ અશુઅ ઇઓજદાથરેમ. ઇઆ
અઁ હેંતે. સપેંતે. મેનીયઅઁ
શ ઇયેઇજી હ્વઆરે નોયદ અઁઆજુ
ખશીચેત. અદ દેવીઆ વીસપા
અઁ મરેનચેંતે ઇઆઅઁ હેંતે.

ડપતો કેરેશો હુઅ નઊઅ એશ
મેનીઅઊઅ. ઇઆજત અંધુંઉ
અસતુયતે પેતે દરાંમ નોયદ પેતે
સતાંમ વીહેંતે. ઇઓ ઇઅજત હુ
અરે ઇઅદ અમેશોમ રેમ ઑરૂ
અદ અસપેમ. પેતશતાતે તમંધાં
મ પેતેશતાતે તેમસચેથરનાંમ દેઉ
અનાંમ. પેતશતાતે તાઇઑનાંમ
ચ હજ્જશનાંમચ. પેતશતાતે ઇઆ
તાનાંમચ પેરેકનાંમચ. પેતશતા
તે અયથીઅજંધો મરશોનહે. ઇ
અજંત અહુરેમ મજદાંમ ઇઅજ
ત અમેશે સ્પેંતે ઇઅજત હોમ
ઑરૂઆનેમ ખશનાઊઅઇયતે.
વીસ્પે મનુઆયચ. ઇઆજત ગે

થીઆયચ. ઇઓ ઇઆજત હુઆ
રેઇઆદ. અમેશેમ રેમ ઑરૂઆદ
અસપેમ. ઇઆજાય મેથરેમ વો
ઑરો ગોઇઓયતીમ. હજંઘરે
મ ગોશેમ. બેઉઅરે ચશમનેમ.
ઇઆજાય વજરેમ હુનેઉયખતેમ.
કમેરેદે પેતે દેઉઅનાંમ. મેથરો
ઇઓ વોઑરો ગોઇઓયતોયશ
ઇઆજાય હખેદરેમચ. ઇઆદ
અસતે હખેદરનાંમ વહેશતેમ.
અંતરે માઓંઘહેમચ. હુઆરેચ.
અહુરીઆ ખરેનઘહચ. તેમ ઇઆ
જાય સોરોનુઆત ઇઆસન. હુ
અરેખશેતેમ. અમેશેમ રેમ. ઑ
રૂઆદ અસપેમ. જોથરાબીઓ. હુ

અરે ખશેતેમ અમેશેમ રેમ. ઑા
રૂઅહ આસપેમ ઇઅજમેદ. હોમી
આ ગહ્રિઅ બરેશમન. હુજુઆ
દંઘંઘ,ડ. માંથરેચ. વચચ. શીઆ
થનસચ. નોથરાબીઅસચ અરશો
ખરૂબીઅસચ. વાગનોબીઆ ઇય
ઘહેડાતાંમ. આદ ઇઅસને પેત
વંઘો. મજદાઑ અહુરો વથા અ
શાહ ડચા. ઇઆઑંઘાંમચા તાં
સચા તાઑસચા ઇઅજમેદ.
(બાજમાં પઢે) હોરમજદ ખો
દાય. અવજુની મરદુમ મરદુમ
સરદગાં ડમા સરદગાં. ડમબાયસ
ન ખેડાં. ઑાયમ બેહદીન માજ
દીઅસના. આગહી આસતુઆં

ની. નકીરસાંનાહ યદુન આદ.
(પરગટ પઢે) ઇઅથા અ
હુ વરીઆ [૨] ઇઅસ નમચ
વાહુમેમચ. આનજસચ. જઊઅર
ચ. આફરીનાંમ. હુઅરેણ
શેતહે. અમેશાહે રેઊઅહે અા
રૂઅહ અસપાહે. અશેમ વાહુ
(૧) અહુમાયરેસચ.-હ્રજ ઘર
મ.-જસમે.-કેરબા મુજદ.-અ
શેમ વાહુ (૧) રોજ [ફલાંણ]
માહ (ફલાંન) ગેહે [ફલાંન]
નમાજ દાદાર ગેહાંન દાનાંન. અ
શનોથર અહુરહે મજદાઅા ત
રોયદીત. અંઘરહે મેનીયઅાશ.
હુથીઆ વરશતાંમ. હીઅદ વસ

ના. ફરશોતેમેમ. સતામે અશેમ અશેમ વોહુ (૧) ગોરજ ખોરહે અવજાઇઆદ. ખોરસેદ અમરગ રદઍઓમંદ ઑરૂઅદ અસપ બેરેસાદ. અમાવંદ પીરોજગર. અમાવંદી પીરોજગરી દાદ દીને બેહે માજદીઅસનાં. આગાહી રવાઇ ગોઆફરંગાંનીબાદ. હફ્ત કેશવર જમીન યદુન બાદ. મંન આંનો આવાઇઅદ શુદંન. મંન આનો આવા ઇઅદ શુદંન મંન આંનો આવા ઇઅદ શુ દંન. અશાને અશેમ વોહુ [૧]

[દખંણ દશાની તરફ મોહોડું કરીને પઢો]

દાદાર ગેહાંનદીને માજદીઅ

સની. દાદ જરથોશતરી. નેમ
સતે અશાઓંઆમ સેઉઇયશતે. અ
રદુઇસુર અનાહિતે. અશોને અ
શોમ વોહુ [૧] નેમો ઓંરૂઅર
વંથોહીશ મજદદાતહે. અશોને
અશોમ વોહુ (૧) હુઅરેખશેતેમ
અમેશેમ રેમ ઓંરૂઅદ અસપેમ
ઇઅજમેદે. અશોમ વોહુ [૧] ખો
રશેદ અમરગ રઇઓંમંદ ઓંરૂ
અદ અસપ ખેરેસાદ અશોમ
વોહુ [૧]

માહા ઇઆજદ રોજીનો દરવાજે બોલે અને તનને તનદરોશતી બખશે. તથા ગમ-ગીની દુર કરે અને રોશની બખશે.

## માહા ઇઅશત

૫ નાંમે ઇઆજદાંન. હોરમજ્દ ખોદાએ અવજુની. ગોરજ્દ ખોરેહે અવજાઇ આઇદ. માહાબોખતાર માહા ઇઆજદ બેરેસાદ. યજ્દ હુમાગોશાહુ. પતેત પશેમાનોમ. યજ્દ હુરવસતીન. હુશામત હુજ્ઞુખત. હુજ્ઞુઅરેશત. સેમ ૫ ગેથા મનીદ. અઁાયમ ગોફ્ત. અઁાયમ કરદ. અઁાયમ જસત. અઁાયમ બુન બુદ યસતેહ અજાં ગોનેહા. મનશની. ગવશની. કુનશની. તની રોઆંની. ગેથી મા

નાઆંની. ઓએ અવાખશ. ૫શે
માન પસે ગવશની. ૫ ૫તેત
હોમ. ખશનોથર અહુરહે મજ
દાઓ તગ઼ોયદીતે. અંવરહે મેની
યઓાશ. હુથીઆ વરશતાંમ. હી
આદ વસના. ફરશો તેમમ. સના
મે અશેમ. અશેમ વોહુ (૩)

ફરૂઆગ઼ાને મજદ઼ી અસનો જર
થોશતરેશ. વીદેઉઆ અહુરહે દકે
શો. (ન ગેહ હોય તે ૫ઢે) ફરસસ
તીયચ. માઓંઘહે ગાએથરહે.
ગઓાસચ ૫ઊઘો દાયતીઆઓ.
ગઓાસચ ૫ેાઓારો સરેદીઆઓ
ખશનોથર ઇઅસનાયચ વાડમા
૨૩ યચ. ખશનોથરાયચ. ફરસસતી

યચ. ઇઅથા અહુ વઈરીઓ જોતા ફ્રાએ મરૂતે અથા રતુશ. અશાદ ચીદ. હચ ફ્રા અશુઅ. વોહૂઆઓ મરોનુ.

નેમો અહુરાય મજદાય નેમો અમેશએબીઓ સ્પેન્તએબીઓ. નેમો માઓંઘાય ગોચીથ્રાય. નેમો પેતે દીતાય. નેમો પેતે દીતે. કદમાઓ ઓખશીયન્તે કદમાઓ નેરેફસેંતે. પંચ દશ માઓ ઓખશીયન્તે પંચ દસ માઓ નેરેફસેંતે. ઇઆઓ હે ઓખશીઆંસતાતો. તાઓ નેરેફસીઆંતનાતો. તાઓ નેરેફસી આંસતાતો. ઇઆઓ હે ઓખશી આંસતાતસચીદ. કે ઇઆ માઓ

ઍાખશીયત. નેરેક્સેતે થવદ
માઍાંધહ્રેમ ગોએથેરેમ અશુઅ
નેમ અશાહ્રે રતુમ ઇઅઅજમેદ.
તદ માઍાંઘહ્રેમ પેતે વેનેમ તદ
માઍાંધહ્રેમ પેતે વીસેમ. રોખશ
નેમ માઍાંધહ્રેમ યવે વેનેમ. રો
ખશાનેમ માઍાંધહ્રેમ યવે વીસે
મ. હ્રેશતેંતે અમેશા સપેંતા ખ
રેનો દારીઅંતે. હ્રેશતેંતે. અમે
શા સપેંતા ખરેનો બંખશેંતે. જા
મ પેતે અહુરદાતાંમ આદ ઇ
અદ માઍાંધહ્રે રોખશાને તાપી
યતે મેશતે ઍારૂઅરનાંમ. નેરે
ગોનનાંમ જરેમેમ પેતે નેમાદ.
ઍાજુખશીઅંતે. અંતરે માઍાં
ઘહ્રાઍાસચ. પેરેનો માઍાંઘહ્રા

ઍાસચ વીસપતથાઍાસચ અંત
રેમાઍાંઘહેમ અશુઅનંમ અશાહે
રતુમ ઇઅજમેદે. પૈરેના માઍાંઘ
હેમ અશુઅનેય અશાહે રતુમ ઇ
અજમેદે. વીસપતથેમ અશુઅને
મ અશોહે રતુમ ઇઅજમેદે. ઇઅ
જાય માઍાંઘંહેમ ગોચેથરેમ બગે
મ રેઉઅંતેમ. ખરેનઘહુંતેમ. અ
ફ્નઘહુંતેમ તફ્નંઘહુંતેમ. વરચ
ઘહુંતેંમ. ખશતાઊઅંતેમ. ઇશાતુ
અંતેમ. ઇચો ખશાતુઅંતેમ. શો
કુઅંતેમ. જરમીઆાઊઅંતેમ.
વાહુઆાઉઅંતેમ. બગેમ બેશાજેમ.
અહુરીઅ ખરેનઘહુચ. તેમ
ઇઅજાય સોરોનુઅત ઇઅસન.
માઍાંઘહેમ ગોચેથરેમ નાથરા

બીઆ. માઍાંઘહેમ. ગોચેથરેમ
અશુઆનેમ અશાહે રતુમ ઇઅજ
સેદ. હોમીઆ ગઉઅ બરેસમન
હુજુઆ દંયંઘડ. માંથરેચ. વચ
ચ શીઆથનસચ. જોથરાબીઅ
સચ. અરશોખદબીઅસચ. વા
ગનબીઆ. ઇયંઘહે હાતાંમ. આ
દ ઇઅસને પેતે વંધો મજહાઍા
ઍહુરો. વેથા અશાદ હચા. ઇ
આઍાંઘાંમચા તાંસચા તાઍાસ
ચા ઇઅજમેદ. (બાજમાં પઢે)
હુારમજદ ખાદાય. અવજુની
મરદુમ મરદુમ સરદગાં હમા સર
દગાં. હમબાયસત બેહાં. ઍાયમ
બેહદીને માજદીઅસનાં. આગ

હી આસતુઆંની. નેકીરસાંનાદ યદુન બાદ.

(પેરગટ પઢે) ઇઅથા આહુ વેરી એ। (૨) ઇઅસનેમચ. વાહ મેમચ. આજસચ. જઉઅરેચ. આફરી નાંમે. માર્ઑંઘહુ ગોએથરહે. ગેર્ઑશચ. યઊએ। હાયતીઆ ઑ. ગેર્ઑશચ પોર્ઑરો સરેદી આર્ઑ. અશેમ વોહુ (૧) આહમા યરેસચ.-હર્જ ઘરેમ.-જસમે. કેર બા મુજદ. અશેમ વોહુ (૧) રોજ [ફલાંન] માહા [ફલાંન] ગાહ [ફલાંન] નમાજ દાદાર ગે હાંને દામાંન. ખશનોથર અહુર હે મજદાર્ઑ તરોયદીતે. અંઘ

રહે મેનીથચ્ઑશ હુથીઆ વરશ
તાંમ. હ્રીઆદ વસ્ના. ફરશોતેમે
મ. સ્તોમે અશેમ અશેમ વોહુ (૧)

ઓરજ ખ્વારહે અવજાઇઆદ.
માહ બોખતાર માહ ઇઆજદ
બેરેસાદ. અમાવંદ પીરોજગર અ
માવંદી પીરોજગરી. દાદ દીનબે
હે માજદીઅસ્નાં આગાહી રવાઇ
ગોઆફરંગાનીબાદ હફત કેશવર
જમીન ચહ્દુન બાદ મંન આંનોઆ
વાઇઆદ શુદંન મંન આંનો આવા
ઇઆદ શુદંન. મંન આંનો આવા
ઇઆદ શુદંન અશોને અશેમ વો ૧)

(દખ્ખણ દશાની તરફ મોહોડું કરીને પઢો)

દાદાર ગેહાંન દીને માજદીઅ

રની. દાદ જરથોશતરી નેમસતે
અશાઓંમ સેઉઇયશતે અરેદુઇ
સુર અનાહિતે. અશોને અશેમ
વોહુ (૧) નેમો ઓંહ્રમઅજ્દ વંઘો
ધીશ મજ્દદાતહે. અશોને અશે
મ વોહુ (૧) માઓંઘહેમ ગોચે
થ્રેમ અશુઅનેમ અશહે રતુમ
ઇઅજમેદે. અશેમ વોહુ (૧) મા
હોખતાર માહ ઇઅજદ ખોરે
સાદ. અશેમ વોહુ. (૧)

સરોશ હજદ રાત અને દાહાડામાં કેટલી
એક વખત દોશતની માફક સંભાલ
રાખવાને વાસતે આવે છે.

## સરોશ ઇઅશત હાદોખત.

પ નાંમે ઇઅજદાંન. હોરમંજદ
ખોદાય. આવજુની ગોરજ
ખોરહે અવજાઇઆદ. સરોશ અ
શો. તગીતંન ફરમાંન. શેકફત
જીન. જીના અવજાર. સાલારે
દામાંને. હોરમજદ બેરેસાદ. અજ
હમા ગોનાહ. પતેત પશેમાનોમ.
અજ હરવસતીન દુશમત. દુજુખત
દુજુઅરેશત. મેમ પ ગેથી મનીદ.
ઓયમ ગોફત ઓયમ કરદ. ઓ
યમ જસત. ઓયમ બુન બુદ યસ
તેદ. અંજો ગોનેહા. મનશની. ગવ

શની. કુનશની. તની રોઅાંની. ગેથી મીનોઆંની. ઓખે અવાખશ પશેમાંન પસે ગવશની. પ પતેત હોમ. ખશનોથર અહુરહે મજ દાઅેા. તગોયદીતે. અંઘરહે મેની યઅેાશ. હેથીઆ વરશતાંમ. હી અદ વસના. ફરશોતેમેમ. સતો મે અશોમ અશામ વોહુ (૩)

ફ્રૂઅશને મજદીઅસનો જર થોશતરેશ. વીદ્દઊઆ અહુરહે દકેશો. [જે ગેહે હોય તે પઢે] ફ્રરસતીયઅ. સરોશહે અશીઅહે. તખમહે તનુ માંથરહે. દરેશી દરોશ આહુયરીઅહે. ખશનોથર ઇઅસનાયઅ. વહમાયઅ. ખશનો

થરાયચ. ફરૂઆસતીયચ. ઇઆથા આહુ વેરીઓ જોતા ફરામે મરૂ તે. અથા રતુશ. અશાદ ચીદ. હચા ફરા અશુઆ. વીદુઆઓ મરોતુ.

(કરદો ૧ લો) સરોશેમ અશીમ હુરોદેમ. વેરેથરાજનેમ. ફરાદદ ગેથેમ. અશુઅનેમ અશહે રતુમ ઇઆજમેદે. નેમો વોહુ. નેમો વોહુશતેમ. જરથોશતર ગેથાબીઓ તદ દરૂઅતો દરૂઅતાંમ ઓરૂઅથો પેતકારેશત. તદ દરૂઅતો દરૂપતીઆઓસચ. અશે ઓશે કેરેન ગઉઆ દુઆરેથર જફરે દરેજુઆંન. પેરે ઓરૂ યશતેમ. ઇ

અહ નમો વાહુ અહૂઇમ અહમે
શામ. નેરે હુંમ વરેતેશ. દરોજો
વાૠેથરેમ હાવ્રેશત. સરોશા અશી
અ્યા દરેગેમ થ્વાતાતેમો. હો વરે
થરજામ દરેજેમ જગનેશતેમ.
નાચ અશુઅ. આખ્રી વચેસતે
મો. હો વેરેથર વેરેથરૂઅસતેમો.
માંથરો સપેનતો. મેનીઓમ દરો
નેમ નેજબરેશતો અહુનો વેરી
અ્યા વચાંમ વેરેથરૂઅ સતેમો અ
રશોખદા વાખશ ઇઅાહુી વેરેથ
રજાંસ તેમો. હેન માજદીઅસને
શ વીસપેશો વંધોશો વીસપે
સો અશો ચેથરશો હુથીઅ દા
તેમ. અથ દાતેમ જરથોશતર
ઇઅસચ જરથોશતર યમહ અ્યા

ખ્રેમ વચો. ફ્રૂઓચાદ. નાવા
નાયરે વા. આશસર મનંઘહ.
અશસર વચંઘહ. અશસર શીઓ
થન મસો વા આપો. મસો વા
થવશો ખશો વા તાંયથરીઆ
ઓ. યપે હુઆંનીરીઆઓ. આ
પાંમ વા નાઉઅઇઅનાંમ. પેત પે
રેથુશ. પથાંમ વા પેતે વીચરેના
ઓ. નરાંમ વા અશાઓનાંમ
હુંજમનાયશ. દરૂઅ તાંમ વા દેઉ
અઇઅસનનામ હુંદુઅરેનાયશ.
કહ્મે કહ્માયચીદ વા અપીઅનાં
મ. કહ્મે કહ્માયચીદ વા અર
થવીઅનાંમ થવેશો એઉઅઉઆ
ઓ. નાયદ હેમ. નરઅંઘહે
આઇઆંન. નોયદ અંઘાઓ ખશ

પો. હઝુઆર્આેા જરેતો. જદનો
મનો જજરાનો અશોથીઅ. અ
ઉઅ સપસતચેન. ઍાય અઉ
અ સપસનોયદ. નોયદ ગદહે
વજો વાંધવીઅહે. હખેશો ફરાંશ
તચેન. ફરાંશતોઇ આદ યમદચ
જરથોશતર. યમદ ઍાખદેમ વ
ચો. ફર મરોઇઆર્આેા. ઇઅદ
આાજસાદ. કેરેસસચ. ગદોતુસચ.
દેઉઅઇઅસચ ઙંદરમેન. આદ
દઝુઅતાંમ. દેઉઅઇઅસનનાંમ ઇ
આતોસચ ઇઅઃતામતાંમ. પેરેક્ષ
ઍાસચ પેરેઝુઅંતાંમ. હખેશો
ફરતરેસાંન. ફરદુઅરાંન. નીઆ
ઍાંચો દેઉઍાા. નીઆાઍાંચો
દેઉઅઇઆજો. જફરે ઍાય ગેઍા

રૂઇઆંન. ઇઅથ રારેશીઅંતો.
ઇઅથચ પશુશ હુરૂઆઅઁાંધો ય
તદ સરોશેમ અશીમ. પેરે બરા
મેહે. ઇયમ અશુઅનેમ વેરેથરા
જનેમ. યતદ સરોશેમ. અશીમ
ફ્રા ઇઆજમેદ. ઇયમ અશુઅને
મ વેરેથરોજનેમ. હુમતાયશચ.
હુખતાયશચ હુઅરેશતાયશચ.

અહુરીઅ ખારેનઘાડચ અંઘહુ
અમ વેરેથરગનેચ. અહુ ઇઆમ
ન ઇઆજતનાંમ. તેમ ઇઅજાય
સોરોનુઅત ઇઅસન. સરોશેમ
અશીમ જોથરાબીઓાં. અશીમ
ચ વંઘોહુીમ બેરેનંતીમ. નેરેમચ
સંઘેમ હુરોદમ. આચનાં જમી

આાદ અઊાઅંઘહે. વેરેથરજાઓ
સરોશો અશીઓ. સરોશેમ અ
શીમ ઇઅજમેદે. રતુમ બેરેજંતે
મ ઇઅજમેદે. ઇયમ અહુરેમ મજ
દાંમ. ઇઓ અશહે અપનો તેમો
ઇઓ અશહે જગમુશ તેમો.
વીસપ સરૂઆઓ જરથોશતર
ઇઅજમેદે. વીસપચ હુઅરશત
શીઓથન ઇઅજમેદે. વરશતચ.
વરેશીઅમનચ. ઇયંઘહે હાતામ.
આદ ઇઅસને. પેત વંઘો. મજ
દાઓ અહુરો. વેથા અશાદ
હચા. ઇઆઓંઘાંમચા. તાંસચા.
તાઓસચા ઇઅજમેદે.

(કરદો ૨ જો) સરોશેમ અશીમે હુરાદેમ. વેરેથરાજનેમ. ફરાદદ ગેથેમ. અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. ઇઓ વનનો કઇઅ દહે. ઇઓ વનનો કાયદીયહે. ઇઓ જંતે. દઉઆઓ હરોનો. અશુઅ જંધો. આહુમ મેરેનચો. ઇઓ હરેત. યવીઆખશતસચ. વીસપીઆઓ ફરૂઓયશ ગેથી આઓ ઇઓ અનુઅંઘહ. બદે મનો નેનંઘ. નેપાયતે મજદાઓ દામાંન ઇઓ અનુઅંઘહ. બદે મનો નેનંઘડ. નેશાહુરૂઅત મજ દાઓ દામાંન ઇઓ વીસપેમ આહુમ અસતુઅંતેમ યરેદવ સને

થેશ. નેપાયતે પસઅ હુફ્રાશમો
દાયતીમ. ઇઓ નાયદ પસાયેત.
હુર પજ્ર ઇઅત મેનીઉ દામાંન.
હેદીતમ. ઇઅસઅ નોમતો મેની
સ્ચઓશ ઇઅસતઅ અ'ઘુર. હુશાદ્દ
આશહુ ગેધાન્ઓ. ઇઓ વાંતસો
યત અઇઅાજસઅ. પરીઝ્જસઅ.
ઇ ઊયદીયતે. માજનીયવીઓ હુઉ
હેઊયળીઓ. હો નાયદ નરશતો
ફ્રાનાસાયતે થવેશાઉ પરો હેઊ
યળીઓ. ફ્રા અહુમાહ. પરોવી
સપે હેઊઓ અહુરો નરશતો
નેમતે. તરશત તેમહો હુઅરેન
તે. અહુરીઅ પરેનબહુચ. અ'
ઘહુ અમ વેરેથરગનેચ. આહુ ઇ
અસન ઇઅજતનાંમ. તેમ ઇઅ

જાય સોરોનુમત યઅસાન. સરો
શેમ અશીમ નાયશરાખીઓ. અ
શીમચ વંઘોહીમ બેરેજંતીમ.
નેરેમચ સંઘેમ હુરોદેમ. આ
અજો જનીઆદ અરેઆંઘહે.
વેરેથ્રજાઓ સરોશો અશીઓ.
સરોશેમ અશીમ યઅજમેદ. રતુ
મ બેરેજંતેમ યઅજમેદ. યયમ
અહુરેમ મજદાંમ. યઓ અશહે
અપનો તેમો. યઓ અશહે જ
ગમુશતેમો. વીસપ સરૂઆઓ
જરથોશતર યઅજમેદ. વીસપેચ
હુઆરશત શીઓથન યઅજમેદ.
વરશતચ. વરેશીઅમનચ. યયંઘહે
હાતાંમ. આદ યઅસાન. પેતે વં

ઘો. મજદાઓ અહુરો. વેથા અશાદ હચા. ઇઆઓંઘાંમચા. નાંસચા તાઓસચા ઇઅજમેદ.

(કરદા ૩ જો) ઇઅથા અહુવે રીઓ (૧) સરોશેમ અશીમ હુરોદેમ વેરેથરાજનેમ. ફ્રાદદ ગેથેમ અશુઅનેમ અસહે રતુમ ઇઅજમેદ. ઇઓ આખશતસચ. ઓરૂયતસચ. હરોનો સપેસો સપેનેશતહે અઉઆયન અમેશા સપેનત આઃઉઆ હપતા કેરેશુ ય રીમ જાંમ. ઇઓ દેનો દેસો દેનીઆઓ. અહમાય દેનામ દેસીઆદ. અહુરો મજદાઓ અશુઅ. અહુરીઅ ખરેનંઘ

ચ. અંધહુ અમ વેરેથેરગનેચ.
અહુ ઇઆસન ઇચાજતનાંમ તેમ
ઇઅજાય સોરોનુઅત ઇઆસન.
સરોશોમ અશીમ નોથરાબીઆ
અશીમચ વંધોહીમ બેરેનતીમ.
નેરેમચ સંધેમ હુરોદેમ. આચ
નો જમીઆદ અઉઅંદાહુ. વે
રેથરજાઓ સરોસોઅશીઓ સ
રોશોસ અશીમ ઇઆજમેદે. રતુ
મ બેરેજંતેમ ઇઆજમેદે. ઇયમ
આહુરેમ મજદાંમ. ઇઓ અશ
હુ અપંનો તેમો ઇઓ અશાહુ
જગમુશ તેમો. વીસપ સરૂઆ
ઓ જરથોશતર ઇઆજમેદે. વી
સપેચ હુઅરશત શીઓથન ઇઆ
જમેદે. વરશતચ. વરેશીઆમનચ.

ઇયંઘહે હાતાંમ આઅદ ઇઅસને
પેત વંઘો મજદાઓ અહુરો વેથા
અશાદ હચા ઈઆઓંઘાંમચા
તાંસચા. તાઓસચા ઇઅજમેદે.

(કરદો ૪થો) ઈઅથા અહુ
વેરીઓ (૧) સરોશેમ અશીમ
હુરોદેમ. વેરેથરાજનેમ. ફરાદદ ગે
થેમ. અશુઅનેમ. અશાહે રતુમ
ઇઅજમેદે. ઇયમ દથદ અહુરો
મજદાઓ અશુઅ. પશામહે
ખરૂઇ દરોખશ હમેસતારેમ. આ
ખશતીમ ડાંમ વેનતીમ ઇઅજ
મેદે. પરતસચ. મરૂઇઆઓસચ
ડમેસતાર ડખીઅ સરોશહે અ
શીઅહે. ડખીઅ રશાનોયશ રને

સનાહે. હુખીઅ મેથરહે વોઆ
રે ઓરમોઆયતીયશ. હુખીઅ
વાનહુ અમોઓ. હુખીઅ દેનીઆ
ઓ વંઘુહીઆઓ. માઝદીઅ
સનોયશ. હુખીઅ અરશતાતે.
ફરાદદ ગેથીઆઓ. વરેદદ ગેથી
આઓ. સઉકો ગેથીઆઓ.
હુખીઅ અશોયશ વંઘોહીઆ
ઓ. હુખીઅ ચેશતોયશ વંઘોહી
આઓ. હુખીઅ રઝસતીઆઓ
ચેસતીઆઓ. હુખીઅવીસપેશાં
મ. ઇઅજતનામ. હુખીઅ માથ
રહે સપેનતહે. હુખીઅ દાતહે
વીદઉઅહે. હુખીઅ. દરેગી
આઓ ઓપેનીઆઓ. હુખી
અ અમેશનાંમ સપેનતનાંમ.

હખીઅ અહમાકેમ સોશી
અંતામ. ઇઅહ બેરેતેશતનાંમ અ
શોનાંમે હખીઅ વીસપીઆઓ
અશોનો શતાયશ. અહુરીઅ ખ
રેનઘહુચ. અંઘહે અમ વેરેથ
રગનેચ અહે ઇઅસન ઇઅજ
તનાંમ તેમ ઇઅજાથ સોરોનુ
અત ઇઅસન. સરોશેમ અશીમ
નાથરાબીઓ. અશીમચ વંઘો
હીમ બેરેજેતીમ. નેરેમચ સંઘેમ
હુરોદેમ. આચનો જમીઆદ
અઊઅંઘહે વેરેથરજાઓ. સરો
શો અશીઓ. સરોશેમ અશીમ
ઇઅજમેદે. રતુમ બેરેજંતેમ ઇઅ
જમેદે. ઇયમ અહુરેમ મજદામ
ઇઓ અશહે અપનો તેમો. ઇઓ

અશહે જગમૂશ તેંમો વીસપ
સહૂઆર્યો જરથોશતર ઇઆજ
મેદે. વીસપચ અહુરશત રીઓ
થન ઇઆજમેદે. વરશતચ. વરે
સીઅમનચ. ઇયદહે હાતાંમ.
આઠ ઇઅસને. પેતે વંઘો.
મજદાઓ અહુરો વેથા અશાઠ
હચા ઇઆઓંઘાંમચા તાંસચા.
તાઓસચા ઇઆજમેદે.

( કરદો પંમો ) ઇઅથા અહુ
વેરીઓ (૧) સરોશેમ અશીમ
હુરોદેમ વેરેથરાજનેમ. ફ્રાદદ
ગેથેમ અશુઅનેમ અશહે રતુમ
ઇઆજમેદે-પાયરીમચ. ઓપેમમ
ચ. મદેમેમચ. ફ્રતેમેમચ. પાય

ફ્રાચાચ ઇચ્અસન ચ્યાંપેમેમચ
મદેમેમચ ફ્રતેમેમચ વીસ્પા
ચ્યાં સરોશહે અશીચ્અહે તખ્મ
હે તનુ માંથ્રહે. તખ્મહે હંમ
વેરેતુચ્અતો બાજુશ ચ્યોજંઘા
રથેશતાચ્યાં કમેરેદો જનો. દઉ
અનાંમ વનતો વનેતીશ. વને
નુચ્અતો અશોને વનતો વનેતીશ.
વનંનતીમચ ચ્યાંપરતાતેમ ઇચ્અ
જમેદે. ઇચ્આંમચ સરોશહે અશી
ચ્અહે. ઇચ્આંમચ અરસતાયશ ઇચ્અ
જતહે વીસ્પ નમાનહે. સરોશો
યાત ઇચ્અજમેદે. ઇથંઘાદ સરે
શો અશીચ્યો ફ્રીચ્યો ફ્રથો પેત
જંતો નાચ અશુચ્અ ફ્રશાઇચ્યો
હુમતો. ફ્રશાઇચ્યો હુખતો. ફ્રશ

ઇઓ હુઅરશતો. કેહરપેમ સરો
શાહે અશીઆહે ઇઅજમેદ. કેહ
પેમ રશનોયુશ રજીશતહે ઇઅજ
મેદ. કેહરપેમ મેથરહે વોઓરો
ગોઇઓયતાયશ ઇઅજમેદ. કેહ
રપેમ વાતહે અશોનો ઇઅજ
મેદ. કેહરપેમ દેનીઆઓ વં
ઘોહીઆઓ માજદીઅસનોયશ
ઇઅજમેદ. કેહરપેમ અરશતાતો
ફ્રશાદદ ગેથીઆઓ. વરેદદ
ગેથીઆઓ સઊઓ ગેથીઆ
ઓ ઇઅજમેદ. કેહરપેમ અશો
યશ વંઘોહીઆઓ ઇઅજમેદ.
કેહરપેમ ચેસતાયશ વંઘોહીઆ
ઓ ઇઅજમેદ. કેહરપેમ રજસ
તીઆઓ ચેસતીઆઓ ઇઅજ

મેહે. કેહરપેમ વીસપેશાંમ ઇઆજ
તનાંમ ઇઆજમેહે. કેહરપેમ માં
થરહે સપેનતહે ઇઆજમેહે. કેહર
પેમ હાતહે વીદઉઆહે ઇઆજમેહે.
કેહરપેમ હરેગીઆઓ ઓપે
નીઆઓ ઇઆજમેહે. કેહરપેમ
આમેશનાંમ સપેનતનાંમ ઇઆજ
મેહે. કેહરપેમ અહુમાકેમ સોશી
અંતાંમ ઇઆદ બે પેતેશતનાંમ
અશોનાંમ ઇઆજમેહે. કેહરપેમ
વીસપીઆઓ અશોનો સતોયશ
ઇઆજમેહે. અહુરીઆ ખરેન
ઘડચ અંધહે આમ વેરેથેરગને
ચ. અહે ઈઅસન ઇઆજતનાંમ
તેમ ઇચાજાય સોરોનુઆત ઇઆ
સન સરોશેમ અશીમ નાથરા

બાઝ્વાઓ. અશીમચ વંઘોહીમ બેરેજંતીમ. નૈરેમચ સંઘેમ હુરેદેમ. આચનો જમીઆદ અઉઅંઘાદે. વેરેથરજાઓ સરોશો અશીઓ. સરોશેમ અશીમઇઅ જમેદે. રતુમ બેરેજંતેમ ઇઅ જમેદે. ઇયમ અહુરેમ મજદાંમ ઇઓ અશહે અપનો તેમો ઇઓ અશહે જગમુશતેમો. વીસપ સરૂઆઓ જરથોશતર ઇઅજમેદે.

વીસપચ હુઅરશત શીઓથન ઇઅજમેદે. વરસતચ વરેશીઅમનચ ઇયંઘહે હાતાંમ આહ ઇઅસને. પેત વંઘો મજ

હાવ્યાઁ આહુરો. વેઘા આશાદ હ
ચા. ઇઆઁઘાંમચા તાસચા
તાઁસચા. ઇઅજમેદે.

[બાજ માં પઢે.] સરોશ અશો.
તગીતંન ફરમાંન શેકફ્ત જીન.
જીના અવજાર. સાલારે દામાંન
હોરમજદ બેરેસાદ. યદુન બાદ.
[પરગટ પઢે] ઇઆથાઆહુવેરી
ઓ (૨) ઇઅસ્નેમચ. વહમે
મચ. ઓજસચ. જઉઆરેચ.
આફરીનામિ. સરોશહે અશીઅ
હે. તખમહે તનુ માંથરહે દર
શીદરોશ આહુરીઅહે અશેમ
વોહુ (૧) અહમાયરેસચ. હુજ
ઘરેમ. જસમે કેરબા મુજદ.
અશેમ વોહુ. (૧) રોજ [ફલાંન]

મઝડા [ફ્લાંન] ગેહે [ફ્લાંન]
નમાજ દાદાર ગેહાંન ફામાંન
ખશ્નોથ્ર અહુરહે મજદાઓ
તરોઇદીતે. અંઘરહે. મૈનીય
અશ્મા. હેથીઆ વરશતાંમ. હી
આદ વરશાતા. ફરશોતેમેમ. સતોમે
અશેમ અશેમ વોહુ (૧) ગોહજ
ખારહે અરજાઇઆદ સરોશ
અશો તગીતંન ફરમાંન શેકફત
જન. જના અવજાર. સાલાર
દામાન હોરમજદ બેરેસાદ અઆ
વંદ પીરોજગાર. અમાવંદી પીરો
જગરી દાદ દીન બેહે માજદી
અસગાં. આગાહી રવાઇ ગોઆ
કરંગાની બાદ. ઉપત કશ્વર

જમીન યદ્દુનઆઈ. મંન આંનો આવાઈઅદ શુદન. મંન આનો આવાઇઅદ શુદંન. મંન આનો આવાઇઆદ શુદન. અશોને અશેમ વાહુ (૧)

[દખણુ દીશાની તરફ મોહોડું કરીને પઢે.]

દાદાર ગેહાંન દીને માજદી અસની. દાદ જરથોશતરી નેમ સતે અસાર્ઑામ સોઇયશતે અરે દુઈસુર અનાહિતે. અશોને અશેમ વાહુ (૧) નેમો ઑારૂઅર વંધાહીશ મજદદાતહે. અશોને અશેમ વાહુ (૧) સરોશેમ અશીમ હુરોદમ વેરેથરાજનેમ. ફરાદદ ગેથેમ અસુઅનેમ અશાહે રતુમ

ઇઅજમેદે. અશેમ વોહુ (૧) સરો
શ અશો. તગીતન ફરમાંન. શેક
ફ્ત જીન. જીના અવજાર. સાલારે
દામાંને હોરમજદ બેરેસાદ. અ
શેમ વોહુ (૧)

---

નીરંગ સરોશ ઇઅશત હાદોખ્ત
ની પછવાડે વાર ૩ પઢવાની

ગોરજ બોરહે અવજાઇઆદ.
સરોશ અશો. તગીતન ફરમાંન
શેકફ્ત જીન. જીના અવજાર. સા
લારે દામાંને. હોરમજદ બેરેસાદ.
યતુન બાદ અશેમ વોહુ (૧)
[ વાર ૩ પઢે ]



---

## ૩૮૬ સરોશ ઇબ્લિશત રાતની વડી.

રાતે શરોશ ઇબ્લશત પડે તે રાતના તારી સંભાલ કરનાર થાય જીવને આરામ રાખે, તારા ઘેરથી દરૂજોને અફશોસ કરનાર દેવોને દૂર કરે, તે જગોના રેનારાઓને ઘણા ખુશ રાખે.

### સરોશ ઇબ્લશત રાતની વડી.

**ય નામે ઇઅજદાન. હોરમજ**
**દ ખોદાય. અવજુની ગોરજ**
**ખોરહે અવજાઇઆદ. સરોશઅ**
**શો. તગીતંન ફરમાંન. શેકફત**
**જીન. જીનાર અવજોર. સાલારે**
**દામાન. હોરમજદ ખેરેસાદ. યજ**
**હમા ગોનાહ. પતેત પશેમાનોમ.**
**યજ હરવસતીન. દુશમત. દુજુ**
**ખત દુજુ અરેશત. મેમ પ ગેથી**
**મનીદ. ઓયમ ગોફત. ઓયમ**
**કરદ. ઓયમ જસત ઓયમ**

ખુન ખુદ યસ્તેદ. અજાં ગોને હા મનશની. ગવશની. ફ્રુનસની તની રોઆંની ગેથી મીનોંઆની. ઓખે અવાખશ. પશેમાન યસ્ર ગવશની. ય પતેત હોમ. ખશ નોથર અહુરહે મજદાઓ. તરો યદીત. અંઘરહે મેનીયઑશ. હે થીઆ વરશતાંમ. હીઅદ વસ ના. ફ્રશોતેમેમ. સતામે અશેમ અશેમ વોહુ (૩)

ફ્રુઆરાને મજદીઅસનો જર થોશતરેશ. વીદઉઓ અહુરહે દકેશો. યવેસરૂથહેમાય યપેગાઇ આય અશોને અશહેરથવે. ઇઆસ નાયચ. વહમાયચ. ખશનોથરા

યચ. ફરસસતીયચ. ફરાદ્દ વીસ
પાંઝ હુજીઆયતે. જશ્થાસતરો
તેમાયચ. અશોને અશહે રથવે.
ઇઆસનાયચ. વહુમાયચ. ખશ
નોથરાયચ ફરસસતીયચ. સરોશ
હે અશીઅહે. તખમહે તનુ માં
થરહે. દરેશી દરોશ આહુયરી
અહે. ખશનોથર ઇઆસનાયચ.
વહુમાયચ. ખશનોથરાયચ ફરસ
સતીયચ. ઇઅથા અહુ વેરીઓ
જોતા ફરામે મરૂતે. અથા રતુશ
અશાદ ચીદ. હચ ફરા અશુઅ.
વીદુઆઓ મરોતુ.

[કરદા ૧લો] સરોશેમ અસીમ
હુરોદેમ. વેરેથરાજનેમ ફરાદદ

ગેથેમ. અશુઅનેમ અશાહે રતુમ
ઇઅજમેદે. ઇઓ પોયરીઓ મજ
દાઓ દામાંન ફરસતેરે તાદ પેત
બરેસમન. ઇઅજત અહુરેમ મજ
દાંમ. ઇઅજત અમેશે સપેનતે.
ઇઅજત પાંઇઉ શવારેશતાર ઇઆ
વીસપ થવરેશતા દામાંન. અહે
રીઅ ખરેનઘાડચ. અંઘહે અમ
વેરેથગનેચ. અહે ઇઅસન ઇઅ
જતનાંમ તેમ ઇઅજાય સોરોનુ
અત ઇઅસન. સરોશેમ અશીમ
જોથરાબીઓ અશીમચ વંઘોહી
મ બેરેજતીમ. નેરેમચ સંઘેમ હુરો
દેમ આચનો જંમીઆદ અઉઅ
ઘહે. વેરેથરજાઓ સરોશો અ
શીઓ. સરોશેમ અશીમ ઇઅ

જમેદે. સ્તુમ ઐરેજંતેમ ઇઅજ
મેદે ઇથ્મ અહુરેમ મજદાંમ ઇઓ
અશાહે અપનોતેમો. ઇઓ અશ
હે જગમુશતેમો. વીસપ સરૂઆ
ઓ જરથોશતર ઇઅજમેદે. વીસ
પચ હુઅરશાત શીઓથન ઇઅ
જમેદે. વરશેતચ. વરેશીઅમનચ.
ઇયંઘહે હાતામ. આદ ઇઅસને.
પેત વંઘો મજદાઓ અહુરો
વેથા અશાદ હચા. ઇઆઓ
ઘાંમચા. તાંસચા તાઓસચા ઇઅ
જમેદે.

[કરદા ૨જો] સરોશેશ અશીમ
હુરોદેમ વેરેથરાજનેમ ફરાદદ ગે
થેમ. અસુઅનેમ અશહે સ્તુમ

ઇઅજમેદ ઇઅ્યા પોયરીઅ્યા ખેરે
સમ ફ્રસતેરેનત. થરીઅ ઇઅખ
શતીસચ. પંચ ઇઅખશતીસચ.
હ્રપત ઇઅખશતીસચ. નઉઅ
ઇઅખશતીસચ. અખશનુસચ.
મેદ્દીઅ્યા ગેતેશતાનાંસચ. અમેશ
નાંમ સપેંતનાંમ ઇઅસનાયચ વ
હ્રમાયચ ખશનોથરાયચ ફ્રસસ
તીયચ. અહુરીઅ ખરેનઘહ્રચ.
અંઘહે અમવેરેથરગનેચ. અહુ
ઇઅસન ઇઅજતનાંમ તેમ ઇઅ
જાય સોરોનુઅત ઇઅસન. સરો
શેમ અશીમ જોથરાબીઅ્યા. અ
શીમચ વંઘોહ્રીમ બેરેજતીમ. ને
રેમચ સંઘેમ હ્રુરોદેમ. આચનો
જમીઆદ અઉઅંઘહે. વેરેથર

નાઓ સરોશો અશીઓ. સરો શેમ અશીમ ઇઅજમેદે. રતુમ બેરેજંતેમ ઇઅજમેદે. ઇથમ અ હુરેમ મજદાંમ. ઇઓ અશાહે અપનો તેમો. ઇઓ અશાહે જગ મુશ તેમો. વીસપ સરૂઆઓ જ રથોશતર ઇઅજમેદે. વીસપચ હુ અરશત શીઓથન ઇઅજમેદે. વરશતેચ. વરેશીઅમનચ. ઇયં ઘહે હાતાંમ. આદ ઇઅસને પેત વંધા. મજદાઓ અહુરો વેથા અશાદ હચા. ઇઆઓંઘાંમચા. તાસચા તાઓસચા ઇઅજમેદે.

[કરદો ૩જો] સરોશેમ અશીમ હુરેદેમ. વેરેથરાજનેમ ફરાદદ ગે

થેમ અશુઅનોમ અશહે રતુમ
ઇઅજમેદ. ઇઓ પોયરીઓ ગા
થાઓ ફ્રસરાઊઅઇઅદ. ઇઆ
ઓ પંચ. સપેતામહે અશોનો જ
રથોશતરહે અફ્સમનેઊઆંન. વ
ચસતશતુઅદ મદ આનેનતેશ.
મદ પેતે ફ્રસાઓ અમેશનાંમ
સપેનતનાંમ. ઇઅસનાયચ વહુમા
યચ. ખશનોશ્નરાયચ. ફ્રસસતી
યચ અહુરીઅ ખરેનઘહુચ અ
ઘહે અમ વેરેથરગનેચ. અહે
ઇઅસન ઇઅજતનાંમ. તેમ ઇઅ
જાય સોરોનુઅન ઇઅસજ સોર
શેમ અશીમ બેથરાબીઓ. અશી
મચ વંધોહીમ બેરેજતીમ બેરે
ચ સઘેંમ હુરોદેમ આઅનો જસી

આાદ અઉઅંધહે. વેરેથર જાઓ
સરોશો અશીઓ સરોશેમ અશી
મ ઇઅજમેદ. રતુમ બેરેજંતેમ
ઇઅજમેદે. ઇયમ અહુરેમ મજ
દાંમ. ઇઓ અશહે અપનો
તેમો. ઇઓ અશહે જગમુશ તે
મો. વીશપ સરૂઆઓ જરથોશ
તર ઇઅજમેદ. વીસપચ હુઅ
રશત શીઓથન ઇઅજમેદે. વરશ
તચ વરેશીઅમનચ ઇયંધહે હા
તામ. આદ ઇઅસને પેતે વંધો.
મજદાઓ અહુરો. વેથા અશાદ
હચા. ઇઆઓધાંમચા તાંસચા.
તાઓસચા ઇઅજમેદ.

[કરદો ૪થો] સરોશેમ અશી
મ હુરોદેમ વેરેથરાજનેમ ફરાદદ

ગેથેમ અશુઅનેમ અશાહે રતુ
મ ઇઅજમેદે. ઇઓ દરેગોસચ.
દરીઉઅઇઆઓસચ. અમુઆદ.
નમાનેમ. હાંમ તાશતે. પસચ
હુફ્રશામો દાયતીમ. ઇઓ યશ
મેમ સતરેથવત. સનથેશ. વીખરૂ
મેનતેમ. ખરેમ જનતે. અદચ હે
બાદ. કેમેરેદેમ જગનુઆઓ. પે
તે ખંધઇયતે. ઇઅથ ઓજાઓ
નાયદીઆઓંઘહેમ. અહેરીઅ
ખરેનઘાડચ. અંઘહે અમવેરેથર
ગનેચ. અહે ઇઅસન ઇઅજતનાં
મ. તેમ ઇઅજાય સોરેનુઅત ઇ
અસન. સરોશેમ અશીમ જોથ
રાબીઓ આશીમચ વંઘોહીમ બે
રેનતીમ. નેરેમચ સંઘેમ હુરેદેમ

આચનો જમીઆદ અઉઅંઘહે. વેરેથરજાઓ. સરોશો અશીઓ. સરોશેમ અશીમ ઇઆજમેદે. ૨ તુમ ખેરેજંતેમ ઇઆજમેદે. ઇયમ આહુરેમ મજદાંમ ઇઓ અરાહે અપનો તેમો. ઇઓ અશાહે જગસ્તુશતેમો વીસપ સરૂઆઓ જરથોશાતર ઇઆજમેદે. વીસપચ હુઅરશત શીઓથન ઇઆજમેદે. વરશતચ. વરેશીઅમનચ ઇયંઘહે ડાતામ. આદ ઇઆસને. પેતે વંથો. મજદાઓ આહુરો. વેથા અશાદ હુચા. ઇઆઓંઘાંમચા. તાંસચા. તાઓંસચા ઇઆજમેદે.

[કરદા ૫મો] સરોશેમ અશીમ હુરોદેમ વેરેથરાજનેમ ફ્રરાદદ ગેથેમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. તખમેમ આસુમ. ઓજો અંઘાહ્ંતેમ. દરેશતેમ શુરેમ. બેરેજતીમ. ઇઓ વીસપેબીઓ હુચ અગ્રેનબીઓ વઉઅનુઆઑ. પેત જસેત. વીઆખમ. અમેશનાંમ સપેંતનાંમ. અહુરીઅ ખરેનઘહુચ અંઘહેઅમ વેરેથરગનેચ. અહે ઇઅસન ઇઅજતનાંમ. તેમ ઇઅજાય સોરોનુઅત ઇઅસન. સરોશેમ અશીમ જોથરાબીઓ. અશીમચ વંઘોહ્વીમ બેરેજતીમ. નેરેમચ સંઘેમ હુરોદેમ આશના જમીઆદ અઓઅંઘહે.

વેરેથરજાઓ સરોશો અશોઇઓ. સરોશેમ અશીમ ઇઅજમેદે. રતુમ બેરેજંતેમ ઇઅજમેદે. ઇયમ અહુરેમ મજદાંમ. ઇઓ અશહે અપનો તેમો. ઇઓ અશહે જગમુશ તેમો. વીસપ સરૂઆઓ જરથોશતર ઇઅજમેદે. વીસપચ હુઅરશત શીઓથન ઇઅજમેદે. વરશતચ વરેશીઅમનચ ઇયંઘહે ડાતામ. આઢ ઇઅસને પેતે વંઘો મજદાઓ અહુરો. વેથા અશાદ હચા. ઇઆઓઘાંમચા તાસચા તાઓસચા ઇઅજમેદે.

[કરદા દઠા] સરોશેમ અશીમ હુરોદેમ વેરેથરાજનેમ ફराદદ.

ગેથેમ અશુઅનેમ અશહે રતુમ
ઇઅજમેદે. ઇઉનાંમ એઓનેશતેમ.
ઇઉનાંમ તંચેશતેમ ઇઉનાંમ થવ
ખશેશતેમ ઇઉનાંમ અસેસતેમ.
ઇઉનાંમ પરો કતરેશતેમ. પેતેસત
માજદીઆસન. સરોશહે અશીય
હે ઇઅસનેમ. હુરાદ હચ આઙ
માદ નમાનાદ. હુરાદ હચઅંઘાદ
વીસદ. હુરાદ હચ આઙમાદ જં
તોદ. હુરાદ હચ અંઘાદ દંઘાદ.
અગાઓ યથીયજાઓ. વાયગ
નાઓ. ઇયંનતે ઇયંગ્રહે નમા
નીઅ. સરોશો અશીઓ વેરે
થેરજાઓ. થરાફેદો અસતે પેત
જંતા નાચ અશુઅ. ફરાઇઓ
હુમતો. ફરાઇઓ હુખતો. ફરા

ઇર્ગાં હુઅરેંશતો અહેુરીઅ ખરે
નઘહુચ. અંઘહે અમ વેરેથર
ગનેચ. અહે ઇઅસન ઇઅનજત
નાંમ તેમ ઇઅજાય સોરોનુઅત
ઇઅસન. સરોરોય અશીમ જોથ
રાબીન્મો. અશીમચ વંધોહ્રીમ
મેરેનંતીમ. નેરેમચ સંધેમ હુરો
દેમ. આચનો જમીઆદ અઊ
અંઘહે વેરેથર જાર્ગા સરોશો
અશીગ્મો. સરોરોમ અશીમ ઇઅ
જમેદ. રતુમ મેરેજંતેમ ઇઅજ
મેદ. ઇયમ થ્યહુરેમ મજદાંમ
ઇમ્મો અશહે અપનો તેમો.
ઇમ્મો અશહે જગમુશ તેમો. વી
સપ સરૂઆર્ગાજરથોશતર ઇઅ

જમેદ. વીસપેચ હુમ્રેશત શી
અોથેન ઇઆજમેદ. વરસતચ.
વરેશીઅમનચ. ઇયંથહે હાતાંમ
આહ ઇઆસને. યતે વંઘો મજદા
અૉ અહુરો. વેથા અશાદ હચા.
ઇઆઓંઘાંમચા. તાસચા. તાઓ
સચા ઇઆજમેદ.

[કરદો ૭મો] સરોશેમ અશી
મ હુરોદેમ. વેરેથરાજનેમ. ફરાદત
ગેથેમ. અશુઅનેમ. અશહે રતુ
મ ઇઆજમેદે. ઇઓ વનનો કઇ
અદહે. ઇઓ વનનો કાયદીયહે.
ઇઓ જંતે હેઊઆઆઓ દરેજો.
અશી ઓઓજંઘો. અહુમ મેરેનચો
હુઓ હેરેત. યવીઆ યવરેતસચ,

વીસપીઆઆઓ ફરૂઓઆયશ ગેથી
આઓ ઈઓ અનુઅંઘહ. બ
દેમનો. જેનંઘહ. નેપાયતે મજ
દાઓ દામાંન. ઈઓ અનુઅંઘ
હ બદેમનો જેનઘહ. નેશાહુરૂ
બત મજદાઓ કામાંન ઈઓ
વીસપેમ અહુમ અસતુઅંતેમ ય
ેહવ સનેથેશ. નેપાયતે પસચ
હુશ્રશમો દાયતીમ. ઈઓ નો
યઠ પસચેતે. હુશ ખશ. ઈઅદ
મેનીઊ દામાંન. હેદીનેમ. ઈઅ
સચ સપેનતો મેનીયઓશ. ઈઅ
સચ અંઘરો. હેશારો અશહે
ગેથાઓ. ઈઓ વીસપાયશ અઠ
આનસચ. ખશશ્નસચ. ઈઉયદીય

તે. માજનીયબીઓ હુદદઉીયબીઓ. હુ નોયદ તરશતો. ફરાના માયત થવેશાદ. પરો દઉયબીઓ. ફરા અહમાદ. પરો વીસપે દઉીઓ. અનુસો તરશતો નેમતે. તરશત તેમંઘો હુઅરેનતે.

અહુરીઅ ખરેનઘહચ. અંઘહે અમ વેરેથરગનેચ. અહુ ઇઅસન ઇઅજતનાંમ. તેમ ઇઅજાય સોરો નુઅત ઇઅસન. સરોશોમ અશીમ નોથરાબીઓ અશીમચ વંઘોહુી મ બેરેજંતીમ. નેરેમચ સંઘેમ હુરોદમ. આઅનો જમાઆઇ અઉીઅ યંહુ. વેરેથરજાઓ સરોશો અશીઓ. સરોશોમ અશીમ ઇઅજમેદે. રતુમ બેરેજંતેમ

ઇચ્અજમેદે. ઇચ્યમ અહુરેમ મજ
દાંમ. ઇચ્આ અશહુ અપનો
તમો. ઇચ્આ અશહુ જગમુશ
તમો. વીસપ સરૂચ્આર્ચ્ચા જર
થોશતર ઇચ્અજમેદે. વીસ્પેચ
હુઅરસત શીચ્આથન ઇચ્આજમેદે
વરશતચ. વરેશીઅમનચ. ઇચંઘ
હે હાતાંમ. આદ ઇચ્અસને. પેત
વંઘા. મજદાર્ચ્ચા અહુરો. વેથા
અશાદ હચા. ઇચ્આર્ચ્ચાંઘાંમચા.
ત્નાંસચા. તાર્ચ્ચાસચા ઇચ્અજમેદે.
[કરદો ૮ મો] સરોશેમ અશીમ
હુરોદેમ વેરેથ્રાજનેમ કુરાદદ
ગેથ્મ અહુરમઝદેમ આશહુ વહુમ
ઇચ્અજમેદે. ઇચ્યમ ઇચ્આજમ. હુ
મે કરાશ્ણેમ પેશાઉત્ઘ્નેમ. વાહી

રો ખશથ્રીઓ. નરે દાયથરો.
બેરેજેશતે પેત બેરેજહે. હરેથી
એ પેત બેરેજીઆઓ હુ વચા
ઓ. આપો વચાઓ. પેરે ગાઓ
વચાઓ. પેથેમનો વીસપો પેસી
મ મસતીમ ઇઆંમ પોઓરો આ
નનતીમ માંથરહેચ પોઓરુચ
નાતમે. અહુરીઆ અરેનવહઆ
અંઘહે આમ વેરેથરગનેચ. આ
હુ ઇઅસનં ઇઅજતનાંમ. તેમ
ઇઅજાથ સોરોનુઅત ઇઅસન.
શરોશેમ અશીમ જોથરાબીએ.
અશીમચ વંઘોહીમ બેરેજંતીમ.
નેરેમચ સંઘેમ હુરોદેમ. બાઅનો
જમીઆદ અઊઆંઘહે. વેરેથર

જાએઁા સરૂ્શો અશીએ઼ા. સરો શેમ અશીમ ઈઆજમેદે. રતુમ બેરેજંતેમ ઇઆજમેદે. ઇયમ અ હુરેમ મજદાંમ. ઇએઁા અશહે આપનો તેમો. ઇએઁા અશહે જ ગમુશ તેમો. વીસપ સરૂઆએઁા જરથોશતર ઇઅજમેદે. વીસપેચ હુઅરશત શીઓથન ઇઅજમેદે. વરશતચ. વરેશીઅમનચ. ઇયંઘ હે હાતાંમ. આદ ઈઅસને. પંતે વંઘો. મજદાએઁા અહુરો. વેથા અશાદ હચા. ઇઆએઁાંઘાંમચા. તાંસચા. તાએઁાસચા ઇઅજમેદે.

(કરદો ૯મો) સરોશેમ અશીમ હુરોદેમ. વેરેથંરાજનેમ. ફ્રરાદદ

ગેથેઅ. અશુઅનેમ અશાહે રતુમ
ઇઅજમેદ. ઇયંઘહે નમાનેઅ.
વારેથરગનેમ. ઙજંઘરે સતુનેમ
વીદાતિમ. બેરેનશતે. પેતે બેરેજહે
હરેથીઆ. પેતે બેરેજીઆઆર્યા. ખા
રેખશનેમ અંતરે નેમાદ. સતે
હર પેસંઘેમ નેશતરે નેમાદ. ઇ
યંઘહે અહુનો વેરીઆ સનેથે
શ. વીસેતે વેરેથરજાર્યાં. ઇઅ
સનચ હ્પતંગ હાયતેશ. ફશુશ
ચ માંથરો. ઇઆ વારેથરગનેશ
વીસપાર્યાસચ ઇઅસનો. કરેતી
આ. અહેરીઅ ખરેનઘહચ અં
ઘહે અમ વેરેથરગનેચ અહે ઇ
અસન ઇઅજતનામ. તેમ ઇઅ
જાય સોરોનુઅત ઇઅસન. સરોશે

મઅશીમ નોથરાબીઓ. અશી
મચ વંઘોહીમ બેરેજેતીમ. નેરે
મચ સંઘેમ હુરોદેમ આચનો
જસીઆદ અઉઅંઘહે. વેરેથર
જાઓ સરોશો અશીઓ સરોશે
મ અશીમ ઇઅજમેદે રતુમ બેરે
જતેમ ઇઅજમેદે. ઇયમ અહુરેમ
મજદાંમ ઇઓ અશહે અપનો ત
મો. ઇઓ અશહે જગમુશ તેમો
વીસપ સરૂઆઓ જરથોશ
તર ઇઅજમેદે. વીસપચ હુઅર
શત શીઓથનઇઅજમેદે. વરશ
તચ. વરેશીઅમનચ. ઇયંઘહે ઙા
તાંમ. આદ ઇઅસને. પેતે વંઘો
મજદાઓ અહુરો વેથા અશા
દ ઙચા. ઇઆઓંઘાંમચા તાસ

ચા. તાઓ઼ઃસચા ઇઅજમેદે.
(કરૂદો ૧૦મો) સારોશોમ અ
શીમ હુરોદેમ. વેરેથરાજ્જેમ. ફરા
દદગેથેમ આશુઅનેમ અશાહે રેતુ
મ ઇઅજમેદ. ઇયંધેહ્રે ચામચ વે
રથરગનેચ. હુજાંથવેચ. વેદીચા
ચ. ચાળિઆયન અમેશા સપે
નત. અળિય હ્ડપતા. કેરેશુયરીમ
જાંમઇઓ દેનો દેસો દેનીચાઓ઼
વસો ખશથરો ફરચરાયતે. ઓાય
ઇઆંમ અસતુયતીમ ગેથાંમ આઇ
ઓ દેનીઅ ફરાગેનતે. અહુરોમ
જદાઓ઼ અશુઅ. ફરા વાહુમનો
ફરા અશોમ વહ્રેશતમ. ફરા ખશ
થરેમ વેરીમ. ફરા સપેનતીઆઓ઼

આરૂમેતાયશ. ફરા હુરૂઆતાસે
ફરા અમેરેતતાસ ફરા આહુયરેશ
ફરશાનો. ફરા આહુયરેશ હકેશો.
ફરા અહરિાયળીઅ. આહુળીઅ.
ઉયળીઅનો અહુળીઅ. નપીઆ
ઑ આય સરોશહે અશીઅહે હુ
રોહહે. આહેય અંઘહેઑશ ઈ
ઐ અસતુઅતો. ઇઅસચ અસ
મતે મનહીઐ. પેરે હરૂઅતહ
મડરકાહ. પેરે હરૂઅતહ યશમાહ.
પેરે હરૂઅતહળીઐ. હુનેળીઐ
ઈઆઑ ઑાસ ખરૂરેમહરફશોમ
ગેરૂવનાંન. યશમહે પંરો હરેમે
ળી મે. ઈઆઑ યશમો હુજહા
ઑ હરાઊિઅઈઆહ. મહવીહાતોહ

હેઊિઍા દાલાદ. અદ નો તુમ સ
રોશહે અશીઆહે હુરોદહે. જા
ઉઅરેહીઆઍા. હેતબીઍા. દરૂ
અનાતેમ તનુબીઍા. પોઍારો
સપખશતીમ હબેશીઅંતાંમ પેત
જીતીમ દુશમેનીચાઉઅનાંમ. હુથ
શાનઊિયતીમ હમેરેથેનાંમ અઍા
રૂઅથનાંમ. હબેશીઅંતાંમ. અ
હુરીઅ ખરેનઘહુચ. અંઘહે અ
મ વેરેથંરગંનચ. અહે ઇઅસન
ઇઅજતનાંમ તેમ ઈઅજાય સો
રોનુઅત ઇઅસન. સરોશોમ અ
શીમ જોથરાબીઍા. અશીમચ વ
ઘોહીમ બેરેજતીમ. નેરેમચ સં
ઘેમ હુરોદેમ. આચનો જમી

આઃઠ અઉઅંઘહે. વેરેથરજાર્ઓ, સરોશો અરદીઓ. સરોશેમ અ શીમ ઇઅજમેદે. રતુમ બેરેજંતે મ ઇઅજમેદે. ઇથમ અહુરેમ મજ દાંમ. ઇઓ અશહે આપનો તેમો. ઇઓ અશહે જગમુશ તેમો. વીસપ સરૂઆઓ જરથોશતર ઇઅજમેદે. વીસપેચ હુઅરશત શી ઓથન ઇઅજમેદે. વરશતચ. વરે શીમનચ. ઇયંઘહે હાતાંમ. ** તાઓસચા ઇઅજમેદે.

[ કરદા ૧૧મો ] સરોશેમ અ શીમ હુરોદેમ વેરેથરાજનેમ ફરા દદ ગેથેમ અશુઅનેમ અશહે રતુમ ઇઅજમેદે. ઇયમ ચેથવારો.

આરૂઅંતા અંરોશ રોખશને.
ફ્રરાહેરેસર. સપેનત વીદુઆઅંાં
ઘો સહઅ મેનીઅઉિઅસઘો વને
નતે શરૂયન યશાંન સશઅંાંઘો.
જરનીઅ પેત થવરેશતાઅંાંઘો.
આસીઅંઘહે અસપેઆઅ. આ
શીઅંઘહે વાતેબીઅ આસીઅં
ઘહે વાહેબીઅ. આસીઅંઘહે
મેગેબીઅ. આસીઅંઘહે વહય
બીઅ હુપેતરતેબીઅ આસીઅં
ઘહે ઉિઅસતીઆઅંા. અંઘહે
મેનીઆઅંા. હઅંાય વીસપેત
આપીયૂતે. હઅાંમ અંઉિય પસ
[illegible]
[illegible]
[illegible]

મન ઇયમ વોહુ સરોશેમ અશી
મ. ઇઅદ એદ ઓશ સતેરેહેન
હુઓ. આગેઓરૂઆઇયતે. ઇઅદ
એદ દુશસતેરે નેગને. અહેરીઅ
ખરેનંઘહચ. અંઘહે અમ વેરે
થરગનેચ. અહે ઇઅસન ઇઅજ
તનાંમ. તેમ ઇઅજાય સોરોનુઅત
ઇઅસન. સરોશેમ અશીમ નાથ
રાબીઓ અશીમચ વંઘોહીમ
બેરજતીમ. નેરેમચ સંઘેમ હુરો
દેમ. આચનો જમીઆદ અઓ
અંઘહે. વેરેથરજાઓ સરોસો અ
શીઓ સરોશેમ અશીમ ઇઅજ
મેદ. રતુમ બેરેજંતેમ ઇઅજમેદે.
ઇયમ આહુરેમ મજદાંમ. ઇઓ
અશહે અપનો તેમો ઇઓ અશહે

જગમુશતેમોવીસપસરૂઆર્ઑજ રથોશતરઇઅજમેદ વીસપેચહુઆ રશાતરશીઓથનઇઅજમેદ. વરશાત ચ. વરેશીચામનચ. ઇયંધહે હાતાં મ * તાર્ઑસચા ઇઅજમેદે.

[કરદા ૧૨મો ] સરોશેમ આ શીમ હુરોદેમ વેરેથરાજનેમ. ફરા દદ ગેથેમ અશુઅનેમ અશાહે રતુમ ઇઅજમેદે. ઇઓ બેરેજો બેરેજ ઇઆસતો મજદાર્ઑ દા માંન નેશંધસતે ઇઓ આથરેતીમ હમહે અઇઆંન હમીઆર્ઑ વા ખશપો. યમદ કેરેશુઅરે. અઉઆ નતે ઇઅદ ખનેરેથેમ બામીમ. સનેથેશ જસતીઆ દરેનમનો.

અરોયથરો તનુમ. હુઆઘઅગેમ.
ક્રમેરેદે પેતે દેઊઆનાંમ. સનથાય
અંઘરહે મેનીયઓશ દ્રૂઆતો.
સનથાય યસમહે ખરૂઈ દરોખશ
સનથાય માજનીઆનામ દેઊઆ
નામ. સનથાય વીસપનાંમ દે
ઊઆનાંમ. અહુરીઆ ખરેનઘહે
ચ અંઘહે અમ વેરેથરગનેચ
અહે ઇઅસન ઇઅજતનાંમ. તેમ
ઇઆજાય સોરેનુઆત ઇઅસન
સરોશેમ અશીમ નાથેરાથીમ્નો.
અશીમચ વંઘેહીમ બેરેજતીમ
નેરે સરુઅ સંઘેમ હુરેઇટેમ. અસાઆનો
અરશીઆઘ અહુઊઆ હે. વેરેથરજનો
અશે સહુરોઈ આશીઆઓ અશેરેશા

અશીમ યઝમેદે રતુમ બેરેઝેં
તેમ યઝમેદે યિમ અહુરેમ
મઝદાંમ. યો અશહે અશવનો
તેમો. યો અશહે જગાઉરુ તે
મો. વીસપ સરઓશહે જરથોશ
તર યઝમેદે. વીસપેઅ હુમર
શત શ્રીરમાથ્ર યઝમેદે. વરશ
તઅ વરેશીઅમનઅ. યયંઘહે. હા
તાંમ... તાઓસચઃ યઝમેદે.

[કરદો ૧૩મો] સરોશેમ અશી
મ હુરોદેમ વેરેથરાજનેમ. ફ્રાદદ
ગેથેમ અશુઅનેમ અશહે રતુમ
યઝમેદે. યદચઅ યનેદચઅ યદ
દચઅ વીસપાંઝચઅ યપે યમાંમ જામ
વીસપાઓ સરોશહે તખ્મહે તનુ
૨૭માંથરહે. તખ્મહે હુંમ વરેતઇ

અનો બાજુશઓાજબો રથેશતા
ઑા કમેરેદાજનો દેઊિએનાંમ.
વનતો વનતીશ. વનેતુઅતો ચા
શાનો વનંતો. વનતેરો વનંતીમચ.
ઑાપરતાનેમ ઇઆજમેદ. ઇઆાં
મચ સરોશહે અશીઅહે. ઇઆાંમ
ચ અરશતોયશ ઇઆજતહે વીસ
પ નમાનહે સરોશો પાત ઇઆ
જમેદ. ઇયંઘાદ સરોશો અસી
ઓ ફરીઓ ફરેથો પેતો જંતો.
નાચ અશુઆ. ફ્રાઇઓ હુમ
તો. ફ્રાઇઓ હુખતો. ફ્રાઇઓ
હુઅરશતો. આહેરીઅ ખરેનઘહ
ચ. અંઘહે અમ વેરેથરગનેચ.
આહે ઇઆસન ઇઆજતનાંમ તેમે

ઇઅજાય હોરોહુમઅન ઇઆસન.
સરોશેમ અશીમ નાથ્રાથીઓ.
અશોમચ વંઘોહીમ બેરેજંતીમ.
બેરેમચ સંઘેમ હુરોહેમ. આચ્ચેનો
જસીઆત અઉઅંઘહે. વેરેથેર
જાઓ સરોશો અશીઓ. સરોશે
મ અશોમ ઇઆજમેદે. રતુમ બેરે
જંતેમ ઇઅજમેદે. ઇયમ અહુ
રેમ મજંદાંમ. ઇશ્ઓ અશહે અ
પનો તેમો. ઇશ્ઓ અશહે જગ
મુશ તેમો. વીસપ સરૂઆઓ જ
રથોશતર ઇઅજમેદે. વીસપેચ
હુઅરશત શીઓથન ઇઅજમેદે.
વરશતચ. વરેશીઅમનચ. ઇયંઘ
હે ❀ ❀ ❀ ઇઆજમેદે.

* * * *

(ખોજમાં પઢે) સરોશ અશો. તગીતંન ફરમાન. શેકફતઝ્ઝનં. જીના અવજાર. સાલારે દામાંને હોરમજદ બેરેસાદ. યદુન બાદ (પેરગાટ પઢે) યથા અહુ વેરીઓ (૨) અસ્સંલેમચ. વહુમેમચ ઓજસચ. જઊઆરેચ. આફરીનામે. સરોશહે અશીઅહે. તખમહે તનુ માંથરહે. દરશી દરોશ આહુયરીઅહે અશેમ વોહુ (૧) અહુમાયરેસચ. હુજઘરે. જસમે-કેરબા મુજદ-અશેમ વોહુ (૧)

રોજ (ફલાંન) માહા (ફલાંન

ગેહે (ફ્રલાંન) નમાજ઼ દાદાર ગે
હાંન દામાંન. પશ્નોથ્રર અહુરહે
મજ઼દાઓ રેવહીતે. અંઘરહે.
મેનીયઓશ. હુથીઆ વરશતાંમ
હીઅદ વસના. ફ્રશોતેમેમ. સતો
મે અશેમ અશેમ વોહુ (૧) ગા
રજ઼ ખોરહે અવજાઈઆદ. સ
રોશ અશો તગીતંન ફ્રમાંન. શે
કસ્ત જન. જનાઅવજાર. સાલા
ર દામાંને હોરમજ઼દ ખેરસાદ.
આમાવંદ પીરોજ઼ગર. આમાવંદી
પીરોજ઼ગરી. દાદ દીને બેહે માજ઼
દીઅસનાં. આગાહી રવાઇ ગે
આફ્રરંગાંની બાદ હફત કેશવર
જ઼મીન યદુન બાદ. મંન આનો

અવાઇઆહ શુદંન. મન આનો આવાઈઆહ શુદંન. મનઆનોઆ વાઇઆહ શુદંન. અશોને અશેમ વોહુ (૧)

(દખણ દશાની તરફ મોહોડું કરીને પઢે)

દાદાર ગેહાંન દીને માજદીઆ સની. દાદ જરથોશતરી નેમસતે અશાઓંમ સઊઇયશતે અરદુઈ સુર અનાહેતે. અશોને અશેમ વોહુ(૧) નેમો ઑરૂઆર વંધોહી શ મજદદાતહે. અશોને અશેમ વોહુ (૧) સરોશેમ અશીમ હુરો દેમ વેરેથરાજનેમ. ફરાદદ ગેથ મ અશુઆનેમ અશાહે.રતુમ ઈઆ જમેદે. અશેમ વોહુ[૧] સરોશ અશો. તગીતન ફરમાન. શેકફત

જીન જીના અવજાર. સાલારે દાઆંનો હોરમઝ્દ બેરેસાદ. અ શેમ વોહુ (૧)

દોઆ રાતની સરોશ પછે પઢવાની

ગોરજ ખારેહે અવજાઈઆદ. સરોશ અશો. તગી પીરોજગર બાદ. દશતગીરે રવાંન. હુમા તંન પાંસબાંન. અશોઆંન અશો નગેહેદાર. રોજ માહો શબાંન. હુમા દરાંનીઆંન. ઑપોયરીઆ દકેશાન ગેહાંન દામાંન. બેહેદીનાંન. તાજીઆંન બસતે કુસતીઆંન. જરથોશતરીઆંન નેકાંન ઑપાકાંન હપત કેશવર જમીન. સરોશ ઈઅજદ પનાહબાદ. અશોને અશેમ વોહુ (૧) (ચાર ૩ પઢે)

બેહેરામ યઆશત દુશમનને મારવું અને તોડવું કરે છે, દુશકેમ આશાન કરે છે, નેક મુરાદ બર લાવે છે. બાનનોબી ખુશ રાખે છે.

## બેહેરામ યઆશત

ખ નાંમે. ઇઝદાંન. હોરમજદ ખોદાય. અવજુની ગોરજ ખોર હે આવજાઈઆદ, બેહેરામ ઇઝદ પીરોજગર દુશમન જદાર. અહરમે હુનાશહે બેરસાદ. યજ ડમા ગોનાહે. પતેત પસેમાનોમ યજ હરવસતીન. દુશમત. દુજુખત. દુજવરેશત. એમ પ ગેથી મનીદ. ઓયમ ગોફત. ઓયમ કરદ. ઓયમ જસત ઓયમ બુન બુદ યસતેદ. અજાગોનેહા.

મનશની. ગવશની. ફ્રુનશની. તની રેઆમની ગથા ગ્નોઆ ની. અશ્મો અવઆખશ પસેમાન. પઇ ગવશની. ૫ પતેત હોમ. ખશ નોથ્ર અહુરહે મઝદાઓ તરેશ દીત અંઘરહે મન્યિવઓશ હેચી આ વરશતાસ. દ્રીઆદ વઅના. ફ્રરશોતેમેમ. સતોમે ઝારેમ ઝારેમ વાહુ (૩)

ફ્રરઆરાને મઝદીઅસનો ઝરથોશતરેશ વીદએવો અહુરહે કએશો. [જો ગેહ હોય તે પઢે] ફ્રસસતીયચ. વેહ્થગાનહે આહેર કાનહે. વનંતીઆઓઆત્ત અંગ રતાતો. ખશનોથ્ર ઇઅઅનાયચ.

વાડમાયચ. ખશ્નોથરાયચ્ચ ફ્રસ
સતીયચ. ઇઆથા આહુ વેરીઓ
જોતા ફ્રામે મરૂતે અથા રતુશ
અશાહ ચીહ. હચ ફ્રા અશુઅ॰
વીદુઆઓ મરેતુ

[ કરદો ૧લો ] વેરેથરગનેમ
અહુરદાતેમ ઇઅજમેદે. પેરેસદ.
જરથોશતરો અહુરેમ મજદામ
અહુરમજદ મેનીઓ સપેનેશત
દાતરે ગેથનાંમ. અસતુયતનાંમ
અશાઓમ કો અસતે મેનીઅ
ઊઅનાંમ ઇઅજતનાંમ જીઓતે
મો આહ મરેહ અહુરો મજ
દાઓ. વેરેથરગનો અહુરદાતો
સ્પેંતમ જરથોશતર અડમાય

પોયરીઓ આજસઙ વજેમનો
વેરેથરગનો અહુરદાતો વાતહે
કેહેરપ. હરશીઓયશ સરીરહે
મજદદાતહે વોહુ ખરેનો મજ
દદાતેમ બારદ ખરેનો મજદદાતેમ
બેશેજેમ ઓંત અમેમચ. આદ
આહમાય આમુઅસતેમો. અમ
આહમે અમુઅસતેમો. વેરેથર
આહમે વેરેથરૂઅસતેમો. ખરેનંઘ
આહમે ખરેનંઘસતેમો ઇઆન
આહમે ઇઆનુઅસતેમો. સોક
આહમે સોકુઅસતેમો. બેશજ
આહમે બેશજીઓતેમો. આદ
દબેશાઓં તાઊરુઆઇયને વીસ
પનાંમ દબેશીઅંતાંમ દબેશાઓં
દેઊઆનાંમ મશીઆનાંમચ. ઇઆ

શ્વાંમ પેરેકનાંમચ. સાથરાંમ કોઇ
આંમ કરફનાંમચ આહુરીઆ
જાએનાઓહુચ. તેમ ઇઆજાય સૂરે
વુઅન ઇઅસન વેરેથ્રગનેમ આ
હુરઢાતેમ જોથરાવીઓ. વેરેથર
ગનેમ અહુરઢાતેમ ઇઆજમેદ.
ઇઆાથરા દાતાયશ. પોયરીઆયશ
અહુરહે હોમીઓ ગાઉઅ વારે
સનના. હુજુઓ દંઘંઘહુ માંથ
હેચ વચચ શીઓથનચ. જોથ
રાવીઆરચ. અરશોખદેવીઆ
ચચ વાગજેવીઓ ઇયંઘહે હાતા
મ આહ ઇઅસને પૈત વંઘો મજ
દાઓ અહુરો વેથા અશાદ
હચા ઇઆઓંઘામચા. તાંસચા
તાઓસચા ઇઆજમેદે.

[ કરદો ૨ જો ] વેરેથરગ્નેમ અહુરદાતેમ ઇઆજમેદે. પેરેસત જરથોસતરો અહુરેમ મજદામ અહુરમજદ મેન્યોઃ સપેનેશત દાતરે ગેથનામ. અસતુયતનાંમ અશાઓનામ. કો અસતે મેનીઅ ઊઅનામ. ઇઅજતનાંમ. જીઓ તેમો. આદ મરોદ અહુરો મજદા ઓ. વેરેથરગ્નો અહુરદાતો સપે તમ જરથોશતર આડમાય પે તીઓ આજસદ વનમનો. વેરે થરગ્નો અહુરદાતો. ગએઓશ કે હરપ અરશાનહે સરીરહે. તેરે ગોશહે. જરનીઓ સરૂઅહે. ઇપશ ઓપેરે સરોઇય સેનદ. અ

મોહુતાસતો. હુરેહો વેરેથરગ્નનો
અહુરદાતો. અઉઅથ આજસદ
વાહુ ખરેનો મજદદાતેમ. બરદ
ખરેનો મજદદાતેમ. બેશનેમ
ઑત અમેમચ. આદ આહુમાય
અમુઅસતેમો. અમ આહુમે અ
મુઅસતેમો. વેરેથર આહુમે વેરે
થરુઅસતેમો. ખરેનંઘ આહુમે
ખરેનંઘાહુસતેમો. ઇઆંન આહુમે
ઇઆંનુઅસતેમો સોક આહુમે સો
કુઅસતેમો. બેશજ આહુમે બેશ
જીઆતેમો આદ હબેશાઓ તો
રુઅઇયને. વીસપનાંમ. હબેશીઅ
તાંમ. હબેશાઓ દેઉઆનામ મશી
આનામચ. ઇઆથવામ પેરેકના
મચ. સાથરામ કોઇઆમ કર

ફ્નાંમચ આહુરીઆ ખરેનંઘાડ
ચ. તેમ ઇઅજાય સોરોનુઅત
ઇઅસન. વેરેથરગનેમ આહુરદાતે
મ જોથરાબીઓ વેરેથરગનેમ
આહુરદાતેમ ઇઅજમેદે. ઇઆયશ
દાતાયશ. પોયરીઆયશ આહુરહુ
હોમીઓ ગઉઅ બરેસમન હે
જુઆ દંઘંઘાડ. માથરેચ. વ
ચચ. શીઓથનસચ. જોથરાબી
અસચ. અરશોખદબીઅસચ. વા
ગનબીઓ. ઇયંઘહે હાતાંમ. આ
દ ઇઅસને પેતે વંઘો મજદાઓ
આહુરો. વેથા અશાદ હ્યા ઇઆ
ઓંઘાંમચા. તાંસચા તાઓંસચા
ઇઆજમેદે.

[ ફરદો ૩ જો] વેહેથરગનેમ
અહુરદાતેમ ઇઆજમેદ. પેરેસહ
જરથોશત્રેહે. અહુરેમ મજદાંમ
અહુરમજદ. મેનીઓ સપેનેશ
ત દાતારે ગેથનાંમ. અસતુયતનાં
મ અશાઓનામ. કો આસતે મેની
અહુઆનાંમ ઇઆજતનાંમ જ્યેઓ
તેમો આદ મેરોદ અહુરો મજ
દાઓ. વેરેથરાગનો અહુરદાતો
સપેતમ જરથોશતર. અહુમાય
થરેતીઓ આજસાદ. વજેમના
વેરેથરગનો અહુરદાતો. આસપ
હે કેહરપ. ઓરોશાહે સરીરહે
જરેગોશાહે. જરનીઓ યવેરાન
હે. ઇયમ ઓપેરથનકેમ સેનદ.

અમો હુતાશતો હુરોદો વે
રેથરગ્નો અહુરદાતો અગ્રિઅ
થ આજસદ વોહુ ખરેનો
મજદદાતેમ. ખરદ ખરેનો મ
જદદાતેમ. બેશજેમ ઑાતઅમે
મચ. આદ અડમાય અમુઅસતે
મો. અમ અહમે અમુઆસતેમો વે
રેથર અહમે વેરેથ્રઘ્નઅસતેમો.
ખરેનંઘ અહમે ખરેનંઘહસતેમો
ઇઆન અહમે ઇઆનુઅસતેમો.
સોક અહમે સોકુઅશ તેમો બે
શજ અહમે બેશજીઆતેમો.
આદ હબેશાઑ તાઙ્રુઅઇને. વીસ
પનાંમ હબેશીઅંનામ હબેશાઑ
રદઉઆનાંમ ગરોિઆનાંમચ. ઇઆ

થવાંમ પેરેકનાંમચ. સાથરામ. કોઇઆમ કરશ્નાંમચ. અહેરી અ ખરેજગાહુચ. તેમ ઇઅજાય સોરોશુઅત ઇઅસન. વેરેથરગાને મ અહુર દાતેમ જોથરાબીઓ. વેરેથરગાનેમ અહુરદાતેમ ઇઅજ મેદ. ઇઆયશ દાતાયશ પોયરી આયશ અહુરહે હોમીઓ ગઉ અ બરેસમન. હુજીઓ દંઘંઘહુ માથરેચ. વચચ. શીઓથનસચ જોથરાબીઅસચ. અરશોખદેબી અસચ. યાગાનેબીઓ. ઇયંઘહે ડાતાંમ. અશાદ ઇઅસને. પેતે વંઘો મજદાઓ અહુરો વેથા અશાદ હુચા. ઇઆઓંઘાંમચા. તાંસચા. તાઓંસચા ઇઅજમેદ.

[કરદા ૪થો ]વેરેથરગનેમ અ
હુરદાતેમ ઇઅજમેદે. પેરેસદ જ
રથોશતરો અહુરેમ મજદાંમ અ
હુરમજદ. મેનીઓ સપેનશત દા
તરે ગેથનાંમ. અસતુયતનાંમ અ
શાઓમ કો અસતે મેનીઅઉઅ
નાંમ ઈઅજતનાંમ. જ્ઓતેમો.
આદ મરોદ અહુરો મજદાઓ.
વેરેથરગનો અહુરદાતો. સપેતમ
જરથોશતર. આદ્માય તુયરીઓ
આજસદ વજમનો. વેરેથરગનો
અહુરદાતો ઓશતરહે કોડરપ
વદરીઓશ. દદાંસોશ યવે તએન
હે. ઓઝૂઅતો ફરસપરનહે. ગે
થાઓશ મશીઓ. વંઘહે. ઇઓ

અરશનાંમ. ફ્રથેરેનતાંમ. મનો
શતેમ અેઓનો આયઅતે મનોશતે
મચ્ચ આ મનથેમ. ઇઅેઆ ખશથ
રેશુઅ ચાઓિઅઃયતે. અઉઆઅૉ
ઝી પશથરેશા. હુપાતીાતેમાઅૉ.
ઇઅા અૉઇશતરે પાયને વહરેશ.
અૉસખાજાઅૉશ સતુથ કોષા સ
મરશનો. દેમ ઝીરે સારોં. રેઉઅ
બેરેજો અમુઆઅૉ. ઇઆાંમ હુ
હરેસોકેમ. હુથરે ફ્રઅઓયતે હુત
હુ તાથરીઆામ. યપે પશફનેમ
ઇઅેઆ કફમ યપે સાવીયતે. સપેત
થેમ અૉષ વગહનેમ હુપારાનોથ
ર. હુપેતેશનાતે. ઇઅેઆ હુશતેતે
વીદેદઆઆઅૉ. ઇઅઆઅ શા... હુમો

ખશથ્રો. અઉઅથ આર્જસહ. વોહુ ખરેનો મજદદાતેમ. બરદ ખરેનો મજદદાતેમ. બેશજેમ. ચૅાત અમેમચ. આદ આહુમાય અમુઅસતેમો અમ આહુમે અ મુઅસતેમો. વેરેથર અઃહુમેૂવેરેથરૂ અસતેમો. ખરેનંઘ આહુમે ખરે નંઘહુસતેમો ઇઆજ આહુમે ઇ આનુઅસતેમો સોક આહુમે સો કુઅસતેમો. બેશજ આહુમે બેશ જ્યોતેમો. આદ હબેશાચૅા તો રૂઅઇયને. વીસપનાંમ હબેશીઅં તાંમ હબેશાચૅા. દેઉઅનાંમ મ શીઆનાંમચ. ઇઆથવાંમ પેરેકનાં મચ. સાથરાંમ કોઇઆંમ કરફનાં મચ. અહેરીઅ ખરેનધહુચ. તે

મ ઇઅજાય મોરોનુઅત ઇઅસન
વેરેથરગનેમ અહુરદાતેમ નાથરા
બીઓ વેરેથરગનેમ અહુરદાતેમ
ઇઅજમેદ. ઇઆયશ દાતાયશ.
પોયરીઆયશ અહુરહે. હામી
આ ગઉઅ બરેસમન હેજુઆ
દંઘંઘહ માથરેચ. વચચ શીઆ
થનસચ. નાથરાબીઅસચ અર
શાખદબીઅસચ. વાગનબીઆઇ
યંઘહે હાતાંમ. આદ ઇઅસને. પે
તે વંઘો મજદાઓ અહુરો. વે
થા અશાદ હચા. ઇઆઓંઘા
મચા તાસચા. તાઓસચા ઇઅ
જમેદ.

[કરદા પમો] વેરેથરગનેમ અ
હુરદાતેમ ઇઅજમેદ. પેરેસદ જ

રથોશતરો અહુરેમ મજદાંમ અહ
હુરમજદ. મેનીઓ સપેંનશત દા
તરે ગેથનાંમ. અસતુયતનામ અ
શાઑંમ. કો અસતે મેનીઅઉ
અનાંમ ઇઅજતનાંમ. ૭ ઓ
તેમો આહ મરોદ અહુરો મ
જદાઑ. વેરેથરગનો અહુરદાતો.
સપેતમ જરથોશતર. અહમાય
પોખદો આજશદ. વનેમનો. વેરે
થરગનો. અહુરદાતો. હુકેહરપ
વરાજહે પેતેરેનો. તેનદાંસતરહે
અરશનો. તેન અસુરહે. હુકેરેદ
જનો વરાજહે. અનુપોયથવહે
ગરંતહે અરશુ અનેકહે. તખ
મહે ઇઊખદહે. પાયરેવાજહે અ

ઉઅથં આાજસદ. વોહુ ખરેનો મજદદાતેમ. બરૂદ ખરેનો મજ દદાતેમ. બેશાજેમ. ઑાતાં અમેશ ચ આાદ આહમાય અમુઆસતે મો. આમ આહમે અમુચાસતેમો. વેરેથર આહમે વેરેથરૂ અસતેમો. ખરેનંઘ આહમે ખરેનંઘહસતે મો. ઇઆાન આહમે ઇઆાનુઅ સતેમો. સોકઆહમે સોકુઆસ તેમો બેશજ આહમે બેશજીઓા તેમો. આાદ હબેશોઓ. તારૂઅ ઇયને. વીસપનામ હબેશીઅંતાં મ. હબેશાઓ. દઉિઅનાંમ મશી આાનાંમચ. ઇઆાથવાંમ પેરેક નાંમચ. સાથરાંમ કોઇઆાંમ કર શ્નાંમચ. અહેરીઅ ખરેનઘહચ.

તેમ ઇઅજાય સોરોનુચાત ઇઅ
સન. વેરેથરગનેમ અહુર દાતેમ
જોથરાબીઓ. વેરેથરગનેમ અ
હુરદાતેમ ઇઅજમેદે. ઇઆયશ
દાતાયશ. પેંાયરીઆયશ અહુ
રહે. હોમીઓ ગઉઅ બરેસ
મન. હેજુઓ દંઘંઘડ. માંથરે
ચ. વચચ. શીઓથનસચ. જોથ
રાબીઅસચ અરશોખદેબીઅસચ
વાગજબીઓ ઇયંઘહે હાતાંમ.
આદ ઇઅસને પેત વંઘો મજદા
ઑ અહુરો વેથા અશાદ હચા
ઇઆઓંઘાંમચા. તાંસચા. તાઓ
સચા ઇઅજમેદે.

[કરદા ૬ઠો] વેરેથરગનેમ અ

હુરહાતેમ ઇઆજમેદ. પેરેસદ જ રથોશાતરો અહુરેમ મજદાંમ અ હુરમજદ. મેનીઓ સપેનેશત દા તરે ગેથનાંમ. અશાનુયતનાંમ અ શાઓંમ. કો અસેતે મેનીઅઉ અનાંમ ઇઅજતનાંમ. જીઓતે મો આદ મરોદ અહુગો મજદા ઓ. વેરેથરગનો અહુરદાતો. સ પેતમ જરથોશતર. અહમાય ખ શનુઓ આજસદ. વનેમનો. વે રેથરગનો અહુરદાતો નરશ કોડ રપ. પંચહસંઘો. ખરોતહે સપેતે દોયધરહે. કશુ પાશનહે સરીર હે. અફીઅથ આજસદ. વોહુ

ખરેનો મજદદાતેમ. ખરૂદ ખરે
નો મજદદાતેમ. ખેશનેમ ઑાન
અમેમચ. આદ આડમાય આમુ
અસતેમો. અમ આડમે અમુઅ
સતેમો. વેરેથર આડમે વેરેથરૂ
અસતેમો. ખરેનંઘ અહમે ખ
રેનંઘસતેમો. ઇઆન આહમે ઈ
આનુઅસતેમો. સોક આડમે
સોકુઅસતેમો બેશજ આહમે
બેશજીઓતેમો. આદ દબેરાઑ
તારૂચાઇયને. વીસપનાંમ દબેશી
અંતાંમ. દબેશાઑ દેઊિઅનાંમ
મશીઆનામચ. ઈઆથવાંમ પેરે
કનાંમચ. સાથરાંમ કોઇઆંમ કરે
ફનાંમચ. અહેરીઅ ખરેનઘાડ
ચ તેમ ઇઆજાય સોરેનુઅત

ઇઅસન. વેરેથરગનેમ અહુરહા
તેમ જોથનાબીઓ. વેરેથરગનેમ
અહુરહાતેમ ઇઅજમેદ. ઇઆય
શ હાતાયશ. પાયરીઆયશ અં
હુરહે. હુસાઓ ગઉઅ બરેસ
મન હુજુઆ હંઘંઘહુ માંથેરેચ.
વચચ. શીઆથનસચ. જોથરા
બીઅસચ અરશો ખદેબીઅસચ.
વાગનબીઓ હયંઘહુ હાતાંમ
અઃ ઈઅસને પેતવંઘોં મજહા
ઑ અહુરે વેથા અશાદ હચા
ઈઆઑવાંમચા. તાંસચા તાઑં
સચા ઇઅજમેદ.

[ કરદો ૭મો ] વેરેથરગનેમ અ
હુરહાતેમ ઇઅજમેદે. પેરેસદ જ

રથેશતરે અહુરેમ મજદાંમ
અહુરમજદ મેનીઆ સપેનેશત
દાતરે ગેથનાંમ. અશતુયતનામ
અશાઓંઆમ કો અસતે મેનીઅ
ઉઅનાંમ. ઇઅજતનાંમ. જીઓ
તેમા આદ. મરોદ અહુરો મજ
દાઓ. વેરેથરગને અહુરદાતો.
સપેતમ જરથોશતર. અહમાય
હપતથા આજસદ. વજમના.
વેરેથરગને અહુરદાતો. મરેગહે
કેહરપ વારગનહે. ઓંઅતા
અદરે નેમાદ. પેશતોઓંપર નેમા
દ. ઇઓ વદંઆંય અસતે આસે
સતે. રેનશતોરુરઉઅ જમન
નાંમ. હો યઉઆ ઓંશતજીઅ

તાંમ હુશુઅ વસમેઆપીયતે. ઉ
સચેદ વા. નોયદવા ઇઅદ ચેદ
વજેતે હુઅસપેમ ઇઓ વનેતે.
જરશીઅમનો. અગરાંમ ઑા
સેતીમ ઑાંશાઑાંધેમ. અખશ
ફને ખશફનીમ યસેમનો અસુયરે
સુરેમ યસેમનો વીગાથો મરેજદ
કોફનાંમ બરેશાનુઓ મરેજદ ગેરે
નાંમ જાંફનુઓ મરેજદ રોનાં
મ. સનેથેશ મરેજદ ઑાકુઅરનાં
મ. વઇઆંમ વાએમ સોશ રોશે
મનો. અત્રિઅથ આાજસદ. વાહુ
ખરેનો મજદદાતેમ. બરદ ખરે
નો મજદદાતેમ. બેશાતેમ ઑાત
અમેમચ આદ આડમાથ અમુ

અસ્તેમો આમ આહમે આમુ
અસતેમો. વેરેથ્રર આહમે વેરેથ
્રુઅસતેમો. ખરેનંઘ આહમે ખ
રેનંઘહસતેમો. ઇઆન આહમે
ઇઆનુઅસતેમો સોક આહમે
સોકુઅસતેમો. બેશજ આહમે બે
શજીઓતેમો. આાદ દબેશાઓ
તાઉરુઅઇયનો. વીસપનાંમ દબેશી
અંતાંમ. દબેશાઓ દેઊઆનાંમ
મશીઆનાંમચ. ઇઆથવાંમ પૈરે
કાનાંમચ સાથરાંમ કેઇઆમ કર
ફનાંમચ. અહુરીઅ ખરેનંઘહ
ચ. તેમ ઇઅજાય સોરેનુઅત
હુઅસન વેરેથ્રગ્નંમ આહુરદા
તેમ જોથ્રાબીઓ. વેરેથ્રગ્નેમ
અહુરદાતેમ ઇઅજમેદ. ઇઆાય

શ હાતાયશ. પોયરીઆયશ અ
હુરહે. હોમીઓ ગઉઅ બરેસ
મન. હેઉઝુઓ દંઘંધહે. માંથરે
ચ વચઅચ. શીઓથનચઅચ નાથ
રાબીઅચઅચ. અરશોખહેબીઅસ
ચ. વાગજેબીએ. ઇયંઘહે હા
તાંમ આાઠ ઇઆસગે પેત વંઘો
મજદાઓ અહુરો. વેથા અશા
ઠ હચા. ઇઆ ઓંઘાંમચા. તાંસ
ચા તાઓસચા ઇઆજમેદે.

[કરદા ૮મો] વેરેથરગનેમ અ
હુરેદાતેમ ઇઆજમેદે. પેરેસહ
જરથોશતરો અહુરેમ મજદાંમ
અહુરમજદ. મઇનીઓ સપેનેશ
ત દાતરે ગેથનાંમ. અસતુઅતનાંમ.

મ અશાર્ઓમ. કો અસતે મે
નીઅઊઆનાંમ ઇઆજતનાંમ. ૭
ઓતમો. આદ મરોદ અહુરોમ
જદાર્ઓ. વેરેથરગનો અહુરદા
તો. સપેતમ જરથોશતર. અહુ
માય અશતેમો આજસદ. વન
મનો વેરેથરગનો અહુરદાતો. મે
શહે કેહરપ ઓરોનહે સરીરહે.
નઊઅશતકો સરૂઅહે. અઉઅ
થ આજસદ. વોહુ ખરેનો મજ
દદાતેમ. બરદ ખરેનો મજદ
દાતેમ. બેશનમ. ઓત અમેમ
ચ. આદ આહમાય અનુઆશતે
મો. અમ આહમે અમુઅસતેમો.
વેરેથર આહમે વેરેથરૂઅસતેમો
૨૯ ખરેનંઘ આહમે ખરેનંઘહસતેમો

ઇચ્આંમ અંહમે ઇચ્આંનુઅસતેમે. સોકેઅંહમે સોકુઅસતેમે. બેશજ અંહમે બેશજીઓતેમે. આદ દબેશાઓ તાઉરુઇયને વીસપનાં મ દબેશીઅંતાંમ દબેશાઓ દઉ આનાંમ મશીઆનાંમચ ઇઆથવાં મ પેરેકનાંમચ સાથરાંમ. કોઇઆં મ કરફનાંમચ. અહેરીઅ ખરે નઘહેચ. તેમ ઇઅજાય સોરોનુ અત ઇઅસન. વેરેથરગનેમ અ હુરદાતેમ બોથરાબીઓ. વેરેથર ગનેમ અહુરદાતેમ ઇઅજમેદે ઇઆયશ દાતાયશ. પોયરીઆય શ અહુરહે. હોમીઓ ગઉઅ બરેસમન. હેજુઓ દંઘહે માં

થરેચ વચચ. શીઓથ્નસચ ના થરાબીઅસચ. અરશોખદેબીઅ સચ. વાગનેબીઓ. ઇયંઘહે હા તાંમ. આદ ઇઅસને. પેત વંઘો. મજદાઓ અહુરો. વેથા અશા દ હચા ઇઆઓંઘાંમચા.તાંસચા તાઓસચા ઇએનમેદે.

[કરદો ૯મો] વેરેથરગનેમ અ હુરદાતેમ ઇઅજમેદે. પેરેસદ જર થોશતરો અહુરેમ મજદાંમ અ હુમજદ. મેનીઓ સપેનેશત. દા તરે ગેથનાંમ અસતુયતનાંમ અ શાઓમ. કો અસતે મેનીઅઉ અનાંમ. ઇઅજતનાંમ. જીઓત મો. આદ મરેદ અહુરો મજદા

ઑ. વેરેથરગનો અહુરદાતો. સ
પેતમ જરથોશતર. અહમાય ને
મો આજસદ. વનીમનો. વેરેથર
ગનો અહુરદાતો બુજહે કેહર
પ. રેનહે સરીરહે તેજે સરૂઅ
હે. અઊઅથ આજસહ. વોહુ
ખરેનો મજદદાતેમ ખરદ ખરે
નો મજદદાતેમ. બેશનેમ ઑત
આમેમચ. આદ અહમાય અમુ
અસતેમો. અમઅહમે અમુઅસ
તેમો. વેરેથર અહમે વેરેથરૂઅસ
તેમો. ખરેનંઘ અહમે ખરેનંઘહ
સતેમો. ઇઆન અહમે ઇઆનુ
અસતેમો. સોક અહમે સોકુ
અસતેમો. બેશજ અહમે બેશ
જીઆતેમો. આઃદ દબેશાઑ

તારૂઅઇયને. વીસપનાંમ દબેશી
અંતામ. દબેશાઓ દેઉઆનાંમ
મશીઆનાંમચ. ઇઆથવાંમ પેરે
કનાંમચ. સાથરાંમ કોઇઆંમ ક
રફનાંમચ. અહુરીઅ ખરેનહુઘ
ચ. તેમ ઇઆજાય સોરોનુઅત
ઇઅસન વેરેથરગનેમ અહુરદાતે
મ જોથરાબીઓ વેરેથરગનેમ અ
હુરદાતેમ ઇઆજમેદે ઇઆયશ દા
તાયશ પોયરીઆયશ અહુરહે હો
મીઓ ગઉીઅ બરેસમન હેજુ
ઓ. દંઘંઘહ માંથરેચ. વચચ
શીઓથનસચ. જોથરાબીઅસચ
અરશોખદેબીઅસચ. વાગનબી
ઓ. ઇયંઘહે હાતાંમ આદ ઈ

અસને. પેતે વંધો મજદાઓ અહુરો. વેથા અશાદ હુચા. ઇઆઓંઘાંમચા તાંસચા તાઓ સચા ઇઅજમેદે.

[ કરદા ૧૦મો ] વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજમેદે. પેરેસદ જરથોશોતરો અહુરેમ મજદાંમ અહુરમજદ મેનીઓ સપેનેશત દાતરે ગેથનાંમ અસતુયતનાંમ અશાઓમ. કો અસતે મેનીઅઉ અનાંમ ઇઅજતનાંમ. જીઓતે મો આદ મરોદ અહુરો મજદા ઓ. વેરેથરગનો અહુરદાતો. સ પેતમ જરથોશાતર અહમાય દસે મો આજસદ. વનેમનો વેરેથર

ગનો આહુરદાતો વીરહે કોડરપ.
રેઉઅતો સરીરહે. મજદદાતહે.
બરદ કરેતેમ જરનીઓ સુરેમ.
ફરપખશતેમ વીસપો પેસંઘેમ અ
ઊઅથ આજસદ. વાહુ ખરેનો
મજદદાતેમ બરદ ખરેનો મજદદા
તેમ બેશનેમ. ઑત અમેમચ.
આદ આહમાય અમુઅસતેમો.
અમ આહમે અમુઅસતેમો વેરેથ
ર આહમે વેરેથરૂઅસતેમો. ખ
રેનંઘઆહમે ખરેનંઘાહસતેમો ઇ
આંન આહમે ઇઆનુઅસતેમો.
સોક આહમે સોકુઅસતેમો. બે
શજ આહમે બેશજીઓતેમો. આ
દદબેશાઓ તારૂઅઇયને. વીસપ

નાંમ દ્બેસીઅંતાંમ. દ્બેશાઓં દે
ઊઅનાંમ મશીઆનાંમચ. ઇઆ
થવાંમ પૈરેકનાંમચ. સાથરાંમકોઇ
આંમ કરફનાંમચ. અહુરીઅ ખ
રેનધ્હુઅ તેમ ઇઅજાય સોરેનુઅ
ત ઇઅસન વેરેથરગનેમ અહુર
દાતેમ જોથરાબીઓ વેરેથરગનેમ
અહુરદાતેમ ઇઅજમેદે. ઇઆયશ
દાતાયશ. પોયરીઆયશ અહુરહે
હોસીઓ ગઊઅ બેરેસમન. હેજુ
ઓ દંઘંઘહ માંથરેચ. વચચ.શી
ઓથનસચ જોથરાબીઅસચ અ
રશોખદેબીઅસચ. વાગનેબીઓ.
ઇયંઘહે હાતાંમ. આદ ઇઆસ
ને પેતે વંઘો. મજદાઓ અહુરો
વેથા અશાદ હચા ઇઆઓંઘાંમ

ચા. તાંસચા નાર્ઓસચા ઈ
અજમેદે.

[કરદો ૧૧ મો] વેરેથરગનેમ અ
હુરદાતેમ ઇઅજમેદે. અરશો કરે
મ. મરશો કરેમ ફરશો કરેમ. હુ
આ ખશતેમ હુઆઇશ્પોનેમ. તેમ
ઇઅજત ઇર્સો અશુઅ જરથો
શતરો વેરેથરગનહે પેતે મન
હે. વેરેથરગનહે પેતે વચહે. વે
રેથરગનહે પેતે શીઓથનહે વેરે
થરગનહે પેતે ફ્રુઆકહે. વેરેથ
રગનહે પેતે પાયતુઆકહે. અહું
માય હથદ. વેરેથરગનો અહુરદા
તો. યરેજોયશ ખાઓ બાજુઆ
ઓ. ઓજો તનુઓ. વીસપીઆ

ઑા દરૂઅતાતેમ તનુમ્આ વીસપી
આનેઁઆ વજદુઅરે અામચ હુકેમ
ઇયમ બરેતો કરા મસીઆ ઑા
પાપો. ઇઅઆ રંઘાહીઆએંઆ. દુરે
પારીઆએંઆ. જફરીઆએંઆ. હ
જંઘરો. વેરીઆએંઆ. વરેસો. સ
તુઅંઘેમ. આપો ઊરૂયસેમ. મા
રીયતે અહેરીઅ ખરેનઘાહ્ચ. તેમ
ઇઅજાય સારોનુઆત ઈઅસન.
વેરેથરગનેમ આહુરદાતેમ નાથરા
બીએંઆ. વેરેથરગનેમ આહુરદાતેમ
ઇઅજમેદે. ઈઆયશ હાનાયશ
પોયરીઆયશ. આહુરહે હો
મીએઁઆ ગઊઅ. બરેસમન હેજુ
આ દંઘંઘહ માંથરેચ. વચચ

શીઓથનસચ. નોથરાબીઅસચ. અરશોખદબીઅશચ. વાગનબી ચ્યૉ. ઇયંઘહે હાતાંમ. આઃદ ઇઅસને. પેતે વંઘો. મજદાઓ અહુરો વેથા અશાદ હચા. ઈઆ ઓઘાંમચા તાંસચા તાઓસચા. ઇઅજમેદે

[કરદો ૧૨ મો] વેરેથરગનેમ અ હુરદાતેમ ઇઅજમેદે અરશો કરેમ મરશો કરેમ. ફરશો કરેમ. હુ આખશતેમ. હુઆઇઓનેચ. તેમ ઇઅજત. ઇઓ અશુઅ ઝર થઃશતરો. વેરેથરગનહે પેતે મનહે વેરેથરગનહે પેતે વચહે વેરેથરગ નહે પેતે શીઓથનહે વેરેથરગનહે

પેત ફરૂઆકહે. વેરથગનહે પેત ચાયતુઆકહે અહમાય દથદ વેરે થરગનો અહુરદાતો યરેજોયશ ખાઓ બાજીઆઓ ઓનોત નુઓ વીસપીઆઓ દરૂઅતા તેમ તનુએ વીશપીઆઊ વજહુ અરેઓમચ ગુકેમ ઇયમ બરેત અસપો અરશ ઇએ તાંથરીઅ શએદ હચ ખશફનો અઉઅખ શેતીઆઓ યપે અવરીઆઓ અ પેમ વરેશેમ જેમાદ. સઇઅ નેમ વનેતે કતારો. અગરૂએ વા યુનુએ વા. અહેરીઅ ખરેનઘ હચ. તેમ ઇઅજાય સોરોનુઅત ઇઅસન. વેરેથરગનેમ અહરદા

તેમ જાથરાબીઓ વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજમેદે. ઇઆયશ દાતાયશ પોયરીયશ અહુરહે. હે: મીઓ ગઉઅ બરેસમન. હેજુઓ દંઘઘહ માંથરેચ વચચ. શીઓથ નસચ જાથરાબીઅસચ અરશોખ દબીઅસચ. વાગાજબીઓ. ઇય' ઘહે હાતાંમ. આદઇઅશને. પેત વ'ઘો. મેજદાઓ અહુરો. વથા અરાદ હ્ડચા. ઇઆઓઘાંમચા તાંશચા તાઓશચા ઇઅજમેદે.

[ કરદે ૧૩મો ] વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજમેદે. અરશો કરેમ. મરશો કરેમ. ફરશો કરેમ. હુઆખશતેમ હુઆઇશ્પોનેમ. તે

મ ઇઅજત. ઇઍા અશુઅ જરથો
શતરો વેરેથરગનહે પેતે મનહે
વેરેથરગને પેત વચહુ. વેરેથરગન
હે પેત શીઍાથનહે. વેરેથરગન
હે પેત ફરૂઆકહે વેરેથરગનહે
પેતપાયતુ આકહે અડમાય દથેદ
વેરેથરગનો અહુરદાતો યરેજોયશ
ખાઍાઁ બાજુઆઍાઁ ઍાજો તનુ
ઍા. વીસપીઆઍાઁ દરૂઅતાતેમ
તનુઍા. વીસપીઆઍાઁ વજદુ
અરે ઍામચ સુકેમ. ઇયમબ
રેતે કહરકાસો જરેનુમેનેશ. ઇઍા
નામીઆચેદ. હચ દ'ઘાદ મુશતે
મ'સઘેમ. ખરૂમ યવે વેનેત.
અઊ અઊચેદ. ઇઅથ સુકી
આઍાઁ બરાજીઆઍાઁ બરાનેમ

અઊઅઉચેદ. ઇઅથ સુફીઆઅૉ
નેમ અહુરીઅ ખરેનઘહ્ચ તેમ
ઇઅજાય સૅારોનુઅત ઇઅસન.
વેરેથરગનેમ અહુરદાતેમ જોથરા
બીઓ. વેરેથરગનેમ અહુરદાતેમ
ઇઅજમેદે. ઇઆયશ દાતાયશ પો
પઈદ્યાયશ અહુરહે હુામીઓાગ
ઊઅ બરેસમન. હુજીઓ. દંઘં
ઘમાંથરેચ વચચ શીઓથનસચ
જોથરાબીઅસચ. અરશોખદબી
અસચં. વાગનેબોઓ. ઇયં ઘહુ
ડાતાંમ. આદ ઇઅસને. પેતવ
યો. મજદાઅૉ અહુરો. વેથા
અશાદ હચા ઇઆઅૉંઘાંમચા તાં
સચા. તાઅૉસચા ઇઅજમેદે.

[ કરદા ૧૯મો ] વેરેથરગનેમ અરહુદાતેમ ઇઅજમેદે. પેરેસદ જરથોશતરે અહુરેમ મજદાંમ આહુરમજદ મેનીઓ સપેનેશત દાતરે ગેથનાંમ. અસતુયતનાંમ અશાઓમ. ઇઅદ બઊઆને યવે સસતા યવેશ મરેતો પોઓરો નરામ દએશીઅંતાંમ. ચેશ અંઘહે અસતે બેશજો. આદ મરોદ અહુરો મજદાઓ. મેરગહે પેશોપરેનહે વારેંજનહે. પરેને અઇઅસેશ સપેતમ જરથોશતર. અન પરેન તનોમ યવસેફ્રાયશ. આન પરેન હમેરેથેમ. પેત સંઘેશ. ઇઆના ઓઅમરેત અસતુઓ. વા. તખમ

હુ મેરેગહુ પેરેનુઆવા. તખમહુ મેરેગહુ. નેહચેશ રેઉઅ મશી અર્જંતે. નેહ ફ્રેરેશીયતે. પોઆરુઅહે નેમો અરેતે. પોઆરુઅ ખરેનાઓ વેહારીયતે. ઓપશતાંમ મેરેગહુ. પે ના મેરેગનાંમ. તાઓઆઅહુરેસાસ રેનાંમ હંધોપેતેશ. નોયહ સતેશ જંતે વેરજ નોયહ હકેરેહજંતે. વીસ્પ ઓયમ જતે ફ્રશાયતે વીસપે. તરેસંતે. પેરેનેને. અઉઅથ માઉઅઇઅ ચેહતનુઆ વીસપં તરેસંતે અઉઅથ માઉઅઈ અચેહતનો ઇય વીસપે તરેસંતે અઓરુઅથ વીસપે તરેસંતે. દુશમેનીઓશ. અમેમચ વેરેથરગનેમચ. નેહાતેમચ. તનોઇય

મનો. ઇયમા વસાઓંતે અહુરા
ઓંઘો વસાઓંતે આહુઇરીઆઓં
ઘો વસાઓંતે હુસરૂઅંઘનોતેમ
વસત કઉઅ હુસરૂઆ ઇયમ અ
શપો આરશ બરેતે ઇયમ ઓશ
તરો વેદરેશ બરેતે ઇયમ આશ્શ
નાઉઆઇઆ. બરેતે ઇયમ થરેતા
નો તખ્મો બરદ હ્યો જનદ
અજીમ દહાકેમ થરેજફ્નેમ થરે
કમેરેદેમ ખશુઆશ આશીમ
હજંઘ્રં ઇઓંખશતીમ અશ
ઓજંઘેમ. દેઉઇમ દરોજેમ. અ
ઘેમ ગેથાઉઆઇઓ દરૂઅંતેમ.
ઇઆંમ અશ ઓજસતેમાંમ. દરો
જેમ ફ્રચ કેરેંતદ અંઘરે મેનીઓ

શ. ઓાય ઇઆંમ અસતુયતીમ ગ
થાંમ મહ્રકાય અશાહેગેથનાંમ.
અહેરીઅ ખરેંનગહ્ય. તેમ ઇઅ
જાય સોરેનુઅત ઇઅસન વેરેથર
ગનેમ અહુરદાતેમ નાથશાબીઓા
વેરેથરગનેમઅહુરદાતેમ ઇઅજમે
હે. ઇઆયશ દાતાયશ પોયરીઆ
યશ અહુરહે. હોમીઓ ગઉઅ
બરેસમન હેજીઓ દંઘંઘહ. માં
થરેચ વચચ. શીઓથનસચ. જા
થેરાબીઅસચ અરશોખદેબીઅસ
ચ. વાગજબીઓ. ઇયંઘહે હાતાંમ
આદ ઇઅસને. પેત વંઘો મજદા
ઓ અહુરો વેથા અશાદ હચા
ઇઆ ઓાઘાંનંચા તાંસચા તાઓસ
ચા. ઇઅજમહે.

[કરદા ૧૫ મો] વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજમેદે. વેરેથરગનો અશઉય યમદ નમાનેમ. ગાસો રાબીઓ ખરેનો પૈરે વેરેનુયતે. ઇઅથ હુઓ મજદ. મેરેગો શેનો ઇઅથ અશઉય અવરાઓ. ઓપાપાઓ. મસેતો ગેરેશ નેઉઆનંતે. અહેરીઅ ખરેનંઘહુચ નેમ ઇઅજોય સોરિનુઅત ઇઅસન. વેરેથરગનેમ અહુરદાતેમ નોથરાબીઓ વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજમેદે. ઇઆયશ દાતાયશપોયરીઆયસ અહુરહે. હોમાઓ ગઉઅ બરેસમન. હેજુઓ દંઘંઘહ માંથેરેચ. વચચ. શીઓથનસચ

નોથરાબીઅસરા અરશો ખદેબીઅસચ. વાગનેબીઓ. ઇયંઘહે હાતાંમ. આદ ઇઅસને. પેતે વંઘોમજદાઓ અહુરો વેથા અશાદઉચા. ઇઆઓઘાંમચા. તાંશચા. તાઓસચા ઇઅજમેદે.

(કરદા ૧૬ મો) વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજમેદે. પેરેસદ જરથોશતરો અહુરેમ મજદાંમ અહુરમેજદ. મેનીઓ સપેનેસત દાતરે ગેથનાંમ. અશતુયતનાંમ અશાઓમ. કુઅ અસતે વેરેથરગનહે અહુરદાતહે. નાંમ અજયાયતેશ. કુઅ ઓંપ સતુયતેશ. કુઅ નેસતુયતેશ આદ મરેદ અહુરો

મજદાઓ ઈઅહ સપાદ હુંજશા
ઓંતે. સપેતમ જરથોશતર. રશ
તેમ રસમ. કતરશચેહ. વેશતા
ઓંધો અહુમીઅ નોયહ વનીઆ
ઓંતે જતાઓંધો અહુમીઅ નો
યહ જનીઆઓંતે જતંઘરો પેરે
નાઓ વેદાઈઓયશ અઉય પથાં
મ કતરસચેહ. ઈઆતારો પોઓ
કુઓ ફ્રાઇઆજોયતે. અમો હુતા
શતો હુરોદો. વેરેથરંગનો અહુર
દાતો. અતારો વેરેથર ઙચેત.
અમેમચ. વેરેથરગનેમચ. આ
ફ્રીનાંમે હુઅ અપાતાર હુઅ
નેપાતાર હુઅ નેશહરેતાર હુઅ
અદવો જેન, હુઅ વીદવો જેન

હુઅ ફ્રરહવો નેમ. હુઅ આમરેને
મ. હુઅ વેમરે નેમ. હુઆ ફ્રમેરે
નેમ જરથોશતર યતેમ માંથરેમ
મા ફ્રરેહસીઓયશ. અનીઅહ.
પોથરે વા. પોથરાય બરાથરે વા
હ્દો જાતાય. આથ્રૂઅનાય વા
થરાઇઓને. યતેચ તે વાચો ઇઓ
ય ઑગર આસ હેરેજરે આસ.
ઑગર આસ. વીઆખને આસ
ઑગર આસ. વેરેથરગને આસ.
ઑગર આસ બેશજીઅ આસ.
યતેચ તે વાચો. ઇઓયપેસે
મચેદ. સારેમ બુનન્તે ઑજ
ગેરેપતેમચેદ. સનથેમ. અપસ
અપ અનુયંતે. અહુરીઅ ખરે
નઘહ્ચ. તેમ ઇઅજાય સોરોનુ

આત ઇઅસન વેરેથરગનેમ અહુરદાતેમ નોથરાબીઓ. વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજમેદે. ઇઆયરા દાતાયશ. પોયરીઆયશ અહુરહે. હોમાઓ ગઉઅ બરેમસન. હેંજુઓ ફંઘઘહુ માંથરેચ. વચચ શીઓથનસચ. નોથરાબીઅસચ. અરશોખદેબીઅસચ. વાગજેબીઓ. ઇયંઘહે ડાતાંમ. આદ ઇઅસને પેત વંઘો મજદાઓ અહુરો વેથા અશાદહુચા ઇઆઓં ઘાંમચા. તાંસચા તાઓંસચા ઇઅજમેદે.

[કરદા ૧૭ મો.] વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજમેદે. પેરેસદ

જરથોશતરો અહુરેમ મજદાંમ
અહુરમજદ. મેનીઓ સપેનેશાન
દાતરે ગેથનાંમ. અશાનુયનનાંમ
અશાઓંામ ઇઓ વીરાનેતે અ
તરે રાસત રસમન. આઅ ફરચ
પેરેસેતે. હુદમેથર. હુદરશનુઓ.
કો મેથરેમ યવે દરોજેતે. કો રશ
નુમ પેતે યરેનેપાતે. કહુમાય
ઇઅસકેમચ. મહરકેમચ. અનામ
બખશાને ખશીઅમનો. આદ
મરોદ અહુરો મજદાઓ. ઇયમ
મશીઆક. ફરાઇઅજાઓંતે. વેરે
થરગનો અહુરદાતો દાતહે ઇયમ
શીયતે. દાયતીઓ તમો. ઇઅસ
નસચ. વહમસચ. અશાદ હુચ

ઈઅદ વહેશતાદ. નોયદ યથ
યરીઆઓ હંઘાઉઓ. ફ્રાશ
હીઆદ હેન. નોયદ વાચગન.
નોયદ પાંમ. નોયદ કપસતેશ.
નોયદહુ હેનીઆ રથો. નોયદ
ઓંજ ગેરેપતો હરફસો. પેતે દેમ
પેરેસદ જરથોશતરો. કદ ૭
અસતે અહુરમજદ. વેરેથરગનહે
અહુર દાતહે. દાયતીઆ તેમો.
ઈઅસનસચ. વહમસેચ અશાદ
હુચ ઈઅદ વહેશતાદ આદમરોદ
અહુરો મજદાઓ. જોથરાઓ
હે ઓંજ બારીયન. યરીઆઓ
હંઘાઉઓ બરેસમ હેસતરીયન.
યરીઆઓ હંઘાઉઓ પશુમ હે
પચીયન. યરીઆઓ હંઘાઉઓ.

ઑારોશેમ વા. વોહુ ગોનેમ વા.
કાચેદ વા ગોનનાંમ. હાુમો ગો
નેમ માહે મેરીઆ ગેર્ઑારૂઆઇ
આયદ. મા જ હેક. મા અસા
રૂઆ અસરાઊઆઇઅદ ગાથો.
અહુમેરેખશ પેતીઆરેનો યમામ
દેનાંમ. ઇઆંમ આહુયરીમ જર
થોશતરીમ. ઇયનશે મેરીઆ
ગેર્ઑારુઆઇઆદ. જહેક વા
અશાહુઆ વા. અસરાઉ અઇ
આયદ ગાથો અહુમેરેખશ પેતી
આરેનો. યમામ દેનાંમ. ઇઆંમ
આહુયરીમ જરથોશતરીમ. પરબે
શાજ હચેતે. વેરેથરગનો અહુર
દાતો. યમચ યરીઆબીઆ દઘો

બીએ વોયગનાઓ જસાઓંતે. હમથ ચરીઆબીએ દંઘોબીએ હુન. ફરપતાઓંતે. હમથ ચરીઆબીએ દંઘોબીએ. જનીઆઓંતે પંચસગનાય. સતગનાયસચ. સતગનાય હજંઘરગનાયસચ હજંઘરગનાય બેઊરે ગનાયસચ. બેઊરેગનાય. અહાંખશતગનાયસચ. અદાદ ઓંયતે ફ્રૂઅશત વેરેથરગનો અહુરદાતો. નોયદ નરે. ઇયસનીઓ. વહુમીએ. ગેઓશ. ઓરૂઅ. દામે. દાતો. ઇઅદ. નુરેમ. વીઆમ. શુર. દેઉઅ. મશીઆક દેઊ અઇઅ:જો. વોહુનેમ વા. નાચીયંતે. ફ્રસેકેમ વા ફ્રશોચંત

ઇઅદ નુરેમ. વીઆમ ખુરદેહઅ મશીઆક. દેહઅઇઆજો અહય આતરેમ. આ બરેતે યતીઆઓ ઓરૂઅરીઆઓ. ઇઆ વાએ હ્પેરેસે નાંમ. યતેમ યસમેમ. ઇઆ વાએનેમેદકનાંમ. ઇઅદ નુરેમ. વીઆંમ ખુર. દેહઅ મશીઆક. દેહીઅઇઆનો. ફરા પરસતેમ [illegible]ામીયતે. વીમેદીઆનેમ ફશા[illegible]ોયતે. વીસપે હંદામે. રાઝયતે. જંન હો સેદેન. નોયદ જનેનહ્દ હો સેદેન. નોયદ હંદેન ઇઅદ નુરેમ. વીઆંમ ખુર. દેહઅ મશીઆકં. દેહીઅઇઆનો. ઓશો પેરે દારીયતે. દેમહો પેરે ઓરૂયશીયતે. અહેરીઆ ખરેન

ઘહુચ. તેમ ઇચાજાય સોરોનુ અત ઇઅસન. વેરેથરંગનેમ અહુરદાતેમ નાથરાબીઓ. વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજમેદે. ઇઆયશ દાતાયશ. પોયરીઆયશ અહુરહે હોમીઓ ગઉઅ બરેસમન હેજીઓ દંઘંઘહ માથરેચ. વચચ. શીઓથનસચ. નાથરાબીઅસચ. અરશોખદેબીઅસચ વાગજબીઓ. ઇયંઘહે હાતામ. આઅદ ઇઅસને. પેતવંઘોમજદાઓ અહુરો. વેથા અશાદ હચા. ઈઆઓંઘાંમચા. તાંસચા તાઓશચા ઇઅજમેદે.

(કરદા ૧૮ મો) વેરેથરગનેમ અહુરદાતેમ ઇઆજમેદે હોમેમ

બેરે શાયરે બોગેમ. હોમેમ વેરે
થરાજનેમ. બેરે નેપાતારેમ. વોહુ
બેરે નેપાતારેમ તનુઇય બેરે
હોમેમ. ઇયમ નેઉઅજતે. નેઉ
અંદાહ. અપીયતે દુશમેનીઓાહ.
આપેશનહુચ. ઇઅથ અનેમ
ઓામ સપાદેમ વનાને ઇઅથ અ
નેમ ઓામ સપાદેમ નેઉઅનાને
ઇઅથં અનેમ ઓામ સપાદેમ
નેજનાને. ઇઓા મે પસકાદ
વનેતે. અહેરીઅ ખરેનંઘહુચ.
તેમ ઇઅજાય સોરોનુઅત ઇઅ
સન. વેરેથરગનેમ અહુરદાતેમ
નાથેરાબીઓા. વેરેથરંગનેમ અહુ
રદાતેમ ઇઅજમેદે. ઇઆયશ

દ્દાતાયશ. પોયરીઆયશ અહુરહે હ્વામીઓ ગઓીઅ બરેસમન હુજુઆ દ'ઘ'ઘહ માંથરેચ વચચ શીઓથનસચ. જાથ્રાઓીઅસચ અરશોખ્દ્દેબીઅસચ. વાગજબીઓ. યથ'ઘહે હાતામ. આદ યઅસને, પૈતિ વંધ્યો. મજદાઓ અહુરો વેથા |અશાદ હચા. યઆઓંઘામચા. તાંસચા તાઓં સચા યઅજમેદ.

(કરદો ૧૯ મો) વેરેથરગનેમ અહુરદાતેમ યઅજમેદ અશાનેમ સેગુયરે ચેથરેમ અબેરે અહુરો પોથરેમ પોથરાઓંઘો. બેઊઅરે પતીઓ અમુઅ આસ વેરેથરૂઅ

નામ વેરેથરૂઅઆસ અમુઅનામ
ઇઅથઅનેમ અઉઅત. વેરેથરહ
ચાને. ઇઅથવીસપે અનીય યરીય
ઇઅથ અનેમ ઓઆમ સપાદેમ વના
ને ઇઅથ અનેમ ઓઆમ સપાદેમ
નેઉનાને. ઇઅથ અનેમ ઓઆમ
સપાદેમ નેજનાને ઇઓઆમે પસ
કાદ વજતે. અહેરીઅ ખરેનંઘ
હચ. તેમ ઇઅજાય સોરોનુઅત
ઇચાસન. વેરેથરગનેમ અહુરદા
તેમ જોથરાબીઓઆ વેરેથરગનેમ
અહુરદાતેમ ઇઅજમેદ. ઇઆયશ
દાતાયશ. પાયરીઆયશ અહુ
રહે. હામીઓઆ ગઉઅ બરેસમન.
હેજુઓઆ દંઘંઘહ માંથરેચ વચચ
૧શીઓઆથનસચ. જોથરાબીઅસચ

અરશોખહેબીઅસચ. વાગજેબી
આ. ઇયંઘહે હાતાંમ આહ ઇઅ
સને. પેત વંઘો મજદાઓ અહુરો
વેથા અશાદ હચા. ઇઆઓંઘા
મચા. તાંસચા. તાઓસચા.
ઇઆજમેદે.

[ કરદો ૨૦ મો ] વેરેથરગનેમ
અહુરદાતેમ ઇઅજમેદે. ઇઅથા
અહુ વેરીઓ (૧) ગઉય અમેમ
ગઉય નેમેમ. ગઉય ઓખદેમ.
ગઉય વેરેથરેમ. ગઉય ખરેથેમ.
ગઉય વસતરેમ. ગઉય વેરેજીઆ
તાંમ. તામને ખરેથાય ફશોઇઆ.
અહેરીઅ ખરેનઘહચ તેમ ઇઅ
જાય સોરેનુઆત ઇઅસન વેરેથ

રગનેમ અહુરદાતેમ જોથરાબી
આ. વેરેથરગનેમ અહુરદાતેમ
ઇઅજમેદે. ઇઆયશ દાતાયશ
પોયરીઆયશ અહુરહે હુામીઆ
ગઊઅ બરેસમન હેજીઆ દંઘ
ઘહ માથરેચ. વચચ શીઆથન
સચ. જાથરાબી અસચ. અરશો
ખદબીઅસચ. વાગજબીઆ ઇયં
ઘહે હાતામ આઠ ઇઅસને. પેત
વંઘો. મજદાઓ. અહુરો. વથા
અશાઠ હચા. ઇઆ આંઘાંમચા
તાંસચા. તાઓંસચા ઇઅજમેદે.
[કરદો ૨૧ મો] વેરેથરગનેમ
અહુરદાતેમ ઇઅજમેદે. ઇઆ
રસમનો સચેંદીયતે. ઇઆ રસમ

ના કેરે'તીયતે. ઇઆ રસમનો ખ'ધહીયતે ઇઆ રસમનો ઇઆ જીયતે. અઉય રસમનો સચે'દીયતે અઉય રસમનો કેરે'તીયતે. અઊ ય રસમનો ખ'ધહીયતે. અઊય રસમનો ઇઆ જીયતે. વેરેથરગનો અહુરદાતા દેઉઅનાંમમશીઆનાં મચ. ઇઆથેવાંમ પેરેકનામચ. સાથરાંમ કોઇઆમ કરશ્નામ ચ. અહેરીઅ ખારેનધહ્ચ. તેમ ઇઅજાય સોશેનુઅત ઇઆસન. વેહ્રેથરગનેમ અહુરદાતેમ નાથરા બીઆ. વેરેથરગનેમ અહુરદાતેમ ઈઅજમેદ. ઈઆયશ દાતાયશ. પોયરીઆયશ અહુરહે. હામીઆ

ગઉઅ બરેસમન. હેજુઓ દંઘં
ઘહુડ. ગાંથરેચ. વચચ શીઓાથન
સચ. જોથરાબીઅસચ અરશોખ
દેબીઅસચ વાગજેબીઓ. ઇય
ઘહુ હુાતાંમ. આદ ઇઅસને પેત
વંઘો મજદાઓ અહુરે વેથા અ
શાદ હુચા. ઇઆઓાંઘાંમચા.
તાંસાચા તાઓ:સચા ઇઅજમેદે.

[કરદા ૨૨ મો] વેરેથરગાનેમ
અહુરદાતેમ ઇઅજમેદે. આદ
ઇઅદ વેરેથરગાનો અહુરદાતો.
થરેખનનાંમ. રસમનામ ઇઓાખત
નાંમ શોયથરનામ. મેથરો દરોજાં
મ મશીઆનાંમચ. અપાંસ ગઊ
ઓ દરેજીયતે. પેરેદમ વારીયત.

અપ ગોશ ગોશીયતે. નોયદ પાદ વેદારીયતે. નોયદ પેતે તઉઆઓ બઉયતે. અહુરીઅ ખરેનઘહચ તેમ ઇઅજાય સોરોનુઅત ઇઅસન. વેરેથરગનેમ અહુરદાતેમ જોથરાબીઓ. વેરેથરગનેમ અહુરદાતેમ ઇઅજમેદે. ઇઆયશ દાતાયશ. પોયરીઆયશ અહુરહે. હોમીઓ ગઉઅ બરેસમન. હેજુઓ હંઘંઘહ. માંથરેચ. વચચ શીઓથનસચ. જોથરાબીઅસચ અરશોખદેબીઅસચ. વાગનબીઓ ઇયંઘહે હાતામ આદ ઇઅસને પેતેવંઘો. મજદાઓ અહુરો વેથા અશાદ હચા. ઇઆઓંઘાં મચા. તાસચા. તાઓસચા. ઇઅજમેદે.

(બાજમાં પઢે.) હોરમજદ. ખોદાય. અવજુની મરદુમ મર દુમ સરદગાં. હમા સરદગાં. હ મણાયસત બેહાંઓયમ બેહદીને માંજદીઅસનાં. આગહી આસતુ આની. નેકીરસાનાંદ. યદુનબાદ. (પરગટ પઢે) ઇઅથા અહુવેરીઓ (૨) ઇઅસનેમચ. વહમેમચ. ઓ જસચ. જઉઅરેચ. આફરીનાંમે. વેરેથરગનહે અહુરદાતહે. વને તીઆઓસચ. ઓપરતાતો અ શેમ વોહુ (૧) અહમાયરે સચ.—હજઘરેમ.—જસમે.—કે રબા મુજદ.— અશેમ વોહુ.(૧) રોજ (ફલાંન) માહા (ફલાંન) ગેહ (ફલાન) નમાજ દાદાર

ઓડાન હામાંન. ખશનોથર અહુ
રહે મજદાઍા તરોયદીતે. આઘ
રહે મેનીયઍાશ. હુથીઆ વરશ
તાંમ. હીઅદ વસના. ફરશોતેમેમ
સતામે અશેમઅશેમ વોહુ (૧)
ગોરજ ફ્રારહે અવજાઇઆદ બે
હુશંમ ઇઅ ‌ ‌ દ પીરોજગર દુશમ
નજદાર અમહે હુતાશતહુ બે
રેસાદ. અમાવંદ પીરોજગર અ
માવંદી પીરોજગરી. દાદ દીને બે
હે માજદીઅસનાં. આગહી રવા
ઇ ગોઆશરંગાની બાદ હુપત
કેશવર જમીન યદુનબાદ. મંન
આનો આવાઇઅદ શુદંન. મંન
આંનો આવાઇઅદ શુદંન. મન
આનો આવાઇઅદ શુદંન અશો

ને અશેમ વોહુ (૧)

(દખણ દશા ની તરફ મોહોડુ કરીને પઢે)

દાદાર ગેહાંન દીને માજદીઅ સની દાદ જરથોશતરી નેમસતે અશાઓમ સેઉઇયશતે અરદુઇસુર અનાહુતે અશોને અશેમ વોહુ (૧) નેમો ઓરૂઅર વંઘોહીશ મ જદદાતહે અશોને અશેમ વોહુ (૧) વેરેથરગનેમ અહુરદાતેમ ઈ અજમેદે. અશેમ વોહુ [૧] બેહેરાંમ ઇઅજદ પીરોજગર દુશમન જદાર અમહે હુતાશતહે બેરેસાદ. અશેમ વોહુ (૧)

# મોનાજાત બેતોની.

બનાંમે ખોદા દાઅજદ્દ દેહુ નમુન,
કે ગેતી બપા કરદ અજ કાફોનુન.
ખોદાવદે અકલો, ખોદાવદે રાએ,
ખોદાવંદે ગંજો, ખોદાવંદે જાએ.
ખોદાવંદે બદલો, ખોદાવંદે દાદ,
ખોદાવદે નીરૂ, ખોદાવદે રાદ.
ખોદાવંદે અરશો, ખોદાવદે ગાહુ,
ખોદાવંદે મેહેરો, ખોદાવદે માહુ.
ખોદાવદે નાહીદો બેહુરામો તીર,
ખોદાવંદે જેગ્નવો કેવાંને પીર.
ખોદાવંદે ફરશો, ખોદાવંદે જાન,
ખોદાવદે હફત આસમાંનો જેહાંન.
ખોદાવંદે અરજે હમે અખતરાંન,
ખોદાવંદે બખશદે ઓ મેહેરબાન.
ખોદાવંદે ફીરોજી ઓ દાદગર,
ખોદાવંદે પાકીઆ જુરો હોનર.

ખોદાવંદે કુરસીઓ લોહો કલંમ,
ખોરદેહ હમે ખલકરા ફેકરો ગમ.
ખોદાવંદે અમશાસપંદા બેહેશત,
ખોદાઈ કે દુર અજ બદા કારે જેશત
ખોદાઇ કે પાકસતો બા દાદો રાએ,
રહીમો ખતા બખશો મુશકેલ ગોશાએ.
ખોદાઈ કે ઉ ચાકો વીજસતો નુર,
ખોદાઈ કે અજ હર બદા જોલમ દુર.
ખોદાઈ કે બા રાહ ખુદ કારસાજ,
ખોરદ ગમ જેહાંરાઓ ખુદ બીનીઆજ.
ખોદાઈ કે વસફશ બુઅદ ના પેદીદ,
ખોદાઇ કે હર મુશકેલીરા કેલીદ.
ખોદાઇ કે બર હર કસી મેહેરબાંન,
અજીમો સરીફસતો રોજી રસાંન.
ખોદાઈ કે ગરદુશ અંદર સેજુદ,
ખોદાઇ કે નતવાંની ઉરા સેતુદ.
ખોદાઈ કે ઉ ખાલેકે કાએનાત
ચો એનસાંનો અજ ઉરવરો કાએનાત.

ખોદાઈ કે મુલકશ બુઅદ બીજવાલ,
નબાશદ બઝોજ નેકોઇઅશ ખ્યાલ.
ખોદાઈ કે કામશ બુઅદ રાસતી,
ખોદાઇ કે દુર અસ્ત અજ કાસતી.
ખોદાઇ કે બર ખલ્ક ફેરીઆદ રસ,
નમાંનદ બદો કશ ન ઉ ખુદ બકસ.
ખોદાઈ કે રબઓ તમીજો હકીમ,
કદીમો કરીમો રહીમો અલીમ.
ખોદાઇ કે ઉ રાજેકે કાએનાત,
જે સંગ આફરીદસત આબે હએઆત.
ખોદાઈ કે અફરૂ ખતસત અખતરાંન,
બેહરેમંદ બર બંદેગાં હર જમાંન.
ખોદાઈ કે અજ આતશો આબો સંગ,
સરેસતેહ હમે ઉરવરાં રંગ રંગ.
ખોદાઈ કે ઉ હસત બીચુનો ચેગુન,
અબી મીસલો માંનદો સાંનો નમુન.

ખોદાઈ કે ઉરા બહુંગાંમે કાર,
કસી દર ખોરશા નીસ્ત અમબાજો યાર.
ખોદાઈ કે હર મુશકેલીરા કેલીદ,
જે કાફ્રા જે નુન કરદ ગેતી પેદીદ.
ખોદાઈ કે ઉરા અજાં તુરો જેબ,
ફ્રેસતે નબીનદ જોજ આવાજે ગયેબ.
ખોદાઇ કે ઊ હરચે ખાહદ બરાએ,
જે કુદરત પેદીદ આરદો રેહેનુમાએ.
ખોદાઈ કે બીમેસલો સાંનો નજીર,
નેકોઇસત હમવારે અશ દર ખમીર.
ખોદાઇ કે દુર અજ બદીહાઓ જુર,
બબંદેહ પસંદેહ નેમાએઅદ ઉગુર.
ખોદાઈ કે ફ્રીન દાદોહમ રેજકો જાંન,
સરેશતેહબ યક લેહજે હરદો જાંહાંન.
ખોદાઈ કે દર નુરે ખુદ હસ્ત ગર્ક,
કુજ અમરશ જેહદ બીપરો પાએબર્ક.

ખોદાઈ કે ઉ રા જેક્કે પીલો મુર,
બ હર કસ રસાંનદ બ મેકદાર ખુર.
ખોદાઈ કે ફેરા સુરતો રંગો ફાંમ,
નબીનદ ફેરશતેહ સીઆસે તમાંમ.
બજોજ ખાંનદનઆવાજે વસતાઓઝંદ,
ફેરેશતે નશાનવદો અમશાસપંદ.
શબો રૂજ હુન જેકરે નાંમે ખોદાએ,
કજુ બાશદ હાંસેલ ન હરદો સરાએ.
હકકા રાજેકા કાદેરા દાદગર,
તોઈ ખાલેકે જોમનેગાં સરબસર.
અજી જેકર નાંમે ખોદાવંદેગાર,
શવદ હલ હમે મુશકેલો સખત કાર.
ખોદાઈ કે નાંમશ હજારો યકસત,
બહર નાંમ ખાંનદન શવી ચારેહ દસત.

# મોનાજાત ખોરશેદ ઇજદની.

અએ નુરે ખોદા પાકતરીન ખુરશેદે ઇઅજદાં—જે નીઆએશો ઇઆશત ખાંદનેમન બાદતો શાદાં. વીબંદગીએ નેકર ખોદા નેજદતો કરદમ--અજ ખેહરે રવા હાજેતમત નેજદશ ખેરસાં. અજ તરફેમનત આરજશાં, દર દરગેહે ઇઅકતા—અજ જુદીઅત ઇમદાદ, કુનો મોસકેલમ આસાં કન રેજક ફરાંખ આબ ફેજા દારીઅમ આબાદ- અફજુનીએ ફરજંદ કુનીજો ખાલેકે ગએ હાં

મોનાજાત માહાબોખતારની

અએ નુરે ખોદા માઅંાદહુ ઇઅજદાં જીનીઆએશો ઇઅ શત ખાંદનેમન બાદતો શાદાં. વી બંદગીએ। જેકર ખોદા નેજદતો કરદંમ અજ બેહરે રવા હાજ તમત નેજદશો બેરેસાં. અજ તર ફેમનાતં અરજ રસાં દર દરગાહે ઇઅકતા અજ જુદીઅત ઇમ દાદ કુનો મોશકેલંમ આસાં. કુન રેજક ફરાખ આબ ફેજા દારી અમ આબોદ— અફજુનીએ ફ રજંદ કુની જાં ખાલેક ગએહા.

## અખએચાચાની

## અરદીબેહેશત ઇચઅશત

ખશનોથ્રે અહુરહે મજદાઓ. અશેમ વોહુ (૬)

ય નામેઇઅજદાંન. હોરમજદ ખોદાય અવજુની. ગોરજ ખોર હે અવજાઇઆદ. અરદીબેહેશત અમેશાસ્પંદ બેરેસાદ. યજદમા ગોનાહ. પતેત પશેમાંનોમ. ય જ હરવશતીન દુશમત. દુજુખત દુજુઅરેશત. મેમ ય ગેથી મનીદ. ઓાયમ ગોશ્ત ઓાયમ દરદે. ઓાયમજસત. ઓાયમ ખુન ખુદયસતેદ. અંજા ગોનેહા. મન ઉરશની. ગવશની કુનશની. તની રે

આંની. ગેથીમીનોઆંની ઓઆ
અવાખશ પરોમાંન પરો ગવશની.
પપેતત હોમ. ખશનોથર અહુ
રહે મજદાઓ નરોયદીતે અંઘ
રહે મેનીયઓશ. હેથીઆ વરશ
તાંમ. હીઅદ વસના. ફરશોતેમેમ.
સતોમે અશેમ. અશેમ વોહુ. (૩)

ફરૂઆશને મજદીઅસનો જર
થોશતરેશ. વીદેઉઓ અહુ
રહે દકેશો. (ન ગેહે હોએ તે
પઠે) ફરસસતીયચ. અશાહે વહે
શતહે સરેશતહે. યશીઅમનો
યશીયહે. સુરહે મજદદાતહે.
સોકીઆઓ વંઘોહીઆઓ. વો
ઓરો દોયથરીઆઓ. મજદ
દાતીઆઓ અશોનીઆઓ. ખ

શનોથર. ઇઆસનાયચ વહ્માય
ચ. ખશનોથરાયચ. ફ્રસસ્તીયચ.
ઇઅથા અહુ વેરીઓ જોતા
ફ્રશમે મરૂતે. અથા રતુશ. અશાદ
ચીદ. હુચ ફ્રશ અશુઅ વીદુઆ
ઑ મરોતુ.

અશેમ વહુશતેમ સરેશતેમ અ
મેશેમ સપેનતેમ ઇઅજમેદે. યરી
અમનેમ યશીમ ઇઅજમેદે. સુરે
મ મજદદાતેમ ઇઅજમેદે. સોકાં
મ વંઘોહીમ વોઑરિ દાયથરાંમ
મજદદાતાંમ અશોનીમ ઇઅજમેદે

અખીઆચા પેતુશ ઇઆ સદ
અહીઆ. વેરેનનેમ મદ અરીઅ
મના અહીઆ દેઉઆમહી. મનો
અ અહુરહીઆ. ઑ રૂઆજંગા·

મજદાઓ થવોએ ફ્રુઆ ઓંઘે.
આઓંઘામં. તંગ દાહીઆઇ
ઓઓ વાઓ હમેશીઆંતી ઓ
બીઓ મજદાઓ અહુરે સારે
મનો વોહુ મનંઘા. ખશથ્રાદહચા.
પેતી મરેદ. અશા હુશે હખા
બેજુઆના સપેંતાંમ વ આરમેતી
મ. વંઘોહીમ વરેમેદી હાનેઆંઘદ
અહઈડરા. હેઉઆ વીસપા
ઓંઘો અકાઠ મનંઘો. સતાચેથ
રેશ. ઇઅસઆ વા મશ ઇઆજતે.
હરુજસઆ પેરેમતોએસઆ. શી
ઓઆમાંમ ઓપી દમેતાના ઇઆ
એશ એસરૂદુમ ખુમીઆઓ.
હપતથે.
આદ ઇઉશતા સ્ટરહમીમથા.

ઇઆ મશીઆ આચેશતા હંતા વખશેંતે દેઊઆ જીુશતા વંઘહ્રુઑાશ સીજદીઅમના મંન ધા. મજદાઑ અહુરા હીઆ. ખરતેઑાશ નસીઅંતા. અશા દચા. તાદે બેનોતા. મશીઅ હુજી આંતાઓાશ.

અમેરેતાતસચા. હીઅદ વાઑા અકા મનંઘા ઇઓગ દેઊિઅંગ. અકસચા મેનીઉશ અેકા શીઓ થનેમ. વચંઘા ઇઆ ફ્રચે નસ. દરેગુઅંતેમ. ખશીઓ પોઑારોઓનાઑા ઓનાખશતા. ઇઆાપેશ સરાઊિઅ હાઓતી ઇપે નનાઓશ. અથા હાતા મરાને અહુરા વહુશતા વાઓશ તા મનં

ઘા. થવહમી વે મજદા. ખશથરે। એ અશાએચા. સેંગો વીદાંમ.

એશાંમ એનંઘામ. નચેદ વીહુ આર્ઓ. ઓજોએ હા દરોઇઆ. ઇઆ જોઇઆ સેંઘેંતી. ઇઆએશ સરાઉઇ. એના અઇઅંઘા. ઇએ શાંમ તુ અહુરા એરેખતેમ મજદા. વેદશતો અહી. એશાંમ એનંઘામ

વીઉીઅંઘોશો સરાઉઇ ઇએ મસચીદ. ઇએ મરીઅંગ. શોખશાનુશો અહમા કુંગગાર્ઓાશ અગા ખરેમનો. એશાંમ ચેદ. આઅહમી થવ અહમી મજદા. વીચેથરોએ એપી દુશ સસતેશે સરૂઆર્ઓ। મોરેંદદ. હુઆ

જીઆતાએશ સેંઘઆએશ અર
તુમ અપો મા ઇશતીમ અપી.
આંતા મેરેખદાંમ. હાએતીમ વંઘ
હુઑાશ મનંધો. તા ઑાખદા
મેનીએઑાશ મહ્રીઆ મજદા
અશાએચા ઇઑાશમેબીઆ
ગેરેજ હુઆ માંના

સરૂઆઑા મોરેંદદ. ઇએ
અચેશતેમ વેનઘહુ ઓ
ગેદા ગાંમ અશેબીઆ હુઅ
રેચા ઇઅસચારદાથેંગ. દરેગુઅ
તો દદાદ. ઇઅસચા વાસતરાદ.
વીરીઆપદ. ઇઅસચા વદરે
વાએજદદ અશોને તેચીદ. મા
મોરેંદાંન. જીઓ તુમ. ઇઓએ
દરેગુઅતો મજબીશ ચેકોએતરેશ

અંઘોહીસાચા. આઘહુઅસચા.
અ:પીઅતે રેખનંઘો વેદેમ
ઇઅોપે વહેશતાહ. અશાઅોનો
મજહા રારેશીઆંન મંનઘો
ઇઆ રંઘહીઅેન. સહૂઅંઘા
વહેશતાહ શીઅોથનાહ. મરેતા
ના અેમેઅે મજહાઓ. આકા
મરોહ ઇઅોઅે ગેઓશ મોરેંહાંન.
ઓહૂઆખશ ઓખતી. ૭અોતુ
ઇઆઅેશ ગરેડમા. અશાદવરતા.
કરપા ખશથરેઅચા. ઇશનાંમ હ
રોજેમ. ઇઆખશથરા ગરેડમે
હીશસહ અચેશતહીઆ. દેસાંને
મનંઘો. આંઘહુઓશ મરેપતારો
અહીઆ ઇઅેચા મજહા ૭ ગેરે
જહ. કા મે થવ હીઆ. સાંધરાનો

હુતેમ. ઇર્ચ્યૅ ઇશ પાઇ ફરેસાઇ.
અશાહુીઆ અાહુીઆ
ગરેહમા. આાહુાઇ થવોએની.
કાઊીઆઇઅસ્ચીઇ. પારતુશ ની ઇ
ઇઇ વરેચાઓ હીઆ. ફ્રેદઆ
હીઆઇ વીસેંતા. ઇરેગુઆ તેમ.
અઊઇઆ હીઆઇચા. ગાઓશ ને
હીઆએ મરેઊીઇ. ઇએ હુરે
શેમ. સોચીઆઇ અઊઇઆ.
અનાઓશ આવીને નાશા. ઇઆ
કરપા તાઓસ્આ કેઊઇતાઓસ
આ. અઊઆાઓશ ઓઈ ઇઅંગ.
દીઅંતી નોઆઇ ઞઆાતઓશ પ
શીઅમનેંઘ વસોતોઓ અાથીઆ.
બેરીઆાઓંતે વંઘહેઆશ આદે
માને મનંઘો.

હમેમતદ. વહ્રેશતા ચેદ. ઇએ
ઑાશ હ્રુરૂઇએ. સીઅસચીદ
દહ્રમીઅ ખશીઆંશ મજદા
આહ્રુરા. ઇએહ્રીઆમા એથીસ
ચદ દુસેથા. હ્રીઅદ એનંઘહ્રે
દરેગુઅતા એએઆનુ એશીએ;
ગ અંધાઇઆ.

અહ્રીઆ ઇઆસા નેમંઘા
ઑાશતા નજસતા રેરેદરહ્રીઆ.
મેનીએઑાશ મજદા. ષોઆ
રૂઇમ સપેંતહ્રીઆ. અશા વીસ
પેંગ. શીઓથ્રા વંઘહ્રેઑાશ.
અરતુમ મજંઘો. ઇઆ ખશનેઉ
ઇરાચા. ગેઑાશાચા ઑારૂઆનેમ.

આહીઆ ઇઆસા નેમંઘા. આ
શતા નજસતો રશેદરહીઆ. મેની
અઆશ મજદા. પોઆરૂઇમસપે
તહીઆ. અશા વીસપેંગ શીઆ
થેના વંઘહેઆશ ખરતુમ મનંઘો
ઇઆ ખસનેઉઇસચા. ગેઆસચા
આરૂઆનેમ. ઇઅથા આહુવેરી
આ [૪] અશેમ વોહુ (૩)

અતુ મેથીઅમ હાઅતીમ ઇઅ
જમેદે. ઇઅંઘહે હાતાંમ. આદ
ઇઆસને. પેતે વંઘો. મજદાઓ
આહુરો. વેથા અશાદ હચા. ઇઆ
આંઘાંમચા. તાંસચા. તાઆસચા
ઇઅજમેદ.

[બાજમાં પઢે] હોરમજદ ખો
દાય. અવજુની મર્‌દુમ. મરદુમ
સરદગાં. હમા સરદગાં. હમ બા
યસત બેહડાં ઑયમ બેહદીન મા
જદીઅસ નાં. આગાહી આસનુ
આની નેકી રસાંનાદ. યહુન બાદ.

(પરગટ પઢે) ઇઆથા આહુ
વરીઓ (૨) ઇઅસનેમચ વહુ
મેમચ. ઑાજસચ. જ઼ઊઅરે
ચ આફરીનાંમે. અશહે વહેશ
તહે. સરેશતહે યરીઅમનો યશી
યહે સુરહે મજદદાતહે. સોકી
આઓ વંઘોહીઆઓ. વેઓ
રે દોયથરીઆઓ. મજદદાતી
આઓ અશોનીઆઓ. અશેમ
વાહુ (૧) આહમાયરેશચ.- હજ

ઘરેમ.- જસમે.- ફ્રેરેબા મુજદ. અ
શેમ વોહુ. (૧)

રોજ [ફ્શાન] માહો [ફ્શાન]
ગેહે [ફ્શાન] નમાજ દાહા
ર. ગેહાંન દાસાંન. પાશનોથ્ર અ
હુરહે મજદાઓ તરોયદીત.
અંઘરહે મેનીયવ્યાશ. હેથીઆ
વરેશતાંમ. હીઅદ વસના. ફ્ર
શોતેમેમ સતોમે અશેમ અશેમ
વોહુ [૧] ગોરજ ખોરહે અવજા
ઇઆદ. અરદીબેહેશત અમેશાસ
પંદ બેરેસાદ. અમાવંદ પીરોજ
ગર. અમાવંદી પીરોજગરી. દાદ
દીને બેહે માજદીઅસનાં આગા
હી રવાઇ ગોઆખ્ર્ગાંની બોદ
હપત કેશવર જમીન યદુન બાદ.

મ'ન આંનો આવાઈઅહ શું'દન.

મ'ન આંનો આવાઈઅહ શું'દન

મ'ન આંનો આવાઈઅહ શું'દન.

અશેમ વોહુ (૧)

(દખણ દશાની તરફ મોહોડું કરીને પઢે)

હાહાર ગેહાંન દીને માજદીઅ સની હાહ જરથોશતરી. નેમસતે અશાઓમ સેઉઇયશતે અરહુઇસુર અનાહુતે. અશોને અશેમ વોહુ (૧) નેમો ઓહ્રમઅર વ'ઘોહીશ મ જદદાનહે. અશોને અશેમ વોહુ [૧] અશેમ વહુશતેમ સરેશતેમ અમેશેમ સપેનતેમ ઇઅજમેહે.

## અશેમ વોહુ (૧) અરદીબેહેસ્ત અમેશાસ્પંદ બેરેસાદ અશેમ વોહુ. (૧)

આફ્રીનગાનની અરદીબેહેસ્ત યસ્ત— એ કરદો ઇજશનેમાં હા ૩૨ મો છે. એ કરદો ઘેહ શારનામાં તથા મુકતાદમાના હોનુવદ ગાથાના હામા તથા વીસપરદ વીગેરેમાં પણ આવે છે. એ યસ્ત પઢવાથી બુરાહવસોને મારી-નાખી દીજ્ઞને નચીનતકથી તનદરૂસ્તી તથા દુનીયામા સુખ શાન્તી પાથરવાની તથા ગોસપંદોની પરવરીશથી વધારો કરવાની અકલ તથા હીમત વધે છે. તથા અંગરોગ ભુત દાકણ વિગેરે અથવા કર કરીતન જાદુઇ વિગેરે તોરવામાં આતશ ઉપર બોઇ વિગેરે બાલીને એજ યસ્ત પઢવાથી એ સઘલું દુર થાય છે. એના પુરાવામાં એના છુટા છુટા પાડેલા

ફકરાઓ પણ જુદાજુદા ફરેશતાની ખશનુમનથી બાજ લેઇ ચોકસ વરદેરોજ ફકરો ઉપલામાંથી ઉપયોગમાં લઇ પછી તેજ ફરેશતાની ખશનુમનથી બાજ મુકવાથી એજ બદીઓ તોરવામાં નીરંગો દાખલ તાવીજો લખીને બાજુ વીગેરે ઉપર બાંધવા તથા પાણીને પીવા વીગેરેનું લખાણ અસલી કેતાબોમાં છે. એ યસ્ત સુરતવાલા મોબેદ ધનજીશા નશરવાનજી નાયલાદારૂએ ઈ૦ સ૦ ૧૯૦૭માં "ભુલે પડી રહેલા અવસ્તા ભાષાના ભણતરો" એવા નામનું જે ચોપાનીઉં છપાવીયું ચ તેમાં "પતેત ફરેશોશતરો" નીસાથે એ યસ્ત પણ જાહેરમાં છપાવી છે. તે ઉપરથી આ ચોપડીમાં એ પણ દાખલ કરવાનુ દરૂસત લાગવાથી છાપી છે.